

# THE FREE INDOLOGICAL COLLECTION

[WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC](http://WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC)

---

## FAIR USE DECLARATION

This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.

Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.

**If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.**

**-The TFIC Team.**



जैन ज्यति शासनम्

ॐ पार्श्वनाथाय ह्रीं

ॐ पद्मावत्यै ह्रीं

आत्म कमल-लभिधसूरीश्वरगुरुभ्यो।

श्री ज्यंत-विक्तम-नवानसूरीश्वरगुरुभ्यो।

ज्ञान-पौरीहत्याकरणसूरीश्वरगुरुभ्यो।

ह शा वै का लि कु सु त्र

चं त न का

: शुलाशिष दाता :

पूज्यपाद तीर्थ प्रक्षावक आचार्य लगवंत

विक्तमसूरीश्वरल महाराज.

\* संपादक \*

पूज्यपाद आचार्य लगवंत विक्तम सूरीश्वरल म. सा. ना.

विद्वान शिष्य पूज्य मुनि राज्यश विजय म. सा.

—: लेखिका :—

पूज्य साध्वी सर्वेहियाश्री म. नी निशावर्ति

साध्वीवर्या वाच्यं यमाश्रील म.

\* प्रकाशक \*

श्री लभिध-विक्तम-सूरीश्वरल संस्कृति केंद्र, अमरावाद-१३.

. प्रथमावृत्ति :

: लाल लेनार :

: नंकद :

वि.सं. २०३७ श्रीमती कंचाणे भीमचंलाई

२०००



## ધ્યાન્ય વાદ

પ્રસ્તુત શ્રી હશવૈકાલિક સૂત્રની અનુપ્રેક્ષાઓનું લખિધ-નિકમ-સંસ્કૃતિ કેંદ્ર તરફથી પ્રકાશન કરતા અમે આનંદ અનુભવીએ છીએ.

પ્રસ્તુત અંથ રચના માટે અમે સાધ્વીવર્યા વાચંયમાંથી ને ધન્યવાદ શું આપવાના છીએ ? તેઓએ તો પોતાનાં સ્વાધ્યાય અને ગુરુ-લક્ષ્મિ માટે જ આ સર્જન કરેલ છે અને તેથી તેઓને અમે સંસ્થા તરફથી લાવપૂર્વક વંદના કરીએ છીએ.

પ્રસ્તુત પ્રકાશનની ડોપીની તમામ રકમ શ્રીમતી કંચનએન ખીમચંદ્રસાઈ તરફથી સહ વ્યથિત કરવામાં આવી છે

સંધ્વણું શ્રીમતી કંચનએન તથા સંધ્વણી શ્રી ખીમચંદ્રસાઈ અમારા શ્રી કલકત્તા-પાલીતાણા છ'રી પાલિત સંધ્વયાત્રાના એક સંધ્વપતિ તો હતા જ, પણ ખૂબ જ ધર્મ પ્રેમી અને આદર્શ જૈન દર્પઠી છે.

પ્રસ્તુત પ્રકાશનનો લાલ તેઓનાં વાત્સલ્યમૂર્તિ સાધ્વીવર્યા સર્વોદ્યાશ્રીલુની પુનિત પ્રેરણથી મળ્યો છે સાધ્વી સર્વોદ્યાશ્રીલુની ખીમચંદ્રસાઈ લીંઘીવાળાનાં સંસારી એન પણ છે. \*

શ્રીમતી કંચનએન તથા ખીમચંદ્રસાઈ ને ધન્યવાદ ! આવાં સુંદર પ્રકાશનો પ્રસિદ્ધ કરીને વારંવાર શાસન સેવા કરવા માટે અમે અનુરોધ કરી રહ્યા છીએ.

સાથે જ જિન શાસનની સુંદર આરાધના અને પ્રભાવનાનો વારસો એમના ચિરંભિવી સુપુનો નીલેશકુમાર તેમજ સુનીલકુમારમાં જિતરે અને તેમની સંસ્કારી પુત્રીએ નયનાએન-ગ્રામાએન-ક્ષાએન પણ ખૂબ જ સંસ્કારમાં આગળ વધે, અમે એ જ ધર્ઘણીએ છીએ.

સંસ્થા તરફથી હું વારંવાર તેઓને ધન્યવાદ આપું છું.

આ સાથે સંપૂર્ણ પ્રનિર્દીંગ કાર્યનું ધ્યાન રાખી કામ કરનાર શુદ્ધકુત્તા શ્રી હસમુખલાંદ કાપડિયાને ધન્યવાદઆપ્યા સિવાય રહેવાતું નથી.

પ્રકાશન મંત્રી, શ્રી રાજેન્દ્ર એ. દલાલ  
તથા



# અનુકૂળ લિખિત કા

૧.	ધરમો મંગલ મુદ્દિદં	૧/૧	૧
૨.	મહુકાર સમા યુદ્ધા	૧/૫	૭
૩.	કામે કમાણી	૨/૫	૧૨
૪.	સંજમં નિદૃઓ ચર	૨/૮	૧૭
૫.	મહેસિણું	૩/૧	૨૨
૬.	ઉજ્જુદસિણો	૩/૧૧	૨૬
૭.	આજિસ તેણું	૪/૧	૩૦
૮.	ઉપસંપન્જિજતાણું વિહરામિ	૪/૧૭	૩૪
૯.	સંવલ્યુપલ્યુઅસસ	૪/૮	૩૬
૧૦.	જ સેથં ત સમાયરે	૪/૧૧	૪૨
૧૧.	સો હુ નાહિદ સંજમં	૪/૧૩	૪૫
૧૨.	સુહસાયગસસ	૪/૨૬	૪૬
૧૩.	અસંભંતો	૫/૧/૧	૫૪
૧૪.	અણુભિવગો	૫/૧/૨	૫૮
૧૫.	જઈ મે અણુગગં કુજળ	૫/૧/૮૪	૬૨
૧૬.	મુહાદાર્છ મુહાજીવી	૫/૧/૧૦૦	૬૬
૧૭.	કાલે કાલં સમાયરે	૫/૨/૪	૭૦
૧૮.	આયયડી	૫/૨/૩૪	૭૫
૧૯.	કિં વિભૂસાએ કારિઅં	૬/૬૪	૮૦
૨૦.	સવિજજ વિજજણુગ્યા	૬/૬૮	૮૪
૨૧.	મિઅં અદુહું અણુવીદ્ધ લાસાએ	૭/૫૫	૮૬
૨૨.	ન ય ટિંક સુયં સંવં લિકભુ	૮/૨૦	૮૩
૨૩.	આસુરતં ન ગંછેજળ,	૮/૨૫	૮૮
૨૪.	નેવ ગૂહે ન નિન્હવે.	૮/૩૨	૧૦૨

૨૫.	અમોહું વયણું કુજળા.	૮/૩૩	૧૦૭
૨૬.	બહુસસયં પજજીવાસેજળા	૮/૪૩	૧૧૨
૨૭.	ન તં ઉવહસે મુણ્ણી	૮/૪૬	૧૧૭
૨૮.	ગુરુપ્રસાયા લિમુહે રમેજળા.	૮/૧/૧૦	૧૨૨
૨૯.	અણુંત નાણોવગગો વિસંતો	૮/૧/૧૧	૧૨૮
૩૦.	તેસિં સિદ્ધખા પવહૃતિ	૮/૨/૧૨	૧૩૩
૩૧.	વગેજળ ન પુણોત્તિય	૮/૨/૧૮	૧૩૬
૩૨.	અસંવિલાગી ન દુ તસ્સ મોકાએ	૮/૨/૨૨	૧૪૩
૩૩.	નિદેસવતી પુણુ જે ગુસણું	૮/૨/૧	૧૪૬
૩૪.	જે છંદ મારાહૃયદ્ધ સુ પુજળે	૮/૩/૧	૧૫૩
૩૫.	અકોઉહલ્યેયસયા સ પુજળે	૮/૩/૧૦	૧૫૮
૩૬.	ગુણોહિ સાહુ અગુણોહિડ સાહુ	૮/૩/૧૧	૧૬૨
૩૭.	પેહેચ હિયાણુસાસણું	૮/૪/૨	૧૬૭
૩૮.	વિયાળિયા અપ્પગમપ્પગોણું	૮/૩/૧૨	૧૭૨
૩૯.	નનતથ નિજજરદ્દ્યાએ તવમહિદ્વિજળા	૮/૪/૩	૧૭૮
૪૦.	ધુવળોગી	૧૦/૬	૧૮૩
૪૧.	અવિહેકાએ જે સ ભિક્ખુ	૧૦/૧૦	૧૮૮
૪૨.	પુઢ્યી સમે મુણ્ણી હવેજળા.	૧૦/૧૩	૧૯૩
૪૩.	અતાણુ ન સમુક્કસે જે સ ભિક્ખુ	૧૦/૧૬	૧૯૮
૪૪.	નિરૂપક્કસે પરિયાએ	૧ ચૂ./૧૧	૨૦૨
૪૫.	વ્યગેજળ હેહું ન દુ ધર્મમસાસણું	૧ ચૂ./૧૭	૨૦૮
૪૬.	પડિસોઅ-લક્ષ-લક્ષેણું	૨ ચૂ./૨	૨૧૨
૪૭.	મમતલાવં ન કહિ પિ કુજળા.	૨ ચૂ./૮	૨૧૮
૪૮.	સુતાસ મગોળુ ચરેજળ લિક્ખુ	૨ ચૂ./૧૧	૨૨૩
૪૯.	તથેવ ધીરો પડિસાહરેજળ	૨ ચૂ./૧૪	૨૨૭
૫૦.	અપો ખલુ સથયં રક્ખિખ અવો	૨ ચૂ./૧૬	૨૩૨

સ મ પ ણ

અનત ઉપકારી

વાત્સલ્યવારિધિ પૂજયપાદ ગુરુહેવ તીર્થપ્રભાવક પૂજય આચાર્ય હેવ  
શ્રીમહ વિજય વિડેમસ્કુરીધેરળ મ. ના પવિત્ર  
કરકમલોમાં.....



આપનું આપને.

સમર્પિકા :-

આપની શિષ્યા વાચયમા

ગ્રંથનું દ્વારા કાલિક સૂત્રની અંતિમ એ ચૂલ્હિકાઓ શ્રી સીમંધર જીના ગવાન પાસેથી લાવીને શ્રુતધરોને તેઓએ સુપ્રત કરી છે. આર્ય મહાગિરિ અને આર્ય સુહસિત જેવા ઉત્તમ કોટિના આગધક અને પ્રલાવક પણ તેઓએ શાસનને સમર્પિત કર્યાનું કહેવાય છે. આર્ય વૃજસ્વામી પણ સ્વાધ્યાય કરતાં સાધ્વીજી મહારાજાઓનાં મુખ્યી અગિયાર અંગનો પાડ સાંલળી ગેંકાદ્વારા અંગ પાડી બન્યા છે ! ચાકિની-મહત્તરા સાધ્વીજીથી પૂ. હરિલભદ્રસુરિજી મહારાજ જેવા મહાન જ્યોતિર્ધર અન્થકુર ગ્રાપેત થયા કે જેઓના અંથોના અભ્યાસ નગર ગમે તેટથો આગમનો અભ્યાસ પણ અધ્યૂરો ગણ્યાય છે. જગ કુવિષ્યાન ‘ઉપનિષિત ભવું પ્રપંચ’ માં ઉલ્લેખ પામેન ‘ગણ્યા’ એક વિદુષી સાધ્વીજી મહારાજ છે. મહાધારી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતાની ‘વિશેષ-આવરયક’ ની ટીકામા સહાયકૃત થયેલ સાધ્વીજી મહારાજાઓનો નામોલ્લેખ છેં. તેમજ ત્યારથાદ પણ સ્તુતિ અને દેવવંદન આદિ ઇપે રચાયેલું કેટલું કસાહિત્ય પૂ. સાધ્વીજી મહારાજાઓનું રચત છે.

વર્તમાન કુણભાં પણ ધણાં સાધ્વીજી મ. પોતાના ગંગાનાયક અને ગણ્યનાયક વડીલો ! તેમજ ગુરુઓની આજાતુસાર કૈન સાહિત્ય-જગતમાં વિવિધ રીતે વૃદ્ધિ કરે છે.

આવા સહુ સાધ્વીવર્ગમાં સાધ્વી સર્વેહિયાશ્રીના નિશ્રાવતી સાધ્વીવર્યા ‘વાચયમાશ્રી’ પણ એક છે. જેમણે કરેલ આગમ અંથ ઉપર આઠલી ‘વિવેચનાવાળું’ વિવેચન તો પ્રથમ પ્રથમ જ જેવા અણે છે. આ દ્વારા કાલિક સૂત્ર પરનો ચિંતનઅંથ એક આગમ અતુ-ગ્રેહાદ્ય અંથરલ છે.... સુવિહિત ગુરુ લગવંતો પાસેથી વાચના ચેળવી પોતાના ક્ષ્યોપશમ પ્રમાણે આગમ વચ્ચેનોને મનોમંહિરમાં વિભાજનમાન કરવામાં આવે છે, ત્યારેજ આવી ચિંતન ધારાઓ પ્રગટ આપ્ય છે. મારે મન તો આ અંથ એક જાહેર અનુપ્રેરણ છે. સામાન્ય

રીતે અનુપ્રેક્ષા માનસિક છે. જ્યારે આ આગમ અનુપ્રેક્ષાઓ ગાડું જનહિતાય પત્ર પર ઉતારવામાં આવી છે. આર્ય વર્ગમાં ચાલી રહેલાં પુષ્ટ સ્વાધ્યાય પ્રયત્નનો આ એક નમૂનો છે.

આ સાધ્વીજી કેટલા બધાં જોડાં ચિંતનવાળાં છે તે વાચક સ્વયં વિચારે. લખવાની રૌલી પણ અનોખી છે. લાવનાના સોંતથી ભરેલી વિવેચના લખનારા સાધ્વીજીએ ૧૧ વર્ધાની ઉમરમાં જ દીક્ષા લીધી છે. દીક્ષા લઈને ખૂબ અભ્યાસ કરો છે અને અમારા પરમારાધ્યપાદ પરમ ગુરુહેવ આચાર્ય લગ્નંત શ્રીમહ વિજયલઘિંધ સ્ફુરીશ્વરજી મહારાજાની પરમ કૃપા ગ્રાપેત કરી હતી. આવા આ સાધ્વીજી અનેક આગમ અંશેનાં રહ્યેને...લાવલરી અને સરળ રીતે હૃદ્યંગમ વિવેચનો લખીને ખૂબ-ખૂબ શાસનની સેવા અને પ્રલાવના કરીને અમારા શાસન શોલાના સાવોને સફ્લ કરનારા થાયો તથા આવા અનેક સ્વાધ્યાય અંશો વધુને વધુ સર્જા...સ્વના ભુગનને શાસન સમર્પિત બનાવી સંયમે રસના આનંદમાં ભસ્ત બનાવી તેમની પર વરસી રહેલા પૂજય પરમ ગુરુહેવ આચાર્યહેવ વિજયલઘિંધસ્ફુરીશ્વરજી મહારાજાના આશીર્વાહિને સાર્થક કરે !

ગ્રલુ પરમાત્માનો આદેશેલ-ઉપદેશેલ ચતુર્વિંધ સંધ પોતપોતાની મર્યાદા વધારી શાસનનો જ્યનાદારો 'જૈન' જ્યતિ શાસનમ्' નો નાદ વિશ્વવ્યાપી બનાવે એ જ અભ્યર્થના.....

અધ. વિકેમસૂરિ.

( કોઈભિન્નતુર )



# આશીર્વાનુ

તીર્થપ્રલાવક પુ. આચાર્યદેવ વિહુમસૂરી મ.

જૈન શાસનમાં અનેકાનેક સૂરિપુંગવો, મુનિપુંગવો થયા છે કે જેઓએ પોતાની પ્રતિલાના બજથી પુષ્કળ પ્રકરણથોની રચના કરેલી છે; અને એ રચનાના આધારથી અનેક આત્માઓએ પોતાની ખુદ્ધિની પવિત્રતાને કેળવી, સંયમની સુંદર આરાધના કરી, પ્રભુના ઉપદેશને સાર્થક કર્યો છે

જેવી રીતે સૂરિપુંગવો, મુનિપુંગવો પરમેષ્ઠિપદમાં બિરાજમાન છે, તેથી રીતે સાધીણ મહારાજ પણ પરમેષ્ઠિપદમાં બિરાજમાન છે. આ પરમેષ્ઠિપદમાં બિરાજમાન સાધીણ મહારાજનું પણ ચતુ-વિધસ ધરમાં એક મહાત્મપૂર્ણ સ્થાન છે.

ચતુર્વિધ-સંધના બીજાં અંગર્ચ્ચ આ સાધીણ મહારાજાઓ, આચાર્યાઓએ ધ્યાન અને સ્વાધ્યાય જેવાં પ્રમુખ અંગોને સુહીર્થ-કાળથી જીવનમાં વળ્ણી લીધાં છે. ધ્યાન-સ્વાધ્યાય અને ધર્મેપદેશમાં જ લીન સાધીણ મહારાજાઓ પાસે શાસન, પ્રત્યે એક અનન્ય-સમર્પણ અને અદ્ધારાવ જ રહેણો આવ્યો છે; અને તેથી શાસનસેવા, રક્ષણ અને પ્રલાવનાનાં કાર્યોમાં તેઓ એટલા બધા ગૌણ ભાવે રહ્યા છે કે આજે આપણી પાસે આર્ય ચંદ્નાથી માંડીને અત્યારના, કોઈપણ સાધીણ મ. ની ગુરુણી પરંપરાની થાદી પણ પ્રાપ્ત થતી નથી. આવી પરિદ્રિથતિને જન્મદ્ર રીતે સહુએ વિચારની જોઈએ.

વળી ક્યાક-ક્યાંક ગ્રાન્થ થતાં સાધીણ મહારાજાઓનો માનસયાર્થ જલ્દેખાથી તેઓની પ્રતિલાનો પરિચય થાય છે. તેમાં મધ્યા-મંહતરા યક્ષા સાધીણ આગમના પ્રાને શુણ ગવાયેલ સાધીણ મહારાજ છે.

ગ્રંથનું દ્વારાવૈકાલિક સૂત્રની અંતિમ બે ચ્યુલિક્ષાઓ શ્રી સીમંધર જીએ ગ્રંથવાન પાસેથી લાવીને શ્રુતધરોને તેઓએ સુપ્રેત કરી છે. આર્થ મહાગિરિ અને આર્થ સુહસ્તિ જેવા ઉત્તમ કોટિના આરાધક અને ગ્રંથાવક પણ તેઓએ શાસનને સમર્પિત કર્યાનું કહેલ્યાય છે. આર્થ વજસ્ત્વામી પણ સ્વાધ્યાય કરતાં સાધ્વીજી મહારાજાઓનાં સુખથી અગિયાર અંગનો પાડ સાંકણી એકાદશ અંગ પાડી બન્યા છે ! ચાકિની-મહત્તરા સાધ્વીજીથી પૂ. હરિલલસુરિજી મહારાજ જેવા મહાન જ્યોતિર્ધર અન્યકાર પ્રાપ્ત થયા કે જેઓના અંથોના અભ્યાસ વગર ગમે તેટલો આગમનો અભ્યાસ પણ અધ્યૂરો ગળણાય છે. જગ વિઘ્યાન ‘ઉપનિષિત ભવ્ય પ્રપંચ’ માં ઉલ્લેખ પામેદ ‘ગળણા’ એક વિદુષી સાધ્વીજી મહારાજ છે. મલ્લધારી હેમચંદ્રાચાર્ય મહારાજએ પોતાની ‘વિશેષ આવંશયક’ ની ટીકામા સહાયભૂત થયેલ સાધ્વીજી મહારાજાઓનો નામોલ્લેખ છે. તેમજ ત્યારણાં પણ સ્તુતિ અને દેવવંદન આહિ ડૃપે રચાયેલું કેરલુ ક સાધિત્ય પૂ સાધ્વીજી મહારાજાઓનું ર અત છે.

વર્તમાન કાળમાં પણ ધણાં સાધ્વીજી મ. પોતાના ગંધનાયક અને ગણનાયક વડીલો! તેમજ ગુરુઓની આશાનુસાર જૈન સાહિત્ય-જગતમાં વિવિધ રીતે વૃદ્ધિ કરે છે.

આવા સહુ સાધ્વીવર્ગમાં સાધ્વી સર્વોદ્યાશ્રીના નિશ્ચાવતીં સાધ્વીવર્યો ‘વાચંયમાશી’ પણ એક છે. જેમણે કરેલ આગમ અંથ ઉપર આઠલી વિવેચનાવાળું ‘વિવેચન તો પ્રથમ પ્રથમ જ જેવા મળે છે. આ દ્વારાવૈકાલિક સૂત્ર પરનો ચિંતનઅંથ એક આગમ અનુ-ગ્રેહાર્થ અંથરલ છે... સુવિહિત ગુરુ જગવતો! પાસેથી વાચના મેળવી પોતાના ક્ષયોપશમ પ્રમાણે આગમ વચ્ચેનોને મનોમંહિરમાં વિરાજમાન કરવામાં આવે છે, ત્યારેજ આવી ચિંતન ધારાઓ પ્રગત ચાય છે. મારે મન તો આ અંથ એક જાહેર અનુપ્રેર્ણા છે. સામાન્ય

રીતે અતુપ્રેક્ષા માનસિક છે. જ્યારે આ આગમ અતુપ્રેક્ષાએ ૧૫૦. જનહિતાય પત્ર પર ઉતારવામાં આવી છે. આર્થિક વર્ગમાં ચાલી રહેલાં પુષ્ટ સ્વાધ્યાય પ્રયત્નનો આ એક નમૂનો છે.

આ સાધ્વીજી કેટલા બધાં ડાંડાં ચિંતનવાળાં છે તે વાચક સ્વયં વિચારે. લખવાની રૌલી પણ અનોખી છે. ભાવનાના સ્થોનથી ભરેલી વિવેચના લખનારા સાધ્વીજીએ ૧૧ વર્ષની ઉમરમાં જ દીક્ષા લીધી છે. દીક્ષા લઈને ઘૂઅ અભ્યાસ કર્યો છે અને અમારા પરમારાધ્યપાદ પરમ ગુરુહેવ આચાર્ય લગ્વાંત શ્રીમહ વિજયલભિંદ સુરીક્ષરજી મહારાજાની પરમ કૃપા પ્રાપ્ત કરી હતી. આવા આ સાધ્વીજી અનેક આગમ અંથોનાં રહ્યોને...ભાવસરી અને સરળ રીતે હૃદયંગમ વિવેચનો લખીને ઘૂઅ-ઘૂઅ શાસનની સેવા અને પ્રભાવના કરીને અમારા શાસન રોલાના ભાવેને સફ્લ કરનારા થાઓ તથા આવા અનેક સ્વાધ્યાય અંથો વધુને વધુ સર્જી...સ્વના જીવનને શાસન સમર્પિત બનાવી સંયમે રસના આનંદમાં મરત બનાવી તેમની પર વરસી રહેલા પૂજ્ય પરમ ગુરુહેવ આચાર્યહેવ વિજયલભિંદસુરીક્ષરજી મહારાજાના આશીર્વાદને સાર્થક કરે !

ગ્રલુ પરમાત્માનો આદેશોલ-ઉપહેશોલ ચતુર્વિંધ સંધ પોતપોતાની ભર્યાદી વધારી શાસનનો જીવનાદ-કરતો ‘કૈન’ જીવતિ શાસનમ्’ નો નાદ વિશ્વાપી બનાવે એ જ અભ્યર્થીના.....

શ્રી. વિકેમસૂરિ.

( કોઈમણું )

# સંપાદકીય....

સ્વાધ્યાય એકત્રથ :

ખરું વાચન આગમનું...!

આગમ અને શાસનરસના ડાડા પ્રેમી પૂજય ગુરુદેવને આગમ કંદસ્થ કરાવવાનો ખૂબ જ શોખ હતો. પૂજય ગુરુદેવે સાધુ જીવનના પ્રારંભમાં શ્રી દશાવૈકાલિક સૂત્ર મુખપાઠ કરાવ્યું. કંદસ્થ થયેલ શ્રી દશાવૈકાલિક સૂત્રને ટકાવી રાખવા પાઠ તો કરવો જ લોઈએ. તેમાં ઉપદેશમાલાકાર શ્રી ધર્મદાસ ગણિજીના એક વાક્યે નવો રસ જગાઉએ. તેઓશ્રીએ ઉપદેશમાલામાં લખ્યું છે કે... ‘સર્જાણ કદ્માણસ્સ ખણે નીંળે જાઈ વેરગં’

સ્વાધ્યાયમાં લાગી રહેલ આત્માને ક્ષણું-ક્ષણું વૈરાગ્ય થાય છે. ચિંતન કરતાં સમજયું કે સ્વાધ્યાયનું માત્ર ફળ જ શ્રી ધર્મદાસ ગણિ બતાવી નથી રહ્યા, પણ સાથે સાથે સ્વાધ્યાય કેવી રીતે કરવો તે પણ કહી રહ્યા છે.

ધીમે-ધીમે... મધુરા સ્વરે જ્યારે જ્યારે પાઠ કરતો, ‘ત્યારે આત્મા આનંદ વિભોર બની જતો. આજે પણું કચારેક-કચારેક સળગા દ્વારા અધ્યયનનો ચૂલ્હાંસ સાથે સ્વાધ્યાય કરું છું, ત્યારે શરીરમાં જાણું કાયાકદ્ય થયો હોય,’ તેવી કોઈ હળવાશ અનુભવાય છે. મનમાં એવી ભસ્તી પ્રગટે છે કે જગતના લોકો સાથે વ્યાવહારિક કે ઔપાચારિક વાત કરવાનું મનનથી થતું.

પરમતારક પૂજય ગુરુદેવ વિજય વિક્રમસ્ત્રીથરળ મહારાજા વારવાર કહે છે “ભાઈ ! બધું વાચન ખરું ! બધાં શાસ્ત્રો ખરાં...! પણ... કોણું જાણું કેમ આગમની વાણી હૈયાને સીધે રૂપર્શી કરે છે.”

આજે ઈતિહાસમાં જેને ‘touching કહીએ છીએ, તેવો સર્વેનશીલ . હૃદયરપર્શ’ શાખોના અર્થ જાણીને સ્વાધ્યાય કેરતારને થથા વગર ન જ રહે તે નિર્વિબાદ વાત છે.

આ જ દ્વારાકાલિક સૂત્રમાં સ્વાધ્યાય અંગે કહું છે કે..... “મોચા સજ્જાય રએ જે સ જિક્કાબુ” આ પદતું સાચું હાઈ-પૂર્વકતું લાયાંતર કરવું હોય, તો લખવું પડે હે... ‘ભાધું’ નથી કે સ્વાધ્યાયમાં મંડી પડ્યા તે જ સાધુ... ’ ખરેખર તો સ્વાધ્યાય એજ સાધુળવન છે. અને તેથી ‘જ શાખાંતરોમાં આવે છે કે ‘સ્વાધ્યાય સમો તવો નંતિથ’ સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી; અને આ ‘દ્વારાકાલિક સૂત્ર’ તો સુંદર પદમાં રચાયેલો એવો સુંદર અંથ છે કે જે સારા મધુર કંઈ ઓતમાંઓ ધીમે ધીમે રણુકતાં મધુર અવાજે સ્વાધ્યાય કરતાં હોય, તો નંદીસૂત્રની પેદી વાત ‘સજ્જાય નેંદીઘોસસ્સ’ ની વાતનું પ્રત્યક્ષીકરણું થાય. સ્વાધ્યાય રૂપ નંદીશ્રીએ સાધુ મંડતીની અનોખી આલા છે.

### સ્વાધ્યાય એક પરમ જ્ઞાનંદ

‘આ સ્વાધ્યાય માત્ર શાખાની પરિવર્તના અને પરિપાઠી રૂપમાં સીમિન્ન નથી થતો,’ તેમાં ‘અનુપ્રેક્ષા પણ લંબાવી જોઈએ અને પરાવર્તના બાદ જે અનુપ્રેક્ષામાં’ પ્રવેશો, તેના માટે ધ્યાન તો લગાલગ ગુલામ જેવું જ છે.’ અનુપ્રેક્ષાના સ્વામી ક્યારે ધ્યાનમાં પ્રવેશી જાય છે, તેની કદ્દપના, ધ્યાતોને પણ હોતી નથી. અનુપ્રેક્ષા એ શાસ્ત્રીય શાખા છે એના માટે અત્યારે પ્રયક્ષિત શાખા ‘ચિંતન’ છે. ચિંતન અને તેમાંય મેહાપુરુષોના શાસ્ત્રનું ચિંતન એ અનંત આનંદ સાશરતી એક મસ્તીલરી સહેલ છે. જે શાસ્ત્રના શાખાનાં ચિંતનો કરી શકે છે, તે પેલા ઉમાસ્વાંતિલુ મહારાજનાં વચ્ચેનોને પ્રત્યક્ષે કરી શકે છે. નૈવાસ્ત્રિ રાજરાજસ્ય તત્સુખે નૈવ

दેવરાજસ્ય યત્સુખं ઇહૈવ સાધોः લોક વ્યાપાર રહિતસ્ય  
સાધુ માટે સ્વાધ્યાય એ લોકોત્તર વ્યાપાર છે. લોકિક વ્યાપારનો  
ત્યાગ કરી ને લોકોત્તર વ્યાપારમાં પ્રવેશશો, તેના આનંદની કોઈ  
અવધિ હોતી નથી.

### ચિંતનણીનેનો કેઠાર

દ્વારાલિક સૂત્ર પણ ચિંતનણીનેનો એક અનુપમ ભજનનો  
છે પ્રસ્તુત ગ્રંથ માત્ર પવાસ ચિંતનણીને પર લખાયો છે. કોઈપણ  
વાચક એમ ન સમજે કે દ્વારાલિક-સૂત્રનું ચિંતનીય તત્ત્વ અહીં  
આટલામાં જ સમાપ્ત થઈ જય છે. આપણે લખાણું અને ગ્રંથની  
એક નિયત મર્યાદા હોય છે, માટે જ અહીં આટલાં ચિંતનણીનેને  
ખીલવવામાં આવ્યા છે. આવાં અફળક ચિંતનણીને આ સૂત્રમાં  
ભર્યાં પડચાં છે.

લેખિકા સાધ્વીવર્યાના માર્ક જે વિશેષ કરીને અન્ય આર્યાં-  
શ્રેષ્ઠો ચિંતન કરવા પ્રયત્ન કરશે, તો તેમને પણ આવી સામગ્રી  
પ્રાપ્ત થશે. વર્ત્માનમાં પૂજયશી શ્રમની સંસ્થા, શ્રમણ મહોદયો  
કરતાં સ્વાધ્યાયમાં વધારે લાગેલા હોય છે તેમ કહેવાય છે તેથી જ  
તેઓએ હુંવે અનુપ્રેક્ષાયુક્ત સ્વાધ્યાયમાં જિનરવું આવશ્યક છે.  
તેઓએમાં અનુપ્રેક્ષા રસ ખીલશે, તો જૈન સંધમાં તેઓના ઐધથી  
મહ્નાસ્તાયો. સમી ભાતાયો સર્વત્યાગી નહીં બનેલી હોય, તો પણ  
જૈનત્વના તેજપુંજ દ્શો દિશામાં પ્રસરાવી શકશે.

### ચિંતન કેવી રીતે થાય ?

ધર્મી વ્યક્તિને ધર્મી વાર ‘ચિંતન’ શબ્દ સાંલળીને આશ્ર્યો  
લાગે છે, ચિંતન કેમ થાય ? ચિંતન કેવી રીતે કરાય ?  
તેવા પ્રશ્નો થાય છે. ધર્મીવાર એવા જિજ્ઞાસુઓ આવે છે. પ્રશ્ન  
પૂછે છે. ‘ચિંતન કેવી રીતે થાય ?’ આ પ્રશ્નનો જવાબ પણ

ચિંતન માંગી લે તેવો છે. ખરેખર તો ચિંતનશક્તિ એ પણ અત્યારની લાપામાં કુહરતી અજીસ કે Natural gift જેને કહેવામાં આવે છે, તેની એક શક્તિ છે, પણ તે શક્તિ આ લવમાં પ્રયત્નથી સાધ્ય નથી તેમ ન માનવું. આપણું ચિંતન કરતાં શું આવડે કે તેવા ભાવો લાની નિરાશ ન થવું.

ચિંતન...ખાસ કરીને શાસ્ત્રીય ચિંતન માટે સંસ્કૃત તેમજ ગ્રાન્ટ લાખાને, સુદર વ્યાકરણ પૂર્વિકને, ઐધ હોવો જોઈએ. આવા લાખાના પરિપક્વ ઐધ બાટ ચર્ચા-વિચારણાની શક્તિ ભીલે માટે વર્તમાનમાં જે ન્યાયનો અભ્યાસ કરવામા આવે છે તેવો અભ્યાસ કરવો જોઈએ. ન્યાય એઠલે ન્યાય...અને તર્ક શક્તિથી બુદ્ધિનો વિકાસ કરવા માટે તર્કસંગ્રહ અને મુક્તાવળિ જી, લણુંબાં જોઈએ તેવો આગ્રહ રાખવાની જરૂર નથી. સારી રીતે સ્થાદ્વાહ મંજરી... તત્ત્વ ન્યાય વિશ્લાંકર... સ્થાદ્વાહ રત્નાંકર... તત્ત્વાર્થ સૂત્રની ટીકા ..વિશેષ આવશ્યકની ટીકા... હરિલદ્ધસ્તુરિઝ મહારાજના પ્રકરણ અથે અને તેના પર જે ટીકા વચ્ચાય તો સારી રીતે તર્કબુદ્ધિ વધવાની સાથે અન્ય શાસ્ત્રીય પદ્ધારોથી પણ વાંચુંની ભતિ સુદૃઢ અને, માટે આવો અભ્યાસ પણ જરૂરી છે ત્યારાદ પણ વિશાળ અને વિવિધ ક્ષેત્રનું વિવિધ વાંચન હોલું જરૂરી છે. તે અંગે ડોઈ નિયત કરેલા અથે વાંચવા તેલું જરૂરી નથી, પણ, જેમાં હોંડાણું ભર્યું હોય, જે ચિંતનઙ્ચું અંથ હોય, તેનું વાચન કરવું જોઈએ.

આટલું કરવાથી સ્વાસ્થાવિક ઉહા-પોહ શક્તિ વિકાસ પામે છે. આ વિકાસ પામેલી શક્તિ આપણું સુંદર માર્ગ પર આગળ વધારે તે માટે આગમશાસ્ત્રના વેતાઓ પાસે... અભ્યાસોઓ પાસે નાન ભાવે ચર્ચાઓ કરવી નાન અને જિશાસુ ભાવે થયેલી ચર્ચા-ઓનો રસ અને આગમ અથના પ્રણેતા અને દાતા પરનું અનન્ય કોટિનું બહુમાન ડોઈ પણ વિદ્યાર્થીને ચિંતન તરફ લઈ જાય છે.

સૂતકાર હેં અથડારે અમુક ગાથામાં અમુક શરૂદો શા માટે મૂકુચા ? એ જ અર્થો માટે બીજી શરૂદો શા માટે ન મૂકુચા ? તેમોના મૂકેલા શરૂદો કેટલા વ્યાપક અને યથાર્થ છે ? તેના ઠેકણે અન્ય શરૂદો હોય તો તે કેવા વાસન અને અયથાર્થ લાગે...! આધી રીતના આંતરિક ઉહાપોહમાંથી એક એવી ચિત્તન શક્તિ પ્રગટે છે કે ધીમે-ધીમે સામાન્ય સમજ ધરાવનાર બ્રહ્મિત્ત કે વિદ્યાર્થી પણ ચિંતક અને છે અને શાસ્ત્રીય અનુપ્રેક્ષાપૂર્વક સ્વ ધ્યાયનો આર્થવાદ કરી કેદી અંલૌકિક આનંદન પામે છે. કંધી શક્તાય હે ..

સ્વાધ્યાય એ સાંદુ લુલા અટે લોજન છે...તો અનુપ્રેક્ષા તે લોજનનો સ્વાદ છે...!

### અન્યથ

પૂજય શુદ્ધદેવ તરફથી આર્થ થતા આ અંથનું મે સંપાદન કરેલ છે, આ કાર્યમાં વિશેષ તો સંપાદન શું કરવાનું હોય, પણ ચિંતનનો એક સરખો પ્રવાહ વાચક સુધી પહોંચે, તે માટે જે જે આવશ્યક લાગતું હતું, તે મેં કરેલ છે.

આવી રીતના સારાએ અંથને અનગાહીને અહૃદ્ય કરેલ ચિંતન બીજે પરંના વિવરણનો કેદી અંથ માગ. જૈવામાં આવ્યો નથી. "દ્વારૈકાલિક સૂત્ર" નામથી તો જૈન ભાવને માન્ય છે, પણ જે અક્ષરદેહે આપણને પ્રાપ્ત થાય છે, તે ડેપે આજે પણ સમસ્ત જૈન પ્રવેતાંથર સંધના તમામ કિરણ્ણાઓને આ અંથ માન્ય છે, તે જેતાં તેના આરાધકો અને વાચકોનો એક વિશાળ વર્ગ છે. આ સમસ્ત વર્ગને પ્રસ્તુત અંથ...

અનુપ્રેક્ષાના આનંદમાં...

ચિંતનના સુખચેનમાં અને સ્વાધ્યાયના સૌંદર્યમાં...

સરકારી દેશી, તેવી આશા...અસ્થિલાપા ..સર્વથા સુયોગ છે.

રાજસ્થાન લંબન,

કેદીમાટુર.

તા. ૨-૬-'૯૨

રાજ્યશા વિજય

# લેખિકાના અંતર ઉદ્ગાર

ગુરુપૂજા

અમારા અનત ઉપકારી વાત્સલ્યવારિધિ ગુરુદેવનો સયમ ગ્રહણ કર્યા પચાંસ વર્ષ થવાં આવ્યાં હતાં. ગુરુલક્ષ્મો અમારાં ગુરુભંધુ સાથે વિચારણા કરતા નહા. અર્ધશતામિટ મહેત્સવ કયાં જિજ્વવો? કેવી રીતે જિજ્વવો? છેવટે નક્ષિણની ધર્મનગરી મદાસમાં મહેત્સવ પ્રારંભ કરવો અને આત્મપ્રદેશના મુકૃમણિ તીર્થ કુદ્દપાકળમાં મહેત્સવની પૂર્ણાહૃતિ કર્વી—આ નિર્ણયને પ્રજ્યપાદ શાંતમૂર્તિ આચાર્યદેવ નવીનસૂરીધીરજુ મના શુલાશિષ પ્રાપ્ત થયા.

અનેક લક્ષ્મો આવતા હતા. સૌ અદ્ભુલક્ષ્મિની લાલ લેવાં જાખતા હના. અનેરી તપ-યાગ-શાન-ધ્ય.ન શાસન પ્રલાવનાની યોજનાએ સાકાર બનવા લાગી.

સૌના ભાવો જેનાં મારા હૃદ્યમાં રહેવ શુભ ભાવો અધિક જાગૃત અન્યા. મને થયું એકાંતર વાર્ષિક તપ કરવા દરા હું પણ ગુરુ-લક્ષ્મિ કરું. મારા ભાવો મેં રજૂ કર્યા. રાનેન્ભાઈએ પણ વર્ષીતપનો પ્રારંભ કર્યો અમારાં સાધ્યા મંદુગમા મહાતપસ્વી સાધ્યા ગીતપદ્માશી અને દીપયશાશીએ ગુરુપદ લક્ષ્મિ અથે વીસ માસક્રમણનો પ્રારંભ કર્યો અને અમારઃ નિદુર્માસાધ્યા નયપદ્માશીજુ, વસુપદ્માશીજુ જિતેશપદ્માશીજુ, પ્રીતયશાશીજુ, વિમેલયશાશીજુ, પાર્વ્યશાશીજુ, અક્ષયશાશીજુ, પ્રજાનયશાશીજુએ પણ માસક્રમણ કરવાનો સંકદ્ય કર્યો.

મારા મનમાં થયુ; જરૂર તપ ગુરુલક્ષ્મિનો ભાર્ગ છે, પણ મન કંઈક ભીજું પણ ચાહતું હતું પ્રેરક વગર પ્રેરણા કયાં મળે? અમારા ગુરુભંધુ પણ રાજ્યશા વિજ્ય મહારાજે પ્રેરણા કરી. જે

સાચે જ ગુરુપૂજા કરવાની ભાવના હોય, તો દ્શવૈકાલિક ઉપર કંઈક લખો. દ્શવૈકાલિક સૂત્ર ઉપર અતુલ્લગ્નિઃ એ જ સાચી ગુરુપૂજા છે

વાત સાચી, પણ મારી નાણાઈઓને તો તુ જ સમજું. ગ્રારંભ, ભાવાવેશમાં જરૂરી થઈ જાય, પણ પૂર્ણાઙુત્તિ દૂર ! ! ! માર્ગદરશમાં એક પ્રકરણ લખ્યું—“મહુગાર સમા ખુલ્લા” અમારા તારક પૂ. ગુરુદેવની સંવાદા મૂક્યું. પૂજય ગુરુદેવ તો ગુણાતુરાગી અને વાત્સલ્યમૂર્તિ. એમણે તો પ્રેરણું પ્રોત્સાહન અને અંતરના શુલ્ષાશિપ વહીબ્યા...“ખસ, તું લખ્યાં કર.”...

### પુહલતીથ્રી

છેવટે પૂજયપાદ ગુરુદેવની આજાથી મદાસથી નવ માઈલ દૂર પુહલતીથ્રીમાં વીસ દિવસ જાપ કરવાનું નક્કી કર્યું. આ તીર્થનું અમને સૌને આકર્ષણું છે. શાંત અને પ્રશામરસવાહિની ચાર ગ્રાનિહાર્યચુક્તા આદિનાથ પ્રભુની અલૌકિક મૂર્તિ છે. શંખેશવ પાશ્ચનાથની શીતળાણાયા છે. શાસન રક્ષક ભાતા પદ્માવતીથી અધિ-  
ઘિત તીર્થ ક્ષેત્ર છે.

પૂજયપાદ ગુરુદેવે લક્તામર સ્તોત્રની આરાધનાનો ગ્રારંભ આ તીર્થમાં જ વિ. સં. ઐહેજાર પચ્ચીસનાં પોષ સુ એકમના દિવસે કરેલ, જે અદ્યાપિ અખંડ નિયમિત ચાલે છે; અને હવે તો ગુરુત-  
સમી આ આરાધના જની ગઈ છે.

### તીર્થમાં પુનઃ ગમન

અમારા પૂજય મોટા મહારાજ સર્વોદ્યાશીળ મ ના શુલ્ષાશિપથી કું સાંધી કુલયશાશી અને સાઠ પાર્શ્વયશાશીને લઈને જાપ માટે ગઈ. વીસ દિવસનાં જાપની શરૂઆત કરી. જાપ દરમ્યાન સમગ્ર  
વ્યવહાર, વાચન સ્થગિત રાખ્યું. છેવટે પુનઃ પ્રેરણું થઈ. દ્શ  
વૈકાલિકનું શું? ખસ, તે દિવસો દરમ્યાન રોજ એ, ત્રણ, તો

કોઈવાર ચાર પ્રકરણો લખવાનાં શરૂ કર્યા. જેમ પ્રકરણ લખાય, તેમ પૂજ્ય ગુરુદેવની સેવામાં મોકદ્વાવતા હનાં. પૂજ્ય ગુરુદેવ વાચે, પૂ. ગુરુદેવ પ્રોત્સાહન આપતાં રહ્યા અને જાપ દરમ્યાન પચાસ પ્રકરણ લખાયાં. આમ, પ્રકરણોની સંપૂર્ણ કોપી સાધી અર્હત-પદ્માશ્રીજીએ કરી અને અમે પૂજ્ય ગુરુદેવને વંચાવતાં રહ્યાં.

શ્રી દશવૈકાલિક સૂત્ર અગેનું ભાડું આકર્ષણું પચીસ વર્ષ પુરાણું હતું.

### ગુરુ મુખે વાચના

વિ. સં. ૨૦૧૦ નું ચાતુર્માસ સિદ્ધક્ષેત્ર પાલીતાળ્યામાં. અમારા-પૂજ્ય ગુરુદેવે પૂર્ણ રત્નચૂલાશ્રીજી મ. સા. અને મને દશવૈકાલિકની વાચના આપનાનો પ્રારંભ કર્યો. વાચનાના પ્રારંભમાં પૂજ્ય દાદા-ગુરુદેવના આશીર્વાદ લેવા ગયા. પૂજ્ય દાદા ગુરુદેવે શુભાશિષ આપી-કર્યું, “ દશવૈકાલિક સૂત્ર પરમ પવિત્ર આગમ છે. પૂર્ણ સેન સૂરી-શ્રગ્રહ મ. દશવૈકાલિકનાં ચારુ અધ્યયનનો પાઠ કર્યા વગર જલપાન પણ કરતા નહિ વિકિમ વિજ્ય ! તમને વાંચના આપશો, તમે ખૂબ લખો.” પૂજ્ય ગુરુદેવ (વિકિમ સૂરીશ્રગ્રહ મ) હૈથાનાં હીર.વહાવી જાનનાં દાન કર્યા. ત્યારથી દશવૈકાલિકનું આકર્ષણું જગેલ અને અમારા પૂર્ણ દાદા ગુરુદેવ અંતિમ અવસ્થામાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ખૂબ પ્રધાનતા આપી હતી, તેથી આ એ આગમ ઉપર અનેરું આકર્ષણું રહ્યું છે.

અમારાં અનંત ઉપકારી તીર્થાંકર પરમાત્માનાં પુણ્યની રમૃતિ-સાના દાદા ગુરુદેવ લઘિંદ્રસૂરીધીરજી મ. સા., પૂર્ણ દાદા ગુરુ દેવની પુનિત નિશાથી મારો સંયમનો શૈશવકાળ ધન્ય બન્યો. પૂજ્યશ્રીની રમૃતિ થતાં શૈશવકાળનાં બાર વર્ષ ( સંયમજીવનનાં ) આંખ સામે તાદ્દશ થાય છે. આપો અશુદ્ધી સલાર બની જાય છે..

તે પૂજયથીનાં અદરથ ચરણ—કમળમાં ભાવનતના કરતાં એક ૪  
નાન વિનિતિ: “પૂ. દાદા ગુરુદેવ ! બસુ આપનો ઉપદેશ અને મારા  
માટે સંવેદ ને લાવો હના તે સહેળ કરવાની શું આ બાલિકાને  
શક્તિ ન આપો ? ”

### ચિંતન કરો -

અમારાં પૂજય ગુરુદેવની સનત પ્રેરણાએ યુવાવસ્થામાં પણ  
શાનપિપાસા તીવ્ર રહી. અહમદનગરમાં એકવાર પૂજય ગુરુદેવે  
એક મુનિને કહ્યું, “ચિંતન કર, વિનય સમાધિ કેમ ? તપ સમાધિ  
કેમ ? શ્રુત સમાધિ કેમ ! અને આચાર સમાધિ કેમ ? ” બસ,  
.ત્યારથી દશવૈકાલિક સૂત અંગે એક માનસિક ચિત્તન આલનું હતું.  
આજે પૂજય ગુરુદેવની દૃપાએ છદ્યમાં રહેલ શુભસાવ પત્ર પર સ્થિર  
થયા. મહામના મહાપુરુષોની તારકદૂપા દ્વારા ૪ મારા માટે  
અશક્ય તે શક્ય બન્યું. દશવૈકાલિકનું ચિંતન કરતાં સહેવ એક ૪  
ભાવ રહ્યો છે. ધ્યાનગોગમાં ક્યારે આગળ વધીશ ? ધ્યાન અને  
નાપમાં ખૂબ ૪ સુચિ અને આનંદની અનુભૂતિ થાય છે. મારે  
આત્મ-વિશ્વાસ છે ગુરુદૂપા દ્વારા સર્વ ક્ષેત્રમાં સિદ્ધિસાધક બની  
શકાય છે.

### વિવિધ રીતે ગુરુપૂજા

છેવટે ધન્ય હિંસ આપ્યો. વિ સં ૨૦૩૫ નાં જેઠ સુદ  
-ગીને પચાસ પ્રકરણુ પૂજય ગુરુદેવને અર્પણ કરી ભાવપુષ્પથી ગુરુ-  
પૂજ કરી શકી. આ પ્રસંગે શક્તિનાં સ્લોત અને જ્ઞાન-ધ્યાન-તપ-  
આરાધનામાં આનંદ અનુભવતાં અમારાં સાધ્યા મંડળને એક મંગલ  
ગ્રલાને માર્ગ-દર્શન આપ્યું. આપણે પણ સૌંઘ્રે ગુરુ-પૂજામાં કંઈક  
કરવું જોઈએ

અમારાં વિદ્યારી વડીલ લગિની પૂજય રત્નચૂલાશ્રી મ. ને  
“વિનિતિ કરી : તમેઓ વિકભ-સકનામરનું સર્જન કરો. અમને સૌને

અનેરી પ્રેરણું મળશે. વિહુંની સાધ્યા નયપદ્માશ્રીજી ! વિનય ઉપર પચાસ પાનાં લખાય તો લખો. સાધ્યા અર્હતપદ્માશ્રીજી ! તમે સુરેખ અને કલાત્મક અક્ષરોમાં લક્તામર સ્તોત્ર આવેણો. ચિંતક સાધ્યા શુભ્રાંશુયશાશ્રીજી ! દ્વાવિધ કમા ધર્મ ઉપર પચાસ પાનાં લખાય તો લખો. સાધ્યા શીતાંશુયશાશ્રીજી ! પંચ પરમેષ્ઠી ઉપર સર્વતમાં લખો. સાધ્યા પુનિતયશાશ્રીજી ! તમે પંચાચાર ઉપર પચાસ પાનાં લખો, સાધ્યા તીર્થયશાશ્રીજી ! તમે જૈન ધર્મની ઇપરેઆનું ધર્મલિંગ લાષામાં રૂપાતર કરો.

આ તમારી સમક્ષ મારા મનોરથ છે. જે આ સર્જન થાય, તો અવ્ય ગુરુપૂજા આપણે સૌ કરી શકીશું.

મારી તો ભાવના હતી, આ આદેખન હસ્તલિપિ જ રહે... પણ જિંદગીમાં જેણે સ્વતું કશું રાખ્યું નથી અને શાસન તથા ગુરુચરણે સર્વસ્વ સમર્પિત કર્યું છે, તેવા અમારા પૂજય મોટા મ. સર્વોદ્યાશી મહારાજની આંતરિક ઈચ્છા હતી. ગુરુપૂજાનાં નિભિત પામાંને લખાયેલ અંથ પ્રકાશન થવો જોઈએ. શક્ય સૌની ઈચ્છાને સત્કારવી જોઈએ, તે ઉપકારીની આજા કેમ અરનીકાર્ય કરાય ? ઉપકારક તો સંદ્રા ઉપકાર કરતા રહે જ. તેઓની પ્રેરણાથી જ સૌજન્યરીલ શી ખીમચંદ્રાઈ અને કંચનઅને હૃદ્યની હાર્દિક લોવનાથી આ અથ પ્રકાશનનો લાલ અમને જ આપો તેવી વિનાનિ પૂજય ગુરુદેવને કરી.

### સુપાદન કાચુ

પૂજયપાદ ગુરુદેવ ની નારક નિઅા જેણલે શાસન-ગ્રલાવના, શાસન રહ્યા અને રાનનાં અખંડ આરાધન આલતાં જ હોય, સમય વીનતો ગયો. અદ્યપશાનનાં કારણે તુટિ, અસ્ત-બ્યસ્તતા તો ખરી. પૂજયપાદ ગુરુદેવની આજાથી અમારા પૂજય ગુરુઅંધુ. રાજ્યશિવિજ્યજ્ઞ

મહારાજ કે ને સહૈવ શાસનકાર્યમાં રત રહે છે, સાચે પૂજ્ય  
મુનિશ્રીનો મંત્ર છે, ગુરુહેવની આશાનું નહિ, પણ અલિપ્રાયનું-  
સાવનું આરાધન કરવાનું તેથી તેઓએ આ પચાસ પ્રકરણુના  
લેખન સંપાદનનું કાર્ય સ્વીકારી એને ખૂબ જ સુંદર રીતે સંપાદન  
કરી આપ્યું.

### પ્રેસ કોપી અને સહાયકો

પૂજ્યપાદ ગુરુહેવ, પૂજ્ય મોટા મ. સા. ( સર્વોદ્યાશ્રીજ )  
કોઈમૃતુર પધાર્યા. હૈદ્રાબાદ-સિકંદ્રાભાદમાં પૂજ્ય ગુરુહેવની આશાથી  
મારા વડીલ પૂજ્ય રતનચૂલાશ્રીજ મ. તથા મારે પંદર ઢાણુને સ્થિરતા  
કરવી પડી. શાસન કાર્ય, શરીરની કંઈક પ્રતિકૂળતા, પ્રમાદ મારા  
મનની લાવનાને સહૃદી થવા હેતો ન હતો, પણ પૂજ્ય રતનચૂલાશ્રીજ  
મહારાજે કહક આશા કરી. બસ, પ્રમાદ હટયો, પ્રયત્ન વિકસિત બન્યો.  
તે દરમ્યાન ખુલારામ આવવાનું થયું. ત્યાંની શાંતિ અને રમણીયતાથી  
અન પ્રકૃતિલિત બન્યું. શરીર સાથ આપે તેવું લાગ્યું. ચાર દિનસમાં  
કાર્યને પૂર્ણ કરવાનું. સૌનાં સહકાર વગર અશક્ય અમારાં સાધ્યી  
મંદળમાંથી ઉત્સાહી સાધ્યી અર્બતપદ્માશ્રી, શુભાંશુયશાશ્રી, પુનિત-  
યશાશ્રી અને પ્રશાન્તિયશાશ્રીએ પ્રેસ કોપી કરવામાં ઉત્સાહ બતાવ્યો  
સૌ પ્રયત્નમાં લાગ્યાં. પણ પ્રશાન્તિયશાશ્રીને સહકાર પ્રશાંસાને પાત્ર  
છે. આ સર્જન દારા ખુશી થશે મારી લધુભગિની સાધ્યી  
શુલોદ્યાશ્રી ને, ને છેલ્ખાં કેટલાંક વર્ષોથી પૂ. ગુરુહેવની આશાને  
આધીન થઈ પદ્ધતીવાલ ક્ષેત્રનાં ઉદ્ઘારનું કાર્ય કરી રહેલ છે.

### ઉપકાર

છેવટે મને આજે સંતોષ છે. પ્રેરકની પ્રેરણું સહૃદી બની.  
દુશ્વૈકાલિકનાં પચાસ પદ ઉપર ને ચિંતન થયું છે, તે શુલુષ્પાનું  
કરી છે. ઉપકારી તરફથી મળેલ અર્ધ ઉપકારીની સેવામાં !

## આનંદ ગુરુની પૂજનો !

હું તો પ્રમાણી છું. અશાન અને ભાવવાહિતામાં કચાંય પ્રભુ શાસન અને મહાપુરુષનાં આશય વિરુદ્ધ લખાયું હોય, તો પ્રથમ ક્ષમા ! હાર્દિક ભાવે નભ વિતંતિ, મારા પર કૃપા રાખી અવર્ય દિશા સૂચન કરજો. બાકી કંઈ પણ સુંદર લેખન થયું હોય, તો તે ગુરુનાં આરીવાંદનો સ્નોત છે.

### જાખના

એક જ જાખના છે, “ને છન્દ મારા હૃયદી સ પૂજનો” ગુરુહેવનાં અલિગ્રાયને અતુસરવાની શક્તિ મળે. ગુરુચરણનાં આલંઘન દ્વારા શાખત સ્થાન તરફ આગેકૂચ કરું. “નૈન” જયતિ શાસનમ् ”તો અનુપમ નાદ ગુંજિત બનો. એ જ અલિલાધાયે વિરમું છું.

શ્રી મહાવીર જૈન પાઠશાળા, } ૬ : પૂજય સાધવી સર્વોદ્યાશ્રી મ.  
ભુલારામ, હૈદ્રાબાદ. } નિશ્રાવતી  
તા. ૧૮—૫-૮૧ } સાધવી વાચયમાશ્રી

# શ્રી દ્શવૈકાલિક સૂત્રની સાહિત્યયાત્રા

શ્રી દ્શવૈકાલિક સૂત્ર લેખિકા  
પુ. સાધ્વીશ્રી વાયંયમાશ્રીજી મ.

## એક સંક્ષિપ્ત પરિચય

જિનેથર પ્રદુના શાસનમાં પાંચ પ્રકારનાં જોનું નિર્ણય છે : ભતિજીન, શુતરીન, અવધિજીન, મનઃપર્યજીન અને કૈવળજીન. તેમાં શુતરીન સ્વપર પ્રકારશક છે. શુતરીનના સુખય એ બેદ છે. (૧) અંગભાષા અને (૨) અંગપ્રવિષ્ટ. અંગભાષા શુતરીનના એ બેદ છે. (૧) ઉત્તાલેક અને (૨) કાલિક.

શ્રી દ્શવૈકાલિક સૂત્ર અંગભાષા ઉત્કાલિક શુતરીનાન છે. પ્રસ્તુત સૂત્રના રચયિના પૂજ્ય યૌદ્ધૂર્ણિધર શાય લંવ સૂરીશ્વરજી મહારાજા છે. પોતાના બાળપુત્ર મનકુંનું અદ્ધ્યાયુપમાં શાય કલ્યાણ થાય તે માટે ત્વિસના અંતિમ પ્રહરમાં કંઈક સમય અવશેષ હતો, ત્યારે આગમોના મંથન દારા દ્શવૈકાલિક સૂત્રની રચના કરી છે. મુનિ મનકના કાળધર્મ બાદ સમસ્ત સંધની વિનંતીથી અલપમેધાવી; અદ્ધ્યાયુષ્ટ વર્તમાન સમયના જીવોના કલ્યાણાર્થે સૂત્ર ચિરંજિવ કરાયું; અને કહેવાય છે કે પ્રચમ આગના અંતિમ આચાર્ય ભગવંત હુએપણ સૂરીશ્વરજી મહારાજના સમય સુંદરી શ્રી દ્શવૈકાલિક સૂત્ર પ્રવર્તમાન =હેઠે

શ્રી દ્શવૈકાલિક સૂત્રની નિર્યુક્તિની યૌક્રમી ગાથામાં કર્ણું છે કે જિનપ્રનિમાનાં દર્શન વડે પ્રનિમોધ પ્રાપ્ત કરેલ મનકના પિતા દ્શવૈકાલિક સૂત્રનાં નિર્યૂંહક શ્રી શાયંલવ ગાથુર્ધરને વદ્દન કરું છું.

“ સેન્નેભત્રે મણધરં જિણ / ડિમાદંસેણ પડિબુધ્ધં ।  
મણગપિઅરં દસ્ત્રે કાલિયસ્સ નિજ્જૂહગં વંદે ॥ ”

તે જ નિર્ણિતિની ૧૬ મી તથા ૧૭ મી ગાથા કહે છે. દ્વા-  
વૈકાલિકનું નિર્ણાહન આ પ્રમાણે કર્યું છે.

આત્મ-પ્રવાહપૂર્વમાંથી ધર્મ પ્રશાસ્તિ નામનું ચોથું અધ્યયન,  
કર્મ પ્રવાહપૂર્વમાંથી પિંડએણા નામનું પાંચમું અધ્યયન, સત્યપ્રવાહ  
પૂર્વમાંથી વાક્ય શુદ્ધિ નામનું સાતમું અધ્યયન; બાકીનાં અધ્યયન  
૧ લું, ૨ લું, ૩ લું, ૫ કું, ૮ મું, ૯ મું અને ૧૦ મું અધ્યયન,  
નવમા પ્રત્યાપ્યાન નામના પૂર્વની ત્રીજી વરસ્તુમાંથી ઉધ્ઘૃત કરેલ છે.

આયપ્પવાયપુબ્વા નિર્જૂઢા હોઈ ઘર્મપજીતી ।

કર્મપ્પવાયપુબ્વા પિંડસ્સ પસણા તિવિહા ॥૧૬॥

સચ્ચપ્પવાયપુબ્વા નિર્જૂઢા હોઈ બકસુદ્ધી ઉ ।

અબસેસા નિર્જૂઢા નવમસ્સ ઉ તદ્યવત્થુઓ ॥૧૭॥

### વિષય સૂચના

શ્રી દ્વાવૈકાલિક સૂત્રની નિર્ણિતિની ૨૦ થી ૨૪ ગાથામાં  
અધ્યયનનાં વિષયોનું રૂપણીકરણું કર્યું છે.

અધ્યયન	શ્લોકસંખ્યા	વિષય
૧. દુભપુણિકા	શ્લોક ૫	ધર્મ પ્રશાસ્તા
૨. આમણ્ય પૂર્વિકા	શ્લોક ૧૧	ધૈર્ય
૩. કુલલક્ષ્માર	શ્લોક ૧૫	આચાર વળ્ણન
૪. ધર્મ પ્રશાસ્તિ પદુ જીવનિકા	શ્લોક ૨૮	આત્મ સંયમ અને જીવ સંયમને ઉપાય
૫. પિંડએણા	શ્લોક ૧૫૦	લિક્ષા વિશુદ્ધિ
૬. મહાચાર	શ્લોક ૬૮	વિસ્તૃત આચાર વળ્ણન

७ वाक्य शुद्धि	श्लोक ५७	वाक्य शुद्धि-सापाने। विवेक
८ आचार प्रतिष्ठि	श्लोक ६४	आचारनुं अनुपमवर्णन
६ विनय समाधि	श्लोक ६२	विनयवर्णन
	सूत्र-७	
१०. सलिक्षु	श्लोक २१	लिक्षुनुं वर्णन

### चूलिका :

श्लोकसंख्या विषय

१ रतिवाक्यो श्लोक १८ संथममां अस्थिरने स्थिरीकरण  
सूत्र-१

२. विविक्तयर्था श्लोक १६ विविध मुनियर्थानु वर्णन

पहमे धम्मपसंखा सो य इहेवौ जिणसासृणमित्ति ।  
बिहप बिहप सक्का काउ जे पस धम्मोत्ति ॥२०॥

तहप आयारकहा उ खुड्हियो आयसंजमोवाओ ।

३ तह जीवसंजमोऽवि य होई चउत्थंमि अज्ञायणे ॥२१॥

मिक्खविसोही तवसंजऽस्स गुणकारिठा उ पंचमप ।

छद्घठे आयाहुकहा महई जोगा महयणस्स ॥२२॥

वयणविभत्ती पुण सत्तममिं पणिहाणिमढुमे भणिये ।

णवमे घिणओ दसमे सामाणियं पस भिक्खुत्ति ॥२३॥

दो अज्ञायणा चूलिय विसीथियर्थं ते थिकरणमेगं ।

बिहप विवित्तवरिया असीयणगुणाइरेग फला ॥२४॥

## ગૌરવલભુ' સ્થાન

શ્રી દ્શવૈકાલિક સૂત્ર જિનશાસનના ચાર અનુયોગમા ચરણ-કરણાનુયોગ પ્રધાન વિશિષ્ટ સૂત્ર છે. કોઈ પણ ધર્મ તેનાં વિશુદ્ધ પાલકનાં આચારઅળથી જ વિસ્તૃત થાય છે, તેથા જૈનશાસનમાં દીક્ષિત અનતા જ મુનિને આચારાંગસૂત્રનાં શલ્વપરિજ્ઞા અધ્યયનનો અભ્યાસ કરાયા બાદ ઉપસ્થાપના (વડી દીક્ષા) અપાતી. હાલ પણ જ્યારથી શ્રી દ્શવૈકાલિકસૂત્રની રૂચના થઈ, ત્યારથી શ્રી દ્શવૈકાલિક-સૂત્રનાં ચાર અધ્યયનના અભ્યાસ બાદ ઉપસ્થાપના કરવામાં આવે છે. આ જ અતાવે છે કે જૈનશાસનમાં આ સૂત્રનુ' કેટલુ' ગૌરવલભુ' સ્થાન છે.

શ્રી જૈન સધમા માગલિક ઉચ્ચચારણ વખતે દ્શવૈકાલિકનું પહેલુ' અધ્યયન જ ઉચ્ચચારવામાં આવે છે. પ્રાયઃ પ્રત્યેક સાધુ-સાધી આ સૂત્રને કંઠસ્થ કરે છે કેટલાંય સ્વાધ્યાય-પ્રેમી, સાધુ-સાધીએ મ. ચાર અધ્યયનનાં સ્વાધ્યાય બાદ જ પાણી વાપરે છે. છેવટે સતત ગાથાનાં સ્વાધ્યાય પહેલાં તો કોઈ પણ સાધુ-સાધી આહાર કરતાં જ નથી.

## પંચાંગીથી પૂર્ણ'

શ્રી દ્શવૈકાલિક સૂત્ર પંચાંગી પૂર્ણ છે. તેનાં ઉપર નિર્ધારિત, લાખ, ચૂણી અને અનેક દીકાગ્રો છે. તેમાંથી મુખ્ય ઉપલખ્ય સાહિત્ય નીચે મુજબ છે.

શ્રી દ્શવૈકાલિકસૂત્રની નિર્ધારિતના ઉછો' શ્લોક છે. તેના રચયિતા દ્વિતીય લદભાડુસ્વામી છે. લાખની ગાથા ૬૩ છે. તે અર્ણાન કર્તૃએ છે. વર્તમાનમા દ્શવૈકાલિકની બે ચૂણીઓ છે. એકનાં રચયિતા અગસ્ત્યસિંહસૂરીશ્વરણ છે. બીજી ચૂણીનાં રચયિતા જિનદાસગણિ મહાતર છે.

શ્રી દ્શવૈકાલિક સૂત્રની અવચૂર્ણ પણ છે. શ્રી દ્શવૈકાલિક-સૂત્રની અનેક ગીતાઓ છે, પણ વિશિષ્ટ અને અદ્વિતીય ગીતા છે ૧૪૪૪ અંથ રચયિતા આચાર્યપુંગવ શ્રી હરિલદસ્સરીશ્વરજી મહા-રાજની શિષ્યાધિની ગીતા. પાપનીય સંઘના અપરાજિત સૂર્ય યા વિજ્ઞાચાર્યની વિજ્ઞાદ્યા નામની ગીતા છે. (પરંતુ ઉપલબ્ધ નથી.) પૂજય હરિલદસ્સરીશ્વરજી મ. રચિત ગીતાના આધાર ઉપરથી શ્રી તિલકાચાર્ય ગીતા બનાવી છે. શ્રી ભાણુકયશેખરની નિર્ણયકીય દીપિકા ગીતા છે. શ્રી સમયસુંદરજીની દીપિકા ગીતા છે. શ્રી વિનયહંસજીની પણ ગીતા છે. શ્રી રામચંદ્રસરીશ્વરજી મંતું વાર્તિક પણ ઉપલબ્ધ છે. અદ્યાપિ શ્રમણસંધમા દ્શવૈકાલિક સૂત્ર ઉપર ચિંતન મનન ચાલુ છે અને તેનાં ઉપર અંથેતું સર્જન થયા કરે છે.

શ્રી દ્શવૈકાલિક સૂત્ર એક એવો અદ્વિતીય સંગમ છે, જેણે ચિંતામાંથી ચિંતન તરફ દોરી જય તવે અક્ષય ખળનાનો મહા-સાગર આધો છે.

પૂજય શાચ્છવસરીશ્વરજી મહારાજને અલપાયુષ્ક સુનિ મનકના હિતની ચિંતા થઈ અને દ્શ અધ્યયનની રચના થઈ; અને કલ્પ-સૂત્રમાં જેમના ભાટે વિશેપણ છે. ‘પુત્રી તુલ્યા’ એવા ધક્ષા સાધ્વીજી મ.ને પોતાના ખુહના આરાધકપણાની ચિંતા થઈ અને પ્રભુ સીમાંધર સ્વામીના સમોવસરણમાં પહોંચ્યા. થક્ષા સાધ્વીજી મહારાજ એક આરાધક મહા મહતારા સાધ્વીજી હતા, તેથી પ્રભુ સીમાંધર સ્વામી પાસેથી ચાર ચૂલિકા લાવ્યા, જેમાંથી એ ચૂલિકા દ્શવૈકાલિકમાં સ્થાપિત કરવામાં આવી.

### સૂત્રના અંતરેંગ

આચે જ ચિંતા જીવનને કોરી ખાય છે, ત્યારે હિતચિંતા કંઈ અનોખું-આગવું સર્જન કરે છે. પુત્રની ચિંતા અને સ્વની ચિંતા

‘લિન છે. યુગ-કાલ-લિંગ-અવસ્થાના ભેદ લિન હોય, તો પણ મહાપુરૂષોની-લબ્યાતમાઓની હિતવિત્તિ-હિતચિંતા લિન નથી હોતી. એકે આગમ મંથન કર્યું...તો એકે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરણ કર્યું, ...પણ...હિતનું આરાધન કર્યું. હિત અને મંગલની લાવના જ મંગલ છે. કોઈ વ્યક્તિ કે કોઈ પ્રસંગને જદેશીને પ્રારંભ થાય, પણ પછી તેના દ્વારા સર્વનું મંગલ થાય. મુનિ મનકના મંગલાર્થે સર્જન થયેલ દ્શવૈકાલિકસૂત્ર એકવીશ હળવર વર્પ સુધી અવિરત મંગલનો સ્નોત બની અનેક સાધકને અધ્યાત્મના અમીપાન કરાવશે.

શ્રી દ્શવૈકાલિક સૂત્રની શૈલી ગદ્ય-પદ્યમય કાવ્યાત્મક છે. જ્યાં તેના શખદનો સંચાર થાય, ત્યાં આશ્રવના...કૃષાયના...દ્યદ્રિયના... એગનાં તોફાન શાંત થવા લાગે છે. શ્રી દ્શવૈકાલિક સૂત્રની શખદ મધુરતા એના સ્વાધ્યાયમાં લીન બનનારા જ અનુભવી શકે છે. જેમં... ‘મા’ શખદ બોલતાં બાળક થાક્તો નથી...કંટાળો અનુભવતો નથી.

પ્રેમી પ્રેમપાત્રના નામના પુનઃ પુનઃ સમરણમાં આનંદ અનુભવે છે.

તેમ સાધક મહાત્માઓ દ્શવૈકાલિક સૂત્રના સ્વાધ્યાયમાં એક અનોખી ભરતી અનુભવે છે. દ્શવૈકાલિકનો સ્વાધ્યાય કરતા સાધકને જોઈ એ ત્યારે લાગે કે...શું આ અમૃતનો આસ્વાદ કરી રહ્યો છે? અને જ્યારે શ્રી દ્શવૈકાલિકસૂત્રના અર્થ અને તેનું ચિંતન ચાલે છે, ત્યારે લાગે કે શું રતનના ચાહકને રતનની પ્રાપ્તિ થઈ રહી છે?

શ્રી દ્શવૈકાલિક સૂત્રના દરેય અધ્યયનો અર્થની દશ્ટિએ સાગરથી પણ અધિક વિશાળ અને ગંભીર છે મુનિ જીવનને લગતા દરેક પ્રશ્નોને આ સૂત્રમાં આવરી લેવામાં આવ્યા છે અને સાથે સાથે સુકોમળ ભાપામાં આત્માને સમાધાન થાય તેમ દરેક પ્રશ્નોનો જવાબ આવરી લેવામાં આવ્યો છે.

શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથાનો અક્ષર ‘ધ’ અક્ષર-શાસ્ત્રના નિયમ મુજબ ઉત્તમ-લાલદ્વારાયક-સર્વ મુખ્યાણુદ્વારાયક અને વિજયકારક છે.

### મહામાંગલિક

શ્રી દશવૈકાલિકનું પ્રથમ અધ્યયન અને તેની પ્રથમ ગાથા એટલે લાગે વિશ્વનો સાર . ! ધર્મ-ઉત્કૃષ્ટ અને અગલ...આવા ત્રણું પ્રથમ શઃપદ જ વ્યક્તિમાં ઝંખના પેતા કરે.

કયો ધર્મ ઉત્કૃષ્ટ મંગલ...? તરતજ તેનું સમાધાન.

અહિસા-સંયમ અને તપના ત્રિવેળી સંગમ સમો...!

ધર્મનું પાલન કરું તો શું...?

ત્રણું લોક તારા ચરણો.. !

પ્રથમ શ્લોકનું ચિંતન જ માનવીને આકૃષ્ટ કરી હે છે, પણ ખીન શ્લોકો...ખીન અધ્યયનો વાંચન કરવા સાધકને-જિજ્ઞાસુને પ્રેરણ્ણા કરવી પડતી નથી. સાધકને પહોંચાં જ શ્લોકમાં એવી લગતી લાગે છે હે ખીન શ્લોક આપ મેળે વગ્યાઈ જય છે અને સ્વેચ્છાએ દશવૈકાલિક સૂત્ર પર ચિંતન થર્ઢ જય છે.

આમ દશવૈકાલિક સૂત્ર સાહુતાના વિકટ રાહ પર એક નિકટનો ચિંતક ર્મત્ર બને છે હિતચિંતક સખા સમો બને છે અને પરમ અને ચરમ ઉપાદ્ય મોક્ષની પ્રાપ્તિમાં અનન્ય સહીયક બને છે !

ખ્સ, મારા જૈવા અનેક આત્માનું ભાર્ગવીંશન કરતો આ મહાવૈરાગ્યવાહી અંથ સહુનું કલ્યાણ કરે, એજ અલિલાપા.

‘ દુશાવૈકાલિક ’—સાધુઆચારનો,

મહાગ્રંથ

કરુણાનિધાન પૂ. શાયંલવસૂરીશ્વરજી મ. ના હૃદયમાં  
લાવકરુણા લહેરી છે. પોતાના પુત્ર મનકને તેની માતાના  
ઉદ્દરમાં હતો, ત્યાં જ છોડી, પૂ. શાયંલવસૂરિજી મ. દીક્ષિત  
થયા હતા. બાળક મનક આઠ વર્ષનો થતાં પિતાને શોધવા  
નીકળ્યે. તેના પિતા તો જગતમાં મોર્જુંદ હતા, પણ માત્ર  
તેના પિતા રૂપે નહીં, જગતપિતા સાધુ રૂપે! મનકે આ  
સાધુ ખનેલ પિતાને શોધ્યા તો, ખરા, પણ... પણ એ  
લાવકરુણાના સાગરે તે પુત્રને પણ સંસારતારણી દીક્ષા  
આપી. દીક્ષા આપ્યા બાદ ભાવિ જોયું રે! ખસ! બાલક  
માત્ર છ જ મહિનાનો મહેમાંન છે. ડેમળ આ બાળક  
સાધુપણાના કઠોરજીવનમાં છ મહિનામાં સાગર કેવાં  
શાસ્કોનો પાર કેવી રીતે પામશો? અને શાસ્કનો મર્મ નહીં  
જણે, તો સંસારને તરશે કેવી રીતે?

ભાવકરુણાના સ્વામીને મૃત્યુની ચિંતા ન હોય, તેને  
ચિંતા હોય તેના આત્માના હિતની. મૃત્યુ બાદ પણ કથાં  
પહોંચશે તેની; અને તેથી જ ભાવકરુણાના નાયક સૂરિ-  
લગવંત પૂ. શાયંલવ સૂરીશ્વરજીએ આ પુત્રની સંયમયાત્રા

સાર્થક ખનાવવા અદ્યપસમયમાં સક્રિલ કરવા એક પુરુષાથી  
કર્યો. તમામ આગમ અને પૂર્વમાં રહેલ સાધુ આચારને.  
આલક સમજે એ રીતે સંગૃહીત કર્યો. અનેક આગમરૂપ.  
પુણ્યોમાંથી એક સાધુ આચારના ક્રમાનની માળા ખનાવી.  
આ જ અંથ આજે જગતમાં દશવૈકાલિકના નામથી પ્રસિદ્ધ છે.

આ મહાન અંથ આમ તો સાધુલુલવનના આચારને  
અનુલક્ષીને રચાયો છે, પણ તેમાં માનવલુલવનનાં તૈકાલિક  
સત્યો છે. શ્વેઠ શ્વેઠ માધુયો છે, શ્વેઠ શ્વેઠ લાવ-  
કરણુની જલક છે. શીધ આત્મહિત કરવા માટે હોટ મૂકી.  
શક્કિએ તેવી એક નવી પગદંડી છે. આ પગદંડી પર હવે  
આપણે ચિંતનની ચકોર નજરે પા...પા...પા...પગદી માંડવાની છે.



# ૧. ધર્મભો મંગલ મુક્કિટું

ખ

વિશ્વનો પ્રાયેક વિચારક માનવ મંગલની ઝંખના કરે છે મંગલની સાધના, મંગલના સંશોધન, મંગલની શરણાગતિ માનવીનું લક્ષ્ય છે.

જેમ કસ્તુરીએ મૃગ સુગંધ માટે આખું જરૂર ફરી વળે છે. પણ ખુહની નાલિમા રહેલ સુગંધીને-કસ્તુરીને પીણાણી શકતો નથી અને અંતે થાડીને ઘૂમ મારે છે અરે! સુગંધ ક્યાં છે? તેમ માનવ પણ મંગલ માટે માર્યો માર્યો કરે છે. કોઈ જ્યોતિષી પાસ હોડે છે. કોઈ હસ્તશાખી પાસે હોડે છે. કોઈ એકાદી શ્રીકૃષ્ણની શોધ કરે છે. કોઈ દક્ષિણાવર્તી શંખની આગળ પાછળ દેરા મારે છે અંતે ઐદુ ઓદું સાખિત થાય છે અને માનવ બરાડી ભોડે છે મંગલ ક્યાં છે? હું મંગલનો ચાહુક અને મને મંગલ ના મળે?

જ્યાં સાચી ઝંખના છે ત્યાં કશું અશક્ય નથી સર્વ વર્ષુ સુલભ છે, દુર્લભ નથી પણ કરોડો ટન રેતી પીડો. પણ તેમાંથી એક દીપુ પણ તેલ ના જ નીકળે. સાચે તેલની જરૂર હોય તો તલ જ પીસવા જોઈએ. પથરણ ભૂભિમાં ગમે તેવા બીજ નાંખો અને પાણી સીયો. ત્યાં પુણ્ય ન પાંગરે અરે! એકાદ અંદુર પણ નવપદ્ધતિન ન થાય. સાચે પુણ્યની ચાહના હોય તો ઢાણી માટી અને કંગદુપ ભૂભિમાં બીજ વાવવું જોઈએ પછી પાણી સી ચો એકાદ રાત્રિમાં અંદૂરો નવપદ્ધતિન થઈ જાય. અને એ ચાર દિવસમાં પુણ્યના પ્રમરાટથી નાતાનરણ મધ-

મધતું થઈ જય. હુનર વાર હુનર ખોટી ચાવી ફેરવીએ તો તાજું ના જિધડે. તાજું જિધાડલું હોય તો એક જ સાચી ચાવી બસ છે. એક જ વાર ચાવી ફરશેને તાજું જિધડી જરો

## માનવ!

સાચું કહી દે, જરા પણ વાર ન કર તારે મંગલ જોઈએ છીએ? નિર્ણય કરીને ઓલ, ઉતાવળ ના કરતો ગેરયડ ના કરતો અંતરના ઊંડાણુથી જવાય આપ કે તારે શું જોઈએ?

## મહાત્મા!

શું આપને મારી વાતમાં અસત્યનો સ્વર લાગે છે? હું ખોટો લાગું છું? મંગલ માટે તો મેં સમસ્ત પૃથ્વીની પરિકૃત્તમા કરી સાચું કહું છું. દ્વો દ્વિશાભાં લભી વળ્યો પણ મંગલના ફર્શન હુર્લાલ છે. મહાત્મા પ્રતિશાપૂર્વક કહું છું. હું મંગલનો ચાહક છું. મગલની પ્રાપ્તિ માર્દ ધ્યેય છે. ઓલ તારી મંગલની વ્યાખ્યા? મગલને સમજુશ નહિ તો મંગલના નામે અપમંગલનો આરાધક અની જઈશ.

તારી મંગલના વ્યાખ્યા આવી જ ને?

સુખને કરે તે મંગળ અને હુખને હરે તે મંગળ

પણ કોણું મંગળ? શ્રીફા-સ્વસ્તિક-પુષ્પમાળ- બહારના જ પદાર્થ ને? બનલું છે ગણિતના પારંગત અને ભૂલ કરે છે એક, બે, ત્રણ ગણવાભાં. મેળવલું છે મંગળ અને ભૂલ કરે છે મંગલની વ્યાખ્યા સમજવાભાં...

“જે હુઃખને કરે તે મંગળ નહિ પણ હુઃખને પેદા જ ન થવા હે તે મંગળ.”

“જે સુખને કરે તે મંગળ નહિ પણ સુખની ચાહના ન થવા હે તે મંગળ”

“જે પાપને હૂર કરે તે મંગળ નહિ પણ પાપના અધ્યવસાય પેદા થવા ન હે તે મંગળ”

‘જે રોગને હૂર કરે તે મંગળ નહિ પણ  
અશાતાવેહનીય કર્મનો બંધ થવા ન હે તે મંગળ”

‘જે ભરણુને રોકે તે મંગળ નહિ પણ  
આધુાય કર્મનો બંધ થવા ન હે તે મંગળ”

“જે કષ્ટોને કાપે તે મંગળ નહિ પણ  
લવના બ્રમણુને હૃદાવે તે મંગળ.”

“જે અહિત ન થવા હે તે મંગળ નહિ પણ  
આત્માને હિતમાં સ્થાપી હે તે મંગળ”

હુદે, આપ જવાખ ! મંગળનો ઉપાસક છે ? મંગળ મંગળ કહી  
ફરતો હતો પણ મંગળને જાણુતો નથી તેવું તો નથી ને ?

મંગળ કોઈ પદાર્થ નથી અને પદાર્થને કોઈ મંગળ કહે તો તે  
કણનાર ભાટે છે. શ્રીકાળ હાથમાં લઈને ભણે તો મંગળ. પણ તે જ  
શાકળ શિર પર લગાવે તો ખલાસ. મંગળના સ્પર્શ દ્વારા જ અપ-  
મંગળના શ્રીગણુશ શરૂ થઈ જય.

મંગળ તારો આત્મા ના...ના...ભૂલ થઈ સર્વશ્રોષ સર્વોત્કૃષ્ટ મંગલ  
તારો આત્મા.

શું તારો આત્મા મંગલ ? અને તે પણ ઉત્કૃષ્ટ મંગલ શું દિવસે  
તારા દેખાડવા જેવી વાત કરો છો. હું મંગલ નહિ. પણ મંગળનો ઉપાસક.

ના...ના લવ્યાત્મા ! તું જ મંગલ, તારો આત્માજ ઉત્કૃષ્ટ મંગળ  
પણ તારા આત્માને ન્રિવેણીના જળથી શુદ્ધ કરે તો ?

નેતું આખું શરીર ગંદુ છે તે એક બિંદુ પાણીથી શુદ્ધ થાય ? સ્વર્ગથ થાય ? ના . થાય . સ્નાન કરે પણ શરીર લુંછે નહિ તો પાણી મારી લાગે અને કર્રી ગઈને . શરીર લુંછે પણ પછી શરીર પર સુગંધા તેલ ના લગાડે તો સુવાસ કયાંથી પ્રગટે ? નેમ મલિનમાંથા સ્વર્ગથ થના માટે પ્રત્યેક પ્રક્રિયા પૂર્ણ રૂપે કરવા જોઈએ તેમ મંગલ બનના તારે ધર્મનું શરણ દેવું જોઈએ . ધર્મના શરણ વગર મગલ બનના નહિ . ધર્મભય બને તો જ મંગલની પ્રાપ્તિ ધર્મ જ્યારે સાચા સ્વરૂપે સમજય લારે તેના ઓજસ જુદા હોય . નેમ મહેમાનના સત્કાર કરવાના . ભોજન . વરત્ર , શચ્ચા , વચ્ચન અને દ્વિકથી તેમ ધર્મના આચરણ પણ અંતરના આદર ભાવથી કરવાના . સ્વરૂપ સમજુને કરવાના

ધર્મના વિશિષ્ટ ત્રણ બેદ ત્રણ બેદ વગર ઉત્કૃષ્ટ ધર્મની આરાધના થાય નહિ તો ઉત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ થાય નહિ .

અહિંસા , સંયમ અને તપ ત્રણ બેદથી ધર્મની જ્યારે આરાધના થાય ત્યારે ધર્મની પૂર્ણ રૂપથી આરાધના .

નેમ ગંગા યમુના અને સરસ્વતીનું જળ એકનિત થાય તો જ સંગમહેં તીર્થ તેમ અહિંસા , સંયમ , તપનું આરાધન સાથે મળે તો જ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ —

ઉત્કૃષ્ટ મગલની પ્રાપ્તિ માટે અહિંસાનું પૂર્ણ પાલન જરૂરી કાયિક , વાચિક માનસિક રીતે હિંસાનો ત્યાગ કરવાનો . હિંસાનો ત્યાગ કર્યો પછી કાયાની દુષ્ટવૃત્તિ કે વચ્ચનનું દુષ્ટભાપણ કે મનના દુર્વિચાર જરા પણ ન ચાલે . જગતના ડોઈ પણ જીવને દુઃખ કરાય જ નહિ . ચાહે તે જીવ પોતાનું સંરક્ષણ સમજે કે નહિ પણ તે સર્વ જીવના સંરક્ષણના પ્રત લીધા છે . તારાથી ડોઈને માનસિક કલેશ પહોંચે તેવું

પણ અગોન્ય વર્તન ન કરાય અને અહિસા પ્રતના સંરક્ષણ માટે જ સંયમ જોઈએ. સંયમ ન સ્વીકારે તો અહિસાનુ પૂર્ણ પાલન ન થાય ! સંયમ એટલે સમભાવ સંયમ એટલે સારી રીતે કાણુ કરવો કોની ઉપર કાણુ કરવો ? પાપો આવવાના રસ્તા ઉપર ? સુખ્ય રસ્તા પાય હિસા, જૂઠ, ચોરી, અભિષ્ઠ અને પરિણહ તેનો ત્યાગ કુલ પાપો આવવાના સત્તર રસ્તા-આશ્વાસી પાપ આવે, ધર્મિયથી પાપ આવે, કપાયોથી પાપ આવે, ગોગથી પાપ આવે. પાપના દ્વારા કર્મના દ્વારા બંધ કરવા, રોકવા તે સંયમ-અહિસા સંયમ દ્વારા શુદ્ધ થયેલ આત્મા તપની સુગંધીઓ મધ્યમધ્યમાન બને. તપ દ્વારા પણ દેહને તપાવવાનો અને કર્મને પણ તપાવવાના ?

દેહ તપે નહિ તો કષ્ટની અનુભૂતિ થાય નહિ  
કર્મ તપે નહિ તો નિર્જરા થાય નહિ.

આત્મા ખાવા પીવાની લપમાં પડે તો લાન ભૂલે તેથી આહાર સંશો-સ્વાદ લોલુપતા દુર કરવા બાળતપ આદરવાનો અને આત્મગુણોનો વિકાસ થાય તે માટે અભ્યંતર તપ કરવાનો બાલ્ય અને અભ્યંતર બને તપ પ્રભુના ફરમાવેલા અથારાક્ય દરેકની આરાધના કરવાની ઉપેક્ષા એકની પણ નહિ કરવાની. અહિસા સંયમ તપરૂપ ધર્મજ ઉત્કૃષ્ટ મંગલ અને આવો શ્રેષ્ઠ ધર્મ ને વ્યક્તિમાં વસા જય, ધર્મમય ને આત્મા બની જય તે શ્રેષ્ઠ મંગલ.

જ્યાં મંગલમય ધર્મમૂર્તિ આત્મા ત્યાં દેવોના પણ નમસ્કાર દેવની આરાધના ઉત્કૃષ્ટ ધર્માંએ નહિ કરવાની ઉત્કૃષ્ટ ધર્મની ઉપાસના દેવ તેની ચરણરજ દ્વારા દેવ ધન્ય બને ધર્મી આરાધના કરે દેવાધિદેવની આરાનો ..

ખાલ મનક !

તું ધન્ય છે. કૃતપુણ્ય છે. પિતાને શોધવા નીકળ્યો પણ પ્રાપ્ત કર્યા પરમપિતાને જિતેશ્વરને પ્રાપ્ત કર્યું. ઉત્કૃષ્ટ ભંગલને અંતે ભંગલને પામી તું ભંગલસ્વરૂપ પ્રાપ્ત કર. એજ ચાહના છે સંયમી પિતાની....

શાયંભુવસ્યૂરિ મ. !

આપ પણ ભંગલ. આપના પુત્ર પણ ભંગલ. આપનું બનાવેલું દ્શવૈકાલિક પણ ભંગલ. અમે પણ આપના આદેશનું પાલન કરીશું તો આપના જ પુત્રને ! મનક માટે બનાવેલ દ્શવૈકાલિકના અમે પણ અધિકારી.

ખસ્ત હુવે એક જ નિનંતિ અમને પણ ભંગલ બનાવો...  
અમારા પણ ભંગલ કરો...



## ૨. મહુગાર સમા યુદ્ધા



જગતનો પ્રત્યેક વ્યવહાર વિશેપણુથી જ ચાલે છે. વિશેપણની એળાખાણુ વિશેપણ દારા જ થાય છે. વ્યાકરણુકારો કહેશે જે વિશેષામાં વિશિષ્ટતા પેઢા કરે તે વિશેપણ

વ્યવહાર શાસ્ત્રના અનુભવી કહેશે જેવા વિશેપણ વાપરશો તેવી વ્યક્તિ બનશો. ત્યારે ધર્મશાસ્ત્રકાર કૃપાળુ હૃદ્યે કહે છે. યોગ્ય વ્યક્તિ માટે તેના આત્મિક યોગ્યતાને શખ્ષ દારા રજુ કરવા વિશેપણ માત્ર સાધન છે.

ત્યાગી વૈરાગી સંત-સાધુ અંગે અનેક વિશેપણ વપરાય છે. અનેક વિશેપણો સંશોધન પામી રહ્યા છે, ત્યારે સાધુજીવનની એક આગની યોગ્યતાને વ્યક્ત કરતુ અદ્ભૂત વિશેપણ છે. “ મધુકર સમાન ”

સાધુતાનો પ્રારંભ પણ મધુકર સમાનવતથી સાધુતાની સાધના પણ મધુકર સમાન વ્રતપાલનમાં મધુકર સમા વ્રત સિવાય સાધુ સંસારી.

મધુકર સમા વ્રત સિવાય સાધુતાની સાધના અશક્ય.

મધુકર સમા વ્રત સિવાય સાધુતાની સુવાસ નહિ.

સાધુને અનેક વિશેપણુથી નવાજ્તાં પહેલાં પૂ. શયંલવસૂરિ મહારાજ “ મહુગાર સમા ” કેમ કહે છે ? એમના એ શાન્દોમાં સાધનાની અદ્રિતીય ગાહનતા છે.

“ ભ્રમરને કોઈ ધર નહિ, સાંધુને કોઈ ધર નહિ ”

“ ભ્રમરને સમસ્ત પૃથ્વી પોતાની, સાંધુને સમસ્ત પૃથ્વી સુતાની ”

“ ભ્રમરને કોઈ સુજન નહિ, સાંધુને કોઈ સુજન નહિ ”

“ ભ્રમરને સુગાંધથી મહેંકતા પુષ્પમાં કોઈ પરજન નહિ, સાંધુને ધર્મલાલથી શોલતાં ગૃહસ્થમાં કોઈ પરજન નહિ ”

ભ્રમરને પોતાના આગમનની વધાઈ આપવાના નહિ પણ પ્રકૃતિ વિકસિત બની ત્યાં પહોંચી જવાનું, સાંધુને પણ પોતાના આગમનની નોંધ કરાવવાની નહિ પણ... “ કાંદેણું નિકખલે લિકખું ” ગૃહસ્થને ત્યાં લિકાનો કાળ થાય ત્યારે પહોંચી જવાનું.

ભ્રમર જ્યાં જય ત્યાં પોતાના આગમનને સુચિત કરવા ગુણરવ કરે, સાંધુ જ્યાં જય ત્યાં ધર્મલાલનો મધુરો ગુણરવ કરે.

ભ્રમર વિકસિત પુષ્પનો રસ અહેણું કરે, સાંધુ ગૃહસ્થ માટે બનેલ આહાર અહેણું કરે ભ્રમર પુષ્પમાંથી રસ અહેણું કરે પણ પુષ્પને પીડા ન કરે, સાંધુ ગૃહસ્થને લાંથી લિકા અહેણું કરે પણ પુનઃ છ કાયની વિરાધના થાય તેમ નહિ

‘ભ્રમર પુષ્પમાંથી રસ મળે તેમાં જ સંતોષ માને. ભ્રમર પુષ્પરસ સિવાય કંઈ લેવા ન જાઓ, સાંધુ નિર્દેષ આહાર સિવાય કંઈ પણ લેવા ન જાઓ, ભ્રમર આજની આજુવિકા આજે જ પુછું કરે પણ વધુ અહેણું ન કરે. અને ઝેડે પણ નહિ સાંધુ પણ રોજની જે સમગ્રે જેટલી જરૂર હોય તેટલી ‘કુદાંસ સંખલરસ’ વૃત્તિ રાખે પણ તેને નહિ કાલની ચિતા કે નહિ સાંજની પણ ચિંતા. ’

પુષ્પનો રસ’તો અધમાખી પણ પોવે છે અને ભ્રમર પણ ગીવેં છાં સાંધુને અધમાખીની નહિ, ભ્રમરની ઉપમા કેમ ?

ભવમાખી સંગ્રહ કરવા પુઅપરસ પીવે છે પણ અમર આજુવિકા માટે રસ પીવે છે, તેમ સાંધુ શરીરની પુષ્ટિ નહિ પણ સંયમળુંનના પાલના માટે લિક્ષા દે છે.

‘અમર રસ પીધા પછી ચુંબરવ કરતો દૂર-સુદૂર ચાલ્યો જાય, સાંધુ આહાર લીધા પછી ધર્મલાલ કહી મોક્ષમાર્ગની સાધના માટે અગ્રતિષ્ઠ વિહારના ક્રમે આગળ વધે.

વિશ્વમાં વિવિધ ધર્મો છે. એટલાક ધર્મોએ આત્માના પ્રકૃતીકરણ માટે અંતિમ લક્ષ્યમાટે સાંધુતાની આવશ્યકતા સ્વીકારી છે. પણ વિશ્વમાં વીતરાગના એક ધર્મો રૂપાઈ કર્યું છે કે સાંધુતાની પ્રાપ્તિ વિના મોક્ષ અશક્ય છે. મોક્ષ માટે સાંધુતા અનિવાર્ય છે. સાંધુતાની પ્રાપ્તિ માટે સાંધુ ઘનતું સ્વાભાવિક રીતે જ જરૂરી છે સાંધુતા સૌથે કહી પણ સાંધુતાના પાલનમાં પૂર્ણ નિયમો પૂર્ણ પણે કયાય નહિ મળે. વીતરાગતાના શાસને સાંધુતા અરૂપી, સાથે જ સાંધુતાની સાધનાના પૂર્ણનિયમોની સુંદર સુરેખા આપતાં ધર્માંથો બનાવ્યા.

મોક્ષની સાધનાનો પ્રારંભ શરીરમાં રહેલો આત્મા કરે છે. સાધક શરીરને મોક્ષની સાધનાનું અંગ બનાવી હે છે. મોક્ષ સાધનાનું સાધન શરીર છે એટલે શરીરનું જતન કરવું પડે. પણ... જતન એટલે જતન. લાડકોડ અને લાલન પાલન નહીં. શરીરની શક્તિ જાળવી રાખવાની તેના પરની આસક્તિને ફેંગાવી હેવાની.

મોક્ષની સાધનમાં સહાયક શરીર, તે શરીરનું રક્ષણ આહાર દારા... એટલે સાંધુને માટે આહાર વિધિ સૌથી વધુ આવશ્યક.

આહારની અસર શરીર અને મન પર તેથી જ જૈનાગમોએ સુદ્ધમ તેમજ વિશ્વ વિવેચન આહાર વિધિ માટે કર્યું છે. વિશાળ જૈનાગમ

તેનો અભ્યાસ તેતું રહેણ્ય હોઈ પુણ્યાત્મા જ મેળવી શકે... પણ ભાવ કરણું મૂર્તિ પૂ. શયંલવસુરિ મહારાજ જે દ્વારે કાલિક સૂત્રના પ્રથમ અધ્યયનમાં હજારો મુખ્ય નિયમોને... લાખો પેટા નિયમને આવરી લેતા એક વિશેપણ વાપર્યું. “મહુકાર સમા બુદ્ધા” જે વિશેપ સાંદુતાની અનેક આંતરિક સંપત્તિનું વિભૂતિનું અનુપમ દર્શાન કરાવે છે.

મોક્ષ અંતિમ લક્ષ્ય

મોક્ષની ગ્રામિ ધર્મદારા

ધર્મનું પૂર્ણ પાલન સાંદુ શ્રવનમાં

સાંદુતાનું સાધન શરીર

શરીરનો રક્ષક આહાર.

મોક્ષના સાધક માટે જ્યારે આહાર અનિવાર્ય બને છે. ત્યારે આહાર ગ્રહણ અને આહારના ઉપભોગ અંગે પણ કંડક નિયમો જરૂરી બને છે ત્યારે વાત્સલ્યમૂર્તિ પૂ. શયંલવસુરિ મહારાજ જે લિક્ષાઅંગેના અનેક નિયમોને એક નાનાશા વિશેપણમાં સાકળી લીધા...  
“મહુકાર સમા બુદ્ધા”

આહાર જેવી શ્રવનની અનિવાર્ય જરૂરિયાત અંગે પણ મધુકર સમ કઠોર પ્રતિ...  
તો...

સાંદુ શ્રવનના પાલનમાં કેટલા ઉત્સર્ગ અને અપવાહની આવશ્યકતા... કેટકેટલી ચીજના ત્યાગની અનિવાર્યતા, કેટકેટલા જ્ઞાન ધ્યાન અને ગુરુગમની આવશ્યકતા, ગુરુગમદારા મેળવેલ જ્ઞાનને સાચવવા સ્વાધ્યાયની કેટલી આવશ્યકતા—અને વિકથાનો ત્યાગ કેટલો જરૂરી આવા અનેક વિચાર પ્રવાહનો સમાવેશ પૂ. શયંલવસુરિ મહારાજનું એક વિશેપણ “મહુકાર સમા બુદ્ધા” માં થઈ જય છે

પાંચ જ ગાથાનું આ પહેલું અધ્યયન એક અતોષી ભર્હતા રાખે છે। સાધુ ભગવાન્તો આ પાંચેથે ગાથાનો તેરસ આદિના માંગલિક પ્રતિક્રમણમા પણ માંગલિક સ્વાધ્યાય સર્જાય તરીકે ઉપયોગ કરે છે.

આ પાંચ ગાથાઓના પ્રલાન વિષે અનેક માન્યતા છે. આ ગાથાઓ પરથી સુશર્ણસિદ્ધિના કદ્યો રેયાયા છે! પણ નાનકડું આ અધ્યયન ગંભીરતાપૂર્વક વિચારવામા આવે તો બાહિના નવ અધ્યયન આજ આવેનો વિસ્તાર છે પણ અધ્યાત્મના પિપાસુઓ માટે એ પિષ્ટ પેષણ નથી પણ ધ્યાન પોષણ છે.



### ૩. કામે કમાણી

એક ને નહીં અનેકને, અનેકને જ શા માટે? સર્વને જીવન દુઃખમય ક્યારેક લાગ્યુ છે! કેટલાકે તો દુઃખને જીવનનો પર્યાપ્ત માન્યો છે. અનાવી લીધો છે...

હુઃખના હુંગરો તો શું, પણ હુઃખના કંકર પણ માનવ સહન કરવા તૈયાર નથી. ઓળિ કે ભોળિ ..શોઠ કે સંત...હેવ કે નારક સહુને હુઃખના હુંગર એણાંગી જવા છે? પણ થોખો...હુઃખને એણાંગવાની જરૂર નથી...હુઃખના હરીયાને બાંધવાની જરૂર નથી. એ પ્રયત્નો કદી સફળ થવાના નથી. હુઃખને ઝૂદીને હુઃખ એણાંગાચ ગયું હોત તો આજ ક્યાંય હુઃખહોત જ નહીં. ક્યાંય... કોઈ હુઃખી હોત જ નહીં. એટલે સાચો રસો...હુઃખને એણાંગી જવાનો રાજમાર્ગ શાયંભવસૂરિજી મહારાજ ફરમાવી રહ્યા છે...

હુઃખને નહીં હુઃખના મૂળને એણાંગ  
હુઃખનું મૂળ છે કામના...ઇચ્છા...અભિલાષા,

શાયંભવસૂરિ મહારાજ બાલમુનિ મનકને કહે છે તું ચાલ નહિ પણ એણાંગી જ. વાત્સલ્યનિધિ પિતા ખુદના એકના એક બહાલસોયા પુત્રને પ્રમજિત અનાવી મુનિજીવનની મહત્ત્વા સમજાવતા સાધનાની ઉચ્ચ્ય ભૂમિકા પર લઈ જતાં એક સેનાપતિની કઠોરતા લાવી સૈનિકને જે



સીનતા તમને પ્રશ્ન પૂછવા પ્રેરણે એન! કુલથી ય ડોમગ પુત્ર છે પણ  
હુઃખ હેમ? કર્મનું વરદાન અને આપ સાથે જ મળ્યા. સુંદર પુત્રની  
માતા પણ જન્મથી હાર્ટનું હ્વ્યે છે. જન્મથી શ્વાસ લેવામાં પરાવીન.

સુંદર કહેવરાવવામાં પંચેન્દ્રિયની પૂર્ણતા સાથે નિરોગી શરીર જેણે.

નિરોગી શરીરવાળા કથંક ૧૪-૧૫ વર્ષના શક્તિના ધોધ સમા  
હિશોરેને તમે બાલ ગુનેગાર ગૃહમાં જેણો? આમ હેમ? માતાપિતાનો  
વિશોગ... સમાજની ઉપેક્ષા, કામ કરવાની શરન, મોજ મજાક કરવાની  
ઘેલણા અમને અહીં લઈ આવી.

જરા ફૂટપાથ પર નજર કરો. વહેલી સવારથી મોડી રાત ચુંધી  
અમ કરનાર અમજુવીને પૂછો... હેમ લાઈ? શ્રીમંતો લોહી પી જાય છે  
લોહીનું પાણી કરીએ. અમારો અમ અને તેમના તાગડધિનના.

અદ્યતન સર્વ સામન્દીથી સજજ શીત ધરમાં એઠેલો શ્રીમંતો પૂછો  
કે તમે સુખી? મારા સુખને પૂછશો નહિ, મારી વાત જહેરમાં ચર્ચાય  
તેવી નથી. મારા કરતા મારો પહેરેગિર મુક્ત હાસ્ય કરી શકે છે. ખુલ્લામાં  
તાપમા નિંહ લઈ શકે છે. લાઈ આ સામની સાધન અને સગવડ અને  
ધનના ઢગલાં વચ્ચે મારું સુખ તો હાથતાળી ફર્જને મૃગજળની જેમ ક્યાંય  
ભાગી ગયું છે. હતાં પણ સુખની છંચળા છોડયા વગર હું સુખની  
છંચળાથી અવિરત જાગૃત બની પ્રયત્ન કરું છું પણ...

ઓલતાં ઓલતાં મોદું લાલ થઈ ગયું. અતિ હુઃખના કારણે  
આંગે આંસુના તોરણું બંધાઈ ગયા પણ આંસુ ન પડ્યાં.

સમસ્ત વિશ્વના સમસ્ત પ્રાણી હુઃખી શા માટે? ઈચ્છાની સ્થયંકર  
ભૂતાવળનાં કારણે જ, છંચળાની કયારે પણું પૂર્ણાદુતિ થતી નથી.  
એક ઈચ્છાની તૃપ્તિ અનેક ઈચ્છાને જન્મ આપીને જ જાય,

સાપ છંડા મૂકે ત્યારે હળવો અને લાઘેની સંખ્યામાં જ. ઈચ્છાની તૃપ્તિ કરવા જતાં માનવ મલકાય છે...આ ઈચ્છા પૂર્ણ થતાં તો સુખી થઈશ પણ તેને અધર નથી ઈચ્છા ક્યારે પણ એક નથી આવતી એ તો રાવણની રાક્ષસી માયા છે. અનેક ઇપોમાં પ્રગટ થયા કરશે પારાને પકડવા જઈશ તો હળવ ઢેકાણે રેલાધ જશે તેમ ઈચ્છા પણ અનેક ઇપો કરીને તમને હેરાન કરશે.

નિશ્ચના એક ગરીબમાં ગરીબ લિખારીથી ભાંડી રાજમહાલયમાં નિવાસ કરતાં રાજ સુધી સૌના હુઃખના કારણ તપાસ...એક જ જવાય ભગરો. ઈચ્છાને સંયમિત ન કરી શક્યા. ઈચ્છાને પૂર્ણ કરવા ગયા તેથી જ હુઃખી થયા.

શયંભવસૂરિ મહારાજ અનંત હુઃખેનાં અનંત યાતનાના મૂળ બીજને જાણે છે, બાલક મનકને લધુવયથી એક અમૃત સીંચે છે, બેટા...! કિમિયં ખુ દુકંખ

કોઈપણ પદાર્થની પ્રાપ્તિ ક્યારે પણ સુખી નથી કારણ કે કોઈ પણ પદાર્થ...કોઈપણ અનુકૂળતા કોઈપણ સાધન મળે તે પુણ્યના ઉદ્દ્યથી પણ...

સાધનની અલિલાખા...આશા ઈચ્છા જુખના મોહનીય કર્મના ઉદ્દ્યે.

કર્મ માત્ર એક હુઃખ...કર્મનો ઉદ્દ્ય માત્ર એક સજી તો કર્મનો સર્જિક મોહ લય કર હુઃખ...ઈચ્છા મોહનીય કર્મના ઉદ્દ્યે. એં શિશુ!

તું ઈચ્છાને ઓળંગી જા... હુઃખનો લયંકર સમુદ્ર પાર પામી જઈશ.

શયંલવસ્તુરિ ભહારાજે શિશુ મનકને દૃચ્છા એણાંગવાના બહાને  
મોહનીય કર્મ સામે જરૂર ખેલવાનું આહવાન કર્યું છે.

એ મનક !

મોહના જગને જીતી જા, બસ પછી તો અનેય વીર ઘનીશ.

હિતસ્વી પિતા સિવાય આવાં હિતશિક્ષાનાં અમૃત ક્યાંથી મળે ?  
મન લક્ષ્યાય છે...પણ આવા પિતાના ખોણા ખુંદના...જેમણે પારણામાંથી  
મોહનીય કર્મ સામે જરૂર જરૂર આવવાનાં અલોદ્ધ વ્યૂહ ટેખાડ્યા છે ..



## ૪. સંજમં નિહુએ ચર



પ્રતિક્ષણ-પ્રતિપળ જગતમાં કર્મધીન પ્રાણીના જનમ અને ભરણ થાય છે જગતે પણ તે લોકશિથતિને સહજ સ્વીકારી લીધી છે. છતાં જગત સ્મૃતિ કરે છે. ખુદના સ્નેહી જનથીય અધિક આમ જનતી. જગત કથારે પણ ભૂલતું નથી એવા મહાપુરુષોને જેણે જીવન જીવી જાણ્યું છે.

કેટલોક વ્યક્તિ જીવનને પૂર્ણ કરે છે. કેટલોક વ્યક્તિ જીવનને ઉલ્લાસી જાણે છે જીવનને પૂર્ણ કરવામાં કોઈ મહાનતા નથી. જીવનને ઉલ્લાસવામાં કોઈ લગ્ન ધોરણી પૂર્ણાંહુતિની જરૂર પડે. કોઈ પદ, સત્તા, સ્થાન મળવા સહેલા છે પણ તે સ્થાન ટકાવવા અધરા છે તે સ્થાનોને શોભાવવા તો હુર્દાલતમ છે

કોઈપણ ચીજની પ્રામિ પુણ્ય પર આધારિત છે પણ તેને શોભાવવી તે પુરુષાર્થને આભારી છે. એકદો પુરુષાર્થ ન ચાલે ઉત્સાદ યુક્ત માર્ગ તરફનો પુરુષાર્થ જોઈએ...

“ મનક ! તું કેવો પુણ્યશાળી છે જિનેશ્વર ભગવંત ને માનવ. જનમને હુર્દાલ કહે તે માનવનો જનમ તને મલ્યો જેના મૂલ્ય ના થાય તેના આર્થિક આર્થિક પચેન્દ્રિયપૂર્ણ નિરોગી શરીર. શાસ્ત્રશ્રવણ હુર્દાલ અદ્ધા અને હુર્દાલતમ સર્વશ્રોંડ ચારિત્ર તને બાલઉંમરમાં મલ્યું. તારા પુણ્ય પાસે અમારું પુણ્ય ધારું વામણું છે તું ને ચારિત્ર પામ્યો છે તેની વિચારણા અમે કરીએ સહૈય આનંદ સાગરમાં સ્નાન કર્યા કરીએ...

પણ...તારક પરમાત્માએ થમ નથી બતાવ્યા એ ઘ્યાલ કરણે થમ એટલે ઈદ્રિયોને બળાલ્કારે કાખુમાં રાખવી આંખ ભૂલ્ય કરે તો હેડી નાંખવી. હાથ ચોરી કરેતો કાપી નાંખવા .. આવી વાતો સર્વજ્ઞના શાસનમાં ન હોય...આ તો બધી તાપસોની વાતો . આ પણ એક આત્મહક્ત્યાનો પ્રકાર છે આત્મહક્ત્યાને નોતરનાડું કુકર્મ છે. તેમાં કદાચિત્ પશ્વાતાપનો ભાવ હોઈ શકે છે પણ તે અજ્ઞાનપૂર્ણ આવેગ છે તેમા પુનરૂત્થાનની કોઈ ચોજના નથી સર્વજ્ઞનું શાસન અસતતા વિસર્જન પૂર્વકજ સતતું સર્જન કરવામાં માને છે.

.જિનશાસનમાં સ્વનેમા પણ બળાલ્કારની વાત નહિ, આ શાસન જ્ઞાનપ્રધાન છે. સમજ પ્રધાન છે. હુકમ પ્રધાન નહિ પણ ઉપરેશ પ્રધાન છે.

વીતરાગના શાસનમા ગુરુટ્ટેવો પણ શિષ્યને ઉપરેશ આપે છે, ગ્રેગણા આપે છે અને આદેશ ઝખ્તાને આજ્ઞા ક્રમાવે છે શિષ્ય કહે, 'ઇચ્છુ છું' મારી પર કૃપા કરો મહાત્મત આપો તોજ જીવનલારના પત ઉચ્ચરાવે... અરે નવકારશી જેવું પચ્ચકખાણ પણ શિષ્યની ઇંછા વગર ના આપે

ગુરુતું કર્તાવ્ય શિષ્યને-શ્રોતાને ધર્માલિમુખ કરવાતું છે શિષ્યતું કર્તાવ્ય ગુરુના લાવને પણ આજ્ઞાતુલ્ય માનીને અનુસરણ કરવામાં છે.

મનક ! તું યમી નહિ તુ સંયમી યમી માત્ર વિનાશક હોય સંયમી શુલનો સર્જક પણ હોય, યમી ઈદ્રિયની દુષ્ટતા માત્ર ને જ જણે છે તેથી ગલરાય તેનો નાશ કરે છે.

સંયમી ઈદ્રિયોની સાધકતા શ્રેષ્ઠતા પણ સમજે છે એટલે તેનાથી ગલરાયા વગર સમજ વિચારને તેને ખુલ્ણી સાધનાના સાધન ઘનાવે છે.

કહેવાય છે West માંથી Best ના સર્જન કરવાની કાગ કોઈમાં હોતી નથી એવા સર્જનને કરનાર સર્જન અનોએ...

ઇદ્રિયોને આધીન બનનાર અનેક લોગપિપાસુ..

ઇદ્રિયોને માત્ર દમન કરી યમી બનનાર અનેક અરૂની...

ઇદ્રિયોને આત્મતત્ત્વની સાધનાના સાધન બનાવનાર પ્રભુના સંયમી મહાત્માએ...

કોઈ ખાગક કોઈ ભૂરખ કોઈ અરૂનીના હાથમા જરા તલવાર આપો પછી જુઓ. જે તલવાર રક્ષણ હતી તેજ ઉપયોગ કરતાં ન આવડે તો અનુભૂત બનાવવા કોઈ અનોખી અંકિયા જોઈએ માત્ર યમ નહીં પણ સમ્યક્ યમ સંયમી જોઈએ. ઇદ્રિયો જે સાધનામાં તોફાન મચાવનાર છે તેજ ગુંડા પારીને સાધનાના રક્ષણની જવાબદારી સોએવી તે કેટલું સાહસલયું કામ છે.

આ કાર્યમાટે કુનેહ પણ જોઈએ ને સાહસ પણ જોઈએ સંયમી સાધુ ઇદ્રિયના સેનાપતિ મનને, શાન ધ્યાન આત્મવિચારણા સોંપી હે પછી મન ઇદ્રિયોને કામ સોંપી હે... મારા આટલા કાર્યો તારે કરવાના છેપરોપકાર... તીર્થયાત્રા પૂજ્યસ્તુતિ... શાસ્ત્રપાઠસુગ "ધ-હુર્ગ" ધના પુહગદોનું ફેંટશાન જિનહર્ષન-શાસ્ત્રવાચન, છવદ્યા સહગુણશ્રવણ-શાસ્ત્રશ્રવણ કરો મારે ખાસ જરૂરી છે. મારી વક્ષાદાર સેના સહૈવ સેનાપતિના હુકમને અતુસરે છે. જે ઇદ્રિયો સાધનામાં વિધન કરતી હતી તેને સેનાપતિ મન આત્મરાજને શરણે ગયો, કારણ તેને વિચારવાની ધ્યાનની, ચિંતનની, ખડુમોટી જવાબદારી મળે. ઇદ્રિયસેના તો મન સેનાપતિનો જ આદેશ પાળનારી છે. સંયમી આત્માનો મન સેનાપતિ કહિ પોતાની ઇદ્રિય સેનાને અયોગ્ય આદેશ આપતો નથી.

મહાત્મા મનક ! આતું નામ સંયમ, અધ્યનલરના સાથે પાપના ત્યાગ, આ અવન પંચમહાત્મતા પાલન અને ઈદ્રિયને સારીરીતે સાધનામાં સહાયક બનાવવા તું તત્પર બન્યો છે, તારી પ્રશંસા હું એકલો ના કરું. તીર્થંકર પરમાત્મા પણું કરે ઈદ્રિયો વિકસિત બને તે પહેલાં સાધના પ્રારંભી. નિર્દ્દિષ્ટ ગોચરી દારા તારું શરીરભૂષિત પાખ્યું. તારા લોહાના કણુંદુંમાં પવિત્રતા બ્યાપી અને તેના દારા ઈદ્રિયોનો વિકાસ સાચે તારી ઈદ્રિયો લોગેન્ડિય નહિ પણ જાનેન્ડિય બની તારા હૈયાની પવિત્રતા એટલી. અપૂર્વ હશે. વિલાસી અને બલિયારી તારા નજીક આવી નહિ શકે, અને કોઈ વિલાસી બલિયારી આવશે તો જરૂર તારી પવિત્રતા દારા તેના પાપ ધોવાઈ જશે. તારી પાસે પાપાત્મા આવવાની હિંમત નહિ કરે, અને કદાચ કોઈ ભૂલ્યો ભટક્યો પાપાત્મા આવશે તો મહાત્મા બનશે. તારા આકર્ષણ જેના હૈયામાં જગશે તે તારાથી પવિત્ર થનારો તારો ગતજરૂરનો કોઈ ઋણાતુંબધો હશે ! તે પણ આ જરૂરે તારી સમીપ આવી તારા આત્માના શુલ સંસ્કારનો વારસદાર બને ?

સંસારીને ત્યાગીના આકર્ષણું જરૂરી થાય નહિ અને કદાચ થાય તો પણ... પૂર્વજરૂરના અનુરાગના કારણે પણ મહાત્મા પાસે આત્માના એવા ઓઝસ હોય છે. ત્યાં રાગના વાસનાના તોકાન શરી જય છે.

કોઈ સંગીત સમ્ભાટે સંગીતની ભર્તીમાં આવી માલકોશમાં રાગ ગાયો હોય તો બીજા સંગીતકારની તાકાત નથી કે ત્યા તે બીજે રાગ ગાઈ શકે. ગમે તેવો નિષણાત હોય તો પણ માલકોશના સૂરમાં ચાલ્યો જય...

જો કલાકારની શક્તિ આટલી હોય તો સાધક-મહાસાધકની શક્તિ કેટલી હોય ? જેના અવનની કણું કણું પગ પળ સદ્ગ્રામારથી સુવાસિત બની છે તેવા જરૂરતીર્થના પરિયયમાં આવનાર સંયમની સુવાસ ના પામે એ બને ?

વજ્ઞસ્વામીની પ્રશંસા સાધ્વીજ મહારાજના મુખથી સાંભળી ડુકમણી વજ્ઞસ્વામીની અતુરાગી બની પણ એ સંયમપૂત આત્માદારા તે પણ વીતરાગપંથની ઉપાસિકા બની આજ પવિત્ર પુરુષની ખૂબી છે.

ગેરસ્પાના ધોધમાંથી વીજળીની પ્રાર્થિ સુલલ હોય કે ન પણ હોય .. પણ સંયમની પવિત્રતાના ધોધમાં આધ્યાત્મિકતાની આત્મપ્રલાની શાંતિની વિદ્યુત સહૈવ સુલલ છે.

એટા મનક ! વધુ નથી કહેવું તને જે સંજમ મદ્યું છે તેમાં મજાની પ્રસંનતા એ વિચર . ચક્કનીં છ ઝડ્ઢ પૃથ્વીજીતીને જે આનંદ ન માણી શકે તે તું માણ ડર લાખ વિમાનનો માલિક સૌધર્મેન્દ્ર એક ભુકુટિ દારા સારા દેવલોકને કંપાવતો પણ છન્દ્રાણી પાસે બિચારો... ત્યારે મારા મનક ! તું સંયમદારા સર્વસ્થળ-સર્વ સમગ્રે સર્વત્ર સર્વદી અન્નેયવીર છે બસ અન્નેયવીર રહે... અનંત... શાક્ષત સુખના સાંપ્રાણ્ય આત્મ કર...

અને તેથી આ દ્શવૈકાલિક શાસ્ત્રમાં કહેવાયું “ સંજમં નિહુએ ચર ”.

થમી નિભૂત મનથી પ્રસંનતાવાળો ન હોય તે બને ! પણ સંયમી તો નિભૂત જ હોય પ્રશાંત મનનો જ હોય આવો સંયમી નિભૂત મનવાળો લલે ને જગત્ ના ચોકમાં અરે વિચરે વિહરે, પણ તે પોતાની સાધનાથી કહિ ય વિઘૂટો ના પડે...

## ૫. મહેસિણું

મહેસિણું

જગત ક્યારે ય સત્રહશીલ વ્યક્તિને નમન કરતું નથી

જગત ક્યારે ય અહુંકારીને, માનતી ઝંખનાવાળાને માન  
આપતું નથી

જગત ક્યારે ય જ્ઞાનનો ડોળ કરનારને જ્ઞાની કહેતું નથી

જગત પાસે પણ માનવીના મૂલ્યાંકન કરવાની એક આગ્રવી  
અનોખી દર્જા છે.

શ્રીમંતોના નામ પર લોકો થૂંક્યા છે.

વિલાસીએ સામે લોકોએ તિરસ્કાર વરસાવ્યો છે.

આપખુદી સત્તા સામે જનતાએ બળવો પોકાર્યો છે.

જગત ઝ એ છે કોઈ સર્વોત્તમ-સર્વશ્રેષ્ઠ અનુપમ પાત્રને જ્યાં  
અનુપમતા, અદ્ભૂતતા, અર્દ્ધતાયતા, અલૌકિકતા અને સર્વશ્રેષ્ઠતા  
હોય છે.

ત્યા ‘મારા’...‘તારા’ના લેદ સહજ ભૂલાય છે. મારી ભૂમિનો...  
મારો સ્નેહી મારો સ્વજ્ઞન .. મારો દેશઅધુ-એ બધા ભર્યાદાના  
સીમાડા અશક્તિના, અપૂર્ણતાના પ્રદર્શન છે.

પૃથ્વી પહાડ અને સરિતા પર કોઈ મારાતું લેખલ લગાડતાં હશે  
પણ એ અનોખા તત્વો કહે અમે તો કોઈના નહિ.. અમારે તો

અમારું સનાતન સ્વરૂપ જળવવાનું તમે તમારું કાર્ય કરો યા ના કરો  
પણું અમે તો સહી અમારા ધર્મથી-કર્તાવ્યથી પીછેહું કરવાના નહિ.  
કર્તાવ્યના કપરા યજ્ઞ દ્વારા, સહજ સ્વરૂપમાં સ્થિર રહે તે જ પૃથ્વી,  
પહુંડ અને સરિતા.

છતાં કાળખળ એક એવું વિષમ તત્ત્વ છે કે સહનશીલ પૃથ્વીમાં  
ક્રાડ પડે, ધીર પહુંડને ચલિત કરી શકે ખળખળ વહેતી સરિતાની  
ગતિ બહલી શકે પણ કાળખળ સામે ય ઝૂભમનાર છે.  
મહેસિણું મહુર્ધિઓ....

પૂ. શય્ય ભવસ્સુરિ મહારાજ બાળ મનકને કહે છે.  
એં પુત્ર... ના...ના, એં શાચિતપથિક ! તું મહુર્ધિ બન...

- એક અનુભવી... શાસ્ત્રપારગામી...અનેક શિષ્યોના અનુપમ  
ગુરુદેવ... વાત્સલ્યમૂર્તિ પિતા... પોતાના એકના એક સંતાનને દીક્ષા  
આપી .. હજુ તો પૂરી આડ સાલ જેને વીતાવી નથી એવા બાલને  
કહે છે. “મહુર્ધિ બન...”

આચો મહાતમા જ હેહના એથે હંકાગેલ નિરાટ મહાતમાને ખોળી  
શકે છે. તેથી જ તેમની દર્શિએ આડ સાલનો બાલક એક અનુપમ  
બાલક એક સાધક હેખાય છે. આ નાના શા સાધકને સિધ્ધ સાધક  
આહુવાહન કરે છે. મહુર્ધિ બન... ઝડપિ નહિ પણ...મહુર્ધિ બન...

જ્યા વાત્સલ્યની સરિતા વહે છે... જ્યાં કંઈક અનુગ્રહ કરવાની  
જખના જગે છે. જ્યા સ્વર્ણ સાકાર બને એવી યોગ્યતા લાગે છે  
ત્યાં જ મનોરથ પૂર્ણ વિકસનર બની શકે છે.

વાત્સલ્યમૂર્તિ પિતા પુત્રમાં એક હિન્દુ ચેતના જગાવી રહ્યા છે.  
એટા ! તારો જન્મ હેહના કુંગરા ખુંદ્વા માટે નથી. તારો જન્મ

એકાદ જન્મના માતપિતાના—મનોરથ પૂર્ણ કરવા નથી તને મળેલી પંચેન્દ્રિય જગતના પદ્ધાર્થ વિજ્ઞાનને જાણુના નથી. તે પ્રાપ્ત કરેલ ખુદ્ધિંગોરવ જગતને સાચા ઝોટા સારા ખરાણના પ્રમાણપત્ર આપવા નથી...

## એ અનંત શક્તિના સ્વામી !

પહેલા સાધનાની તળેટીએ આવ...મહુર્પિ બનવાતું લક્ષ્ય રાખ. નહિં... મહાન નહિં બન. જગતમા તારા જીવનને આદર્શ બનાવી સાધનાની પગદંડી પર ડગ ભર. મહુર્પિ બનવા તારે કપરી સાધના કરવી પડશે. મહુર્પિ બનવાની સાધના કઠીન છે. ચાશક્ય નથી.. વિમાન સંચાલક દિશાને જે સ્ક્રેમતાચી લક્ષ્યમાં રાખે તે દર્શિથી તુ તારા આત્માના લક્ષ્યને પકડી રાખ. તું ઉપવાસ કર કે લોાજન કરે... તું જગે કે સૂર્ય જાય તું ચાલે કે બેસે... તું એક જગ્યાએ સ્થિર રહે કે વિશ્વમાં પરિબ્રમણ કરે... તું સ્વાધ્યાય કરે કે વૈયાપૃત્ય કરે... તું મૌન કરે કે સૌના હિલ ડોલાવી હે તેવું વ્યાપ્તયાન કરે.

પણ...તારું લક્ષ્ય આત્મશુદ્ધિ તારું ધ્યેય કર્મક્ષય... તારું પદ નિજાનંદની પ્રાપ્તિ ધ્રુવબિંહુ મોક્ષ તો જ તું મહુર્પિ... તારી સમસ્ત પ્રવૃત્તિ... તારી સમસ્ત વૃત્તિ .. તારી સમસ્ત લાવના... તારી સારી જિંદગીની તમામ જ ખનાને એક લક્ષ્યબિંહુમાં લગાવી હે... તારી સાધનાની સિદ્ધિ એટલે મોક્ષ પ્રાપ્તિ .. તો જ તું મહુર્પિ...

મહુર્પિ બનવા શું વિપયોગે છોડવા પડશે ? શું ? માતપિતાના તાગ કરવો પડશે ? એવી કાયર માયકાંગલી વાત નહિં ચાલે.

છોડવું અને ત્યાગવું આ એ માં આકાશ અને પાતાળનું અંતર છે. પૂર્વ અને પશ્ચિમનું અંતર છે. છોડવામાં પદાર્થ છૂટે છે. પણ આસક્તિ રહી જાય છે. ત્યાગમાં પદાર્થ છૂટે કે ન છૂટે પણ પદાર્થની ભમતા લાંગ્ણાને લુક્કો થઈ જાય છે. ત્યાગેલી ચીજની સ્વભેનમાં પણ જંખના જગતી નથી.

ત્યાગમા અદ્ભૂત અલૌકિક ચીજનો સ્વીકાર : એ જ સુપ્ય છે. નશ્વર ચીજેનો, ના મૂલ્ય ચીજેનો તિરસ્કાર તો “છોડવા”માં આવે છે.

જગતના એ ઠા માન... સન્માન ..કીર્તિ ..પદ ..સત્તા સ્વામિત્વ... અધિકાર... આ બધી જંખનાનો અલિન્મન કરાની હે, આ બધી જંખનાનો વિલય કરાવે તેવી મોક્ષની જ ખના ..નિજનંદ્તી લાલસા-સ્વરૂપ પ્રાપ્તિની ઉલ્કંઠા જાગે ત્યારે જ મહિં પદનો રંગ જમે.

મોક્ષની એક જ એપણા .. જંખના . નાલિમાંથી નહીં તારા આ કરોડ ઝંવાડામાંથી પેઢા થાય ત્યારે તું મહિં પદ પ્રાપ્ત કરી શકીશા

એટા મનક... બાલમુનિ... મહિં બન...

અગ્નસ્તયસિ હસ્તરિ મહારાજે શય્યાભવસ્તરિ મહારાજનું હલ્ય વાંચ્યું છે તેથી જ દ્શવૈકાલિકની ચૂણ્ણીમાં તેઓ મહેસિણું નો અર્થ કરે છે. મોક્ષની જ ખના કરનાર... જે સાંધુ મોક્ષની તીવ્ર અલિલાપા કરે છે તે વાત્સલ્યનિધિ શય્યાભવમ્બરિ મહારાજની હિતશિક્ષાનો આહક બની જાય છે શય્યાભવસ્તરિ મહારાજની હિતશિક્ષામા છ અહિનામાં આત્મ કદ્યાણ થાય તેવી અમેધ શક્તિ છે આપણે સૌ તે પ્રાપ્ત કરીએ

## ૬. અંજુદ્દસાહો

આને જ્યારે મુત્સદી થવાની આગવી શિખામળું અપાઈ રહી છે ત્યારે વિશ્વ વાતસલ્યનિધિ સૂરિદેવ એક બાળકને પહેલા ધોરણનો પહેલો પાડ લણ્ણાવે છે.

એટા ! અંજુદ્દર્શીં થને...સરલદાષ્ટિ બનને.

માત્ર એક જન્મની નહિ પણ જન્મ જન્મની સહૃદ્યતા મેળવવા અને પુનઃ પુનઃ સહૃદ્યતા મેળવવા અને પુનઃ પુન સહૃદ્યતા ગુંબદ અનાવવા સૂરિદેવ ફરમાવી રહ્યા છે. “ એટા ! અંજુદ્દર્શીં થા । ”

અંજુદ્દર્શન એટલે શું ? સીધું જેવું. શિકારી સીધું જ જુંએ છે. લક્ષ્યપેદી પણ લક્ષ્ય તરફ જ નજર કેન્દ્રિત કરે છે. શું આ બધા અંજુદ્દર્શીં છે ? આવા અંજુદ્દર્શીં થવા પિતાની પુત્રને ગ્રેરણા ? ગુરુની શિષ્યને ગ્રેરણા ?

સ્વાર્થ...સત્તા...કીર્તિ...અધિકાર ..લાલસા...આસકિતના કારણે ધણું સીધું જેયું સીધું યોલ્યા પણ સાચા અર્થમાં તે અંજુદ્દર્શીં નથી.

“પરમાર્થને જે સિદ્ધ કરી શકે તે અંજુદ્દર્શીં” “ પરેપકારને જે પૂર્ણ કરી શકે તે અંજુદ્દર્શીં” “ જીવનમાં નક્કી કરેલા આચારના કઠોર નિયમને અનુસરી શકે તે અંજુદ્દર્શીં.”

સ્વ અને પરના બેદ જેને મન તે ઋજુદ્ધરીં શાનો? સ્વ અને પરના કાર્યને અલગ લેખે તે ઋજુદ્ધરીં શાનો? સ્વના હુઃખના મૂલ્યાંકનો અલગ અને પરના હુઃખના મૂલ્યાંકનો અલગ તે ઋજુદ્ધરીં શાનો? સ્વના આવેગો આવેશો—લાગણીને પૂર્ણ કરવા ઝર્મે અને પરના આવેગો આવેશો લાગણીને પોતાની રંગલરી નજરે જુએ અને દ્વૈપ લરી નજરે લોકો સમક્ષ રજુ કરે તે ઋજુદ્ધરીં શાનો?

સ્વના સ્વાર્થને કુચુક તે ઋજુદ્ધરીં.

પરના કાળે-પરાર્થ-કાળે જીવન ભર ઝર્મે તે ઋજુદ્ધરીં.

ઋજુદ્ધરીના શખદ કોશમાં સ્વ અને પર આ એ શખદો ક્યારેય પણ ન હોય માર્દ અને તાર્ડ.. પારદુ અને પોતાનું આ ઘધા બેદ માયાવીના

ઋજુદ્ધરીં ફૂકત આત્મા તરફ જુએ. આત્મા તરફ જુએ એટલે પરમાત્મા પદ્ધની ઝાંખના જાગે. પરમાત્મા પદ્ધની તીવ્ર અભિલાષા એજ ઋજુદ્ધરીની સાચી ઓળખાણ. આમ પૂ. હરિલદસ્સરિ મહારાજ દ્શરૈકાલિકની ટીકામાં કહે છે.

ઋજુદ્ધરીં હોવાથી સંયમી. જેને સત્યદર્શન લાયે તે જ સંયમી બની શકે. ધર્મિયના ધોડાને હુનિયાના ચોગાનમા છૂટા ના મૂડી હે. સત્ય દર્શન હોવાથી લાલ અને નુકશાનના સરવૈયા પહેલાં કરે લાલ હેખાંય ત્યાં પવનવેગો ટેડે અને નુકશાન હેખાંય ત્યાંથી એટના જળની જેમ ક્ષણ વારમાં સરકી જય.

ઋજુદ્ધરીન એટલે સર્યગ દર્શન

ઋજુદ્ધરીન એટલે સત્ય દર્શન

ઋજુદ્ધરીન એટલે પરમાત્મ દર્શન

અંજુદર્શન એટલે હેણી સીમિત શક્તિના દર્શન  
 અંજુદર્શન એટલે આત્માની અનંત શક્તિના દર્શન  
 અંજુદર્શન એટલે હેણ અને હેણીના વિવેકનું દર્શન  
 અંજુદર્શન એટને સધ્યમની સાધના દારા સિદ્ધિના દર્શન  
 અંજુદર્શન એટલે એક એક સમ્યગ આચારના પાલનમાં સંપૂર્ણ  
 સાધુતાના દર્શન  
 અંજુદર્શન એટલે એક અધ્યરના પણ સમ્યગ જાનમાં કેવળજાનના  
 કેવળજાનના દર્શન  
 અંજુદર્શન એટલે અનંત જડશક્તિનો તિરસ્કાર  
 અંજુદર્શન એટલે અનંત આત્મશક્તિનો સત્કાર  
 એ ભનક !

તારે જન્મ જન્મના હેરા ટાળવા છે ? જેને જન્મના ચેક મીટાવવા છે. રાગદેપની લભરીમાંથી દુર જવું છે તેને ઝડ્ઝુદ્ધી થવું જ પડે. કપડં કાર્ય છે અનતકાળથી શીખેલા ગણિતના ગોટાળા દૂર કરવા પડેશે. કપાગોંગે તને સુખમાં દુખ અને દુખમાં સુખના બ્રામક ખ્યાલો પોણ્યા છે. આશાંકિતએ તને અનાશાંકિત નિરાશાંસલાવ સામે નજર નાંખવા દીધી નથી. તેથી તારા પ્રાથમિક જીવનમાં પ્રાથમિક ગુણનો પહેલો પાઠ ભણુતા ગોખરાતું નહિ રદ્દવાતું નહિ પણ જીવનના ક્ષાસે શાસમાં વણ્ણી લે, આચ્યરી લે, ઝડ્ઝુદ્ધીતાના આ ગુણ સહજદર્શિન સાથે સંકળાયેલ છે. પણ તેતું રહસ્ય આચાર સાથે વણ્ણાયેલું છે. એ ભૂલતો નહિ હો !

પ્રભુમાર્ગનો અતુયાયી સાચા માર્ગની એકલી ધા નથી... પણ...  
એકલી ખુમાખુમ તો પાંગળો કરે... પ્રભુમાર્ગના અતુયાયીને સમ્યગદર્શિન  
સમ્યગ ચારિત્ર પ્રાપ્ત થાય. તેથી જ બાળક મનકને પિતા ઝડુદ્ધાઈ  
થવાના બહાને યથાપ્યાત ચારિત્ર તરફ મીટ માંડતો કરી હે છે.

એટા ! તું સામાયિક ચારિત્રમાં છે. પણ તારું લક્ષ્ય યથાપ્યાત ચારિત્ર સામાયિક ચારિત્ર છેદોપસ્થાપનીયચારિત્ર એતો યથાપ્યાત ચારિત્ર ઇંજીએકડાની પૂર્વાવસ્થા છે.

એક એકડો લખતાં હળગે લીંટા અને ભીડા કરવા પડે છે. તેમ યથાપ્યાત ચારિત્ર મેળવવા તારે અનેક વાર દવ્યચારિત્ર સ્વીકારવું જ રહ્યું રહ્યું હૈ.

જેમ લીંટા ભીડા કરવાર બાળકને ખ્યાલ આપવો પડે છે. ભાલકા તું ચકરડી લમ્બરડી રમવા લીંટા ભીડા નથી કરતો પણ તું એકડો શીખવા લીંટા ભીડા કરે છે. તેં ચારિત્ર ઋજુદ્ધરીં થવા લીધું છે.

જે ઋજુદ્ધરીં બને છે તે તે અરીજ્મઝતુમાં આતાપના લઘ શકે છે. કઉકડતી ઠડીમા સમશાનમાં કાયેટ્સર્ગ ધ્યાનમાં રહી શકે છે. વર્ષાઝતુમાં અંગોપાંગ સલીન બનાવી સલીનતા તપ આદરે છે પ્રત્યેક પ્રસંગમાં મુસમાહિત રહે છે જગતને હુચમચાવે એવા કઠીન કાળમાં પણ તેની સાધના અવિરત ચાલે છે

ઋજુદ્ધરીં આત્માને સિદ્ધિ સહાર કરવા આતુર છે. હું એક એવો પિતા હું મારા પુત્રને અનંતગુણનો સ્વામી જોવા ચાહું હું.

એટા ! ભને તારી ગતિ નહિ પ્રગતિ ગમે.

એટા ! ભને તારી સાધના નહિ સિદ્ધિ ગમે.

એટા ! ભને તારા વિકલ્પો નહિ સંકલ્પો ગમે.

એટા ! ભને તારા દુર્ગુણો નહિ સદ્ગુણો ગમે.

ખસ વધુ શું કહું ? તને ઋજુદ્ધરીં થવાના બહાને અનંતગુણ સમુદ્દરનો અવગાહન કરતો હેખવો છે. એક જ આશા... ઋજુદ્ધરીં થા અને તારા અનંતગુણ ખજાનાને પ્રગટિત કર !! !

## ૭. આઉસંતોણું

અંસ્કારી વ્યક્તિ, સંસ્કારી વડીલો જ્યારે પણ કોઈને બોલાવે છે ત્યારે તેના નામને ગૌણું કરે છે. તેના ગુણું, તેના કર્તાને આગળ કરી બોલાવે છે.

આત્મામાં દોપ તો અનાદિના છે. દોપના કારણે દોપી વ્યક્તિ એ તો સહજ છે. ખામીમાંથી ઘૂણીનું સંશોધન કરે તે જ મહાપુરુષ.

મહાપુરુષની વાણી વૃથા વહેતી નથી. મહાપુરુષના હૃદયમાં વિશ્વના સમસ્ત જીવો માટે વાતસલ્ય સરિતા ખળખળ વહે છે. વાતસલ્ય-સરિતાના નિર્મણ નીર દ્વારા અન્ય આત્મામાં બીજ રૂપે રહેલી ચોચ્યતા વૃક્ષ રૂપે વિકાસ પામે છે.

મહામના મહાત્માએ કરણાસિંહું હોય છે. સામાન્ય વ્યક્તિના સહજ સુલલ ગુણુને પણ તેએ એક પારંગામી દર્શિએ જુઓ છે અને હિમાલયમાંથી ગંગાના પવિત્ર નીર દવે તેમ તેમના હૃદયમાંથી પવિત્ર વાણી વહે છે.

પુ. શય્યંલવમૂર્ખ મહારાજ મહાપાત્રન આગમ દ્શવૈકાલિક સૂત્ર દ્વારા બાલમુનિ મનકનું ધડતર કરતાં કહે છે...

હે અસ્યાયુધ્યમાન !

બાળમુનિ મનકની વયમર્યાદા જણુનાર અલ્પજ મનુષ્ય જરા  
હસી પડશે. આઠ વર્ષો હીક્ષા લેનાર અને ૬ મહિનામા કાળ કરનાર  
૮॥ વર્ષના ખાળકને પૂર્વધર મહિપ્રિ આયુષ્યમાન કલે.

એ બુદ્ધિના વામન ! રૂક જા...

આકાશના અનંત તારલાને ગણુના કદાચ તું સમર્થ હશે !  
પૃથ્વીના પડનું સાન કરી ભૂસ્તરશાસ્ત્રી બનવાની તારી શક્તિ હશે !  
વનમાં રહી પંખીની સાથે જીવી કદાચ તેની લાપા જણુના તું સમર્થ  
હશે ! કદાચ સમુદ્રના જળ અને અફાટ રેતીકણું તાડં ગણિત ગણી  
શકતું હશે ! માપી શકતું હશે પણ... હજુ મહાપુરુષના હિત્યની હિંદ્ય  
કરણાને સમજવા પણ તું વામન છે તારી બુધિ નહી આંણી શકે.  
નહી માપી શકે .. અનંત કરણાનિધાન... કરણામૃતી ગુરુજ્ઞનોની અનંત  
કરણાને...

પૂ. શયંલવસ્તુરિ મહારાજે જે મનકને સંઓધેલ વિશેપણ આયુષ્યમાન!

પ્રત્યેક સાધકને માટે દીવાદીની ગરજ સારે છે. શાશ્વત ચિંતનનો  
રાહ બતાવે છે પૂ. અગત્યસિંહસ્તુરિ મહારાજ, પૂ. જિનહાસગણિ મહિતર  
મહારાજ અને પૂ. હરિલદસ્તુરિ મહારાજ જેવા હિગુજજ વિદ્ધાનો પૂ.  
શયંલવસ્તુરિ મહારાજના હાઈને પામવા તેમના ચરણમાં આગોટી રહ્યા છે.

મનક ! એ મનક !

તું અલ્પાયુષી નહિ, તું આયુષ્યમાન કારણ... તાડં આયુષ્ય સંયમ  
ચોગ્ય બન્યું સાધના સેવાને ચોગ્ય બન્યું તારે માનવ જન્મ સફળ થયો.

પૂ. શયંલવસ્તુરિ મહારાજ એક માત્ર મનકના જ એછા પિતા  
છે ? પાંચમા આરાના અંત સુધીના સમસ્ત સાધુકુળના એ પિતામહ  
છે સમસ્ત સાધુ મહાત્માના રાનદાતા ગુરુ છે.

હૈયાના હીર નીચોની જેને વિદા આપવી છે શું તેની પાત્રતા નહિ વિચારવાની ? આયુષમાન વિશેપણ દ્વારા કહી રહ્યા છે. જિનશાસનનું શાન ચિરંભવીને આપવું, જેથી જિનશાસનની પરંપરા અવિચિન્હન રહે.

એક જ્યોતિર્લિપી પણ જનકની કુંડળીને જેતાં સૌથી પહેલાં આયુષ્ય સ્થાન કેમ જુઓ છે ? સમસ્ત ફાગાદેશનો આધાર આયુષ્ય પર છે. ને જ્યોતિર્લિપાને મન આયુષ્ય પ્રથમ તો જેને જીવમાત્રના, આત્માના જોખ જોવાના છે જેને જિનશાસનની પરંપરાને અવિચિન્હન રાખવી છે, તે આયુષ્યમાનને પસંદ ના કરે એ અને ખરું ?

દીર્ઘાયુષ બાદ બીજા ગુણ વિચારવાના...આયુષ્ય એ કર્મ... કર્મ એટલે દ્વોપ. પણ સંયમાનું દીર્ઘાયુષ્ય એટલે ગુણ. ખુદ ગુણી અને... શાની બને...અનંતને ગુણી બનાવે અનંતને શાની બનાવે.

આયુષ્યમાન વિશેપણ...હજુ આગળ પ્રેરે છે

## અલા સાધક !

મેં તારા માનવ આયુષ્યના ગુણ ગાયાં તેથી સમજજે. “માનવનું આયુષ્ય તેં ગુણો દ્વારા મેળવ્યું છે. બીજી ગતિના આયુષ્યમાં ગુણોની જરૂર નથી, પણ માનવના આયુષ્યને મેળવવા તેં કેટલાં ગુણો મેળવ્યાં તે કથારે પણ ભૂલતો નહિ.”

માયા, ગ્રાફ, ફુડ, ક્રેટ, ડાર્ચા, મલસરને તેં તિલાંજલિ આપી. મરણતા-ઉદારતા-સ્પષ્ટતા-સાત્ત્વિકતાને તેં જીવનસંગી બનાવ્યા... લોલને હટાવ્યો... દાનડાચિ પ્રગતી અને લાલે તું સર્વગુણ સંપન્ન ન બન્યો...પણ...જીવન મરણના લોાગે પણ તને પ્રાપ્ત થયેલ ગુણોને મધ્યમ લાવે રહ્યા. ત્યારે જ તું માનવ બન્યો. ઓલ, તારા આ માનવ

આયુષ્યને ન બિરેદાવું ? ગુણ દારા ભલેલાં માનવ આયુષ્યને નવાજું છું. તેથી સાચે જ તને સહૈવ આ ગુણો સાચવવા ગુપ્ત સલાહ આપું છું. આયુષ્યડ્ર્પ ગુણની પ્રશંસા દારા તારી ઉત્તમ જલ્લિ તાર્દ ઉત્તમકુળ તારા ઉત્તમ સંસ્કારને પણ પ્રોત્સાહન આપું છું. આયુષ્યમાનું એ તો સંકેત છે. પણ સાચે તો તારા ઉચ્ચ્ય ગુણોની અનુમોદના છે. મારે તને સિદ્ધાંતના રહેસ્ય આપવા છે જે તારી આત્મિક યોગ્યતા ન હોય તો તું સિદ્ધાંતના રહેસ્યને પચાની નહિ શકે ‘ઉત્સર્જમાર્ગનો ઉપયોગ બીજા અલ્ય સત્તવવાળાને માટે કરીશ . અપવાદનો ઉપયોગ તારી ચુકોમન્દ વિજિને પોષવા કરીશ.’ તેથી જ જ્ઞાન હેતાં પહેલાં આત્મિક યોગ્યતાનો સૂચક આયુષ્યમાનું શબ્દ વાપર્યો છે.

શાસ્ત્રમાં આયુષ્યમાન શબ્દનો અર્થ ચરણુની સેવા કરતાં એવો પણ થાય છે શાસ્ત્રમાં એવો હેતું પણ આવે છે કે સહૃદને આયુષ્ય-જીવન પ્રિય છે એટલે આયુષ્યમાન કરી શિષ્યને ખોલાવવા આ અસત્યામૃપા છે.

જિનશાસનના રહેસ્યો કદાચ જ્ઞાનવરણીય કર્મના કષ્યોપશમના કારણે સહેલાઈથી સમજ શકીશ...પણ...જિનશાસનના પરમ રહેસ્યોને લારે જ પચાની શકારો...મોહનીય કર્મનો ઉચ્ચ્ય કષ્યોપશમ હશે ! અદ્ધાની નિર્મણિતા હશે ! તેથી જ આયુષ્યમાન ચિરંજીવીના સંકેત દારા જ્ઞાનના પાત્ર બનવા પૂર્ણ શર્યાતનું મહારાજ પ્રેરે છે.

એ સમસ્ત સાધુકુળના પિતામહ !

હૃપા કરો ..દ્વા કરો ..આમ અજ્ઞાની પર.. નિર્ગુણી પર.. નથી તો શાસ્ત્ર સમજ્યા...નથી તો શાસ્ત્રકાગેને સમજ્યા . બસ, તમારા ચરણની આશ સહૈવ રાખી...ઇચ્છાએ આપના હૈયાના લાન પ્રમાણે અમે ચિરંજીવી બનાએ.

ચિર ..શાસ્ત્ર અખંડ જિનશાસનની અવિચિન્ન પરંપરાને વહન કરવા યોગ્ય ચુપાત્ર બનાએ.

## C. ઉવસંપન્નિજતાણું વિહરામિ



કોઈ પણ વિવા, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ સાધના, પુસ્તકમાં વાંચીને પણ કરી શકાય છે જ. તેવું કહેનાર ભાગે ગમે નેટલો નઅતાનો દેખાવ કરતો હોય. પણ આંતરિક રીતે તે માનનો જ દાસ છે.

જગત્ કહે છે નથુરુચા કોઈના જોઈએ જેને ગુરુ નહિ તે કોઈનો પણ ગુરુ ના બની શકે.

ગુરુ શિષ્યની પ્રથા એટલે આધ્યાત્મિકતાની આપ લે. ગુરુ વગરના તીર્થાંકર પરમાત્મા હોય કે સ્વયં સંભુદ્ધ હોય, આડી અદ્વિતીય ગુરુ ના કરે તે કેમ ચાલે ?  
મનક !

મહાત્મતો જાતે સમજય નહિ. જાતે સ્વીકારાય નહિ મહાત્મતધારી જ્ઞાની ગુરુ આ મુખે પ્રતના દાન કરે છે. ત્યારે આપણા આધ્યાત્મિક ભાગના ચોગક્ષેભની જવાબદી સ્વીકારી લે છે.

જુન એ તો એક સમરંગણ છે. જ્યાં હજારો નહિ બલ્કે લાખો સમસ્યા ખરી થવાની છે. ત્યાં ગુરુના સહારા વગર એકલો અહૃદો હું નારી ત્યાગભાવના-આધ્યાત્મભાવનાનું રહાણ કેવી રીતે કરી શકે ?

“ ઉવસંપન્નિજતાણું વિહરામિ ” હું પુન. પુનઃ ચિંતન કર. ઉવસંપન્નિજતાણું એટલે ગુરુની સમીપમાં મહાત્મત સ્વીકારીને હું

વિચરણ કરું છું મહાવતનો સ્વીકાર... સ્વીકાર સ્વેચ્છા અને મહેચ્છાએ હોય. મહાવત ક્યારેય ડોધને પરાણે અપાતા નથી. છ્ચા વગર અપાતા નથી. આંતરિક અલિલાષાએ ડોધ વરતુ પ્રત્યેની સહૃદ્દ સંમતિ જાહેર કરવી તે સ્વીકાર.

ગુરુની સમીપમાં એટલે આપના (ગુરુના) જીન તપ-તાગ-અને ચારિત્રના પવિત્ર વાતાવરણમાં હું મહાવત સ્વીકારું છું.

ગુરુની સમીપમાં એટલે આપના (ગુરુના) સયમપૂત શ્રીમુખે મહાવતનો સ્વીકાર કરું છું.

ગુરુ સમીપમાં એટલે આપની કૃપાનો પાત્ર બનીને મહાવતનો સ્વીકાર કરું છું.

ગુરુની સમીપમાં એટલે આપની આર્થિક વડે મારા આત્માની આધ્યાત્મિક ચિહ્નિત્વા કરાવવા મહાવત સ્વીકારું છું.

ગુરુની સમીપમાં એટલે આપના જીનના પ્રકાશમાં મારા આત્માના અજ્ઞાન દૂર થશે. એવી શ્રદ્ધારી મહાવત સ્વીકારું છું.

ગુરુની સમીપમાં એટલે પથરને પળુ પારસ બનાવનાર મહાપુરુષની શુલાશિપ ત્રણણ કરી મહાવત સ્વીકારું છું.

ગુરુની સમીપમાં એટલે ક્ષાય સામે વિષય સામે સતત લડાઈ ચલાવનાર સેનાપતિના હાથે સંયમી સૈનિક બનતા વિજયતું તિલક કરાવું છું.

ગુરુની સમીપમાં એટલે સદ્ગ આપના ચરણનો દાસ બની મહાવત સ્વીકારું છું.

નથી જાણુતો સજજન બનવાની પ્રક્રિયા.

નથી જાણુતો સંત બનવાની પ્રક્રિયા.

નથી જાણુતો મહંત બનવાની પ્રક્રિયા કે,

નથી જાણુતો ભગવંત બનવાની પ્રક્રિયા.

પણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે, આપના શ્રીચરણમાં તેથી આપના ચરણે સમર્પિત બની આપના ચરણુનો સેવક બની મહાત્મત સ્વીકારું છું.

જેમ જ્ઞાની સાથે રહે અને તેનું શિષ્યત્વ સ્વીકારે તો તે જ્ઞાની પરખમાં નિષ્ણાત બની શકે છે આપ મહાત્મત ધારી છો ! અધ્યાત્મમૂર્તિ છો ! આપના શિષ્યત્વને સ્વીકાર્ય વગર મારા વ્રતના પાલન કેમ થાય ?

મહાત્મત ઉચ્ચરણવા દ્વારા ગુરુદેન પોતામાં રહેલો આધ્યાત્મિક શક્તિનો શક્તિપાત વિનિભય શિષ્યમા કરે છે. શિષ્યની અધી આસક્તિઓ શુસ્તની શક્તિ દ્વારા શુદ્ધ બની જાય છે

પત્રિત મહાપુરણોના આત્માના ઓજસ એવા હોય છે કાળ અને કર્મના દોપો પણ હરિદે છે. કાળ સુકાળ અની જાય છે. કર્મ ધર્મનું સહાયકારી તત્ત્વ અની જાય છે. શિષ્યની કૃપાત્તા નાટ થઈ જાય છે. અને સુપાત્રતા પેદા થાય છે.

વિષય-કથાય-વાસના રંગ રાગ દ્વારા પગુ બનેલો આત્મા મહાત્માના સમીપે જવાથી વૈરાગ્યના કઠોર પથપર દોડ મૂકી શકે છે.

ગુરુ સહારે ગુરુ કૃપાએ મહાત્મતો સ્વીકાર્ય બાદ શિષ્યમાં નિર્માભાવ પેદા થાય છે. એટલે આમ-નગર-વિશ્વ-નદી-પહુંડના વેરાન

માગે સંચરતા પરિષહ ઉપસર્ગથી હારતો નથી, થાકતો નથી, કંટક  
અને કંકરને કર્મ નિર્જરામાં સહાયક માને છે તેથી સદૈવ વિહાર માં  
મજા અનુભવે છે.

ગુરુ કૃપાએ મહાત્રત સ્વીકાર્યાં બાદ નિર્મભલાવ પેદા થાય છે  
તેથી સ્નેહી સ્વજનના બંધન તેને મુક્ત વિહારમાં રોકી શકતા નથી.

ગુરુ કૃપાએ મહાત્રત સ્વીકાર્યાં બાદ જ વસુવૈવ કુદુંઘકમ્  
ની અનુપમ લાવના પેદા થાય છે. એટલે અપ્રતિબદ્ધ વિહારમાં જે જે  
મહાનુભાવોને સમાગમ થયો તેના પ્રત્યે વાત્સલ્યભાવ પેદા થાય છે.

ગુરુ સમીપે મહાત્રતો સ્વીકાર્યાં પછી જ અનાસક્તિભાવ પ્રગટે  
છે. એટલે દેશ દેશની, ધર-ધરની ગૌયરીમાં સંયમની સાધના સમજય  
છે. અને પ્રસન્નભાવે વિહરણ થાય છે

ગુરુ સમીપે મહાત્રત સ્વીકાર્યાં હોવાના કારણે જ આધ્યાત્મિક  
શક્તિના પ્રગટી કરણ થાય છે. એટલે સહજ સમભાવ. સહજ ઔદ્ધારાં  
સહજ અક્ષાયભાવ પેદા થાય છે અને આત્મામાં વિહરણ થાય છે.

ગુરુ સમીપે મહાત્રત સ્વીકાર્યાં હોવાથી જ જગત્ તત્ત્વનું સાચું  
સ્વરૂપ સમજય છે તેથી અદ્ભૂત ભધ્યસ્થભાવ પેદા થાય છે અને  
આત્મા આત્મામાં વિચરતો થાય છે.

ગુરુ સમીપે મહાત્રત સ્વીકારનારમાંજ નિજનાનું ભરતી પ્રગટે  
છે એટલે આત્મભાવનું ચિંતન થાય છે અને સિદ્ધોની દુનિયામાં  
વિહરણ થાય છે.

વિહરણ જે ભાત્ર વિહરણ હોય ! તેના પૂર્વે ઉવસંપન્જિજતાણું ન  
હોય. વિશ્વમાં વિહરતા અંતરથી ગુરુ સામીય ન હોય તો આત્મા  
ભટકતો જ થઈ જાય. અનંત સંસારની અટવીમાં કયાંય અટવાઈ જાય  
અને એટલે જ જેને આ સંસારની ગહુન શરીરમાં અટવાલું ન હોય  
તેને વિહરણ કરવાનું...પણું... “ ઉવસંપન્જિજતા ” “ ઉપસંપદ ” કોઈ  
પણ લૂટી ન જાય તેવા સાંનિધ્યને પ્રાપ્ત કરીને.

મનક !

જોને ગુરુ ગૌતમે મહાવતોના દાન સાથે કેવળજાનના કેવા દાન કર્યાં, તેં પણ લાગ્યવાન ! ગુરુ સમાપે મહાવત સ્વીકાર્યાં છે હવે 'વિહૃરામિ' ની ઉદ્ઘોષણા કર.

ગુરુદેવ ! વિદ્યા ! છેદદી વિદ્યા..સિદ્ધોની ભૂમિ પર વિહાર કરું છું.

મનક ! તું પણ ધન્ય અનીશ અને તને વિદ્યા આપી હું પણ ધન્ય અનીશ.

જો ગુરુએ શિષ્યના હિતાર્થે મહાવતના ઉચ્ચારણ કરાવ્યા હોય તે ગુરુ શિષ્યની આધ્યાત્મિક પ્રગતિની ફેટકા મુશ થાય ! તેમનો આત્મા કેટલો પ્રસન્ન બને.

'જિનશાસનનુ' ચારિત્ર અદ્રિતીય અને ચારિત્ર અહૃણની પહુંચનિ પણ અદ્રિતીય અને ચારિત્રના પાલન પણ અદ્રિતીય.

વિહૃરામિ — હું વિહાર કરું છું આ એલાતાં સમસ્ત સંસારના સમસ્ત બંધનોને ક્ષણનારમાં તિલાંજલિ... વિહૃરામિ હું માર્ગ પર પ્રયાણ પ્રારંભું છું. વીતગાળના મોક્ષમાર્ગ પર અવિરત - ગતિ એ માર્ગ પ્રસ્થાન શરૂ કરે છું.

વિહૃરામિ — જ્ઞાન દર્શિન ચારિત્ર દારા મારા આત્મરાજ ના લંઘયભેદમાં મજાથી મહાલું છું.

વિહૃરામિ — શુદ્ધ અધ્યવસાય દારા ચિત્ત પ્રસન્નના ૩૫ નગરમાં સુખે સંચરું છું.

પૂર્ણ શય્યભવસુરિ મહારાજ અમે પણ ગુરુપાસે મહાવત સ્વીકાર્યાં છે મહાત્મા મનકે વિહૃરામિનો સિંહનાદ કર્યો. અમને પણ એ વિહૃરામિના સિંહનાદ કરવાની શક્તિ આપો.

કુદુ  
કુદુ

## ૬. સર્વભૂયપ્રભૂસસ

### સમું ભૂયાઈ પાસએ...

આર્થિક મહિને યુગ-પારગામી આચાર્યને એક દૂધમલ બાળકને કહી રહ્યા છે ..

વત્તસ ! ચામડાની આંખે હુનિયાના દર્શન કરે તે ચમાર હુનિયાને જોવા માટે ચામડાની આંખ અપૂર્ણ છે ધૂળમાં કચરો હેઠે તે ગમાર-ધૂળમાં સેતું હેઠે તે સોનાર. (ધૂળ ધોયો) બીજભાં વૃક્ષ હેઠે તે ભાળી. પવન દ્વારા વર્ષાના અનુમાન કરે તે જ્યોતિષિ. અને કચ હિંશાનો પવન અને કેવી વર્ષા. એ વર્ષા દ્વારા લાલ કે અંલાલ એ કહેનારો જ સાચો લવિષ્યવેતા...

વત્તસ . ભાલ... ચામડાની આંખે હુનિયા ના હેખ .. કરેણું નિધાન પરમાત્માવીરે હુનિયાને જોવાની એક દર્શિ આપી છે. એ દર્શિમા એક અનોખી પવિત્રતા છે કર્તાવ્યપથનું આહુવ્યાન છે. પ્રેરણ્યામૂર્તિ પિતા ! હિતશિક્ષાદાતા શુદ્ધ !

મારી વાન સાંભળો... ભાલ છે મારો દેહ . પણ મારો આત્મા અભાલ છે. આપની હિતશિક્ષાને અનુસરીશ મને સમજવો, પરમાત્માની પરમકર્ણા યુક્તન દર્શિ.

સામે જો કોણું છે ?

કંઈક શું છે ?

દેહ હેવો છે ?

તારા જેવો ?

તું હેવો ?

શું તું નિવેકી માનવ ? હા આપની કૃપાએ જ નિવેકી માનવ.

ઓ શિષ્ય ! દેહ અને દેહના લેટ સમજનાર શું તું પણ ભૂલ્ય કરે ? શુભમાંથી શિવ બનનાર તારું પણ ગણિત આવું કાચું ? તારું દર્શન અપૂર્ણ છે. પરમાત્માનું દર્શન અનોખું છે

મને ના લલચાવો જલ્દી બનાવો.

પાપીને પાપી કહે તે હુણ્ણ. પાપીને પાપી ના કહેતા સૌના દિવાનાં કુમળી લાગણ્ણને જુએ તે સંત-દેહના આવરણને લેહી દેહના દર્શન... દેહના દર્શન દારા ચિત-શક્તિને પીણાણું...આત્માની તિરેખૂત અનંતશક્તિને જો. એ શક્તિના તને દર્શન થાય ત્યારે તું સાચો સંત.

સ્વાધીને મન મારું તે સારું...ધીનાનું તે ખરાઅ...

પણુ...

સંતને મન ખરાઅ કોણું ? કર્મ કે આત્મા ? કર્મનો સ્વભાવ આત્મશક્તિનો અવરોધ કરવો તે. આત્માનો સ્વભાવ કર્મ આવરણ હુટાવી શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવાનો તે બનેના સ્વરૂપનો વર્ષે સુધી જેને અભ્યાસ કર્યો છે...ચિંતન કર્યું છે મનન કર્યું છે તે કોને ખરાઅ અને કોને સારું કહે ? તેની પાસે જવાઅ છે પદાર્થનો ધર્મ વિલિન છે. આત્મા ચેતના શક્તિ, પુદ્ગલ જડ...

બસ...હવે સ્થિર થા...આ તારી દર્શિને જ વિસ્તૃત બનાવ .. હું આત્મા, ફુનિયાના દરેક શું પણ આત્મા. તારા આત્મામાં જેવી છુંઘા, આશા અલિલાપા જન્મે. તારામાં જેવી લાગણ્ણ પેદા થાય તેવી જ શુભમાત્રમાં થાય... તને જેમ નાની નાની બાખતમાં પણ મુખ હું ખનો અનુભવ થાય તેવો જ સહુને થાય. તારામાં જેવી

“ કંઈક છું ”

એક દેહ છે.

પચેંનિદ્રય છે.

ના. ના. અવિવેકી પશુનો.

હું નિવેકી માનવ.

આત્મામાંથી મહાત્મા અને મહાત્મામાંથી પરમાત્મા બનવાની શક્તિ... તારામાં જેવો હિંયશક્તિનો સોત-એવો હિંય સોત જીવમાત્રમાં-પછી એ જીવ નિગોદ જેવા સ્વધૂમ શરીરમાં રહેલો છે કે ઈન્દ્ર જેવા મોટા શરીરમાં..

પરમાત્માની હિંયદર્શિ છે કે સર્વ આત્મામાં તારા જેવા હિંય આત્માના દર્શન કર. તારા હુંઘ સુખ માટે તુ આકાશ પાતાળ એક કરે છે-તેમ પ્રાર્થિતીમાત્ર માટે તું હર્તાંબ્ય રત બન પછી તે વિકસિત-અવિકસિત જગૃત ચેતના. અજગૃત ચેતના...માનવ...પણ. પાપી પુષ્યશાળી હુંઘ.. સંત આ બધા ભેદ ભૂલી જ... વિસરી જ.

પામરાત્મા પોતાની છંચા પૂર્તિમાં જગતની છંચા પૂર્તિ સમજે છે. અધમાત્માએ જ પોતે સુખી થયા એટલે હુંઘી જગતની ઉપેક્ષા કરી શકે છે. અથ્વ વિચારવાળા જ પોતાના હુંઘે સહૂને હુંઘી કરવા તૈયાર થાય છે. પરમાત્માની સુંદર દર્શિને પામેલો તો જગતના તમામ આત્મામાં પોતાના આત્માનું તાદ્વાન્ય સાથે છે. નાનીશી માખની પાંઘ હુલાતા પણ સાધક પોતાના ચિત્તમાં ગ્લાનિતું સ વેદન અનુસારે છે. પરના સુખહુંઘને જાણે સ્વભાવ જ પેઢા થતા સુખ હુંઘ છે તેવું સંવેદન થાય ત્યારે જ કલામયી દર્શિ બને. ત્યારે જ હિંયદર્શિ બને.

તારી નિત્યનોંધતું એક નવું પાતું આદેખ. સર્વ જીવ મારા જેવા .. ‘સર્વમં ભૂયાધ’ પાસએઓ.’ આ જ હિંયગાન... આ જ ભગ્ર જીવનના શાસે શાસમાં ધૂંટ્રાએ... પ્રાર્થિતીમાં પોતાના આત્માના દર્શન જેવા મારા જતન... જેવા મારી પ્રગતિના સોણુલા... તેવા જ જીવમાત્રના સોણુલા સેવે તે જ સાચો દસ્તા. આ પ્રભુ પરમાત્માની હિતશિક્ષા. બાળક મનકને પૂ. શાયંલવસ્તુરિ મહારાજ સમજાવી રહ્યા છે .. આ સનાતન હિતશિક્ષા છે... માનવમાત્રના નહિ પણ પ્રાર્થિતીમાત્રના ઉધ્વારક આપણુંને પણ એ પૂર્વપુર્વપનો નાદ સંલગ્નાય અને આપણું પણ આત્મવત્ત સર્વભૂતેપુના મંગલગીત જ નહિ મંગલ આચરણ કરવા શક્તિશાળી બનીએ.

## ૧૦. જીં સેયં તં સમાયરે...



હેણ ઉપર રાજ્ય કરવાની પદ્ધતિ અલગ,  
હિલ ઉપર રાજ્ય કરવાની પદ્ધતિ અલગ.  
હેણનું અનુશાસન કરે તે ગોવાળ—  
આત્માનું અનુશાસન કરે તે સંત—

મહારિંગ્ઓએ કયારે ય સત્તા અને અધિકારથી ધર્મ સામ્રાજ્યની સ્થાપના કરી નથી. તેથી જ સાધના દ્વારા સત્ય લાઘ્યા પછી પણ તેઓ ઉપદેશ કરે છે, આદેશ નથી કરતાં.

પૂર્ણ શય્ય લનસ્ફુરિ મહારાજ પણ એક સેષ સાધક મહાત્મા છે હજરો સાધક—લાગે આરાધક જેમના ઉપદેશ ઉપર નોચાવર થયા છે, તે પૂજ્ય એક આઠ વર્ષના બાળકને મોાખમાર્ગની અનુપમ સાધનાની પ્રાથમિક ભૂમિકા ઉપર લાવી હવે કહે છે, પુત્ર ! તું બાળક છે .. પણ સિંહનું બાળક છે, શૂરાનો સપૂત્ર છે પરમાત્મા મહાતીરનો તું અનુયાયી છે, તને આદેશ નહિ, મારે તો ફક્ત તને માર્ગદર્શિન આપવાનું.

તારામાં પણ એક ચિંતન મનન કરવાની શક્તિ છે, તું અનંતનો અભિલાષી—કોઈનો દોરવાયો ના દોરવાય ! તારી જાતે તારી રીતે વિચાર પછી આગે કદમ ભરે...  
“ જીં સેયં તં સમાયરે ”

તું પાપને પણ જણુ . પુણ્યને પણ જણુ—

તું સાધના માર્ગના સહાયક તત્ત્વને પણ જણુ

અને સાધના માર્ગના વિધાતક તત્ત્વને પણ જણુ—

તું ગ્રેયને પણ સમજ અને હેયને પણ સમજ

તુ શ્રેયને પણ સમજ અને ધ્રેયને પણ વિચાર

હેય... ગ્રેય શ્રેય અને ધ્રેય આ તત્ત્વોને સમજ હેય સામે તો તે કથારની પીડ કરી દીધી છે. હવે તારે મનોમથન કરવાનું છે ગ્રેય અને શ્રેયની વર્ણણે

ગ્રેયનો માર્ગ સુંદર છે પણ એ રેતીનો પહોડ છે. બસ તારો પગ જ્યા લરાઈ ગયો ત્યાં તું પટકયો, શ્રેયનો માર્ગ કઢિન છે, પથ્થરનો પહોડ છે, ચઢતા પગમાં કાંકરા વાગશે-કથારેક લોહી નીકળશે. ભલે એ સુંવાળો માર્ગ નથી પણ તારુ રક્ષણ અવશ્ય કરશે.

સનહી-સ્વરૂપનોમાં ગ્રેમ આપવાની તાકાત છે, પણ વિયોગના હું ખથી તને હુઃખી થતાં રોકવાની તાકાત નથી, આ ગ્રેયનો માર્ગ... ગુરૂજનો ધેલણાલ્યો મોહ જગવતા નથી-હિતસ્વીઓ મોહ કરવામાં માનતા નથી, તેઓ મોહક બનવા મથતા નથી, પણ તેમના વાતસલ્યાં લર્યાં ઉપદેશમાં એક અદ્ભુત તાકાત છે, સખાધીઓનો સંયોગ થવા દેતા નથી. સંયોગ નહિ તો વિયોગનું હુઃખ કયાંથી? આ શ્રેયનો માર્ગ.

મનક !

તું ગ્રેય અને શ્રેયના વિવેકને ભૂલતો નહિ. ગ્રેય અને શ્રેયની બેદરેખા એકવાર સમજ જા. સત્ય સમજય પહી તું અસત્યના માર્ગે નહિ ચાલે. કારણ તું માર્ગ લોહી છે. મેં પણ એકવાર ગ્રેયના માર્ગે

દોટ ભૂકો હતી. પણ પૂ. પરમોપકારી ગુરુદેવના શિષ્યોએ મારી સામે સાવધાનીને ધંટ વગાડ્યો. બસ, તારક ગુરુવરના શાળાએ મારી શ્રેય-માર્ગ સાધના પ્રેરી...તેથી જ એ ફિફેશની ભધુરી વાત તારી સમક્ષ કુંજુ કરે છું.

તું સત્ય-અસત્ય, પાપ-પુણ્ય, ધર્મ-ધર્મને સમજ, પછી તને જે શ્રેય લાગે તે આચરને.

એક આડ વર્ષના બાળકને સમજ વિચારી સાધનાનો પ્રારંભ કરવાનો તો પછી બીજાને કેવી રીતે ?

પરમાત્મા સર્વજ્ઞના ભાર્યાં પુને પિતાનું અનુકરણ કરવાનું નથી. શિષ્યે ગુરુનું અનુકરણ કરવાનું નથી. પુત્રીએ માતાના માર્ગ દોડવાનું નથી ! પણ શ્રેયમાર્ગ સમજ વિચારી અનુસરણ કરવાનું છે.

અનુકરણ વાનરવૃત્તિ છે.

અનુસરણ માનવવૃત્તિ છે.

અનુકરણમાં ખુદ્દિ વગરની નકલ કરવાની છે...

અનુસરણમાં સમજ વિચારી શરણાગતિ સ્વીકારવાની છે.

મનહ ! જે શ્રેય લાગે તે સારી રીતે આચર.

પૂ. શય્યાલવસ્તુરિ મહારાજનું નાનુ આ વાક્ય સામસ્ત સાધકોને ચિંતન મનન કરવા અંગે એક નમ્ર અનુરોધ કરે છે. સાથે શ્રેયમાર્ગ આગે કહું ભરવા પ્રેરે છે



# ૧૧. સો હુ નાહિઈ સંજમું



વૈદ્યકશાસ્ત્રના પારંગામી બનવા જેમ વાત પિતા છેના વિકારે સમજવા જરૂરી છે. જે તે ન સમજય તો રોગના મૂળ જણી ન શકાય. રોગ ના સમજય તો નિદાન ન થાય... અને નિદાન ન કરી શકે તે વૈદ્ય શાનો ?

ગણિતશાસ્ત્રના પારંગામી બનવું છે. ભીજગણિત અંકગણિત વિગેરે અનેક શાખા પ્રશાખાઓ જાણુંની છે. પણ... એકથી નવના અંકને શાખવા નથી. તો ગણિતશાસ્ત્રના રહસ્ય મળે ?

કોઈ પણ વિદ્યા કોઈપણ શાસ્ત્ર કોઈપણ કાર્યમાં નિષ્ણાત બનવા પહેલાં તેના મૂળને સમજવા જોઈએ. મૂળ સમજયા વગર ડાળીએને પહુંચવાથી શું લાભ ?

મનકુ ! તારે માત્ર સંયમનું પાલન નથી કરી જવું પણ સંયમ દારા શોલી ઉઠવું છે. સંયમભય બની જવું છે... સંયમ દારા ધન્ય બનવું છે... પણ... સંયમભય બનવું સહેલું નથી સંયમભય બનવા માટે ખૂબ્ય સાવધાની સતત ઉપયોગ અને તત્પ્રતાની જરૂર છે. સુદ્ધમતત્વદર્શિની જરૂર છે. તું સંયમનાં પાલન કેવી રીતે કરીશ ? સંયમ કયાં રાખવાનો ? સંયમ કોનો રાખવાનો ? સંયમના પ્રકાર કેટલા ? શું પ્રવૃત્તિ કરે તો સંયમભય બનાય ? ક્યું અકર્તાવ્ય કરે તો સંયમનો નાશ... સંયમની વિરાધના થાય ? એ બધું તારે જાણવું જ પડે !

સુંદના ગાંગડે ગાંધી ના બનાય' પણ... પૃથ્વી પરની અનેક વનસ્પતિઓના નામ આવડાં જોઈએ તેની જાતિ ઉપજાતિની ખખર પડવી જોઈએ. પ્રત્યેક વનસ્પતિના પંચાંગ ખખર હોય તો જ સાચા ગાંધી બનાય. તેમ સંયમના પાલન માટે માતાપિતા છોડ્યા. માથું સુંડાંબું, ઓદ્યો મુહૂરતિ લીધા... પૂંજતા પ્રમાર્જાતા આવડી ગયું તેટલાથી તારી જતને પૂર્ણ માનવાનું સાહુસ ના કરતો.

કરતાં કયારે ય ડરીશ નહિ. સોનાં રૂપાં ધર ક્ષેત્રની ભમતા ઉત્તરશે. આંખને આંલે તેવું રૂપ કોઈલ કંઈ ક્લેવો સ્વર, વારંવાર જોવું ગમે તેવો ‘અહેરો’ આ બધું દેહનો ધર્મ સમજ્યા પછી તેના પર પણ ભમત્વ નહીં રહે.

અળુવના જ્ઞાન દ્વારા જ તું અળુવ સંયમનું પાલન સમજ્યા જેમ તું જીવ ઉપર ગુસ્સો ના કરે તેમ વસ્ત્ર-પાત્ર-સ્થળ ઉપર પણ ગુસ્સો નહિ કરે. અતાલિના સંસ્કાર છે ને વચ્ચે આવે તેના પર બધો ગુસ્સો ઢાલવી દેવો. પણ અળુવત્તવના જ્ઞાન સાથે અળુવ સંયમ સમજારો એટલે તારો સાધુનો આત્મા પોકારશે— ભારે સર્વત્ર સર્વાવસ્થામાં સર્વ પ્રત્યે સમલાવી રહેવાનું છે. જીવનાં જતન કરવાના અને અળુવના પણ જતન કરવાનાં જીવનો જ્ઞાન ગુણ વિકસિત કરીશ તો અળુવ પુરુષાત્ત્વના સહાયક ગુણનો પણ વિચાર કરીશ. એટલે તેને તારી સાધનાનું ઉપકરણ બનાવીશ.

તું જીવનું સ્વરૂપ જાણે નો જ તને જિનેશ્વરનું સ્વરૂપ સમજ્યા. અને સંયમ દ્વારા તારા આત્માને પણ શિવમંગલ બનાવો શકે !

મનહ ! જીવ અને અળુવના જ્ઞાનથી તને સમસ્ત સંસારની ધર્મ જળ સમજાઈ તેથી વૈરાગ્ય માર્ગ સ્ત્રીકાર્ય લાગ્યો. અને મોક્ષના પવિત્ર રાજમાર્ગ પર વિહરણ કરવા લાગ્યો જીવ અને અળુવના બેદ જાણુંતો હતો તેથી જ તને સંયમનાં માર્ગ હોરી શક્યો. હવે તું.. ધરાયર જીવ અને અળુવનું જ્ઞાન સમજ લે. તે સમજવાથી જ તુ સંયમ સમજ શકીશ.

### સો હું નાહિક્ષ સંજમ

પરમહૃપાળુ પૂ. શય્યાભવસ્ત્રિ મહારાજે દશ વૈકાલિકના જ અધ્યયનમાં કુમાલ કરી છે. સૈદ્ધાનિતિક દર્શિયે જીવ અને અળુવનું જ્ઞાન કેટલું ઉપરોગી છે. અને તે દ્વારા જીવન ઉન્નતિના એક એક સોાપાન કેવી રીતે આરોહી શક્ય છે તેનું રોચક વર્ણન કર્યું છે. ધર્થીવાર તો આ પદોનો સ્વાધ્યાય કરતાં આત્મામાં સ્પંદન પેદા થાય છે...જાણે અમે પણ પ્રગતિપથ પર ચડી રહ્યા છીએ આપના આશીર્વાદ કોઈક વાર તો અવશ્ય સાધનાની સોાપાન શેરી પર આરોહણ કરાવશે તે ભાવ લઈ પુનઃ સ્વાધ્યાયમાં લીન અનીએ.



## ૧૨. સુહસાયગસ્ત

જગત જ્યારે સુખના પાછળ ઘેલું બન્યું છે સુખ પાછળ ધમ પછાડા કરો રહ્યું છે. સ્વભનમાં પણ સુખ શબ્દ સાંભળે છે. તો ય આનંદની અનુભૂતિ કરે છે. ત્યારે એક નાનકડાં બાળકને પિતા પ્રભોધી રહ્યાં છે.

લાઉલા, સુખનો માર્ગ સોહામણો છે. રણિયામણો છે. તારી આંખો ખુશ થઈ જશે, કાન આતુર બની જશે, જલ લપ લપ લપ કરવા લાગણો. ભુખડી બારસ જેવી તારી પાંચે ઈન્દ્રિય તોફાન મચાવી દેશે, મન માજા મૂકી કુલ્પનાના તરંગો રમી એક આગવી સૃષ્ટિ ખરી કરી દેશે માનવમાત્રના શબ્દકોશનો મહામૂલ્ય જો કોઈ શબ્દ હોય તો તે એક જ છે. “સુખ”

જગતના સર્વ જીવો સુખની પાછળ આસક્ત છે. તેની પાછળ તું આસક્ત ન બને એ કંઈ બનવા જેવી વાત છે?

પણ મારે તને સુંવાળા ‘માર્ગ’ નથી ચલાવવો. સુખની સૃષ્ટિ એ સત્ય છે કે ઈન્ડ્રિયાણ છે. તે સમજાવવું છે. તું જ મનોમંથન કરે! સત્યદર્શન હેઠામાંથી ઉદ્ભબવે છે.

શું સુખ તારા જીવનનું ધડતર કરશે?

શું સુખ તારી જીવનશક્તિઓને વિકસિત કરશે?

શું સુખ તને સશક્ત બનાવશે?

શું સુખ તને સ્વાધીન બનાવશે?

શું સુખ તને સૌનો સોહી રાખશે?

પરમાત્માનું પ્રડેલું સંયમ શ્રેષ્ઠ છે અને સંયમનું પાલન પણ શ્રેષ્ઠ છે. અને સંયમભય બની જવું તે અતિશ્રેષ્ઠ છે જેટલી ચોજ મૂલ્યવાન તેટલા તેના જતન પણ જાઓરા જ કરવાના...ને!

સંયમના પાલન માટે જ્ઞાન ખૂબ જરૂરી છે જ્ઞાન વગર સંયમના પાલન મહાવિદેહ ક્ષેત્રમાં પણ ન થઈ શકે તો ભરતક્ષેત્રમાં કયાંથી થઈ શકે?

કંજુ અને પ્રાજ્ઞ ર૨ તીર્થાંકર પરમાત્માના સાધુઓ પણ જ્ઞાન વગર સંયમનું પાલન ન સમજુ શકે તો પરમાત્મા મહાવીરના વડ અને જડ સાધુઓ જ્ઞાન વગર સંયમની પાલના હેમ સમજુ શકે? આંખ વગર જેમ દેખી ન શકાય, કાન વગર સાંલળી ન શકાય તેમ જ્ઞાન વગર સંયમ સમજુ ન શકાય તો પાલન કયાંથી?

જેમ જીવન ધ્યાણ માટે પ્રાણું જરૂરી છે તેમ સંયમ પાલન માટે જ્ઞાન જરૂરી. લયાંકર જંગલમાંથી પસાર થવું હોય પણ સાથે ભોગ્યો ન હોય તો અટવી પસાર ન થઈ શકે. દુઃકર સંયમનું પાલન કરવું હોય તો જ્ઞાન વગર થઈ શકે?

એક સસારી અજ્ઞાની હોય તો ચાલે, પણ સાધુ અજ્ઞાની હોય તો ચાલે? તેની સાધના જ્ઞાન વગર ઐરબે પડી જય. સાધુ અજ્ઞાની રહે તો તેના સંયમના પાલન, મહાત્મના રહણ તુટી પડે જીવનમા જેટલી આખની આવશ્યકતા તેથીય અધિક સંયમપાલનમાં જ્ઞાનની આવશ્યકતા.

જ્ઞાન ન હોય તો સતત પ્રકારનો સયન ડેવી રીતે જાણો? જ્ઞાન ન હોય તો સંયમનાં ૭૦ બેદ ડેવી રીતે જાણો? જ્ઞાન ન હોય તો ચરણસિતરી અને કરણસિતરીના બેદ ડેવી રીતે સમજુ શકે? જ્ઞાન ન હોય તો પૂજય અપૂજયના બેદ ડેવી રીતે જાણી શકે? જ્ઞાન ન હોય તો આરાધન। વિરાધનાનું ગૃથછકરણ ડેવી રીતે કરી શકે? જ્ઞાન વિના સંયમવિરાધના અને આત્મ વિરાધનાના રહસ્ય હેમ સમજુ શકે? જ્ઞાન વગર વીતરણ દેવ અને ભિથ્યાત્મી દેવના બેદને હેમ જાણી શકાય? જ્ઞાન સંયમ પાળવું છે તો કંમર કસી પુરુપાર્થ કર અને તેમાં પણ

મહાતમા તારે શાન સંયમના પાલન માટે જોઈએ છે તો તારે કેટલો પુરુષાર્થ કરવો પડે ? વિશ્વની શાન વિજ્ઞાનની અનેક શાખા અનેક પ્રશાખાઓ નહિ જાણે તો કેમ ચાલશે ?

જીવ અને અજીવનું જાન હોશે તો જ તારું ગાડું આગણું ચાલશે કારણું પ્રભુ પરમાત્માનો સાધુ છે તેને જીવ સંયમ અને અજીવ સંયમ બનનેતું પાલન કરવાનું હોય છે

જીવનું શાન તેને તારું સ્વરૂપ સમજાવશે.

અજીવનું શાન તને સ સારનું સ્વરૂપ સમજાવશે.

જીવનું શાન તને તારા જન્મ ભરણ અને અનેક યોનિઓનું શાન કરાવશે. તારા સ્થળો. તારા દૃપો જોઈ કોઈ પણ જીવ પ્રત્યે તું અપ્રીતિ-દ્રોષ નહીં કરે.

અજીવનું શાન તને પુરુષનું સ્વરૂપ સમજાવશે અજીવની સમજ વિસ્તરતાં તને સમજાશે કે ક્યાંક તું વર્ણ લોલુભી બન્યો...તો ક્યાંક તું રસમાં આસકત બન્યો. એટલે જ તું અથડાયો. ફૂટાયો અને જન્મ-ભરણના ચક્રમાં ફસાયો.

જીવનું સ્વરૂપ જાણ્યા બાદ કોઈના પર તને દ્વારા નહિ થાય...તો અજીવનું સ્વરૂપ સમજાયા બાદ ક્યાંક રાગ નહીં થાય રાગદ્વેપના રૌદ્ર દૃપો જાનીને શાન દ્વારા સમજાય અને સમજાયા બાદ સંયમ દ્વારા રાગદ્વેપથી બચાય જીવ અજીવનું શાન મોકલમહાલયમાં પહોંચાડ્યા માટે સમર્થ બની શકે તો સંયમના કેટલું સહાયક થાય ? તે વિચાર કર

જીવનું શાન તને હિસાથી બચાવશે હિસાના બેદ સમજુશ તો માનસિક હિસા, વાચિક હિંસા કાચિક હિંસા-સ્વરૂપ હિંસા-પરિણામ હિંસા સ્વ હિસા-પર હિસા સમજાશે સાથે જ હિસાને ઉતેજક કોઈ, માન, ચર્ચા વેર વેરાનુભંધ-રૌદ્ર પરિણામ કડોરતા નિર્દ્યયતા સમજાશે. સંયમના પાલન માટે આ બધાનો ત્યાગ જરૂરી છે. મારે જીવ સંયમનું પાલન કરવું છે જીવ સંયમના પાલન માટે પડિલેહણું પ્રમાર્જના હ્યા કરુણા, વાત્સલ્ય, ભધુદુર્દ વચન અને નિર્મણ અધ્યવસાયોને સમજુશ તો આચરીશ ને ?

અજીવનું શાન તને ઘૂણ ઘૂણ સહાયક થશે. ને તારા રાગને દૂર કરશે. એટલે અજીવ સંયમના પાલન માટે ને જરૂરી ત્યાગ છે તે

કરતાં કથારે ય ઉરીશ નહિ. સોનાં તૃપાં ધર ક્ષેત્રની ભમતા ઉત્તરશે. આંખને અંજે તેવું રૂપ કોકીલ કંઠ જેવો સ્વર, વારંવાર જેવું ગમે તેવો. ‘ચહેરો’ આ બધું દેહનો ધર્મ સમજ્યા પછી તેના પર પણ ભમતલ નહીં રહે.

અળુવના જ્ઞાન દ્વારા જ તું અળુવ સંયમનું પાલન સમજુશ જેમ તું જીવ ઉપર ગુર્સો ના કરે તેમ વસ્ત્ર-પાત્ર-સ્થળ ઉપર પણ ગુર્સો નહિ કરે. અનાદિના સંસ્કાર છે ને વચ્ચે આવે તેના પર બધી ગુર્સો દ્વારાવી હેવો. પણ અળુવત્તવના જ્ઞાન સાથે અળુવ સંયમ સમજારો એટલે તારો સાધુનો આત્મા પોકારશે— ભાડે સર્વત્ર સર્વાવિસ્થામાં સર્વ પ્રત્યે સમલાવી રહેવાનું છે. જીવનાં જતન કરવાના અને અળુવનાં પણ જતન કરવાનાં જીવનો જ્ઞાન ગુણ વિકસિત કરીશ તો અળુવ પુછગણ-તત્ત્વાના સહાયક ગુણનો પણ વિચાર કરીશ. એટલે તેને તારી સાધનાનું ઉપકરણ બનાવીશ.

તું જીવનું સ્વરૂપ જાણે તો જ તને જિનેશ્વરનું સ્વરૂપ સમજાય અને સંયમ દ્વારા તારા આત્માને પણ શિવમંગલ બનાવી શકે !

મનક ! જીવ અને અળુવના જ્ઞાનથી તને સમસ્ત સંસારની છદ્દ જાળ સમજાઈ તેથી વૈરાગ્ય માર્ગ સ્વીકાર્ય લાગ્યો. અને મોક્ષના પત્રિન રાજમાર્ગ પર વિહરણ કરવા લાગ્યો જીવ અને અળુવના બેદ જાણતો હતો. તેથી જ તને સંયમનાં માર્ગ દોરી શક્યો. હવે તું બરાબર જીવ અને અળુવનું જ્ઞાન સમજ લે. તે સમજવાથી જ તું સંયમ સમજ શકીશ.

### સો ઈ નાહિદ સંયમં

પરમકૃપાળું પૂ. શાય્યાલબસુરિ મહારાજે દ્વારા વૈકાલિકના જ અધ્યયનમાં કુમાલ કરી છે. સૈદ્ધાન્તિક દર્શિયે જીવ અને અળુવનું જ્ઞાન ફેટલું ઉપગ્રોગી છે. અને તે દ્વારા જીવન ઉન્નતિના એક એક સૌપાન કેવી રીતે આગોહી શકાય છે તેનું રોચક વર્ણન કર્યું છે. ધણીવાર તો આ પદોનો સ્વાધ્યાય કરતાં આત્મામાં સ્પંદન પેદા થાય છે...જાણે અમે પણ પ્રગતિપથ પર અડી રહ્યા છીએ આપના આશીર્વાદ કોઈક વાર તો અવશ્ય સાધનાની સૌપાન શ્રેણી પર આરોહણ કરાવશે તે ભાવ લઈ પુનઃ સ્વાધ્યાયમાં લીન અનીએ.



## ૧૨. સુહસાયગુર્સ

જગત જ્યારે સુખના પાછળ ઘેલું બન્યું છે સુખ પાછળ ધમ પછાડા કરે રહ્યું છે. સ્વભનમાં પણ સુખ શર્દુ સાંભળે છે. તો ય આનંદની અનુભૂતિ કરે છે. ત્યારે એક નાનકડાં બાળકને પિતા પ્રભોધી રહ્યાં છે.

લાડલા, સુખનો માર્ગ સોહમણો છે... રળિયામણો છે. તારી આંખો ખુશ થઈ જશે, કાન આતુર બની જશે, જીબ લપ લપ લપ કરવા લાગશે. ભુખડી બારસ જેવી તારી પાંચે ઈન્દ્રિય તોક્કાન મચાવી દેશે, મન માજા મૂકી કલ્યાનાના તરંગો રમી એક આગવી સૃષ્ટિ ખરી કરી દેશે માનવમાત્રના શર્દુકોથનો મહામૂલ્ય જો કોઈ શર્દુ હોય તો તે એક જ છે. ‘સુખ’

જગતના સર્વ જીવો સુખની પાછળ આસક્ત છે. તેની પાછળ તું આસક્ત ન બને એ કંઈ બનવા જેવી વાત છે ?

પણ મારે તને સુંવાળા માર્ગે નથી ચલાવવો. સુખની સૃષ્ટિ એ સત્ય છે કે ઈંદ્રજાળ છે. તે સમજાવવું છે. તું જ મનોમંથન કરે! સત્યદર્શન દૈવમાંથી ઉદ્ભબે છે.

શું સુખ તારા જીવનનું ધડતર કરશે ?

શું સુખ તારી જીવનશક્તિઓને વિકસિત કરશે ?

શું સુખ તને સશક્ત બનાવશે ?

શું સુખ તને સ્વાધીન બનાવશે ?

શું સુખ તને સૌનો સ્નેહી રાખશે ?

શું સુખ તને કર્તવ્ય પથ પર સ્થિર રહેવા દેશે ?

શું સુખ તને પોતાને પ્રગતિના પંથે પ્રયાણ કરવા દેશે ?

શું સુખ તને સુખે જીવવા દેશે ?

છેલ્દે હજુ એક પ્રશ્ન પૂછી લઉં. ગભરાતો નહિ શું સુખ તને  
છેલ્દે શ્વાસ બેવા દેશે,

હું સમજું છું, આ પ્રશ્નાવલી તને કહવી લાગશે... આકરી  
લાગશે. તારું મુખ પ્રશ્ન સાંભળી મુરારી જણો...પણ...નું રથસૂચ બની ..  
શાંત મને વિચાર કર, તને તારા વિદ્યનો જીગતો દેવ જવાબ આપશે.  
આજ સુધી સુખની પાદ્યણ ઘેલાં બની તો માંદ્વલાને મુંજબ્યો છે. તેનો  
દોહ કર્યો છે. હવે જરા કુરસદ કાડ.

ઓક વખત મુક્ત મને હસ્તી બે. સંસારની બધી જંઝટને દ્વાર  
દૂર કે કી દે. પછી શાંત પ્રશ્નાં બની વિચાર કર. બોલ નારા સુખની  
વ્યાખ્યા ?

સાધન તેજ સુખને ?

સગવડ તેજ સુખને ?

અનુકૂળતા તેજ સુખને ?

સાધન—સગવડ અને અનુકૂળતા ઓજ સુખ હોત તો જગત  
સુખ માટે ફંઝા ન મારત. ભાઈ. પાયામાં જ પહેલી ભૂલ કરે છે.

આદ્યસના મહાહુંગરા પર તારે આરોહણ કરવું છે. અને  
તળેટીથી પગ ના ઉપાડે તો ચાલે ? તળેટી છાડે તો જ શિખરના  
સફુરની મજા મહાયુદી શકાય. સુખ સમજયા વગર સુખના ફંઝા તને  
સુખી નહિ બનાવે. ભયંકર હુંખસાગરમાં હુબાડી દેશે. તારી કદ્યના  
નારા વાતાવરણે તને સગવડતા સાધન અને અનુકૂળતામા સુખની ભ્રમણા  
કરાવી છે. તેથી જરા કંઈક મનોભાવ મુજબ જોયું, ઘેલા થઈ પાદ્યણ  
પહ્યો. પૂર પાટ દોડ ચલાવી. જરા મનમોહક—આકપોંક પદાર્થ મળ્યા.  
આંજે ઠથારો કર્યો. નાકે ચાથ આપ્યો. છલ સગવળી. અને હાથ

મશીનની લેમ તેથાર થઈ ગયા. એક મિનિટ માટે લાગ્યું હું સુખનો બેતાજ બાટશાહ. મારા લેવા લે.ય્ય પદાર્થ કોની પાસે? જુખી સુખી સુખનું બૂમરાણ કરી જગતને ગજવી મુક્યું. સૌ તને અભિનંદન આપવા આતુર બની આવવા લાગ્યા. સૌ હસતા આવે છે. પણ તેંતો કાગારોળ કરી મૂકી છે.” મરી ગયો બાપલોયા” બચાવો બચાવો. અસંખ્ય વેદના અગણિત દુઃખ. ભયંકર દુઃખી છું..અરે ભાઈ. નમે કેમ આવ્યા. મારા દુઃખીને ઝૂંપડીયે ..

તારા સુખની બૂમરાણ સાલળીને દોડી આવ્યા. તને અભિનંદન આપવા, ત્યારે તું પણ દુઃખની બૂમરાણ કરે છે. ચાચું શું ?

ભાઈ મને વધારે ના બોલાવો. થાકી ગયો છું. નસે નસ ખેંચાય છે. આંતરડાં તૂટે છે. મારો શ્વાસ ધૂંટાય છે. બે ટુકડાં જરા સારા ખાવા મલ્યાં મેં સુખનો અનુભવ કર્યો. પણ ત્યાં તો એ ટુકડાએ તેનું નગન સ્વરૂપ પ્રગટ કર્યું. બસ જૂઓ મારી પરિસ્થિત મને ના બોલાવો. મારાથી મારા દુઃખનું વણ્ણેન થતું નથી હવે તો રડીને પણ આંસુ ઝૂટ્યાં. કંઈ શેતે વ્યક્ત કરું મારી દુઃખની વેદનાં બસ તમે દૂર ભાગો.

‘ મેં સાધનમાં સુખ જેયું.

મેં સંગવડમાં સુખના દર્શન કર્યો.

મેં અનુકૂળતાને સુખ માની લીધું તેની પાછળ આસક્ત બન્યો. સુખના બોલુપી એવા મને તેની ભૌતરમાં રહેલ સત્ય સ્વરૂપનાં દર્શન ના થયા.

ઓ મનક ! સાંભળ, ખા એક જ વ્યક્તિની એક જ કથની. નારે આનાથી અધિક વિચાર કરવાનો છે.

સુખનો બોલુપી સ્વાર્થી બને છે.

સુખનો બોલુપી ઈર્પળુ બને છે.

સુખના લોલુપીને કોધ માન માયા વોલ ભરખી જાય છે. ભૂતની જેમ વળગી જાય છે. સુખના લોલુપીને સત્તા અધિકાર ભાન ભૂલાવે છે. કર્તવ્ય પથથી ભ્રષ્ટ કરી દે છે. પરિણામે તેની ઘટમાણ એક જ હોય છે. આકાશ પાતાળ એક કરી ઈથને પ્રાપ્ત કરું. અનિષ્ટને દૂર કરું. ન મળે તો મારું કે મરું બળું કે બાળું.. આ ભયંકર દુલ્હિવ તેને દુર્ગતિમાં લઈ જાય છે. સદ્ગતિ દૂર થાય છે.

મનક...તું મોક્ષનો મુસાફર ! સયમનો ઉપાસક ! તું સુખ લોલુપી ના બનતો.. સુખની આસક્તિ તારી સદ્ગતિને રોકી દેશે. તારી આત્મક પ્રગતિને થંભાવી દેશે.

તારી નોંધપોથીમાં આવેખી લે. તારા હદ્દયપટમાં કોતરી લે. હું સાધુ ! હું મોક્ષચાહક મને મોક્ષ બાધક...સુખ સ્વાહૃતા ના જોઈઓ. સુખની આસક્તિ મને ના ઘ્યે....

જે હું સુખ લોલુપી બનું. પ્રાપ્ત સુખોમાં પણ ભાન ભૂલું તો મારા લવાટે દુર્ગતિના લેખ લખાઈ જાય. સદ્ગતિ મારાથી રીસાઈ ને ભાગી જાય. આત્મશુદ્ધિ મારો સત્કાર કરવા તૈયાર છે તે દૂર સુદુર થઈ જાય.

બેટા મનક ..

“સુખનો સ્વાદ એટલે દુર્ગતિને આમંત્રણ” સાચે સુખની આસક્તિ દૂર કરવાના બહાને તને મોક્ષની નજીક લઈ જઉં છું એ ભૂલતો નહિ. તેં સુખનો સ્વાદ છોડ્યો એટલે સુખના પ્રબલ સાધન પ્રધાન સદ્ગતિ તારા ચરણમાં.

સુખ સ્વાદની જંખના તને કયાં લઈ જશે ? તારું અધ્યાત્મન ક્રેટલું થશે. તે મેં સમજાઈયું છે. આત્મવીર હવે તું તારી જતે વિચાર

“સુખનો સ્વાદ માણું કે સાધનાનો સ્વાદ માણું ? સુખનો

સ્વાદ દુગર્તિ આપશે, સાધના સિદ્ધિ આપશે. બસ. સુખથી કોણો  
દુર ભાગ અને સાધના માર્ગ હરણકૃત ભર.

### ઓ પૂર્વધર મહાત્મા

મહાત્મા મનકે સુખને અવગાણી સાધના માર્ગ હરણકૃત જરી  
ત્યારે તો છ મહિનાના અદ્યપ સમયમાં સમાધિના શિખર સર કર્યાં.  
અમારે સુખની વ્યાદુળતા છોડવી છે. સમાધિમાં લીનના કેળવવી છે.  
આપો આશીર્વાદ અમ સેવક જન ઉપર .





## ૧૩. અસુખંતો

જગતના સમસ્ત માનવીઓની ઓક વાત છે. જરૂરી કામ છે. કાર્ય તરિત પૂર્ણ કરવું છે. હવે થોબવાનો સમય નથી બસ્ત દોડવા દો અમે દોડયા જ કરીશું. નાના બાળકની જેમ નહિ પણ—નદીના ઘોડા પૂરની જેમ દોડિશું. વાગુથંભે દોડિશું. શું દોડવાની જ મજા માણશો. દોડવામાં જ લહાવા છે કે થોબવામાં? સવાલ જવાબની માથાકૂટ માટે ઉલ્લો રહું તો મારી આગેકૂચ બંધ થઈ જય... હું દોડવાને ટેવાયેલો છું.

જુંદગી અલ્પ છે, કાર્યની વણુઝાર છે. ઓક સોંકડ બળદે તો મારી જીતની બાજુ હારમાં પલટાઈ જય. ચુવાંથી ઊહું છું ને પેલી ઘડીયાળ ડંકા કરી મારા સામે આઢુહાસ્ય કરે છે, હું પણ સમયની રાક્ષસી માયાજળ સામે દાંત કચકચાવી — હાથની મુઠીઓ વાળી કંઈક નિશ્ચય કરું છું. જલ્દી દોડું છું. શૌચ — સ્નાન પતાવું જરા મોડું થશે માટે ભાગું છું. લાઈનમાં, મારો નંબર જેઈ હસું છું. ત્યાં પાછળ-વાળાનું જુધુ હાસ્ય મને કનಡે છે. ભાઈ? નંબર લગાવ્યો.. લોટો કૃયા? આનંદ શોકમાં પલટાઈ ગયો.. જીત હારમાં ફેરવાઈ ગઈ. આ ઓક સંસારીની કથા જેવી મારી પણ ઓક વ્યથા છે.

મને સમજતું નથી દોડું છતાં હાડું કેમ?

મને સમજતું નથી અદ્યયન કરું છતાં જ્ઞાન કેમ નહિ?

મને સમજતું નથી કામ કરું છતાં ભક્તિ કેમ નહિ?

મને સમજતું નથી ચારિત્ર પાળું છતાં કર્મનિઃ ક્ષય કેમ નહિ?

મને સમજતું નથી તપુ કર્દે છતાં કર્મને તાપ કેમ લાગતો નથી ?  
 મને સમજતું નથી વિહાર કર્દે છતાં આત્મ વિહરણ કેમ થતું નથી ?  
 મને સમજતું નથી વિનય કર્દે છતાં ગુરુકૃપા કેમ મળતી નથી ?  
 મને સમજતું નથી નવકાર ગણું છતાં નમૃતા કેમ પ્રાપ્ત થતી નથી ?  
 મને સમજતું નથી ગુણીના સમાગમમાં રહું પણ ગુણની સુવાસ કેમ મળતી નથી.

મને સમજતું નથી વિદ્વાનોની સેવા કર્દે છતાં અજ્ઞાન કેમ દૂર થતું નથી !

મને સમજતું નથી વીતરાગીની સેવા કરું છતાં રાગડોધ દૂર કેમ થતાં નથી. ?

આ પ્રશ્ન અમગ્ર સાધકોના. આરાધકના છે. અને બાલમુનિ મનકની મનોભૂમિમાં પણ આ ભયંકર વિકલ્પજળ પેદા થઈ શકે તે શ્રુતકેવલી પૂ. શર્યાભવસ્થુરિ મહારાજ જાણે. છે. જીવ—અજ્ઞવના તત્ત્વોના પારગામી સાધકના મનની.. બાલસાધક તેમાં પણ ખુદના લાડીલાની વ્યથાની કથા કેમ ન જાણે. ?

મહાપંથના મુસાફર મનક ..

તારી હારને જીતમાં પલટાવવા તારે લક્ષ્ય રાખવું પડ્યો. એક વાતનું પાકું ધ્યાન રાખવું પડ્યો. .

પિતાજી ! મમ જીવન ધરુલૈયા .

મને આપો. દિવ્ય ગુટિકા હારને જીતમાં પલટાવું આપ કૃપાએ વિજ્ઞયની વરમાળા પહેઢું

ઓ... .

સાધક ! અંધીરો ન થા. તારા માર્ગના કંટકો અને ગુલાબ બને જાણું છું. ઓક લાખ વાર તારા મનને પૂછી બે ‘હું સાધક છું કે નહિ’

“ સાધકનો જીવનમંત્ર અસંભ્રાન્ત દશા ”

અસંભ્રાન્ત દશા એટલે સતત જગૃત અવસ્થા.

અસંભ્રાન્ત દશા એટલે આત્માની ઉનત અવસ્થા.

અસંભ્રાન્ત દશા એટલે અનંત પ્રતિ અમીટગતિએ દ્વારા મુક્તનાર.

અસંભ્રાન્ત બન. ભ્રાન્તિ ..ભ્રમ ..તારા માર્ગના ભયંકર વિધન છે.

ભ્રાન્ત આત્મા કર્તાવ્યપથથી ચ્યુત થાય છે. ભ્રાન્ત મંજીલે પહોંચી શકતો નથી. તો પછી સંભ્રાન્તનું તો પૂછવું શું ?

સંભ્રાન્ત પ્રત્યેક કિયામાં સ્વાર્થ તત્પર બને છે સાધક રવાર્થ પર બને છે. ત્યારે સ્વ — પરનો રક્ષક તારક ઉદ્ઘારક સ્વમાં સીમિત બની જય છે. ચૌદરાજ બોકના સમઝત જીવનો વિચાર કરનાર પોતાની પરિધિ પર ધૂમવા લાગે છે. આત્માની સાધના ભૂલી દેહની સાધનામાં લીન બને છે. સાંભળ—ધ્યાનપૂર્વક સાંભળ.

આહાર દેહની જરૂરિયાન એ વિશ્વની વાત. સાધકને મન આહાર એટલે મોકસાધક દેહનું માત્ર સાધન. સાધક સાધન પણ સાધનાથી મેળવે તેનું સાવધાનીથી રક્ષણ કરે. આકાર જેવી દેહની જરૂરિયાત માટે પણ દેહ ભાવ ભૂલી જવાનો. મોકનો ભાવ મુખ્ય રાખવાનો એટલે જ અસંભ્રાન્ત બનવાનું. અસંભ્રાન્તને હું પહેલો પહોંચુ તેવો ભાવ પેદા ન થાય.

અસંભ્રાન્તને “ મને મળશે નાં તેવો દીનભાવ પેદા ન થાય ”

અસંભ્રાન્તને પગ મૂક્તાં પહેલા ઈર્યાસમિતિ યાદ આવે. તેથી જવદ્યાનો જ્યાલ રહે.

અસંભ્રાન્તને બોલતાં પહેલાં ભાયાસમિતિનો જ્યાલ આવે તેથી તેનાથી પાપમય દિલ દુઃખર સર્વજ્ઞની આજ્ઞા વિરુદ્ધ વચ્ચન કયારે પણ ન બોલાય.

અરાંભાન્તને ગૌચરી જતાં પહેલાં ગુરુ આજ્ઞા ગુરુ કૃપા યાદ આવે. એટલે બોલે ઈરછાકારેણ—સંદિસહ ભગવન.

અસંભ્રાન્તને આહાર લેતાં પહેલાં એપણા સમિતિ યાદ આવે એટલે સાધુ જીવનના કલખા કલખેના અનેક નિયમો — ઉપનિયમો — લાભ—નુકશાન વિગેરે યાદ આવે.

અસંભ્રાન્તને આહાર વાપરતાં પહેલા ગુરુની ભક્તિ યાદ આવે એટલે ગુરુભક્તિ દૂરા બાલ — વૃદ્ધ — ગ્રાન તપસ્વીની સેવાની સાધના થાય.

અસંભ્રાન્તને આહાર વાપરતાં પહેલા મોક્ષમાર્ગની સાધના યાદ આવે — તેથી મહર્ષિઓની યાદે ચાંખ અંસુથી ભરાય.

અસંભ્રાન્તને આહાર વાપરતાં અણાહારી વીતરાગની યાદ આવે કુરગડુ મુનિની યાદે હાથમાં કોળિયો અને મન મુક્તિમાં પહેંચે. મનક...

તારે જીંદગી જીતવી છે. તો જીંદગી જીતવાની જડીબુટી લઈ લે. અસંભ્રાન્ત થા. અસંભ્રાન્ત બનીશ એટલે તારા શબ્દ કોશમાંથી હાર. પરાજય. નાપાસ. નિરાશ. ભૂલ શબ્દો અદશ્ય થશે.

સાધનાનું ઉત્સુંગ શિખર સર કરવા બેટા અસંભ્રાન્ત થા. સિદ્ધ તારા ચરણ ચૂમશે.

અસંભ્રાન્ત દશા એટલે જગૃત સાધક દશા. પ્રત્યેક કિયા. પ્રત્યેક પ્રવૃત્તિમાં જિનાજી મુજબ જ ચાલનાર જિનાજી નજર સામે રાખી, મોક્ષનું લક્ષ્ય રાખી સાધના માર્ગમાં ચિથર થદું તે અસંભ્રાન્તતા.





## ૧૪. અગુંવુંગો॥

“ ચાલું ! શું કરું ગમતું નથી. આ તે કરી છુંદળી છે. કંટાળો આવે છે” ભૌતિકયુગનો કોઈ ભયંકરમાં ભયંકર અભિશાપ હોય તો આજ છે.

વિચાર હતો ડોક્ટર થવું પણ ડોક્ટર કહે અમારી જુંદળીમાં ભૂલથી પણ પગ મૂકશો નહિ. છાથવારે નલી દવા. નવા રોગ. અને દર્દીને જોઈએ તરત આરામ. અમને જોઈએ સેવાને નામે મેવા. અમે રોગ નથી જોતાં. રોગી નથી જોતાં. દવા નથી જોતાં. પથ્ય નથી જોતાં. ફૂક્ત જોઈએ છીએ સંપત્તિ અને સગવડ. પણ કોઈના નિઃસા-સાથી મળેલી સંપત્તિ અને સગવડ અમને ભરખી ખાય છે. હવે એ બધાંથી કંટાળ્યા છીએ. પણ કયાં જઈએ ?

ના. ના. ડોક્ટર નહીં થતાં ઊંઘની ગોળી પણ અમને ઊંઘ આપતી નથી.

ડોક્ટરની જુંદળીને હવે સલામી કરી. હવે થયું કે વેપારી બન્નું તો કેવું સારું ?

પણ આ શું ? વેપારી મહાજનતો પ્રભાતનાં મંગળ સમયે પણ કાણ માંદીને બેઠાં છિ.

વર્તમાન પત્ર વાંચ્યું બનેટ જાયું કાયદાની ભગંકર જળ જોઈ નાહી નાંખ્યું. જુંદળીમાં કમાયા તે બધું ટેક્ષમાં ખલાસ. હાય આ ન મેળવ્યું હોત તો સારું ઉપાધિ જ ન હોત.

વેપારીની પરવશતા જોઈ થયું ચાલ પ્રધાન બન્નું પહોંચી ગયો નાં. ‘પ્રધાનને મળવું છે.’ આજે તેનો મુડ આઉટ છે. કારણ ?

અરે બધાનાં કારણ કહેવાતાં હો ? મનદાન વખતે વચ્ચેનો આપ-  
વાનાં હોય... પાળવાના હોય.. સેવા સાદાઈની વાન કરવાની પણ  
સંતતિની ચિંતા કરવાની કે નહિ ? અમારી સંતતિએ સત્તાના જેરે  
જહેરમાં છબરડા કર્યો હવે સત્તાની આ ત્રણપાયાની ખુરશીનાં ધરતી-  
કંપની આગાહી થઈ ચૂકી છે. બીમારીનાં ઢોંગે જીવવા દો.

નાનો બાળક જેમ ઝૂંદુકુદા કરે તેમ મે પણ મારી સૃષ્ટિમાં  
ઉથલ પાથલ કરી. નિર્ણય કર્યો. બસ હવે તો શિક્ષક બનીશ કશી  
જંઝટ નહિ એય ! ડિલો રહે અમારી જંઘગી ખૂબ જોખમમાં છે.  
બાળ છોડના ઘડવૈયા. સંસ્કાર દાતા અમે વિદ્યાના દાન નથી કરતાં  
વેચાળું કરીએ છીએ. તેથી અમારી વિદ્યાના પણ કાળાબજર થાય છે.

ગુંડા જેવા વિદ્યાર્થીને પાસ કરી સાચા વિદ્યાર્થીને નાપાસ  
કરી અમે આદર્શ શિક્ષક બન્યા

સરસ્વતી અમારાથી રૂસણાં લઈ રહી છે સુખની લાલસા છૂટતી  
નથી સરસ્વતીનું અપમાન ખમાતું નથી. અમે પણ ઉદ્વિગ્ન છીએ.

જગતમાં જ્યારે ચારે બાળુ આસક્તિ નિરાશા જંખનાએ માનવ  
માત્રને ક્ષુણ્ય-ઉદ્વિગ્ન કરી દીધો છે. જગતના બેતાજ બાદશાહ  
સ્ટેલીન જ્યાા. પણ. ઉદ્વિગ્નતાની ભર્તીમાં શોકાય છે. ત્યારે. સદૈવ.  
શાંત પ્રસન્ન અભયભાવમાં રચતાં પૂ. શાય્યભવસૂરિ મહારાજ દૂધમલ  
બાલક મનકને કહે છે.

ઓ સાધક ! અનુદ્ધિગ્ન થા

એક મ્યાનમાં જેમ બે તલવાર ન રહે તેમ સાધના સાથે  
ઉદ્વિગ્નતા ન રહે. તું ઉદ્વિગ્નતાને ખંધેરી નાંખ. સાધના માર્ગની  
સાથે તેને ભયંકર શગૃતા છે.

‘ઉદ્વિગ્નતા કંટાણો કોને આવે તે જોણો છે ? ‘ પ્રલો ! પ્રકાશો...  
મારા માર્ગના અંધેરા ઉલેચો. સાંભળ.’

કંટાળો તેને આવે જેને પોતાના માર્ગની માહિતી ન હોય.  
 કંટાળો તેને આવે જેને પોતાનો માર્ગ નિરસ લાગે.  
 કંટાળો તેને આવે જે આપત્તિનું સાચું સ્વરૂપ ન જાણતો હોય.  
 કંટાળો તેને આવે જેને રાન્ત્રિના અંધકાર પછી મંગલ પ્રભાત  
 થવાનું છે તેની ખમર નથી.

પૃથ્વીમાં બીજ દટાય નહિ તો બીજ વૃક્ષની ભવ્યતા પામી  
 શકે ? પથ્થર ટાંકણા ન સહન કરે તો મનોહર મૂર્તિ બની શકે ?  
 પાયાનો પથ્થર બની જમીનમાં દટાય નહિ તો ઉત્તુંગ શિખરનાં દર્શન  
 શક્ય બને ? બે તટની મર્યાદામાં સરિતા ન વહે તો પવિત્ર પાવની  
 લોકમાતા બની શકે ? કચરો-મોતી કે છીપલા જે આવે તેને સમાવે  
 નહિ તો સમૃદ્ધ રત્નાકર બની શકે ? ગર્ભની પીડા જી સહન ન કરે  
 તો માતૃત્વનો મંગલ આનંદ માણી શકે ?

જીવનનું કયું ક્ષેત્ર છે કે જ્યાં વેદના વગર સુખ છે ?

સાધક !

તું તો સાધનાનો ઉપાસક ! તેં તો દીક્ષાના દિવસે મંત્ર  
 ઉચ્ચાર્યો છે કે અનુદ્વિગ્ન થઈશ.  
 અનુદ્વિગ્ન એટલે ? સુખ માટે ધર્મથી પીछે હડ નહિ કરનાર.  
 અનુદ્વિગ્ન એટલે કર્ત્વથી પીछે હડ નહિ કરનારો.  
 અનુદ્વિગ્ન એટલે દુઃખથી તરી કર્ત્વથી ભાગનારો નહિ.

સાધક એટલે

ઠંડી યા ગરમી પડે

અનુકૂળના મળો યા પ્રતિકૂળતા મળો

માન મળો યા અપમાના મળો

પણ એ બધાને વૈણીને પી જનારો.તેથી જ અનુદ્વિગ્ન  
 સાત્ત્વકલામાં સિંહથી પણ અધિક પરાક્રમી બની દુઃખની સાથે લડી  
 લે. મુખની આસક્તિ તેને મૂંઝવે નહિ. તેને ભય ભૂલાવે નહિ.

ગુસ્યો ગુલાંટ ખવરાવે નહિ. સાધક પાણે કર્મસત્તા અને ધર્મ-  
સત્તા બંનેની માહિતી છે. તે બંનેની શક્તિ જાણે તેથી કર્મવિજ્યો  
બને તો પણ ગભરાય નહિ. કારણ. તે જાણે છે. એક દિવસ સોનાનો  
સૂરજ ઉગવાનો છે.

તું વીતરાગના દશવિલા માર્ગે ચાલે છે. તો તને સિદ્ધિનો  
સંશય રહે જ નહો ; જો તને સિદ્ધિનો સંશય ન થાય તો તારી  
સિદ્ધિ નિશ્ચિત છે ! તારી સિદ્ધિ નિશ્ચિત છે તેથી તું આનંદમાં રહેવો  
જ જોઈએ ?

ઉદ્ઘિરનતા નિઃકૃતને હોય.

ઉદ્ઘિરનતા સફળતાનાં ફંકાધારીને હોય.

ઉદ્ઘિરનતા નિઃસહાય અને નોંધારને હોય.

પણ તારા નેવા સાધકને ઉદ્ઘિરનતા શાની હોય ?

ઉદ્ઘિરનતા એટલે ઘેટ,

આ ઘેટ જ આરાધેલી આરાધનાનો છેટ કરે છે. આ ઘેટનો  
તું હૂર સુહૂર ફગાવી હે !

સાધક.

તું અનુંદુરિન બન. તારા વિજયના મંગળગીતો તને રાંભળાવા  
લાગશે.



## ૧૫. “જઈ મે આગુગુહું કુજળી”

ઘણા એવા કાર્યો છે જે સજનન અને દુર્જન બનેને કરવા મદ્દ છે.

પ્રવૃત્તિ પરથી માનવીનું મૂલ્યાંકન ન કરાય. વૃત્તિ પરથી માનવીનું મૂલ્યાંકન ન થાય.

બાળકને મા પણ મારે અને શેરીની કોધી છી પણ મારે. એક બાળકના હિત માટે મારે અને એક બાળકનું તોડુન સહન ન કરી શકે માટે મારે.

પૈસા આપવા માત્રથી દાન ન કહેવાય. એક સારા કાર્યમાં ધૂષી વ્યક્તિઓએ પૈસા લખાવ્યા — ધરે ગયા પછી સૌની રજૂઆત જુદી.

આને તો માર્યા ઠાર. બધાની વચ્ચે હતા લખાવવા પડ્યા. આ વાત કોઈપણ કરતું હોય પણ તે મમ્માણશેઠનો ભાઈ સમજવો.

આને તો પૈસા લખાવીને આવ્યો, બધાની વચ્ચે વટ રહી ગયો. આ વાત કોઈપણ કરતું હોય તો તે દાની નહિ માનનો દાસ જાળવો.

આને પૈસા તો લખાવ્યા પણ નામ તો જાંદગીનું થઈ ગયું. આ વાત કીર્તિના પ્રેમીની.

આજનો દિવસ ધન્ય; ધાર્યું ન હનુ પણ ઉત્તામ લાભ મલ્યો. આ દ્રુગાર કોઈ હાર્દિક દાનવીરના.

પ્રવૃત્તિ ગમે તેટલી મહાન કરશો તેથી મહાનતાના શિખર સૂરનહિ થાય. પ્રવૃત્તિ સામાન્ય હોય પણ તેની પાછળ હૈયાની હાર્દિક ઉમદા વૃત્તિ પોષાતી હોય તો તે પ્રવૃત્તિ મહાનતાના શિખર સર કરવા એક ડગ તો આગળ ચલાવણે જ.

મનક ! તું મારો પુત્ર નથી, પરમાત્મા મહાવીરનો પુત્ર. મહાત્મા નારી પ્રવૃત્તિ જ નડી નારી વૃત્તિ પણ મહાન. તારા ગ્રતો પણ મહાન. નારી આચરણ પણ મહાન. ગુરુ ચરણે તારું સુમર્પણું અનોખું અને તેના કિલ્ફાતો પણ અદ્વિતીય — નારી ભાપા પણ ઉચ્ચ પ્રભુના શાસનના સાધુના મુખમાથી ને ભાપા નીકળે તેના ઉપરથી ખબર પડે. આ વાત વાતસદ્ય જંખતા રિષ્ય સાથેની છે

મહાભાગ ! તું પુણ્યશાળી બાધ્ય ઉમ્મરમાં પ્રભુના શાસનને પામ્યો — શાંક્રજ્ઞાન મેળવી રહ્યો છે. મોક્ષ મેળવવાની અભિવ્યક્તિથી શુદ્ધ ચારિત્રનું પાલન કરીશ ચારિત્ર પાલન માટે માધુકરી વૃત્તિ — ગૌચરી ખૂબ જરૂરી છે. ગૌચરી લેવા જરૂરિયા ત્યારે પણ ધર્મલાભ. ગૌચરી મલી કે ના મલી તો પણ ધર્મલાભ ગૌચરી લાવ્યો પણ ધર્મના લાભ માટે. ગૌચરી વાપરીશ પણ ધર્મના લાભ માટે. હવે ગૌચરી લાવ્યા બાદ મુનિ અક્ષિતને ભૂલે? ગૌચરી દ્વારા મુનિને દેહને શુભને કયાં ખુશ કરવા છે? અને ગૌચરી દ્વારા તેને તરફનું છે. તેથી પેટપૂજા પહેલા પૂજયપૂજા યાદ આવે. પૂજયની પૂજા તેમને સારું લાગે — તેમને જરૂર છે માટે કરવાની? ના, ના, કોઈને ય ખુશ કરવા નહીં, પોતાનો આત્મા પ્રસંનતાની ખુશીથી ભરાઈ જય માટે જ કરવાની છે.

કોઈની જરૂરિયાત પૂર્ણ કરે તે સહાયક  
પૂજયોની પૂજા આરાધના દ્વારા ભરવા માગે તે શિષ્ય.

મનક !

તારું ઝૂણ સાધુકુણો છે. વિનય એ નારો સર્વશ્રોષ ગુણ છે. નારા શર્દો એવા હોવા કોઈએ કોમાં તારા હૈથાના ઉમદા ભાવો વ્યક્ત થતા હોય. ગુરુ સાથે વાત કરતાં શર્દના સારિયા નથી પૂર્વવાના, આપણે સાહિત્યકાર છીએ માટે ઉચ્ચ ભાપા નહિ બોલવાની.. ભાપા શાંક્રના નિષ્ણાત છીએ માટે બાકરણશાંકેના નિયમ પુરસ્કર ભાપા

નહિ બોલવાની. મારા ગુરુ તીર્થંકર સદશ છે. જેમ કેવળજ્ઞાન બાદ તીર્થંકર પરમાત્મા એકલા ન હોય તેમ મારા ગુરુ પણ મોટા સમુદ્ધાયથી પરિવરેલા છે. જે હું વિનયપૂર્વક નમૃતાપૂર્વતક થાંત થઈને ક્રેચળ સ્વરે બોલીથ તો મારું જેઈ સૌ તે રીતે બોલતાં શીખશે. હું આ નિયમનો ભંગ કરું તો બધાને અવિનય-ઉલ્લતાઈ શીખવાડવાનું જાણે અજાણે મને પાપ લાગે. જેમ આપણે ઓછો મુહૂરતિ સાથે રાખીએ છીએ તો આપણાં પછી દીક્ષિત ગણ આપણું અનુકરણ કરે છે. જેમ ભાગાના—વિનય—વિવેક નમૃતાના મારા નિયમને અનુકરણ કરવાના છે. મારી પ્રવૃત્તિ મારાથી લઘુદીક્ષિતને અનુકરણીય બની જય છે. સારી બાબતમાં મારાથી નાના મારા શિષ્ય અને કે નહિ પણ અવગુણની બાબતમાં તો મારા જ શિષ્ય બનવાના છે. મારા ગુરુએ પ્રભુ અને ગૌતમસ્વામીનો મારા ગુરુએ ગૌતમરવામી અને કેશીકુમારનો આલાપ—સંલાય સુમજાયો છે. આ બધા શુભભાવો હદ્યમાં પુનઃ પુનઃ સુમજાય કરી ગુરુદેવ સાથે બોલાય.

ગૌચરી લઈ આવો છે. કૃધા વેદનીય દૂર કરવાની ભાવના છે. પણ તું સુમુદ્ધ ! તું હિતકામી ! તું લાભચાહક ! ગૌચરી વાપરતાં પહેલાં પૂજયોને આહાર માટે નિમંત્રણ આપે.

(“જઈ મે આણુગગાં કુજજ સાહુ હુજજમિ તારિઓ.”)

જે મારી પર કૃપા કર્યો તો હું માનીશ મને સંસાર ચાગરથી તારી દીધો.

કેટલી નાની કિયા પણ કેવી ઉમદા ભાવના. શબ્દો નથી પણ તેની અંદર હેઠાનો હર્ષ પ્રગટિત થઈ રહ્યો છે. પ્રભુ ! પ્રભુ ! મેં અનંત ભવ ભ્રમણ કર્યા છે. જીબને આધીન બની ખાવા માટે મેં અનેક ગાપ કર્યા છે. આપે કૃપા ન કરી હોત તો હું કયાંથી સાધુ બનત ? સાધુ બન્યા વગર ૪૨ દોપ રહિન નિર્દોપ ગૌચરીનો વિધિ કયાંથી સુમજન ? નિર્દોપ ગૌચરી લાવ્યા બાદ ગુરુ ભગવંતનો લાભ...મને સાચે આપની મહેરભાની—કૃપા હોય તો જ અન્યથા કયારે પાણ નહિ.

ગુરુ ગૌતમસ્વામી ધન્ય હતા. ૫૦ હજાર શિષ્યના ગુરુ પણ પ્રભુ મહાવીરસ્વામીની ગૌચરીનો લાભ પણ વિનયપૂર્વક લે. આપનું પુણ્ય પ્રભળ. આપની સેવામાં અનેક સેવાભાવી શિષ્યો. મારો નંબર ૪૮ ક્યાંથી લાગે ?

પ્રથમ ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશ્રમ. બાદ પિંડેપણા અદ્યયન સમજવા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશ્રમ. ગૌચરી જતાં મુખ્ય યાચના પરિપહનો વિજય. ચર્ચા પરિપહનો વિજય. લાભાંતરાય કર્મનો ક્ષયો-પશ્રમ હોય ત્યારે ગૌચરીની પ્રાપ્તિ અને ત્યારબાદ આપની કૃપા. મારું સૌભાગ્યનામકર્મ જોરદાર હોય તો થાય ? પ્રભુ ! મને ગૌચરી દ્વારા લાભ આપો તો પણ હું ધન્ય બની જાઉં. ગુરુકૃપા દ્વારા જ મોકાની પ્રાપ્તિ થાય. આપ આહાર કરો તો દેહ સ્વસ્થ રહે. જ્ઞાન-ધ્યાનમાં પ્રવૃત્તિ થાય અને તે દ્વારા જ્ઞાન મેળવી હું પણ આપની કૃપાએ અપ્રેમતાભાવ શુક્લધ્યાન અને ક્ષપકશોણી દ્વારા મુક્ત બનું.

આ તો અનંતજ્ઞાનીનું અનુપમ શાસન. ગુરુકૃપા દ્વારા ગૌચરીનો લાભ મલે તો પણ શીધુ મોકા.

ગૌચરીના લાભમાં જો ગુરુકૃપાની જરૂરિયાન તો મહાવ્રતના પાલનમાં—અંજાવતસર્વ જીવનમાં ગુરુકૃપાની કેટલી જરૂરિયાત ?

ભગવાન ! કરગરીને—લળીલળીને વિનવીને એક જ કંઠું છું. “મે આયુગગંહ” મારા પર કૃપા કરો.

આપની કૃપા દ્વારા જ હું સાધુજીવનનો પાર પામી શકીશ.

મહાત્મા મનક ! ગુરુકૃપાના પાત્ર હતા. ત્યારે તેમના માટે દશ-વૈકાલિકની રચના થઈ. અમે આપની કૃપાના પ્રતાપે દશવૈકાલિક સમજનાર બનીએ. અને તેના વિધિ-નિયેધ મુજબ જીવન વીતાવનાર બનીએ એટલી નાનીકૃપા તો કરો. રખે મારી ઉપેક્ષા કરતા..



## ૧૬. મુધાજીવી મુધાહાયી



એક સભામાં વકતા જોરશોરથી શ્રોતાઓની પ્રશ્નાંસા કરતા હતા. નટસ્થ નિરીક્ષકને થથું...ધન્ય વકતા ! કેટલા સુંદર શ્રોતા મળ્યા છે. સભા પૂર્ણ થઈ. હસીને શ્રોતાની પ્રશ્નાંસા કરનાર વકતા બરાદા પાડી બોલાવા લાગ્યા. બેકાર આદમી છો ! પહેલાં કેટલું માન આપતાં હનાં ? તટસ્થ નિરીક્ષકને થથું લાવ જધારો પતાવું.

શ્રોતા પાસે ગયા. કદંબ વિદ્વાન સાથે જાણ્ય વર્ણન રાજો, આમ કેમ ઉપેક્ષા કરો છો ?

શ્રોતા . ઉપેક્ષા ન કરીએ તો થું કરીએ ? તેમના ચેટ અને પટારા પણ ભરીએ.. ! ધારું વકતા મળે છે. જેવા દો..ઓમનું મોં પણ જોવું નથી.

ત્યાંથી ગયા વકતા પાસે.

‘તમે તો વિદ્વાન છો શાંતિ રાજો.’

વિદ્વાન : વિદ્વાન છું એટલે જ ફૂસાગો. બાપારી હોત તો ન ફૂસાત અહીં લાવવો હતો ત્યારે સાકર જેવા અને હવે લાગ્યા કદવા ?

તટસ્થ : પણ તમે ધરીકમાં કેમ કડવા થયા ? સમજ્યા વગર પ્રશ્નાંસા કરતાં હતાં ? વિદ્વાન અંતે વિદ્વાન છે. સહસ્ર મુખમાંથી શરૂદો નીકળી પડ્યા...ગરજ બિચારી બાપડી...હું નિંદાયો તે તો દીક ! પણ મારી સરસ્વતીનું પણ મેં લોલમાં આવીને અપમાન કરાયું.

જગતના સમસ્ત અજ્ઞાની સ્વાથી માનવોની મીઠાશ કોઈક સ્વાર્થ માટે જ હોય છે. શાન્તનું જેવા મહામંત્રી પણ ગુરુને ‘શાન્તતુવિહાર’ કરો ખૂણો ખૂણો બતાવી થાકે છે. સમસ્ત પાટણ ને શાન્તનું વિહારની

પ્રશંસા કરે છે. તે શાન્તનું વિહારના ભવ્ય મહાલયને ચોપાનથી અટારી સુધી જેઈને પણ મહાન ગૂરીશ્વર તથા તેમના ત્યાગો શિષ્ય મૌન છે.

મંત્રીશ્વર શાન્તનુંને આ મૌન વસમું લાગ્યું. ગુરુદેવણે હાથ જોડીને કૃગરે છે. ગુરુદેવ ! કંઈક તો પ્રકાશો !

આચાર્ય ભગવંત ગંભોરતાના સાગર છે. તેમને તો મૌન દ્વારા જ જે કહેવાનું છે તે કહી દીધું છે પણ. દુનિયાના બીજે અનુભવી શાખમાં જ ડૂબેલા બાલમુનિથી ના રહેવાયું.

મંત્રીશ્વર ! અડાર પાપસ્થાનકના નવકોટિ પદ્યકખાણ કરનાર ત્યાગી મહાત્મા આશ્રાવસ્થાનની અનુમોદના કરશે તો પૃથ્વી રસાયાની મહાત્મા આશ્રાવસ્થાનની અનુમોદના કરશે તો પૃથ્વી રસાયાનમાં જશે ! સમુદ્ર મર્યાદા મુક્ષો ! ત્યાગીની પાસે પ્રશંસા કરાવવી હોય તો પાપની વૃદ્ધિ કરનાર આશ્રાવના સ્થાનને સવરના સ્થાનમાં. કર્મનિર્જરાના સ્થાનમાં ફેરવી દો. મારામાંથી સૌનું બનાવી દો. રૂમાંથી સર્વનું બનાવી દો.

ગુરુદેવ ! ગુરુદેવ ! મારી ભૂલ માફ કરો. પ્રશંસાના નશાએ મને જ્ઞાન ભૂલાવ્યો. આપના પાવન પગલે હવે 'શાન્તનું વિહાર' સમસ્ન પાટણવાસીઓ માટે પૌષ્ઠ્રશાળા બને છે.

ત્યાગીના વચ્ચનમાં પણ રાગદ્વેપને સ્થાન ન હોય તો ત્યાગીના જીવનમાં કેમ હોય ?

પુ. ગુરુદેવ શાખાભવસ્તુર્દિ મહારાજ બાલમુનિ મનકને સંયમી જીવનના મર્મ સમજાવે છે.

બાલ સાધુ ! મુધાજીવી બનજે !

સાધુને મન જીવન એ પાતુ આયુષ્યકર્મની સજા છે.

સાધુને મન મરણ એ પણ મોક્ષની સજા છે. જીવન એટલે દ્વારું ચૂકવવાનું છે.

સાધુ એટલે સજજન શિરોમણિ. કર્મનું દેવું ચૂકવતા કાયરતા  
ન અનુભવે. મરણપ્રાપ્ત થતાં જીવાનિ ન અનુભવે.

જીવન અને મરણમાં સમાન

શત્રુ અને મિત્રમાં સમાન

સોના અને માટીમાં સમાન

ભવ અને ભોક્ષમાં સમાન એટલે મુખાજીવી

જીવનમાં આસક્તિ નહિ...મરણમાં જીવાનિ નહિ ..

રાગમાં કંતતા નહિ દ્રોપમાં દીનતા નહિ.

મુખાજીવી શોધે મુખાદાયીને.

સાધુતાને કારણે પાત્રતાથી પ્રેરાઈને દાન કરે તે મુખાદાયી.

સવજન છે, સ્નેહી છે, સંબંધી છે, જ્ઞાતિ બંધુ છે, દેશબંધુ છે,  
ઉપકારી છે, કયારેક કામ લાગશે, દવા બતાવશે. હુઆ આપશે, સમા-  
જમાં કીર્તિ વધશે, પરલોક સુધરશે, આવી કોઈ પણ કામના...જીખના  
વગર સત્પાત્રમાં ધર્મથી પ્રેરાઈને દાન આપે તે મુખાદાતા.

પાત્રમાં દાન આપવું તે મારું કર્તવ્ય છે આજ વિચારે તે  
મુખાદાતા...

દેહને માટેનાહિ, દેહના સંબંધી માટે નહિ, રાગ માટે નહિ  
રાગી માટે નહિ...આરોગ્ય વધે તે માટે નહિ, અનારોગ્ય દૂર થાય  
તે માટે નહિ. ફક્કત સાધુતાના પાલન માટે જે આહાર ગ્રહણ થાય  
તે મુખાલઘ્ય.

મુખાજીવીને મુખાદાતા સાથે મુખાલઘ્ય આ ત્રણેનો યોગ મળે તો...

સમ્યગ દર્શન.. સમ્યગ ચારિત્રનો નિવેણી સંગમ થાય તો જેમ  
મોક્ષ...દેવ-ગુરુ ધર્મ મળે તો જેમ સત્પથ પ્રાપ્તિ...ધ્યાતા ધ્યેય અને  
ધ્યાન મળે તો જેમ અભેદ..તેમ મુખાજીવી...મુખાદાતા ..અને મુખાલઘ્ય  
આજે તો સાધકની સહજ સિદ્ધ થાય છે..

મનક !

પંચમઅંશે વિષમ છે. હું અને મારાની પૂજમાં મહારથીઓ  
પણ ભૂલવાના તો પછી બાળક તારે કેટલું સાવધાન બનવાનું ?

જાણો...અજાણો જાતિનું ગુમાન સવાર ન થઈ જય ..

જાણો...અજાણો દેશનું અભિમાન જેર ન જતાવી હે...

જાણો...અજાણો ઉપકારનું ભૂત તને ના સત્તાવી હે .

સરિતાની જેમ ફૂકત વહેતા શીખ. કોઈ પાણી પીઓ છે કે  
નહિ ? તે વિચારીશ નહિ. જ'ગલમાંથી પસાર થવાથી શું લાલ તે પણ  
વિચારીશ નહિ. બસ... અવિરત વહ્યા કરવાનું.

જગતના કોઈ નઢ્ઠા નુકશાનના વિચારમાં રહે અટવતો ! એ તો  
અવની ભૂલામણી છે.

જિનવચન મુજબ. જિનાજ્ઞા મુજબ...તું તારી મસ્તીમાં મહાલ્યા  
કર.. સૂર્યની જેમ વળુથ્થાંભી ગતિઓ તારી આરાધનામાં મસ્તે બન.  
હુનિયાની પ્રશંસા...કીર્તિ—માન સન્માન એ તો બધાં સાંકડી ગલીના  
કેલાહેલ છે. તું તો મહાપ્રતના બોારીમાગનિ મહાલનારો. તને આસક્તિ—  
પ્રેમ અનાસક્તિનો. તારી સહચરી ઉદાસીનતા તારી પ્રાણિ નિજની  
મસ્તી. મુખાજીવીનો આનંદ હુનિયાના કોઈ સત્તાધીશ કોઈ સમાટ  
કોઈ ચમરબંધીને મળતો નથી. કારણ તેમને મરણનો જ્ય કોરી ખાય છે.

મુખાજીવીની મસ્તી કોઈ અનેરી છે. નેની મસ્તી તેને ટેવાવિદેવની  
સમીપ લઈ જય છે.

ઓ ગુરુદેવ !

બાળક મનક હુનિયાની સમસ્ત ઉપાધિ છોડી મુખાજીવી બની  
શકે તો હું કેમ ના બની શકું ? પણ એકવાર સનક જેવો કૃપા  
કટાક્ષ મારી પર ફેલાવો. દ્યા કરો. આપની દ્યા મને મુખાજીવી  
બનાવશે.



## ૧૭. કાલે કાલે સમાયરે



જગતમાં કેટલાય મદમરત માનવો છે તેઓ કહે છે અમારી જીંદગીના અમે અધિકારી છીએ. અમે માલિક છીએ. અમે અમારી રીતે જીવવા સ્વતંત્ર છીએ

ન જોઈએ સમયના બંધન.

ન જોઈએ સ્વામીના બંધન.

મન થાય ત્યારે સુવાનું, અને મન થાય ત્યારે ઊઠવાનું.

મન થાય ત્યારે બોલવાનું. અને મન થાય ત્યારે ખાવાનું.

સાચે આવી વૃત્તિનો માનવ દેહથી માનવ છે. પણ સ્વભાવથી તો પણ પંખીથી જગતી જનવરથી પણ અધિક ખરાબ છે. પશુપંખી પણ પ્રકૃતિના નિયમને અનુસરે છે. અર્જુણાદ્ય બાદ જ વૃક્ષ પરથી ઊડે. ચૂર્યાંસ્ત થતાં વૃક્ષ પર પાછાં આવી જાય છે, ગાયનાં ધણનાં ધણ સાંજ પડશે અને સીમમાંથી ગામ તરફ પાછા વળશે. પાણેલો કૂતરો પણ બોજનના સમયે ખાય. અને નિયમિત સમયે બહાર જઈને નિહાર કરે.

મનક ! તું લોકિક સાધુ રાંન્યાસી. જોગી કે તાપસ નથી. પણ તું પરમાત્મા તીર્થાંકરનો લોકોત્તર સાધુ છે. સાધુ એટલે કાલે કાલે સમાય રે જે સમયે જે કિયા કરવાની હોય તે કિયાનું તે સમયે સમાચારણ કરે.

સાધુ કોઈ પણ કિયા અનિયમિત ન કરે ગમે ત્યારે ન કરે. જનેશ્વર ભગવંતે પ્રરૂપેલી કિયાઓ. તેના સમયે જ કરાય. સમય ઉદ્દંધીને કરીએ તો દોષ લાગે. આપણા મહાપુરુષો યોવ્ય સમયે

કિયા કરવા, યોગ્ય સમયે આરાધના કરવા જરૂર્યા છે. તેની તને ખબર છે? સમસ્ત દુનિયાને વિસારી જિનાજાના પાલન ભાતર જે સમયે જે કિયા કરવાની હોય તે સમયે તે કરીને જ રહ્યા છે. આપણે તેનું ગૌરવ બર્દાશ્ટ છીએ. તે છતાં ય આપણને આપણી કિયાનો સમય ઉલ્લંઘાઈ જાય તો દિવમાં દર્દ થતું નથી?

અનક!

કરાય વાદળાનાં કારણે નિયમિત સમયે સૂર્યોદય અને સૂર્યસ્તના દર્શન ન પણ થાય. પણ મારા પ્રભુનો સાધુ એટલે જગતનો ટાવર... મારા પ્રભુનો સાધુ એટલે જગતને સમય બતાવનાર..

અંવત્સરી ચોમાસી — પક્ખી — કલ્યાણકની આરાધના જે દિવસે કરવાની હોય તે આરાધના તે જ દિવસે કરાય તેમ પ્રતિકમણ. પડિ-લેખણ. આહાર...વિહાર..નિહાર..નિંદા. પણ નિયત સમયે જ કરાય. અંજનશલાકા — પ્રતિષા. દીક્ષા. વડીદીક્ષા મુહૂર્તના સમયે જ થાય તેમ સાધુના જીવનની પ્રત્યેક ચર્ચા નિયત સમયે જ થાય.

સાધુ અનિયમિત બને એટલે પોતાની જાતને પૂછે આજે આમ કેમ? તારી નિયમિતતા કેમ ચૂકાઈ? પણ. ભલા! નિયમિત કોણું રહી શકે? તે નું જાણે છે?

તારી પાસે તો એક જ જવાબ છે. શરીર રવસ્થ હોય તે નિયમિત રહી શકે. આ જવાબ તારો બહુ ભૂલ ભરેલો છે.

સાંભળી લે.

શરીર રવસ્થ હોય તે નિયમિત રહી શકે તેમ ન માનતો.

પણ જેનું મન રવસ્થ હોય તે નિયમિત રહી શકે.

જેનો સમબાન સહેલ ટકે તે નિયમિત રહી શકે.

જેના હૈયામાં ઓદાર્યભાવ રહે તે નિયમિત રહી શકે.

જેનું મન પ્રસન્ન રહે તે જ નિયમિત રહી શકે.

જેનું મન પવિત્ર રહે છે તે નિયમિત રહી શકે.  
 જે ખુદનું મૂલ્યાંકન કરી શકે તે નિયમિત રહી શકે.  
 જે સમયનાં મૂલ્યો સમજે તે નિયમિત રહી શકે.  
 જે જીવનાશાનું ગૌરવ સમજે તે નિયમિત રહી શકે.  
 જે ગુર્વાણે આધીન બને તે નિયમિત રહી શકે.  
 જે ધર્મરાધનાનું હાઈ સમજે તે નિયમિત રહી શકે.

મનક !

તું એટલે શાત... દાંત અને મહંત...  
 તું એટલે અદનો સેવક...  
 તું પ્રત્યેક આરાધનાનો યોગ્ય સમયે પ્રારંભ કરે.  
 તું પ્રત્યેક આરાધનાને યોગ્ય સમયે પૂર્ણ કરે.  
 તું પ્રત્યેક આરાધના અયોગ્ય સમયને વર્જને કરે.  
 તારો ઉઠવાનો સમય નિયમિન.  
 તારો સંથારવાનો સમય નિયમિત.  
 તારો પ્રતિકમણનો સમય પણ નિયમિત.  
 અને પહિલેહળું પણ નિયમિત.  
 ગોચરી પણ ગોચરીના સમયે જય અને સમયસર ગાછો કરે.  
 ગોચરી જેવી પણ કિયા અકાળે કરે તો જિલનશાસ્ત્રનાં અપ-  
 ભ્રાજનાથી દોપિત થાય. દુર્લભ બોધિ થાય. સાધુ અકાલે જોગચરી  
 જય તો કોઈના મનમાં શંકા થાય કે સાધુ આ સમગે કેમ ? અકાલે  
 સાધુને ગોચરીશી પાછો કરતો જોઈને કોઈ વિચારે આ સાધુ કયાં  
 રોકાયા હો ? અકાલે ગોચરી જય તો ગોચરી મળે નહિ. કોઈને  
 દુર્ભાગ પેટા થાય છે અને પરિસ્થિતિમે પરને બોધિની દુર્લભનામાં  
 નિમિતા બને.

શાસ્ત્રે કહેલા સમયે કિયા કરે તો સાધુ કાલચારી કહેવાય. અન્યથા અકાલચારી કહેવાય. કાલચારી બને છે તેને શાસનદેવો પણ સહાય કરે છે. કાલે સ્વાધ્યાય કરવાથી અને અકાલને વર્જવાથી જ્ઞાનાચારના પ્રથમ આચારનું પાલન થાય છે.

પ્રભુના શાસનમાં તો અધ્યયનનો સમય હોય છે. કાલિકસૂત્રો અને ઉત્કાલિક સૂત્રોનાં સ્વાધ્યાયનો પણ સમય હોય છે. કાલનામનાં જ્ઞાનાચારનું પાલન જ્ઞાનાવરણીય કર્મના કષ્ટોપશમમાં સહાયક થાય છે. જે કાળ જે કિયા કરવાની તે કાળે તે કિયા કરવાથી કાલલભિધ પ્રગટે છે.

પ્રભુના શાસનમાં કાળનું — સમયનું કેટલું બધું મહત્વ છે. આરાધના..તપ... ત્યાગ .. જ્યોતિઃ... ધ્યાન.. દીક્ષા.. પ્રત .. પ્રદ... પ્રતિષ્ઠા... અણસણ આ બધાનાં અંગે વિશિષ્ટ નક્ષત્રો. વિશિષ્ટ યોગો. શાસ્ત્રે કહેલાં નક્ષત્રો. યોગોમાં જે તે વિધિ થાય તો તેના વિશિષ્ટ ફોંઝો છે.

ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને શ્વાસ્તિકાય જેમ દ્રવ્ય છે તેમ કાળ પણ એક દ્રવ્ય છે. જે દ્રવ્ય છે તો તેનો ધર્મ જીવ પર અસર કરવાનો. તેથી સમયની મર્યાદા સ્થાયવવી જોઈએ.

મનક ! સમયની મર્યાદા જે જગતનો નથી તે જિનાક્ષા તથા ગુરુજીનો ભંજક થાય છે. ખુદના માનવ જન્મને રાગદેપમાં અને પ્રમાદમાં વેડદી નાખે છે અને અંતે અનંત સસારમાં પરિભ્રમાનું કરે છે.

મનક !

ફરી વિચાર કાલચક નિયમિત છે. એક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકર — બાર ચક્કવતી નવ વાસુદેવ, નવ બળદેવ — નવ પ્રતિભવાસુદેવ હોય છે. ઉત્સર્પિણીમાં વર્ણ .. ગંધ... રસ.. સ્પર્શ.

આયુષ્ય ઊંચાઈ બધાની વૃદ્ધિ થાય છે. અવસર્પિણીમાં બધું ઘટનું છ આરા નિયમિત. પહેલા અને બીજા આરામાં તીર્થંકર પણ નહિ—ત્રીજ અને ચોથા આરામાં તીર્થંકર પણ ખરા અને મોક્ષે પણ જવાય પાંચમાં અને છુટા આરામાં મોક્ષ ન હોય.

તને સમજાય છે મોક્ષે જવા માટે સુયોગ્ય સમય જોઈએ. પ્રભુનાં શાસનનાં રહરણો સમજે શાસનાં સતત વાંચન કરે તો સમજાય. દૃવ્ય — કોત્ર કાળ અને ભાવ. દૃવ્ય કોત્ર કાળ અને ભાવને. પામીને જ કર્મો ઉદ્યમાં આવે છે.

જિનશાસનમાં સાર્વત્રિક સમય મર્યાદાને સ્વીકારવામાં આવી છે. તેથી જૈન સાધુના દેહોન્સર્જનને મૃત્યુ ન કહેવાય. ત્યાં પણ એમ જ કહેવાય. જન્મ એ પણ કાળનો ધર્મ અને મૃત્યુ એ પણ કાળનો ધર્મ છે. લોકસ્થિતિ છે.

સૂર્યોદય અને સૂર્યાસ્તની જેમ તેને સ્વીકારી વે. હા. શોક કશુ ના કર. કાલનો ધર્મ આચયર અને જીવન ધન્ય બનાવ.

કાલે કાલં સમાય રે દ્વારા હું તેને આશીર્વાદ આપું છું કે કાલનો વિજેતા બની સાચ અનંત રિથતિને પ્રાપ્ત કર.

### ગુરુદેવ !

અમને મનની સ્વસ્થતાની શક્તિ આપો. મન સ્વસ્થ બનતાં તનથી રવસ્થ બની ‘કાલે કાલ’ ની આરાધના કરી અપ્રમાતા બનીએ અપ્રમાતાપણે કાલના આચારને કવલિત કરી કેવળજ્ઞાન મેળવીએ. કેવલજ્ઞાન મેળવી શાદાને માટે કાલને કંગાલ બનાવી દઈએ.



## ૧૮. આયયદૂરી

\* \* \*

માનવમાત્ર પ્રતિકાળ પ્રનિગલ કંઈને કંઈ કરે છે, કાર્ય—કર્તૃણ એક હોય છે પણ ઉદ્દેશ ભિન્ન હોય છે. ઉદ્દેશમાં જેટલી ભિન્નતા રહેવાની તેટલી કાર્યમાં અવશ્ય ભિન્નના રહેવાની

‘મા’ પણ બાળકને દૂધ પાય છે, આયા પણ બાળકને દૂધ પાય છે, એકને દુગ્ધપાન બાટ બાળને ગેલ કરતું જોઈ આનંદ થાય છે, એકને દુગ્ધપાન બાટ વિચાર આવે છે. પગાર તો પૂરતો મહિંશે ને?

ઈતિહાસના લાખો પુષ્ટ ભરાય છે, કર્તવ્યબ્જની વેદી પર બલિ-દાન દેનારની યશોગાયાથી પણ કોઈ માનસશાસ્ત્રી તે મૃતાત્માને દસ પ્રશ્ન પૂછું ત્યાં ભીતરનું રૌદ્રરૂપ પ્રગટ થશે. નગનસત્ય બહાર આવશે. ભાઈસા’બ ! અંદરથી ખૂબ કાયર હતો પણ સત્તાની ખુરશી જળવવા સમરાંગણે ચડ્યો.

ભાઈસા’બ ! રૂપવતીના કટાકબાણ છૂટતા ન હતા પણ મારી અર્ધાંગના વીરને ચાહતી હતી તેથી વીરતા દેખાડવા કેશગીયા કર્યા. સમરાંગણમાં વિજયી બન્યો છું. લોકો મને વીર—શૂર કહે છે પણ મને ખબર છે. મેં ક્ષાત્રવટ દાખવી નથી.

મને થયું લાવ શૂરવીરને છોડી સતીમાતાને ચરણે નવાદે. એ તો પતિતપાવની ગંગા જેવી પવિત્ર હશે?

સતીમાતા ! સતીમાતા ! પણ ત્યાં તો પોકાર આવ્યો. દુર રહો દિલના પાપ દેહના ત્યાગ દ્વારા ઉજળા દેખાડયા. મનનો મેલ સહન ન થયો. એટલે લોકોને હગવા દેહ ત્યજ્યા.

હડપિંજર જેવા દેહવાળી કૃથકાય તપસ્વીના ચરણ ચૂમ્યા.  
તપસ્વી આશિષ આપો. તપસ્વીએ કહું. તપસ્વી નહિ હું તો કીર્તિનો  
ભિખારી. માન—સન્માન કીર્તિ માટે દેહ ગાળ્યો તપસ્વી તો કોઈ  
શાની હશે.

જ્ઞાનીની જોજમાં નીકળ્યો — લાઘોની ભીડ જમી છે. ભડ્કોની  
પહાપડી છે. સિંહગર્જ નાએ વ્યાસપીડ પરથી વ્યાખ્યાનકાર ગર્જ ના  
કરે છે. વાસનાનું ભયંકર તંડવ નૃત્ય દેખાડી વૈરાગ્યની કથા ફેલાવે  
�ે. કોધ દાવાનલનું સ્વરૂપ શુમજવી સુમતાની જંખના પેદા કરાવે  
છે. ત્યાં પહેંચ્યો. મને થયું ફરી ફરી થાક્યો પણ મારો ફેરો સહ્ય  
થયો. જ્ઞાની મળ્યા. ભવનો ફેરો ટય્યો. એકાંતમાં મલ્યો. હાથ જોઈને  
પૂછ્યું. કહું આપ સાચા જ્ઞાની હો તો મને આશિષ આપો.

જ્ઞાનીના મુખની રેખા ગઠલાઈ ગઈ. જાણું કહું ? હું ટોળા-  
વાડી — ચોપડાવાડી — બરાડાવાડી — નાટક્યો વિદ્ધુન ખરો પણ  
જ્ઞાની નહિ.

ખરેખર અકળાઈ ગયો, કયાં જઉ ? કોને પોકાર કરું ?  
હું આત્માથીનું એમ રંશોધન થાય ?

આત્માનો અથી સ્વના ગીત કચારે પણ ના ગાય.

આત્માનો અથી કોધની જવાલામાં ન શેકાય.

આ-માનો અથી માયાના મૃગજળમાં ના ફૂસાય.

આત્માનો અથી ઈર્પના ઈંધણ નાં જલાવે.

આત્માનો અથી વાહ વાહમાં હવા હવા ન કરાવે.

આત્માનો અથી કંચન — કામિની અને કીર્તિ નણુના કાટવથી  
કયારે ય ના ખરડાય.

આત્માનો અથી ઈહલોકાથે કંઈ ના કરે.

આત્માનો અથી પરલોકના સુખની યે ઝંખના ન કરે.

બેટા મનક !

તું દેહધાસી છે પણ તારે આત્મવાસી બનવાનું છે.

તું દેહધારી છે પણ તારે દેહના બંધન તોડવાના છે.

સાધક મનક !

અહિરાત્મદશામા રહી તન, કુટુંબ ધનમાં જ સ્વના

દર્શન કર્યા... પણ હવે અંતરાત્મ દશા વિચારી મહાત્મા બની  
તારે પરમાત્મા બનવાનું છે.

પરમાત્મા પદ માટે શૂરવીરતાની જરૂર નથી.

પરમાત્મા પદ માટે ત્યાગની જરૂર નથી.

પરમાત્મા પદ માટે જ્ઞાનની જરૂર નથી.

પરમાત્મા પદ માટે તપની જરૂર નથી.

પણ સૌથી પહેલી અને અગત્યની જરૂર છે તું આત્માથી બન  
આત્માથી બનવાની ઝંખના તને સાહસિક ત્યાગી—જ્ઞાની—તપસ્વીની  
બનાવશે જ. આત્માથી બન્યા વગર આ બધા ગુણો તારા જીવનના  
વિધનો બનશે.

જેમ રસોઈ સુંદર હશે, સ્વચ્છ હશે, મનોહર હશે, સંસ્કૃત  
હશે. સુપાચ્ય હશે. પણ નીમક વગરની—મીઠા વગરની રસોઈ સુગ્રાહ  
બનીતી નથી. સુરવાદ બનતી નથી.

મનક ! તપ ખૂબ તપ્યો. કાયા ફૂશ કરી પણ આત્માથી તા  
વગર ફળ ફૂકત કાયા કષ્ટ જ્ઞાન ખૂબ મેળયું. જ્ઞાનની ઝંખનાએ  
આખના હીર ગૂમાલ્યા પણ આત્માથી તા વગરનું જ્ઞાન કીર્તિ મેળ-  
વવાનું પાટીયું.

દેહને ભૂવી સેવા કરી. જાળે સેવાનું વ્યસન હોય એવું લાગ્યું.  
ઠંડી—ગરમી—ભૂખ—તરસ ભૂલાયા પણ આત્માથી તા વગરની સેવા

દેહ ઘસીને બે ઘડીની નામના... માનવ જન્મની પ્રાપ્તિ આત્માથી  
બનીશ નહીં તો અણે જણે. સાધુ બનીને આત્માથી બનીશ નહીં  
તો લગ્નની વેળા ઊંઘમાં વિતાવવા જેવો મૂર્ખ ગણાઈશ.

આત્માથી બનવું સહેલું નથી. રાધાવેધ સહજ સિદ્ધ છે, કીર્તિ  
—માન—સન્નાન સેવા મોહક છે, ક્રયાંક આબરુ, ક્રયાંક સમૃદ્ધાય અને  
છેવટે શાસન પ્રભાવનામું મહોરું લઈને પણ તને સત્તાવશે.

ત્રિલોકનાથનું શાસન અવ્યાબાધ છે, શાસન પોતે જ પ્રભાવક  
છે, સહુ પ્રથમ તારા આત્માને જ શાસનથી પ્રભાવિત કરવાનો છે.

એટબે મહાધ્રતોને સ્વીકરેલ મનક !

તને પુનઃ પુનઃ કહુ છું . પ્રથમ આત્માથી બન આત્માથી  
બનીશ એટબે તારી ગુણસમૃદ્ધ હરી ભરી બનશે. આત્માથી વૃત્તિમાં જ  
કોઈ અનેરી તાકાત છે, આ સત્યને ધૂંટી રાખ આત્માથી વૃત્તિ તારા  
ગુણ ઝા ગળિતશાસ્કનો એકડો છે.

તારી પ્રન્યેક સાધના — તારી પ્રન્યેક પ્રવૃત્તિ પછી તારા આત્માને  
ઢંઢાળીને પૂછું જે માં માટે કર્યું ? જવાબ મળે આત્માને  
માટે,... તો તારી જીત .

આત્માથી પણું એટબે શુદ્ધસ્વરૂપના પ્રગટીકરણનું ધોચ.. આત્મા-  
થી પણું એટબે મોક્ષકાળે સર્વ પ્રયત્ન....

સાધુ પોતાના જીવનમાં ચાહે નિંદ લે કે જગે, ચાહે આરામ  
કરે કે વિહાર કરે, ચાહે સેવા કરે કે અભ્યાસ પણ પ્રન્યેક પ્રવૃત્તિનો  
એક જ જવાબ મેળવ . મારા આત્મા માટે મારા મોક્ષ માટે .. મોક્ષની  
એક જ ખણા એ જ યધણું કરવાનું. આત્માથી બનીશ ત્યારથી તારી  
કૂચ વિજયને વરેલી હશે.

આ વર્ષના મનકમુનિ આત્માથી બની શકે હે કૃપાળ  
શાયં ભવરૂરિ મહારાજ ! શું અમે આત્માથી ના બની શકીયે ?

આપના હદ્દ્યમાં જરૂર છે...

આપના હૃથમાં જરૂર છે...

આપનો તારક પવિત્ર હરન અમારા શિર ગર રાખો...

અમારો દુન્યબી ભાવ નષ્ટ થાય, અમે આત્માથી બનીએ.

ગુરુદેવ ! કૃપા કરો .

આત્માથી બનાવો .

બસુ પુનઃ એક જ વિનાંતિ...



# ૧૮. કિં વિલુસાએ કારિયં



શું પ્રાકૃતિક તત્વો પાસે અપ્રાકૃતિક તત્વોની શોભા છે ? જરણાના જળ ગિરિશૃંગ પરથી ખળખળ વહી રહ્યા છે...ચારે બાજુ આંખને શાંતિ આપે તેવી ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની વનરાજ પૂર્ણ રૂપમાં ખીલેલી છે. પંખીગણો મુક્ત ઉદ્ઘન કરી રહ્યા છે. અને મુક્તિગાન ગાઈ રહ્યા છે ત્યાં પ્રાતઃ કાળે ઉદ્યાચલમાંથી સૂર્યનું પ્રથમ કિરણ વનરાજ પર પણ વેરાણું અહે ! જાણે સોણ શણુગાર સજી બહાર નીકળી. અની ભવ્ય ઉદ્ધકમંડળની પ્રાકૃતિક શોભા નિહાળ્યાં પછી હેંગીગાર્ડન કે વૃન્દાવનગાર્ડન શું મનુષ્યને આકર્પી શકે ? કદાપો આકર્પી શકતા નથી. આમ્રવૃક્ષની ડાળે ડાળે લટકતી મીઠી મધુરી કેરીઓ કયાં ? અને કોઈ શ્રીમંતના શોકેસમાં મૂકેલ લાકડાની કેરીઓ કયાં ?

લાખો લાઈટથી શોભતો મહેસુર મહારાજનો રાજમહેલ કયાં ? અને કયાં સિદ્ધાચલ ગિરિરાજની ટોથને પાવન કરતો દાદાનો દરખાર. જ્યાં પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાના શીતલ કિરણ રૂપ જ/ના દુર્વાધિદેવના દરખારનો અભિપેક કરી રહ્યો હોય તે દશ્ય કયાં ?

શરદ પૂર્ણિમાની રાત્રે ગિરના જંગલમાં ગિરના જ હવે વાણી પીને વધેલી આહિરણના ગરભા કયાં કલાનિકેતનમાં ઝટેજ પર લઈએટના પ્રકાશમાં નિયત વેપભૂપામાં શોભતી આજની વિવાથીનીઓ ! નાકલીતર્ફ તેને જ આકર્પી શકે છે. નેને અસલી તર્ફ નીહાળ્યું નથી. વહાલા મનક !

તું બ્રહ્મચારી છે. બ્રહ્મચારી એટલે હૃહને દમન તો પણ કર્યું તો આત્માના જતન કરનારો.

તારું બ્રહ્મચર્ય જ અલગ પ્રકારનું બે અરણીના લાકડા ઘસાય તો વીજળી પેદા થાય. તું અલખનો યોગી. તનને તાપ ન આપે અને મનને મારે નહિ. છતાં પણ નિજાનંદની મસ્તી પ્રગટે. તારા આત્માના આનંદમાં તું એવો ઘેલો બનેલો રહે કે દુનિયા સામે તને આખ ખોલીને જોવાની પણ કૂરસદ ન હોય.

નિજાનંદની મસ્તી મેળવવા બ્રહ્મના જ્ઞાનમાં ચયર્ય કરે ફર્યી કરે. તારું લક્ષ્ય અનંતનો તાજ મેળવવાનું. અનંતનો તાજ મેળવવા સાધુ જીવનની ગ્રત્યેક પળને ગ્રત્યેક સમયને જ્ઞાન સાધના દ્વારા સહૃદાનભનાવે. ઈદ્દિયોને તું ખુશી ના કરે. પણ તારા જીવનમાં જ્ઞાન સાધનાનું સાધન બનાવે. ઈદ્દિયો તારી સેવામાં રહે પણ તોક્ષન ના કરે. તારું મન પ્રતિદિન જ્ઞાનાર્જનમાં રહે. જ્ઞાનાર્જન કરવા ગુરુની સેવામાં રહે. ગુરુ જ્ઞાની અજ્ઞાન રૂપ અંધારા જીવનમાં જ્ઞાન રૂપ પ્રકાશ પાથરે. જ્ઞાનીની નિશ્ચામા જ્ઞાન સિવાય જંખના શાની થાય? અધ્યાત્મીની છાયામાં અધ્યાત્મ સિવાય શાની કામના પેદા થાય?

જે આનાથી વિપરીત ઈચ્છા થાય તો તું દેહનો બ્રહ્મચારી પણ મનનો વ્યબિચારી.

બ્રહ્મચારી જ્ઞાનીને નથી તો ભોજનમા રસ નથી તો વિશ્વને નિહાળવામા રસ..ધણીવાર બ્રહ્મચારીને પોતે દેહધારી છે એ પણ ભાન ભૂલાઈ જાય છે. તેને મન ખ્રી, પુરુષ, મનુષ્ય, પણ આવા બાલલોદ નહિ. મારી સાથે એક સત્તુ ચિદાનંદ જ્યોતિર્મંય સિદ્ધ સ્વરૂપી આત્મા હું પણ આવો જ સિદ્ધનુલ્ય આત્મા.

દેહની ભૂખ બ્રહ્મચારીને ના સતાવે, જ્યાં દેહીપપુણું ભાન ભૂલાય ત્યાં દેહને શાશુગારવાનું મન થાય?

જેમ તપસ્વી છતાં સ્થૂલ શરીર ના હોઈ શકે.

જેમ સતી છનાં મર્યાદા રહિત ના હોઈ શકે.

જેમ સરિતાના જળ છતાં ખારાં હોઈ શકે.

તેમ બ્રહ્મચારી અને વિભૂપા આ બે સાથે ના હોઈ શકે.

ખૂબ શાંત સ્વસ્થ મને વિચારને, ઉતાવળ ના કરતો. વિભૂપા કેને ગમે? પોતાની કિંમત બીજાની પાસે કરાવવી હોય તેને! દુનિયાની પાસેથી જેને રૂડા રૂપાગાના સર્ટીંફીકેટ જેતાં હોય નેને?

કામાંથો વિપ્યાંધો જે રૂપ જે વિભૂપાથી બે પળ પ્રશંસા કરે છે તે તમે સારા છો માટે નહિ પણ જેમ ભમરો પુષ્પ પરથી રસ પીવો હોય ને માટે મધુર ગુંજન કરે છે તેના જેવું સ્વાર્થભર્યું વલણ છે.

સાવધ રહેને જ્ઞાનની વિભૂપાથી! સુમગ્ર આધ્યાત્મિક શક્તિને નાટ કરી દેશે.

વિભૂપા એ એક એવું ભયંકર તત્ત્વ છે. શોભા બે ઘડીની પણ વર્ષોના વર્ષો સુધી નારા વિચારોનું અધ્યાત્મિક પતન. કોઈ રૂપવતી યોવનાને પૂછી આવજે વિભૂપાએ તેને શું આપ્યું? પછી કોઈ સતી સાધીને પૂછી આવજે સાદાઈએ નને શું આપ્યું?

એકનો જવાબ હશે યાતના...અધ્યાત્મિક પતન ..

બીજનો જવાબ હશે આત્મીયતા .આનંદ.

સાધક દેહને શાશુંગારે તો તેનું જ્ઞાન લાજે

સાધક દેહને શાશુંગારે તો તેના ગુરુ લાજે

સાધક દેહને શાશુંગારે તો સંસ્કૃતિ શરમાઈ જય.

સાધુ વસ્તીમાં, ઉપાશ્રયમાં રહે પણ તેની મનોહરતા ના ઈંછે. સાધું વચ્ચે પહેરે પણ તેને ટાગાટીય ના કરે. સાધુ પાત્રનો ઉપયોગ કરે પણ તેની ઉપરેય ચળકતા ચિનરડા ના કરે.

વિભૂપા તે કરે જેની ખુદની આત્મશક્તિના દર્શાન ના થયા હોય. સાધુ બનીશ. તો દુનિયા આખી નારા દર્શાને આવશે. ભક્તોના ટોળા જમશે. સાધુ થવાથી પુણ્ય પ્રભળ બનશે. વસુમાંગી વસુકલ્પી હજરો સામગ્રી નારા ચરણમાં આળોટવા લાગશે. પણ...ભૂલતો નહિ

એ માનવ સમુદ્ધાય તારા દર્શને નથી આવ્યો, તારા શરીરના દર્શને  
નથી આવ્યો, તારી સાધુતાના દર્શને આવ્યા છે. તારા ત્યાગને કારણે  
આવ્યા છે. લઘર—વધર વેશમાં. મહિન દેહમાં બિરાજમાન પતિત  
આત્માને નિહાળવા આવે છે.

**હિલદુ !**

સાધુ બની વિભૂપા કરીશ તો તને ફળ મળશે માત્ર તુચ્છ  
જનરંજનનું ! દર્શનાથી ઓના નેત્રાંજનનું પણ જ્યાલમાં રાખજો.  
કર્મબંધનું, બીજા જન્મમાં વિડૃપતાનું.

**પ્રભો ! પ્રભો !**

મને આત્મસૌદર્યનું ભાન કરાવો..

મારે દેહના છઠારા ના જોઈએ ..આપના ચરણસ્પર્શ કરી કહું  
છું પ્રભો ! બ્રહ્મચારી બનવાની શક્તિ આપો.



## ૨૦. સવિજજવિજજાગુગયા



વ્યાપારીનો પુત્ર જ્યોતિપુ વિદ્યા જાણે તો શું લાભ ? જ્યોતિપીનો પુત્ર વ્યાપાર વિદ્યા જાણે તો શું લાર્ક ? કંઈક જાણે છે તો ખરો જ ને ? હા.. એ જે જાણે છે તેનાથી તેના જીવનમાં લાભને બદલે નુકસાન ..

મુસાફરી પૂર્વની હતી...ચાલ્યો પશ્ચિમમાં, હા પ્રયત્નના તો કર્મો. પણ તેની મુસાફરી દીર્ઘ બને. તેના ધ્યેયને પૂર્ણ કરનારો પ્રયત્ન તે જ સાચો પ્રયત્ન બાકી દિલ અને દિન બગાડનારા, અંતે ભવ બગાડનારા.

**ભુભુષુ મનક !**

તારી પાસે બુદ્ધિ છે. સૂક્ષ્મ તર્વનો બેધ પામનારી પ્રક્ષા છે. જ્ઞાન અને વિજ્ઞાનના કોત્રમાં જઈશ એટલે તેની લાખો શાખા...અને કરોડો પ્રશ્નાખા છે. જ્યાં અભ્યાસની ઈચ્છા થશે ત્યાં જ્ઞાનની દરે દિશા ખુલ્લી થશે.

શું અભ્યાસ કરું ? શામાં પ્રવીણતા પ્રાપ્ત કરું ? નિર્ણય તારે કરવાનો છે. નિર્ણય કરતાં વિચારી લેને. આયુષ્ય અલ્પ છે. માનવ—જન્મ, શાસ્ત્રજ્ઞવણું—શાસ્ત્રજ્ઞશક્તા અને સંયમની પ્રાપ્તિ દુર્લભ છે. દુર્લભની પ્રાપ્તિ થઈ. તું ધન્ય બન્યો. દેવો ઈન્દ્રો તારા ચરણની રજ લેવા આતુર છે. હવે વિચારવાનું તારે છે શું મેળવવું ? કલ્યાનાના તરંગોને વિસ્તારવામાં મનોરથના અશ્વોને દોડવામાં સમયને પૂર્ણ ના કરી દેતો. જ્વેરી—બજરમાં આવી નકલી માત્ર પાસાદાર અને રંગોની

જ્યોતિ જમાવતા બિલોરી કાચના ટુકડા એકઠાં કરવામાં સમય ના ભગાડતો ?

સમુદ્રનો અધિષ્ઠાયક અનાહત દેવ પ્રસન્ન થયા બાદ છીપુલાને પકડવા ના જતો. તું કેટલો પુણ્યશાળી છે ? વાસનાની ઘેલણા ભર્ગો તે પહેલા પ્રભુના શાસનની શરણુાગતિ મળી. જ્ઞાનાવરણીય કર્મનો જ્યોપથમ ચારિત્ર મોહનીયનો જ્યોપથમ શાલાની ઉજવવળતા પણ તે પ્રાપ્ત કરી હવે જો...ના ભૂલતો.

જો તું મુર્ખ હોત તો ગુરુઆજા સ્વીકારી બેત જો તું અદ્વિત્ય હોત તો નવકારની માણા લઈને બેસી જત, તને કોઈ આમંત્રવા ન આપત..તારામાં બુદ્ધિ છે. એટલે તારી પાસે આકાશમાં રહેલા તારલા જેટલી સુમસ્યાઓ ખરી થશે. લાભ અને નુકશાનના અટપટા અંકડા દેખાવા લાગશે.

કોઈ જ્યોતિનિધી તને. દર્શન આપશે. મારો ચેલો બની જ. એકાદ પરસમાં ગુરુ કરતાં પણ સત્તાયો પ્રસિદ્ધ થઈ જશે. તારા ગુરુને ચાર દિવાલ વરયે કોઈએ ના ઓળખ્યો ..તારા ચરણે દુનિયાના માંધાતાએ પણ જૂકશે.

ના...ના. .મારો ચેલો બને તો ફક્ત ૧૦ દિવસમાં કર્ણપિશાચીની વિદ્યા સિદ્ધ કરવાનો રહ્યો બતાવું ? સારી દુનિયાનું ભૂન ભવિષ્ય પર્તમાન તારી મુહીમાં. ત્યાં વળી નને બીજી દિશામાંથી કહેણ આવશે. ઓ બુદ્ધિમાન...

એ લક્ષ્યામાં ના પડનો. હું તને એકાદ મહિનામાં સત્તાનું સિંહાસન ધૂજીવતા શિખવાડી દઉ. લે આ ત્રાટક વિદ્યા સિદ્ધ કરી લે. શ્રીતા તારા ઈશારા ઉપર નાચશે. તારી જ બોલબાલા થશે. ગ્રીજ દિશાએથી કોઈક પોકારશે.

ઓ પૂનીશ !

મારા વર્ગમાં આવી જ. હું તો ચાણકયનો ય ગુરુ છું. કંકું

કોઈના કાનમાં અને દંસ લાગે કોઈને. આપણે તો પાછા સારા ને સારા. ખુરશી વગરના રાજ. ત્યાં તો કોઈ વાણીનો ગજબનો મદારી કહેશે.

ઓ હેંથીયાર છોકરા !

આપણે બીજું કશું ભાળાવતા નથી. વર્તમાનને જણો. વર્તમાનમાં મહાબો. પ્રકૃતિ અને પુરુષ એ તો નિસર્ગના સહજ તર્ફે છે. મારી વિદ્યા તો પ્રારંભો ત્યાં સમાપ્તિ.

મનક ! આ બધી રાવણની રાક્ષસીમાયા છે. કદાચ તને સોહામણી લાગે તો પણ ભૂલતો નહિ કે આ બધી પરિણામે બિહામણી વિદ્યા છે.

મારા મનક ! તુ સિદ્ધસદ્ધ પવિત્ર આત્મા છે. કર્મ તાડું શુદ્ધ રવરૂપ છૂપાવી દીધું છે. અનાં ભૂલતો નહિ, “તારા આઠ રૂચક પ્રદંશો સિદ્ધ સમાન છે. તારે તારા રવરૂપને પ્રગટિત કરે ત આત્મશાશ્વત ભાગવાનં છે. આત્મશાશ્વત સહજ સુલભ નથી. પણ આધ્ય તો છે જ.” આત્મશાશ્વત જ તને પ્રાપ્ત શરૂ. આ આત્મશાશ્વત શીખવા ગુરૂજ્ઞાને શિરસાવંઘ કરવી પડ્યો. આ આત્મશાશ્વત મેળવવું બચ્ચાના ઐલ નથી. એકાદ બે પુરુતકો વાચવાથી આવડશે નહીં. આત્મશાશ્વત શીખવા કાંજે અનેક આગમ ગ્રંથો ઊંધાણી અવગાહવા પડ્યો. ઈન્દ્રિયોની કુટાકુંદ બંધ કરવી પડ્યો. અને આત્મશાશ્વત શીખવા ક્રીતિની કામનાને ય દૂર ફગાવી દેવી પડ્યો. પણ જ્યાલ રાખજે આત્મશાશ્વતના તેજ અનેરા છે. આત્મશાશ્વત તને પગુ પાવન કરશે. તારી પાસે આવનાર ઝો કોઈને પાવન કરશે.

આત્મવિદ્યા તારી સ્વવિદ્યા છે પણ સ્વના અર્થ તું કદીયે દેહ ના કરતો. નેમ કગડાં દાગીના ઘર તે તું નથી તેમ દેહ. થરીર... પુરુષાલ તે તું નહિ આ બધાથી અલગ.. તું એટલે સ્વવિદ્યાના વિદ્યાથી

બન એ કહેવા દ્વારા તને પુનઃ પુનઃ એક જ કહું છું અધ્યાત્મ વિદ્યાનો પ્રથમ વિદ્યાર્થી બન. અધ્યાત્મ વિદ્યાનો જે વિદ્યાર્થી બને છે. તે ક્યારે તેનો વિશ્વારદ બની જય છે તે ચોતે પણ જાણતો નથી.

મનક !

તું ધર્મલાલ પૂર્વકના અન્નપાન આરોગીશ.

તું ધર્મલાલ પૂર્વકના વસ્ત્રપાત્ર વાપરીશ.

તું તને નમનારને ધર્મલાભના આશિષ આપીશ.

પછી એક પણ પલ...અનાત્મવિદ્યામાં ગુમાવીશ તો મૃપાવાદી બનીશ. આ મનમોહક દશ્ય જરા જોઈ લઉં એમાં શું ? જરા આ મધુરો સ્વર સાંભળી લઉં એમાં શું ? આ રસપ્રેદ લખાણ જરા વાંચી લઉ એમાં શું ? તેનો જવાબ કોઈની પાસેથી નહિ તારી પાસેથી મેળવ.. તને જોઈને, સાંભળીને વિચારીને શું લાલ થયો. સારો ગૃહસ્થ પણ ધરમાં કચરો ના ભરે પવનથી કચરો આવે તો તુરત જાડું ફેરવી કઢી નાખે, ઓરડો સ્વચ્છ થાય પછી જ હાશનો શાસ વે ..

મુમુક્ષુ... તું મને પૂછે છે. એમાં શું ? ધરમાં કચરો નારખાય... અને તું તારા મનમાં કચરો ભરે. કચરા માટે દરવાજ જોલે. અનાત્મવિદ્યા તરફ જોણું એટલે આત્મશત્રુઓને આમંત્રણ આપવુ. અનાત્મવિદ્યાની અભિલાષા કરવી એટલે દુઃખની પરંપરાની અભિલાષા કરવી.

મુમુક્ષુ... પૂ. નિનદાસગણિ. મહત્તર આપણા જેવા વિદ્યાર્થીના કાન પકડે તેવા ગુરુ છે. સવિજનવિજનજાળગ્યાનો આર્થ તેઓ કહે છે. “ બે વાર વિદ્યા શબ્દ લૌકિક વિદ્યાના પરિહાર માટે જ કર્યો છે.” તું કહે છે મેં દુનિયા છોડી છે છતાં દુનિયાદારીની પંચાતના છોડે તો સાધુ શાનો ? તારી જત સાથે કઢી પણ ધાર્મલાલ ના કરીશ.

મુમુક્ષુ... આમવિદ્યા એટલે કેવલજ્ઞાન .

આત્મવિદ્યા એટલે કેવલજ્ઞાન પ્રાપ્તિની પૂર્વવસ્થાનું શુદ્ધજ્ઞાન. શાખના રહસ્યોનો જ્ઞાતા બન. વિસ્મરણ થાય તો પણ મુંઝાતો નહિ ક્ષયોપશમભાવની વિચિત્રતા છે. આજ અને આવતીકાલ વર્ષે અંતર રહેવાનું તારો ક્ષયોપશમ શુદ્ધ, તીવ્ર થશે યા મંદ થરો..પણ જો આત્મવિદ્યા મેળવશે તો શરદાંકના ચંદ્રની જેમ કર્મરહિત વિમલ બની સિદ્ધ પ્રાપ્ત કરીશ અથવા અલ્યુભવમા મોક્ષ જઈ શકીશ તેવો વૈમાનિક દેવ બનીશ.



## ૨૧. મિત્રં અદુટું આગુવીઈ ભાસચે

કોયલ અને કાગડામાં શું ફરક છે? તૃપ્તરંગ બંનેના સમાન છે. એક કુળ અને એક જાતિ છે. કોયલ અને કાગડો ને સંવેદનો અનુભવે છે તે પોતાની શક્તિ મુજબ પોતાના ભાવમાં રજુ કરે છે. ઇતાં કોયલનું હેતુ તે પોતાની શક્તિ મુજબ પોતાના ભાવમાં રજુ કરે છે. ઇતાં કોયલનું હેતુ તે પોતાની શક્તિ મુજબ પોતાના ભાવમાં રજુ કરે છે. બિચારો કાગડો બાબે છે ગીત સાંભળવા દોડી દોડીને સૌ આવે છે. બિચારો કાગડો બાબે છે અને બોકો મનમાં આંગળી નાંખે છે. તેને પથ્થર મારે છે. તેનાથી દૂર થઈ જાય છે.

કારણ શું? સત્ય, પણ પ્રિય મધુરં સાંભળવાને માનવ ટેવાયેલો છે. જન્મદાત્રો માતા પણ કહું કહે તો સાંભળતું ગમતું નથી.

કોથ, માન, માયા, બોલ, દુસ્વર, અનાદ્ય, અપયશ. આ પાપ-પ્રકૃતિ છે. એવું જાણુનારને પણ કોઈ જાણે અજાણે પાપી કહી દે તો પ્રકૃતિ છે. એવું જાણુનારને પણ કોઈ જાણે અજાણે પાપી કહી દે તો દાખ થાય છે. હું પાપી? કેમ નહિ? પાપપ્રકૃતિ ઉદ્યમાં છે તેથી દાખ થાય છે. હું પાપી.. આ સાચું સત્ય કાનને કઠોર લાગે છે. દિલ સ્વીકારવા ના કહે પાપી.. આ સાચું સત્ય કાનને કઠોર લાગે છે. દિલ સ્વીકારવા ના કહે છે તો પછી ને આત્મા પાપ, પુણ્યને નથી સમજતાં ધર્મકર્મને સમજતાં નથી. સમ્યકૃત્વ, મિથ્યાત્વને સમજતાં નથી તે કેવી રીતે સત્યભાપાને અપનાવી શકે?

મનક...

સાધુ જીવન સ્વીકાર્યું કરેમિલ તે ઉચ્ચરી ત્યારથી નારી આદ્ય-માતા સાધનાના પ્રગટીકરણમાં ભાપાસમિનિની જરૂર પડે. ભાપાસમિનિ નને જીવનમાં એક અનોઝો વિવેક સમજાવશે.

બોલવાનું પણ હિતકાને.

બોલવાનું પણ પાપ ન લાગે તેવું.

બોલવાનું પણ કાનને અપ્રિય ન લાગે તેવું.

બોલવાનું પણ કોઈને દુઃખ ન લાગે તેવું.

બોલવાનું પણ કોઈને પીડા થાય તેવું નહિ.

બોલવાનું પણ કોઈના ઉપર કલંક લાગે તેવું નહિ.

સાધુનું વચન એટલે જિનાજ્ઞાથી પવિત્ર વચન.

સાધુનું વચન એટલે કર્તવ્ય ધર્મને નિર્દેશ કરું વચન.

સાધુનું વચન એટલે બાવનાચંદનનો લેપ.

કપાયના તાપથી ધમધમી ઉઠેલાને સમતાના અમૃતકુંડમાં સ્વાનાં  
કરાવે તેવું વચન.

ગુરુદેવ...

હિતકર બોલવું મિત બોલવું પણ સત્ય તો બોલવું ને ? સાચું  
કહેવામાં સાધુને વળી કોણી શરમ રાખવાની ? અમને દુનિયાનું કર્શું  
જોતું નથી. પછી સાચું કહીએને ? ગુરુદેવ ! સત્યમાં શું વાણીના ગુણ  
નથી આવતા ?

ભલા આધક !

તાર્દ જ્ઞાન, તારે જુસ્સો દૂધના ઊભરા જેવો છે. જરા ઠંડો  
પડ. પ્રભુ મહાવીર સ્વામીના સમવસરણમાં કાલસોકરિક કસાય આવે ?  
હા ..

“ પ્રભુ જ્ઞાની કે અજ્ઞાની ” “ પ્રભુ સર્વજ્ઞ વીતરાગ.”

પ્રભુ જાણે ને કે કાલસોકરિક મરીને સાતમી નરકે જવાનો

પ્રભુ કાલસોકરિકની ગતિ જાણે તો તેની વર્ણમાન આજ્ઞિકા  
જાણે એ બને ? “ ના ..પ્રભુ ..જાણે ” કાલસોકરિક પ૦૭ પાડા મારનારો  
.મહાહિંસક...ધાતકી...રૌદ્રપરિણામી.. રૌદ્રદ્યાની.. કૂર.. છતાં પ્રભુ કહે  
હે દેવાનુધ્રિય ! સત્ય જાળવું જુદું છે સત્ય પચાવવું જુદું છે. સત્ય  
જાળવાની શક્તિ એકમાં હોય અને સત્ય પચાવવાની શક્તિ સંજલનમાં  
જ હોય.

આજ વીતરાગના વચ્ચેનની ખૂબી છે. વીતરાગનું વચન વીતરાગની આજાને અનુસરતું વચન એટલે કોઈના દોપ જાહેર કરતું વચન નહિ અને કોઈના દોપ છૂપાવતું પણ વચન નહિ.

વીતરાગની આજાને અનુસરતું વચન એટલે કર્તવ્ય ધર્મનું ઉદભોધક વચન.

સાધુ કૃપારે થ ટકટક ના કરે. ટકોર કરે.

ટકટક સાંભળનાર નઠોર બનો.

ટકોર મનુષ્યને ચકોર બનાવે.

સાધુ પરિમિત બોલે. જેમ રસોઈમાં મીઠા વગર ના ચાલે. મીઠું ના હોય તો સરસ બોલન પણ નિરસ બની જાય. એમથારી વધારે મીઠું નાંખે તો ચુંદર સરસ આહાર પણ વિરસ બની જાય. જાડા અને ઉલટી કરાવે. તેમ સાધુ વધારે બોલે તો સમય વગર બોલે તો બોકોને ધર્મ પ્રત્યે અરુંચિ થાય. સાધુ પ્રત્યે અભાવ થાય. ગુણી પ્રત્યે દ્રોપ થાય. મનક...

ગુરુ આજાના પ્રભાવે તું જ્ઞાની થઈશ. સરસ્વતી તારી સેવામા રહેશે. જિનેશર ભગવંતે પ્રરૂપેલ ચારિત્રનું પાલન તારું સૌભાગ્ય નામકર્મને વધારી દેશે. તારે ત્યાગ સૌને ઝુકાવી દેશે. રાજ મહારાજાઓ અને દેવેન્દ્રો તારી ચરણરજ વેવા પડાપડી કરશે. તારા એક વચન પર ભક્તો સર્વોચ્ચ ન્યોયણાવર કરશે. ત્યારે તારે જ્યાલ રાખવાનો છે.

હું સાધુ સત્ય બોલનારો.

હું સાધુ પરિમિત બોલનારો.

પણ ભારી સાધુતાના સાચા નૂર નો ત્યારે જ ઝળકી ઊંઠે હું નિરવદ્ધ બોલું.

મારા વચનથી જણે અજાણે કોઈ હિંસાની ભૂતાવળ ઊભી થાય તેવું બોલાય નહિ.

હતા. પણ સૌથે નિજ યોગ્યતા મુજબ ખુદની જરૂરિયાત જ્યાં જ્યાંથી પું થાય ત્યાંથી ગ્રહણ કરી તેમ આ વિશ્વમાં અનેક શક્તિઓ રહેલી છે.

રામચંદ્ર અને રાવણ પણ આ પૃથ્વીના માનવો હતાં.

ગુરુગૌતમ અને ગોશાલક પણ પૃથ્વી 'પરના જ માનવો' હતાં.

પિતૃભક્ત અભય અને પિતૃધાતના દોપથી લિપ્ત કોણિક બંને એક જ પિતાના પુત્ર હતા.

પુંડરિક અને કંદરિક બંને એક જ માતાના સંતાન હતા. સમાનકાળ, સમાનલ્બાવ, સમાનશક્તિ, સમાન આવંબન છતાં દરેકના કાર્ય અને આદર્શમાં આકાશ અને પાતાળનું અંતર છે. ક્યાં સજજન શિરોમણિ મહામાનવ સમા ધન્યાત્માઓ અને ક્યાં માનવ છતાં ભયંકર દાનવ જેવા અધ્યાત્મીઓ.

જ્ઞાન જગત્તાપોને જગતના ભાવોને સમજવા માટે છે. જેમ ધરમાં દરવાજે હોય તો દુર્જન પણ આવે અને સજજન પણ આવે પરંતુ સન્માન તો સજજન થાય. દુર્જન—ગુંડો ધરમાં ધૂસી ગયો હોય તો કોઈને વાત પણ ન કરાય. વાત કરીએ તો દુનિયા આપણી જ મશકરી કરે કેવો મૂર્ખ ! ખુદના ધરનું પણ ધ્યાન રાખી શકતો નથી... તેમ તારે આંખ છે. તારે કાન છે અને આંખ તથા કાનવાળા સાથે સંબંધ છે. તારું જ્ઞાન, તારી આંખ અને કાનની સહાયથી થયું છે. કાન વડે તે ધાણું સાંભળ્યું છે, આંખ વડે તે ધાણું જોયું છે. પણ જેટલું જોયું અને જેટલું સાંભળ્યું તેટલું કહેવા નું સમર્થ છે. પણ પરમાત્મા મહાવીરનું વચન સહેવ સમરણપથમાં રાખજે "નય ડિટ્રં સુધ્ય સબ્બ" જરા ભૂલ કરી તો આણુબોરબ...વિશ્વના સમસ્ત વિસ્ક્રોટ દ્રવ્યો જે વિનાશ નહિ. સર્જે તે તારું એક અસંયમિત વચન વિનાશ નોતરશે. એ વિનાશ એવો ભયંકર હશે જેનો હાહાકાર સાંભળતાં નું પણ પાગલ બની વિનાશના ખપ્પરમાં બલિના બેકડાની જેમ હોમાઈ જઈશ.

આસુરી યજો અને આસુરી આરાધનાથી જ્યારે ખરેખર દાનવો જગી ઉઠે છે ત્યારે તેના નોતરનારને પ્રથમ ભક્ષ્ય બનાવે છે. તેમ તારું વચન ક્યારેક તને પણ ભરખી જશે.

જગતની બધી આગો જવલિત બન્યા પછી પણ વશમાં લેવાની કોઈક શક્તિઓ છે પણ વચનથી પ્રગટેલ દાવાનલને ઓલવવા હજી કોઈ શક્તિના સંશોધન થયા નથી. બળ પહેલો જ નિયમ કર જેટલું જેણું જેટલું સાભળ્યનું તેમાંથી અયોધ્યને ભૂતી જઈશ. યોધ્ય વાત પણ મહાપુરુષના વચનને અનુસાર સંયમી બની જરૂર પડે વિવેકપૂર્વક પાપ રહિત પ્રમાણ પુરસ્સર વિચારીને હિતકર બોલીશ.

જેમ હમણાં જ નવું ધર બંધાવ્યું છે. સંપૂર્ણ આધુનિક સુખ જગવડતાના સાધનો છે. કોઈ વાતની અપૂર્ણતા નથી. ગરમ—ઠંડી પહાડ—ઉદ્યાન જે કહો તે બધા જ દશ્યો બધા જ વાતાવરણ બધી જ અનુકૂળતાવાળું ધર... કોઈને ધર જેવા બોલાવ્યા ફરી ફરીને ધરનો એક એક ખૂણો બતાવ્યો દરેક પાછળ તમારી કલાદિશ તમારી આગવી સુજુના દર્શન કરાવ્યા. પણ ભલા ગટર અને સંડાશની કેમ વાત ના કરી. એ તો કંઈ કરાય ?

જેમ ધર બતાવીએ પણ વિવેકથી જ બતાવાય. તેમ બોલવાનું પણ સંગમપૂર્વક જ વિવેક ચૂકીને ક્યારે ન બોલાય. તેમ પુણ્યશાળી અનેક માણસોના પરિયમમાં આવ્યા.. વિશિષ્ટ બુદ્ધિ વિશિષ્ટ સમરણ શક્તિ, અનોખી નિરીક્ષણ શક્તિ છતાં દરેકને દરેક વાત થાય આપણા વ્યક્તિત્વને અનુરૂપ, સામા માણસના વ્યક્તિત્વને અનુરૂપ જ વાત કરાય.

રાષ્ટ્રપતિને ઉલા રાખી કોઈ છોક્રો કહે તેમે અમારા ભારતના સર્વ શ્રોષ નાગરિક છો તો મારું શરીર ખૂબ તપે છે મને તાવ છે કે નહિ કહો ને ? સાચે આ છોક્રો આપણને મુર્ખ લાગે. તાવ અંગે “મા” ને પૂછાય, ડેક્ટરને પૂછાય. રાષ્ટ્રપતિ નહિ. રાષ્ટ્રપતિ આગળ

મારા વચનથી કોઈના હદ્દયના આળા ધા પર મરગું નંખાય  
તેવું બોલાય નહિ.

મારાથી કોઈના પર અજ્ઞાણે કલંક લાગી જાય તેવું બોલાય  
નહિ. વીતરાગ પરમાત્માએ કહેલાં સમસ્ત ભાપાના દોષને પરિહરીને  
જ બોલાય. તેથી જ સાધુ કોઈને તહેને ફૂડ કરી જવાબ ન આપો. જેમ  
આરોગ્યશાસ્કી ચાવી ચાવીને ખાય તેમ સાધુ હજારવાર વિચારીને બોલે.

વિચાર્યા વગર બોલે તે વાણીનો વ્યબિચારી.

વિચારીને બોલે તે વાણીનો સદાચાંગી.

જેમ ગાળા વગરનું પાણી પીએ તો વાળા વગેરે ભયંકર દર્દી  
થાય તેમ સાધુ વિચાર્યા વગર બોલે તો ભવોભવ દુર્લભબોધિ થાય.  
મોન સહેલું છે. પણ સાચું અને સારું બોલવું કરીન છે. હું તો  
બોલીશ નહિ આવી વાત ના કરનો. આ બંધી કાયર બડાલની વાત  
છે. શૂરવીર સાધકતા હૈયામાં હિતભાવના રાખી, પ્રાણીમોત્તનું કલ્યાણ  
થાય તેવી જિનાજ્ઞાપૂર્વકની હિત-મિત નિરવદ્ય ભાપા વિચારીને બોલે.

પ્રભુને તીર્થંકરને સમર્પિત થઈ ઓક જ વિનંતિ કરીશ મને  
તમારા જેવી ભાપા આપો. વાણીના પાંત્રીશ ગુણયુક્ત જ્ઞાનાતિશય  
વચનાનિશયથી શોભતી માલકેશના સ્વર દ્વારા દુર્લેધ શાગદ્રોષને દુર  
કરતી ધર્મ સામ્રાજ્યનું સ્થાપન કરનારી વાણી આપો.

પ્રભુ...

સાધના સહિતની વાણી આપો.

આરાધનાની પ્રેરક વાણી આપો.

ધર્મ તીર્થના સિથરીકયણ માટે બોલવાનું પણ વાણીને સમિતિ  
દ્વારા પવિત્ર બનાવીને ..

ગુરુદેવ ! શક્તિ આપો, સામજ્ય આપો, ભાપા સમિતિના  
રહસ્યને પાર પામું...



## ૨૨. નથ હિંદું સુયં સંવાદ



એક ગુજરાતી કહેવત છે. “ભાવે તેટલું ખવાય નહિ, આવડે તેટલું બોલાય નહિ.

જીબને જે પ્રસંગ હોય તે બધું જ ખાય તો બીજે દિવસે સ્કૂર્ટિંગ શરીર રોગનું ધર બની જાય.

માનવ—માનવને સમજવામા સહાયક ભાપા, પણ મુખ પર આવે તેટલું બોલે તો ધર-ધરમાં મહાભારત અને રામાયણ સર્જય.

મહાભારત અને રામાયણના યુદ્ધના મૂળ શામાં રહેવાં છે? જેવું જેવું તેવું બોલવામાં? જેવું ગમ્યું તેવું કહેવામાં? જુગાર અને રાજ્યલિપ્સા તેના મૂળમાં નથી. આ તો બીજ રોપાઈ ગયા બાદ સ્થિરાયેલા પરિબળો છે.

યુદ્ધના મૂળ હતા ટૌપઢી અને મંથરાની વાણીમાં. એક સંસારીને પણ રાંયમી વાણી જેઈએ — વિવેકી વાણી જેઈએ તો એક સાધુ મહાત્માની વાણી એટલે? તેથી જ પૂ. શય્યભવસ્યુરિ મહારાજ હિતશિક્ષા આપી રહ્યાં છે

મનક !

પૃથ્વી પર મનોહર મધુરા આમૃવૃક્ષ છે. તો કડવા લીંબડાના વૃક્ષો. પણ છે. આમ્ર અને લીંબ એક જ ધરતીની પેદાશ છે. હવા અને પ્રકાશ બધું સમાન છતાં ફરક કેમ? આંબાના બીજે ધરતીના મૂળમાંથી. મીઠાશ શોધી...શોધીને જેંચી લીધી...લીંબડાના બીજે ધરતીના પેટાળ... માંથી જેંચી જેંચીને કડવાશ એકઢી કરી. ધરતીમાં તો બંને તરનો.

હતા. પણ સૌથે નિજ યોગ્યતા મુજબ ખુદની જરૂરિયાત જ્યાં જ્યાંથી  
પુરું થાય ત્યાંથી ગ્રહણ કરી તેમ આ વિશ્વમાં અનેક શક્તિઓ રહેલી છે.

રામચંદ્ર અને રાવણ પણ આ પૃથ્વીના માનવો હતો.

ગુરુગૌતમ અને ગોશાલક પણ પૃથ્વી 'પરના જ માનવો' હતા.

પિતુભક્ત અભય અને પિતુધાનના દોપથી લિપ્ત કોણિક બંને  
એક જ પિતાના પુત્ર હતા.

પુંડરિક અને કંડરિક બંને એક જ માતાના સંતાન હતા.

સમાનકાળ, સમાનલાવ, સમાનશક્તિ, સમાન આદંબન છ્ટાં દરેકના  
કાર્ય અને આદર્શમાં આકાશ અને પાતાળનું અંતર છે. કયાં સંજળન  
.શિરોમણિ મહામાનવ સમા ધન્યાત્માઓ અને કયાં માનવ છ્ટાં ભયં-  
કર દાનવ જેવા અધ્યાત્મીઓ.

જ્ઞાન જગત્તત્ત્વોને જગતના ભાવોને સુમજવા માટે છે. નેમ  
ધરમાં દરવાજે હોય તો દુર્જન પણ આવે અને સંજળન પણ આવે  
પરંતુ સન્માન તો સંજળન થાય. દુર્જન—ગુંડો ધરમાં ધૂસી ગયો  
હોય તો કોઈને વાત પણ ન કરાય. વાત કરીએ તો દુનિયા આપણી  
જ મશકરી કરે કેવો મૂર્ખ ! ખુદના ધરનું પણ ધ્યાન રાખી શકતો  
નથી.... તેમ તારે આંખ છે. તારે કાન છે અને આંખ તથા કાનવાળા  
સાથે સંબંધ છે. તારું જ્ઞાન, તારી આંખ અને કાનની સહાયથી  
થયું છે. કાન વડે તે ઘણું સાંભળ્યું છે, આંખ વડે તે ઘણું જેયું છે.  
પણ જેટલું જેયું અને જેટલું સાંભળ્યું તેટલું કહેવા તું સમર્થ છે.  
પણ પરમાત્મા મહાવીરનું વચન સર્વે સમરણપથમાં રાખજે. "નય  
! દિદ્રઠ સુય સંબ્વ" જરા લૂલ કરી તો આણુભોરબ...વિશ્વના સમસ્ત  
વિસ્કોટ દ્રવ્યો જે વિનાશ નહિ જનો તે તારું એક અસંયમિત વચન  
વિનાશ નોતરશે. એ વિનાશ એવો ભયંકર હશે જેનો હાહુકાર સાંભ-  
ળના નું પણ પાગલ બની વિનાશના ખાપરમાં બવિના બોકડાની  
નેમ હોમાઈ જઈથ.

આસુરી યજો અને આસુરી આરાધનાથી જ્યારે ખરેખર દાનવો જગ્યા ઉકે છે ત્યારે તેના નોતરનારને પ્રથમ ભક્ત બનાવે છે. તેમ તારું વચન કયારેક તને પણ ભરખી જશે.

જગતની બધી આગો જવલિત બન્યા પછી પણ વશમાં લેવાની કોઈક શક્તિઓ છે પણ વચનથી પ્રગટેલ દાવાનલને ઓલવવા હજુ કોઈ શક્તિના સંશોધન થયા નથી. બળ પહેલો જ નિયમ કર જેટલું જેણું જેટલું સાંભળ્યું તેમાંથી અયોગ્યને ભૂલી જઈશ. યોગ્ય વાત પણ મહાપુરુષના વચનને અનુસાર સંયમી બની જરૂર પડે વિવેકપૂર્વક પાપ રહિત પ્રમાણ પુરસ્કર-વિચારીને હિતકર બોલીશ.

નેમ હમણાં જ નંદું ધર બંધાવ્યું છે. સંપૂર્ણ આધુનિક સુખ સંગવડતાના સાધનો છે. કોઈ વાતની અભૂર્ણતા નથી. ગરમ-ઠડી પહાડ-ઉદ્યાન જે કહો તે બધા જ દશ્યો બધા જ વાતાવરણ બધી જ અનુકૂળતાવાળું ધર . કોઈને ધર જેવા બોલાવ્યા ફરી ફરીને ધરનો એક એક ખૂણો બતાવ્યો દરેક પાછળ તમારી કલાદિં તમારી આગવી ચૂઝના દર્શન કરાવ્યા. પણ ભલા ગટર અને સંડાશની કેમ વાત ના કરી. એ તો કંઈ કરાય ?

નેમ ધર બતાવીએ પણ વિવેકથી જ બતાવાય. તેમ બોલવાનું પણ સાયમપૂર્વક જ વિવેક ચૂકીને કયારે ન બોલાય. તેમ પુણ્યશાળી અનેક માણસોના પરિચયમાં આવ્યા ..વિશિષ્ટ બુદ્ધ વિશિષ્ટ સમરણ શક્તિ, અનોખી નિરીક્ષણ શક્તિ છતાં દરેકને દરેક વાત થાય આપણા વ્યક્તિત્વને અનુરૂપ, સામા માણસના વ્યક્તિત્વને અનુરૂપ જ વાત કરાય.

રાષ્ટ્રપતિને ઉભા રાખી કોઈ છોક્રો કહે તમે અમારા ભારતના સર્વ શ્રેષ્ઠ નાગરિક છો તો મારું શરીર ખૂબ તપે છે મને તાવ છે કે નહિ કહો ને ? સાચે આ છોક્રો આપણને મુર્ખ લાગે. તાવ અંગે “મા” ને પૂછાય, ડેક્ટરને પૂછાય. રાષ્ટ્રપતિને નહિ. રાષ્ટ્રપતિ આગળ

તો તેમના વ્યક્તિત્વને અનુરૂપ પ્રેરણ પૂછાય વાત કરાય. તાવની વાત કરવામાં રાષ્ટ્રપતિનું અપમાન...તો કોઈક ધર્મપ્રેરેમી ધર્માભિલાખી ધર્મ-ચછુ આગળ કોઈની નિંદા દ્વાપ કહેવા. તેની બુરાઈ કરવી તે ધર્મનું અપમાન નથી? તેના વ્યક્તિત્વનો અનાદર નથી?

ભયંકરમાં ભયંકર પાપી પણ દવ્યસિદ્ધ છે. તેથી તેની સમજ જીવની બુરાઈ કરવી તે તેની જતિનું અપમાન છે. એક સાધારણ સજનન મનુષ્ય પણ આવું અકર્તવ્ય ના કરે તો જગતના શિક્ષક સમા સાધુ ક્યા અનુભવો કહે? કથી વાતો કરે?

સાધુ જેમ વિશિષ્ટ કારણ વિના પોતાની આત્મકથા ના કરે, સાધુ જેમ પોતાના રૂપના વર્ણન ના કરે..સાધુ જેમ પોતાની વિદ્તાના ગીત ના ગાય. સાધુ જેમ પોતાના કુળની બડાઈ ના કરે, તેમ સાધુ પોતાના અનુવના પ્રદર્શન ના કરે તો પછી જેટલું જેણું, જેટલું સાભળું તે બોલાય જ કેમ? જેમ કુલવધૂના પ્રદર્શન ના થાય. તેમ આપણા અનુભવના પ્રદર્શન કરાય?

જેમ જ્વલપાન કરવાનું પણ ગ્રાણીને જ પાણી પીવાય.

કેરો ખાવાની પણ ગોટલા કાઢીને જ ખવાય


કેળા ખાવાના પણ છાલ કાઢીને જ ખવાય.

તેમ સાધુ જેણેલું અને સાંભળેલું બધું ના બોલે, શાશ્વત આજા દારા દરેક વચનનો પવિત્ર કરીને જ બોલે.

વર્ષો સુધી શાશ્વતોનો અભ્યાસ કર, મૃપાવાદ વિસમાણ મહાધ્રતના સંપૂર્ણ સ્વરૂપને સમજ ભાપા સમિતિ અને વચન ગુપ્તિને આત્મસાત બનાવ આકોશ તાડના તર્જનાને સહન કર. માન અપમાનને પચાવતા શીખ પછી જ ગુરુ આજા લઈને જરૂર પડે તો બોલવાનું અયોગ્ય બિનજરૂરી વિધાતક વાતોને વિસારી સ્વ અને પરનો ઉપકાર જ વંચન બોલવાનું. જે આવી રીતે બોલીશ તો તારામાં વચનસિદ્ધ પ્રગટશે. તારું વચન અમોદ થશે.

સાધુના વચન દ્વારા જગતમાં શાંતિ ફેલાય.  
 સાધુના વચન દ્વારા સૌને આશ્વાસન મળે.  
 સાધુના વચન દ્વારા કર્તવ્યપથનું ભાન થાય.  
 સાધુના વચન દ્વારા જીવમાત્રનું મંગલ થાય.  
 સાધુના વચન દ્વારા મોક્ષમાર્ગનું જ્ઞાન થાય.  
 સાધુના વચન દ્વારા મોક્ષમાર્ગ પહોંચાય.

પ્રભો ! મનકને સાધુવચનના વરદાન મળ્યા, અમને સાધુવચનની  
 સાધના આપો તો પણ ધન્ય બનીશું કૃપાણું કરો.



## ૨૩. આસુરતાનું ગૃહદેશોજણ



સિંહ અને શવાનવૃત્તિ આપણે સૌ સમજાએ છીએ. સિંહવૃત્તિની પ્રશંસા કરીએ છીએ. શવાનવૃત્તિની નિંદા કરીએ છીએ પણ કોણ જાણે માનવ નહિ સાધુ. લિન્ધુ નહિ. જિનેશ્વર ભગવંતની નિગ્રંથ પરંપરાને પ્રાપ્ત કર્યા બાદ પણ કયારેક સ્વાંગ સાધુનો પણ વૃત્તિ શવાનની બની જાય છે.

તત્ત્વની વ્યાખ્યા અને વિચારણા શુદ્ધશ્રદ્ધા. દર્શનમોહનીય, જ્ઞાનાપરણીય કર્મના કષ્યોપશમથી થાય છે. પણ કોધાદિ આંતરશત્રુઓ ઉપર વિજય તો ચારિત્ર મોહનીય કર્મના કષ્યોપશમથી પેદા થાય છે.

સત્તાના જેરે અભિકારીના રૂઆબે ધરાને ધુજવવી એ કંઈ મોટી વાન નથી. એ એક પુરુણનો જેલ છે. આન્માની અદ્વિતીય સાધના તો કોઈને મારવા ઉઠાવેલો હાથ પોતાના ગાલ ઉપર ચલાવવમાં છે. આવું સાહસ તો કોઈ સામાન્ય વ્યક્તિત્વ ના કરી શકે. જેનો પરંપરામાં ત્યાગ હોય, જેનું બોહ્ની વીનરાગીના વારસ સમું હોય તે જ આવું કાર્ય કરી શકે.

ધન્ય હતા પ્રભુ ગ્રહપલદેવતા પુત્ર બાહુભૂલીજ ભરત મહારાજ સત્તાના લોભમાં અન્યાય ગંથ જઈ રહ્યા છે. એક બે ત્રણ ચાર વાર હાર્યા પછી ગોત્રદ્રોહને પણ ભૂલીને ચક્રતન છોડે છે. ચક્રતન પણ બાહુભૂલિની પરિકમ્મા કરે છે. બાહુભૂલીની વજથી મુઢી બંધાઈ છે. મુઢી બંધાઈ નહિ. હવામાં વીંઝાઈ છે. ભરત મહારાજના મસ્તક પર જીંકાવાની ઘડી તોકાઈ રહી છે. ત્યાં તીર્થંકરના પુત્ર બાહુભૂલી સાવય બની ગયા. હું કોણ ? કોનો ? પુત્ર ? ગ્રહપલદેવતાનો પુત્ર હું

મોટાભૂઈ પર હાથ ચલવાનું મુઠીને સફળ કરીશ. મસ્તક પરનો ભાર હળવો કરીશ. એજ મુઠીએ જટાજૂટ બાલ તીતાર્યા. લોચ રો. શામળને યોગ્ય મુંડન કર્યું.

કોઈને સહજ ગુરુસામાં પણ તમાચો મારવા હાથ ઉપાડ્યો હોય. વ્યક્તિત્વટકી જય તો હાથમાં અને છાતીમાં કેવી અણઅણાટી થાય છે. લાખો યુદ્ધમાં લે શ્રમ ના પડે તે મનમાં આવેલાં કોધના આવેગને સમાવવામાં પડે છે. કોધની પળને નિષ્ફળ બનાવવા હદ્ય નાથે ભયંકર વિગ્રહમાં ઉત્ત્રું પડે છે. એવી જગતના માનવોની પરિસ્થિતિ સહજ છે. ત્યારે બાહુઅલીજીનું કેટલું પરાક્રમ કેવું વિશિષ્ટ અને પ્રેરક છે. “ શક્તિના સ્વામી બની કોધને નિરર્થક કરવો એ જ આત્મિક યોગ્યા-ઓનું મુખ્ય કાર્ય છે.”

શું બાલ મનકુને હંમેશાં કપરાં જ ચઢાવ ચડવાના .હંમેશા મુશ્કેલીમાંથી જ વિજયી બનવાનું પિતા ગુરુ થઈને આવા કહક થઈ ગયા. પુત્રની દયા તો દૂર રહી પણ એક માસુમ બાલકની પણ દયા નથી આવતી, જ્યાં મહારથીઓ હાંકી જય છે. ત્યાં આ બાળકનું શું ગજું ?

દુનિયાના સમસ્ત કાયરો અને અહિતસ્વીતીની આ મનોભૂમિકા રહેશે. કોઈ ભોગા સ્પષ્ટ બોલશે. કોઈ મુત્સદી જુદી રીતે રજૂ કરશે.

**ભલા માનવ !**

ભિખારીના પુત્રને એક જ વિદ્યા શીખવાડવાની હોય ..પેટ ભરવાની.. ટુકડો રોટલો રળી ખાવાની...

રાજપુત્રની શિક્ષાપદ્ધતિ અલગ હોય તેને સમસ્ત વિદ્યા શિખ-વાની...સમસ્ત પદ્ધતિ શિખવવાની શામ—દામ—દંડ બેદ નીતિ સમ-જવાની પણ ક્યારે કંઈ નીતિ આચરણવાની તેની અનોખી કોણસુઝ જોઈએ. ભિખારી ગમે તેવો હેંશિયાર હોય તો પણ તે રાજપુત્રનો

ગુરુ ના બની શકે રાજપુત્રનો ગુરુ છહીના ધાવણીથી શક્તપાઠ શીખવે. ઘોડીયામાં રાજપુત્ર રહે તો રાજમાતા કહે કંબેટા ! શૂરી ક્ષત્રિયાણીનું સંતાન નથો ? દુશ્મન દેખીને રહે છે ? બાજુમાં રહેલ વડારણ કહે. ના...મા...ના...મા... આ તો તમારું લોહી છે. ક્ષત્રિઓની મોનમજાહ પર ઉના આંસુ સારે છે. ભિખારીનો પુત્ર દ્યાથી જીવે રાજપુત્ર શૂરવીરતાથી જીવે તો શામણપુત્ર શાના દ્વારા જીવે ?

શામણપુત્ર ક્ષમાના સહારે જીવે તેના શવાસ તેના પ્રાણ, તેનું જીવન ક્ષમા. ક્ષમા રહે તો સાધુના ૧૦ પ્રકારના ધર્મ રહે. ક્ષમા જ્ય તો હાથમાં ઓધ્યો રહે. અને હૃદયમાંથી સાંધુતા ચાલી જ્ય.

પૂ. શાખાંભવચૂરિ મહારાજ સાંધુઓના ઘડવૈયા છે. તેમનું શિક્ષણ કાચું ન હોય. અધુરું ના હોય તેઓ સમજે છે. તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, સાંધુતાને શોભાવનારા પણ સાંધુના ખુદના નૂર શા માં ! ક્ષમામાં.

ક્ષમા વગરની સાંધુતા નાક વગરની સુંદરી જેવી બેહુદી લાગણે વૃક્ષ લીલું કેમ ? મૂળમાં મીઠાં જળ સમાયેલાં છે. વૃક્ષ સુરું કેમ ? મૂળ બળી ગયું છે.

જીવનમાં ક્ષમા તેજ રાખી શકે જેનું હૃદય જિનવાણીની સરવાણીથી નવપદ્ધિત હોય. જિનશાસનના રહસ્ય પામીને સમજને ગુર્ઝેં આવે તો ફાવે નહિ. પડછાયાની જેમ દેખા દઈને પાછો વળી જ્ય પણ સફળ ના બને.

પૂ. શાખાંભવચૂરિ મહારાજ બાલ મનકને સફળ સાંધુ જોવા માંગે છે. તેથી પ્રારંભમાં જ સાધનાના અધરાં ચઢાણ ચઢાવે છે.

શામણ પુત્રના શિક્ષાદાતા મોહી ગુરુ ના ચાલે.

શામણ પુત્રના શિક્ષાદાતા પ્રેમી ગુરુ ના ચાલે.

શામણ પુત્રના શિક્ષાદાતા ગુણી ગુરુ જેઈએ.

ગુણી ગુરુ પચાસ ટકા એંશી ટકાને પણ પાસ ના કરે. તે કહે મારો વિદ્યાર્થી ભલે છકસ્થ મારો વિદ્યાર્થી ભલે ક્રોધના ઉદ્ય-

પાણો... પણ મારી વિદ્યાર્થીની મારા શિષ્યની જીવન પદ્ધતિ વીતરાગ જેવી હોય મારા શિષ્યની જીવન પદ્ધતિ વીતરાગી જેવી હોય...મારા શ્રમણ શિષ્ય પાસે કોઈ ફાવી ના જાય. તો તોફાન શાના કરી જાય? હું શ્રમણનો ગુરું છું. મારો શિષ્ય ક્ષમા માટે શ્રમ કરનારો છે.

ગુસ્સો એતો કોઈ બાલ અજ્ઞાન તપસ્વીઓનો સ્વભાવ છે. વાત વાતમાં ઘડીએ ઘડીએ નાની નાની બાબતોમાં ગુસ્સો જેને સતતાવી જાય છે. તે સાધુતા પાલન કરતો હોય પણ પરિણામે અસુર નિકાયનો દેવ.

મનક! પ્રભુના શાસનની મોટી મોટી વાતો કરવાની નહીં પણ પ્રભુના શાસનના રહસ્યને કોઈ સામે કેશરીયા કરવાના છે, ભૂલે ચૂકે પણ કોઈ તારા રાજ્યમાં ના પ્રવેશે એ માટે તારે સતત જગૃતન રહેવાનું છે.

શાખામૃતનાં પાન કર શાખામૃત દ્વારા કોધના વિષ દૂર થઈ જશે. સમતામાં સ્થિર બનીશ. સમતાદ્વારા જ સાધુતાની શોભા નારો શ્રમ—પ્રયત્ન ક્ષમાનો તું કયારે પણ ગુસ્સાના આવેશને વશ ન થા. ગુસ્સો તને નારી સાધુતા ના ભૂલાવે. તનો પ્રતિદિન પ્રયત્ન કરજે. તું આ પ્રયત્નમાં સફળ બન એજ તારા ક્ષમા માટે શ્રમ કરી રહેલ પિતાની હાર્દિક ભાવના છે.

બેટા! તું કામ કરનાર મંજુર નહિ પણ ક્ષમા કાજે શ્રમ કરનારો ભડવીર..લાડલા..શાસન યસજ અને અનાર્દિના શત્રુ સામે વિજયી બન તો જ મારી પ્રસન્નતા. મારો આનંદ. ક્ષમાભાવને આત્મસૂધ બનાવ અને મને ખુશ કર.

પૂ. શાખાલ્પસૂરી મહારાજ મનક પર જે સમતાથી હાથ ફેરવી કોઈથી દૂર કરો છો, તે કર્યા મારી પર ના કરો. કરણરીને વિનિવું છું. હું પણ તમારો કોઈ જન્મનો સ્નેહી છું.

બસ, મનકની જેમ મારા પણ ભાવ સ્વજન બનો.



## ૨૪. નેવ ગૂહે ન નિનહુયે



જોયો વગર ચાલ્યા અને પગમા પથ્થર વાગ્યો “હાય આજે તો કેવા લોકો છે. આમ વગ્યે પથ્થર નાખતાં હશે.” આમ કહી બીજાની ભૂલ પર ગાળો દેતાં પગ પંપાળતાં આગળ ચાલ્યા જવું તે આજના સમાજની ખાસ પદ્ધતિ છે.

કોઈ ભલી વ્યક્તિ કહે મહાનુભાવ ! આમ ઘોંધાટ શું કામ કરે છો ? આમ પથ્થર બાજુ પર મૂકી દો.. સમસ્યા હતા થઈ નશે.

“મેં વગ્યે પથ્થર નાખ્યો છે તે હું બાજુ પર નાખું ? મારું કામતો બૂમ પાડવાનું.” તેં સાંભળ્યુંને મને સલાહ આપવા આવ્યો તો હવે તું જ બાજુ પર નાખ. તમે રસ્તામાં પથ્થર જોયો તો તમારે બાજુ પર નાખવો જોઈઓ. કેવાહલ કરી અમારી શાંતિના બગાડવી જોઈએ.

પોતાની ભૂલ છૂપાવવી અને બીજાની ભૂલ ઢોલ વગાડીને જહેર કરવી તે રાગીદેપીના ફૂજેતા.

ભૂલ કરવી અને બીજાના નામે ચઠાવવી તે હુજુનવૃત્તિ.

ખૂદની ભૂલ છૂપાવવી નહિ ભૂલ સ્વીકારવી તે સાધુવૃત્તિ.

મનક !

અનાદિ કાલથી આશ્રવોના સંસ્કાર આત્મામાં સ્થિર થયેલા છે. સંવરના સંસ્કાર નવા છે. નૂતન સંસ્કાર—નૂતન આચાર પ્રણાલી છે. એટલે આત્માને સમજાવવો પડશે આચાર અને અનાચારના સતતું જ્યાલ રાખવા પડશે.

આચાર એટલે સન્માર્ગ નિરવદ્ય પ્રવૃત્તિ કર્ત્વય.

અનાચાર એટલે ઉન્માર્ગ સાવદ્ય પ્રવૃત્તિ અકર્ત્વય.

ભૂખ લાગી એટલે ખાવા લાગી જવું તે આહાર સંજ્ઞા !

ભૂખ લાગે છતાં કલાય, એપણીય મળો તો જ આહાર બેવો તે ગૌચરી આચાર.

થાક લાગે એટલે સુઈ જવું તે ઓધસંજ્ઞા !

થાક લાગે છતાં સ્વાધ્યાય કરી ગુરુની સેવા કરી ભૂમિનું પ્રમાન્જન કરી રાત્રિના પ્રથમ પ્રહર બાદ સંથારો કરવો તે સાધવાચાર.

કોઈ કહવો શરૂ કહે અને પથ્થરનો જવાબ પથ્થરથી આપવો તે કોઈ સંજ્ઞા.

કોઈ કહવો શરૂ કહે ત્યારે એ સંસારી છે પણ ધર્મ ક્ષમા છે. એમ વિચારી જવાબ આપે ને ઉપથાન રહે તે સાધવાચાર.

સુખનો સ્વીકાર કરવો ને દુઃખના પ્રનિકારમાં લાગ્યા રહેયું તે આશ્રવ—આચાર.

દુઃખનો આનંદ સાથે સ્વીકાર અને સુખના માટે પૂર્ણ બેપરવાઈ તે સંવરનો આચાર.

પ્રતિક્ષણ તારે આચાર અને અનાચારના પૃથક્કરેણ કરવા પડ્યો. આશ્રવ અને સંવરના બેદને પારખવા પડ્યો. ચઢે તે પડે, ભાગે તે ભૂલે, આરાધના કરતાં વિરાધના થાય, સેવા કરતાં આશાતના થાય, તેમ આચારનું પાલન કરતાં કથારેક અનાચાર થઈ જય. કોઈક અપરાધ અદ્ધાનના કરણે થશે. કોઈક ભૂલ સદ્ગુરુની નિશાના અભાવે થશે કોઈક ભૂલ પાપની આદતના કારણે થશે. પણ જાણો—અજ્ઞાણે છિદ્ગમ્ય હોવાથી આચારમાં વિચારનું મિલન ન રહે. ગુરુ ગૌતમસ્વીમીની પણ ભૂલ થાય. તને હિતશિક્ષા આપનાર મારી પણ ભૂલ થાય. પણ ભૂલ થયા બાદની અવસ્થા એ આનિમક વોગ્યતાનું પ્રતિબિંબ છે.

આપણો આત્મા જ મોહારીન બની અક્ષમ્ય અપરાધ કરી બેસશે. પણ અપરાધ કર્યા બાદ કયારેય અસ્વીકાર કરતો નહિ સર્વજ્ઞશાશ્વતમાં પ્રાયશ્ચિત્તાનું વિધાન છે. પણ પ્રાયશ્ચિત્ત કોને હોય ગુરુ પાસે પોતાની ભૂલ કબૂલે, ગુરુ આગળ પોતાના પાપ પ્રકાશે, ગુરુ આગળ જે પાપ જે રીતે થયા હોય તેની હાઈન્ડ કબૂલાત કરે.

જેમ બેંકનો ચેક પાસ થવામાં હસ્તાક્ષરનો જરા ફરક ન ચાલે. જેમ ડેક્ટર પાસે દેહની રજૂઝાત કરવામાં જરા પણ સંકોચ ન ચાલે તેમ ગુરુ પાસે પાપની કબૂલાતમાં જરા પણ શરમ ન ચાલે. મા પાસે જેમ નાનું બાળક ખુલ્લું રહે તેમ શિષ્ય ગુરુ પાસે દિલ ખુલ્લું કરે.

શિષ્ય ! તું પણ આત્મશુદ્ધ કરે જ છે ને ?

પ્રતિક્રમણ શું છે ? અતિચાર શું છે ? ઈરિયાવહિયા શું છે ? “દેવસિઅં આલોઉં” શું છે ? અખલુટિયો શું છે ? ત્યાં તો અભાવચ્ચે આ સૂત્રો રણકારભર્યા અવાજે બોલે છે. ઓળું સુંદર બોલે છે કે હું ખુશ થઈ જાઉં છું “મિરણામિ દુક્કડમ” બોલતાં સંવત્સરીના દિવસે આકાશ ગંજવી દે છે. અને ગુરુ આગળ આલોચના લેતાં પાણી પાણી થઈ જાય છે. હવે તું કેમ શરમાય છે ? શા માટે ઊર, ભય અને કોલ અનુભવે છે ?

ઓ ગુરુદેવ ! સાચું કહી દઉં મારી પ્રવૃત્તિ મહાત્માની હની. પણ વૃત્તિ મહાત્માની હતી નહિ. આપ સાચા સંત છો. મહાત છો. તેથી મારા પ્રત્યે સદૈવ કરુણાનો ઓત વહાવ્યો છે. ગુરુજી ! જરણના, શુદ્ધિથી ખૂબં દૂર છું. હજુ માયો કપટ શઠવૃત્તિ કયારેક મારા મનમાં સવાર થઈ જાય છે. તેથી આલોચના લેતાં મારા પાપનું પાપ સામે નિવેદન કરતાં કોલ અનુભવું છું. મનમાં થાય છે ગુરુજી તો ગંભીર છે પણ મને બીજા કોઈ પાપી માનશે તો ?

જરણ સાધક !

પાપ થઈ ગયું, અનંત જ્ઞાનીઓએ ‘આણી લીધું’ હવે બે ચ્યારથી દ્યૂપાવવાથી શું ? સૂરજ કંઈ છાબડીએ હંકાય ? પાપ નહિ આદ્વોવીએ,

નહિ સ્વીકારીએ તો ઢંકણે તેથી જ કહું છું “નેવ ગૂહે ન નિનહેવે”  
નું કહીશ ગૂહે એટલે પણ છૂપાવવું અને નિનહેવે એટલે પણ છૂપા-  
વવું એક જ અર્થ માટે બે શર્દદ શા માટે પણ સાંભળ—

“જેમ માનસશાસ્ત્રી કહી દે તમે આને ચોર કહો છો પણ આ  
દિલનો ચોર નથી. ઈર્પાના કારણે તેણે કોઈની વસ્તુ ઉપાડી છે. તેને  
બેઈતી નથી પણ બીજા પાસે રહે એ તેને ગમતું ન હતું ચોર  
પોતાની ચૌર્યવૃત્તિનું પૃથક્કરણ નથી કરી શકતો તેમ આપણે આપણી  
વૃત્તિનું પૃથક્કરણ કરી શકતાં નથી, અન્તણાનીનો અવલ ઈન્સાહ જ  
આપણા અનાદિના પાપને નાથી શકે આપણી અનાદિની પાપવૃત્તિને  
કાબૂમાં લઈ શકે.

**ભાઈ !**

ક્યારેક ભૂલ કર્યા પછી સર્વથા અસ્વીકાર થાય છે ક્યારેક ભૂલ  
કર્યા પછી સામાજિક ધોરણે ભૂલનો થોડો સ્વીકાર કરાય છે, થોડું  
છૂપાવીએ છીએ. આ ક્રમધીન આત્માનો સ્વભાવ છે. હવે તારે  
ધર્મધીન બનવાનું છે, શાખાધીન બનવાનું છે તેથી જ કહું પાપનું  
ગૂહન પણ નહિ કરવાનું અને પાપને છૂપાવવાનું પણ નહિ ગૂહન  
એટલે થોડી વાત કર્યી, થોડી છૂપાવવી, કાંટો થોડો નીકળણે અને થોડો  
રહેણે તો તને કણ વળશે? મોઢું બધું સારું થઈ જશે પણ દાંતમાં  
જરાક કરચર રહેણે તો જીમ ત્યાં જ જશે. થોડું પણ પાપને છૂપાવવા  
દ્વારા તેં પાપનો પક્ષ કર્યો. અપરાધના જ બીજ ઉંડા કર્યા, પ્રાયશ્વિત  
બેવા છતાં તે પાપને સ્થિર કર્યું. તેથી સમજી વિચારીને વર્તને. સાંધુ  
અપૂર્ણ આલોચના લે તો ન ચાલે, તો. પછી સર્વથા અપરાધનો  
સ્વીકાર ના કરે તો કેમ ચાલે?

**મનક !**

પાપનો સર્વથા સ્વીકાર કરવાનો પાપને જરાપણ છૂપાવવાના  
નહિ. શુદ્ધ સાંધુતાના પાલન માટે આ ખૂબ જરૂરી છે. ખુદની ભૂલનો

અપૂર્વ સ્વીકાર ન ચાલે તો આપણી ભૂલ બીજાના નામે થઢાવી દેવી  
તે કેટલું ભયંકર પાપ ભૂલ પોતાની અને દોપારોપણ બીજ પર કરવું  
તે કેટલું ભયંકર.

સાધુ થગો ત્યારે સુભા વચ્ચે રહેવું નિંદામી ગિરિહામિ અપ્યાણિ  
વેસિરામિ હવે શરમ શા કાને ?

શાસ્યના નિદિધ્યાસન કરતાં કહેલું હું જ મારા કર્મોનો કર્તા,  
લોકતા હવે બીજ ઉપર દોપારોપણ કેમ ?

મુનિ મનક તો બાળક છે. બાળક શું પાપ કરવાના અને તેને  
શું છૂપાવવાના—પુ. શથયંભવસ્યુરિ મહારાજ અમારા મસ્તક પર હાથ  
મુક્કો અમારા હદ્દયને સરળ બનાવો. સૃપણ બનાવો, સાત્ત્વિક બનાવો,  
સદ્ગુરુની સાક્ષીએ આત્માનો ઉદ્ધાર કરવા સર્વ અપરાધોનો સંપૂર્ણ  
સ્વીકાર કરીએ. જે ભૂલ આજ સુધી કહી હોય પણ અધૂરી કહી  
હોય તે પ્રગટ કરવાનું બળ આપો—અમારા અનાચાર દૂર કરો પ્રભુ !  
પ્રભુ ! તમારા ચરણમાં આવ્યાં છીએ...દ્યા કરો... આચારમાં સ્થાપો.



# ૨૫. અમોહ વયાળ કુજજા



ઈતિહાસ ડહે છે કે, પિતાના એક વચન પાલન ખાતર રામ-ચંદ્ર વનમાં ગયા — પતિની છાયા બનવા સીતાએ વનમી વસમી વાગ સ્વીકારી — ભાઈની સેવા કાજે લક્ષ્મણે પૂર્ણ કૃતીમા અયોધ્યા માની..

વર્ષો વીત્યા — યુગો વીત્યા. દુનિયા ઉપર નથી કોઈ રામના પુત્રો કે નથી કોઈ લક્ષ્મણના વંશજી...નથી સીતામાતા સીતાના પિય-રીયા..પણ ધરધરમાં — ગામગામમાં નગરનગરમાં અને દેશપરદેશમાં ખુદની આત્માકથાથી એ અદકા પ્રેમથી રામની કથા સૌ વાંચે છે, પ્રેરણા લે છે.

ઈતિહાસ યાકી પૂરે છે કે સત્યવચન પાલન ખાતર હરિશંદ્રે શમશાનને રાજમહેલ માન્યો છે.

ખુદના ખુદની સ્નેહી વ્યક્તિન સ્વજનોના વચન ખાતર જૂઝે એ સંસારીની રીત છે. સ્નેહીની રીત છે. સજજનની કરણી છે... ત્યારે સાધુતાની પદ્ધતિ અલગ...સાધુને પોતાનું કંઈ પણ નહિ. આગ્રહ નહિ, નિયમ નહિ, સાધુ એ તો અગમભૂમિના માનવ, સાધુની. જીવન પદ્ધતિ પણ અગમનિગમની

સાધુ કહે પોતાનું વચન પૂર્ણ કરવું તે માનસંશા.

સાધુ કહે સ્નેહીનું વચન પૂર્ણ કરવું તે લોકસંશા.

સાધુ કહે જીવનનું વચન—ગુરુવચન પૂર્ણ કરવું તે સાચી ધર્મ-સંશા.

ગુરુદેવ. પુ. શાયંભવસુરિ મહારાજ બાલમુનિ મનકનો વાસો. પંગાળે છે અને હિતભરી વાત કરે છે. બેટા મનક ! માણે અને તારો. ઈતિહાસ આજનો નથી. ગઈકાલનો નથી. અનાદિનો છે.

આ બધા સંકલ્પો વિકલ્પો અહંપ્રેમીના છે. પોતાની જતને કંઈક સમજતારાના છે. ગુરુ ગૌતમ એક સાચા શિષ્ય હતા. ખુદના વિસ્મરણ એ શિષ્યના લક્ષણથી શોભતા હતા. ગુરુગૌતમસ્વામીનો આત્મા તો આજ્ઞાપાલનથી હસતો જ હોય..પ્રભુના વિધોળે રહ્યો તે ગુરુગૌતમનો મોહ...પણ આજ્ઞાપાલનના પ્રેમે ગુરુ ગૌતમના મોહને હટાવ્યો.

ગુરુ ગૌતમ આજ્ઞાપાલન ખાતર બાધ્ય સાંનિધ્યને ગૌણ સમજે. અલ્યા કપટી...તારે હજુ અહં પોપવો છે. તું કહે “હું ગુરુની છાયા હતો” બોલ ગુરુનું બાધ્ય સાંનિધ્ય ઉપાસના યોગ્ય કે ગુરુની આજ્ઞા? મેળવ જવાબ તારા અંતરમાંથી...ધન્યતમ શિષ્યો જ નજરીક યા દૂર રહી ગુરુ આજ્ઞાની આરાધના કરી શકે છે. આપણે દેહના ઉપાસક નથી. પણ દેહમાં રહેલાં પાવન ગુરુ આત્માના ઉપાસક છીએ. ગુરુની આજ્ઞા શિરસાવંદ કરવામાં ગુરુનું સતત સાનિધ્ય છે. સાથે રહેવામાં હોય પણ ખરું અને ન પણ હોય — આજ્ઞાપાલનમાં અવશ્ય ગુરુનું સાંનિધ્ય હોય.

મનક ! શિષ્ય બનવા એકલી સેવા પૂરતી નથી. સેવા તો શિષ્યલુણનતું પ્રથમ પગથિયું છે. સાચી સાધના તો ગુરુના વચનને સફળ કરવામાં છે. ગુરુનું વચન કયારે પણ અન્યથા હોય નહિ — મારે પાપનો ઉદ્ય હોય — મારા દુઃકર્મો હોય — પણ ગુરુનું વચન એટલે પુણ્યશાળીનું વચન — આદેયનામ કર્મયુક્ત મહાત્માનું વચન.

પાતાળમાં પાણી હોય... બની શકે કે મેં ખોદયું ત્યાં ન હોય. મારે ભૂસ્તરશાસ્ત્રીના વચન અનુસાર સુયોગ્ય સ્થળો ખોદયું જોઈએ... જુદી જુદી જગ્યાએ નહિ એક જગ્યાએ ખોદયું જોઈએ. પણ પાતાળમાં પાણી ન હોય તે નથે કાળમાં ના બને.

તેમ ગુરુનું વચન સદા સત્ય હોય — મંગલ હોય. હિતકારક

સફળ હોય — ખામી મારા પુરુષાર્થની — ખામી મારા સમર્પણની — ખામી મારા પુણ્યની પણ હું શિષ્ય..સાચો શિષ્ય — ગુરુવચન સફળ કરવા જ જીવી રહ્યો છું. આહાર કરું કે આરામ કરું — અધ્યયન કરું કે આલોચના કરું, તપ કરું કે ધ્યાન કરું પણ મારા શિષ્યત્વનો પ્રાણ ગુરુભાજાને સફળ કરવામાં...

સમસ્ત સાધકે ગુરુવચન સફળ કરવાની સાધના કરવાની છે. જેમ આમન્યા વગર વિદ્યા સિદ્ધ ન થાય. તેમ સાધુકુળની આમન્યા વગર સિદ્ધ ના મળે. આપણે ગુરુવચન સફળ કરનાર મહાત્માના શુભાશિષ્પ પ્રાપ્ત કરીએ. તેમને વિનવીએ — તેમની પાસે કાકલુદી કરીએ — ગુરુવચન સફળ કરવાની સાધનાના રહસ્ય અમને સમજાવે — આપના પંથના અમે ચાહક છીએ. આપના અમે ઉપાસક બનીએ એવા આશિષ્પ આપો....



કેટલીયે વાર માન ખાતર જૂઝ્યો--પાંચ પચ્ચીશ વર્ષ બોક જુબે  
મારી કથા ગવાણી—પણ તને ખબર નથી આ સંસારમાં ત્યાગ સિવાય  
પોતાની સાતમી પેઢીના પુરુષને ભાગ્યે જ કોઈ જાળે છે એટલે  
બોકના દુનિયાના માન-સત્ત્માન ખાતર મારે કે તારે જૂઝુમવાનું નથી.  
હવે જુંદગીમાં જીવ સટોસટની બાજુ જોવાની છે. બેટા બાળમાં રંગ  
જમાવવો છે.

ગુરુજી...પિતાજી ! સમજવો બાળના અટપટા દાવ. આપની  
કૃપા—આપની છાયા—પછી મને જ્ય શાનો ? મારે શાની ચિંતા ?

તારે સાંભળ બેટા !

અભિમન્યુના અફાર કોઠા સહેલા છે, દ્રોણાચાર્ય કે ભીષમ-  
પિતામહના ચક્કબૂહ જીતવો સહેલ છે...પણ આ એક અટપટો ચક-  
બૂહ છે.

તારે તાડું નામ યાદ 'રાખવાનું' — તારા નામથી તને જે કર્તવ્ય  
કહે તે કરવાનું — હંમેશા યાદ રાખવાનું હિતશિક્ષાનો ચાહક હું  
'શિષ્ય ..પણ ખરી મજ તો ત્યાં છે — સંજી — વિચારક પ્રદ્ઘાવાન બની  
તારા અવાજને તારી જતને ભૂલી જવાની—ગૌણ બનાવવાની.

શરીર નાડું...વચન ગુરુનું.

મન તાડું પણ તારા મનમાં ગુરુની અભિલાપા.

ગુરુના વચન ખાતર જૂઝુમવાનું...ગુરુની આજ્ઞાને સફળ કરવાની  
તહતી, હાજી આપ કહો તે પ્રમાણે જ આવી ભાપા બોલવાની  
અને જીવનમાં મશ્યાંતકાય આવે તો પણ સફળ કરવાની—નહિતર આ  
સાધુની ભાપાનો અભિનવ કરનાર તું નટ ..તેથી અધિક કશું જ નહિ.

ગુરુના — તારુકના — ઉપકારીના — જ્ઞાનદાતાના — સૂત્રદાતાના  
અર્થદાતાના — જ્ઞાનમાં સહાયકના — શાશ્વતી શુદ્ધ કરનારના —  
સંયમને નિર્મણ કરનારને — પતનમાંથી ઉત્થાન તરફ લઈ જનારના —  
— સમુદ્રાયના હિતસ્તીના — જ્ઞાનાયિકના — વડીલના — ઉપાધ્યાયના —

આચાર્યભગવતના — શાસન રક્ષકના — શાસન પ્રભાવકના વચનને — આજ્ઞાને આદરથી રવીકારવાની — વચન વડે તહેતિ — ઉસ-પજજમિ કૃપા કરી કહીને શિર પર અંજલિ કરીને રવીકારવાની — કાયાથી જે દિવસથી આજ્ઞા માની તે દિવસથી પ્રવૃત્તિમાં લાગી જવાનું શરીર , તાડું — વચન તાડું — મન તાડું પણ ટેક ગુરુની — વચન ગુરુનું — આજ્ઞા ગુરુની... ગુરુની આજ્ઞા સફળ કરીને રહેવાની.. અમોઘ કરીને રહેવાનું.

નેમ સાચા જ્યોતિધીની આગાહી સફળ હોય છે પણ તેની કહેલ પળ માટે સદા ઉધમ કરવો જોઈએ. તેમ હિતસ્વી ગુરુનું વચન સદા મંગલકારક હોય છે. પણ એ મંગલનું પાત્ર બનવા પ્રયત્નો તારે જ કરવા પડે.

પરમાત્મા મહાવીર ગુરુ ગૌતમને અંતિમ સમયે દેવશમનિ પ્રતિ બોધવા મોકલે.. ચાર જ્ઞાનના માલિક, પચાસ હજાર કેવલી — શિષ્યના ગુરુ ગૌતમ પોતાની જતને વિસ્મરી — પોતાના જ્ઞાનને પણ ભૂલી ગુરુના વચનને સ્વીકારે — હા કહે — એટલું નહિ — વિહાર કરીને ત્યાં જય — વિહાર કરીને જ નહિ અટક્યાં પણ દેવશમનિ પ્રતિબોધ કરીને જ પાછા વળે.

દેવશમનિ પ્રતિબોધ કરી પાછા વળે ત્યાં સાંભળે — ત્રણલોકના દીપક — ત્રણ જગતના છત્ર પરમાત્મા મહાવીર મોક્ષે પધાર્યા. ગુરુ ગૌતમને આજ્ઞા પાલન કરવામાં શું લાભ થયો? પરમાત્મા મહાવીરનો અંતિમ પળે જ વિયોગ થયો.

ગુરુ ગૌતમ કેવા ભોળા રહ્યા — ભગવાની વાત શિરસા વંદ્ય કરવાની... પણ જરા જ્ઞાનનો ઉપયોગ તો મુક્તવો તો — આપ તો ઉભરમાં પણ પ્રભુથી મોટા — જરા વ્યવહારિક જ્યાલ કરવો હતો કે તીર્થીંકર પરમાત્મા પણ દેહથી વિદાય લે છે. આજ્ઞા માની તો માનતી હતી — એક સારા શિષ્યનું કર્તવ્ય હતું પણ જરા આગળ પાછળનું વિચારવું હતું ને?

આ બધા સંકલ્પો વિકલ્પો અહેંપ્રેમીના છે. પોતાની જતને કર્યાંક સમજનારાના છે. ગુરુ ગૌતમ એક સાચા શિષ્ય હતા. ખુદના વિસ્મરણ એ શિષ્યના લક્ષણથી શોભતા હતા. ગુરુગૌતમસ્વામીનો આત્મા તો આજ્ઞાપાલનથી હસતો જ હોય...પ્રભુના વિયોગે રહ્યો તે ગુરુગૌતમનો મોહ...પણ આજ્ઞાપાલનના પ્રેમે ગુરુ ગૌતમના મોહને હટાવ્યો.

ગુરુ ગૌતમ આજ્ઞાપાલન ખાતર બાધ્ય સાંનિધ્યને ગૌણું સમજે. અલ્યા કપટી...તારે હજુ અહેં પોપવો છે. તું કહે “હું ગુરુની છાયા હતો” બોલ ગુરુનું બાધ્ય સાંનિધ્ય ઉપાસના યોગ્ય કે ગુરુની આજ્ઞા? મેળવ જવાબ તારા અંતરમાંથી. ધન્યતમ શિષ્યો જ નજરીક યા દૂર રહી ગુરુ આજ્ઞાની આરાધના કરી શકે છે. આપણે દેહના ઉપાસક નથી. પણ દેહમાં રહેવાં પાવન ગુરુ આત્માના ઉપાસક છીએ. ગુરુની આજ્ઞા શિરસાવંઘ કરવામાં ગુરુનું સતત સાનિધ્ય છે. સાથે રહેવામાં હોય પણ ખડું અને ન પણ હોય — આજ્ઞાપાલનમાં અવશ્ય ગુરુનું સાંનિધ્ય હોય.

મનક! શિષ્ય બનવા એકલી સેવા પૂરતી નથી. સેવા તો શિષ્યજીવનનું પ્રથમ પગથિયું છે. સાચી સાધના તો ગુરુના વચનને સફળ કરવામાં છે. ગુરુનું વચન કયારે પણ અન્યથા હોય નહિ — મારો પાપનો ઉદ્ય હોય — મારા દુષ્કર્મો હોય — પણ ગુરુનું વચન એટલે પુણ્યશાળીનું વચન — આદ્યનામ કર્મયુક્ત મહાત્માનું વચન.

પાતાળમાં પાણી હોય... બની થકે કે મેં જોદ્યું ત્યાં ન હોય. મારે ભૂસ્તરશાશ્વીના વચન અનુસાર સુયોગ્ય સ્થળે જોદ્યું જોઈએ .. જુદી જુદી જગ્યાએ નહિ એક જગ્યાએ જોદ્યું જોઈએ. પણ પાતાળમાં પાણી ન હોય તે ગ્રસે કાળમાં ના બને.

તેમ ગુરુનું વચન સદા સત્ય હોય — મંગલ હોય. દિતકારક

સહ્ય હોય — ખામી મારા પુરુષાર્થની — ખામી મારા સમર્પણની — ખામી મારા પુણ્યની પણ હું શિષ્ય. સાચો શિષ્ય — ગુરુવચન સહ્યન  
કરવા જ જીવી રહ્યો છું. આહાર કરું કે આરામ કરું — અધ્યયન  
કરું કે આલોચના કરું, તપ કરું કે ધ્યાન કરું પણ મારા શિષ્યત્વનો  
પ્રાણ ગુરુભાજાને સહ્યન કરવામાં...

સમર્પણ સાધકે ગુરુવચન સહ્યન કરવાની સાધના કરવાની છે. જેમ  
આગાન્યા વગર વિદ્યા સિદ્ધ ન થાય. તેમ સાધુકુળની આમાન્યા વગર  
સિદ્ધ ના મળે. આપણે ગુરુવચન સહ્યન કરનાર મહાત્માના શુભાશિષ્ય  
પ્રાપ્ત કરીએ. તેમને વિનવીએ — તેમની પાસે કાકલુદી કરીએ —  
ગુરુવચન સહ્યન કરવાની સાધનાના રહસ્ય અમને સમજાવે — આપના  
પંથના અમે ચાહક છીએ. આપના અમે ઉપાસક બનીએ એવા  
આશિષ્ય આપો....



## ૨૬. ખાડુસસુઅં પજ્જુવાસિજીજી



એક નાના બાળકને જવેરી બજારમાં જોઈ પીઠ જવેરીઓ વિચારમાં પડી ગયા. આવદું અમથું ટાબરીયું અહીં કેમ આવ્યું? કોઈ ભૂલો પડુલો છોકરો હશે?

“ ભલા બાલક! તારે ક્યાં જવ્યું છે? ” શું તું રસ્તો ભૂલ્યો છે?

“ ના મહાજન ના. હું રસ્તો ભૂલ્યો નથી...હું જવેરી બજારમાં સમજને આવ્યો છું.” અરે! હીરામોતીના બજારમાં શું કરીશ? શાક માગકીટમાં જાંકોઈ સજજનન...દયા કરશે. તો પણ બે કેળાં ખાવા આપશો.. અહીં તો કાંઈ નહિ મળો.

સજજન! મારા ઘરે ધાણું ખાવાનું છે, હું ખાવા નથી આવ્યો.. કુમાવા આવ્યો છું, મારે જવેરી બનલું છે. હીરા મોતીના વેપાર કરવા છે.”

ભાઈ...તારા મનોરથ સારા પાણી હજી મૂછનો દોરો ફૂટવા દે... અત્યારે તો મજા કર...ના...મહાશય. ના. મારે તમારી સુઝીયાણી સલાહ ના જોઈએ. ભલે વેગારી મોટો થઈશ ત્યારે થઈશ. પણ તમારા જેવાની ગાઢતિ જોઈને અનુભવ તો લેવા દો.

ઉપરની વાત કોઈ કલ્પના કથા નથી, પણ વર્તમાનના એક જગપ્રતિષ્ઠ જવેરાતના વેપારી જીવનની ભવ્ય કથા છે.

લેને લેની ચાડના હેઠાં તે તેની સેવામાં ચાલ્યો જાય, વેપારીની સેવા વેપારી જ બનાવે, રસોઈયાની ઉપાસના રસોઈઓ જ બનાવે, લેને અનંતના જ્ઞાન કરવા છે. લેને પદાર્થમાત્રના અર્થ સમજયા છે. લેને પ્રત્યેક દૃષ્ટિના ગુણ ગર્થિય જાગ્રવા છે. તે કોની સેવા કરે...કોની ઉપાસના કરે?

કામ કરવું અને સેવા કરવી વચ્ચે અંતર છે. ધરમાં નોકર રહે, કામ કરે પણ શેઠની સેવા ના કરે. ધરમાં પુત્રે રહે પિતાની સેવા કરે — પણ તૈયો મળતાં સંપત્તિના ભાગ વહેંથાતા અલગ થઈ જાય. જરૂર પડે ત્યારે સેવા કરવા આવે.

કામ કરવું અને સેવા વચ્ચે નેમ અંતર છે, તેમ સેવા કરવી અને પર્યુપાસના વચ્ચે પણ અંતર છે.

પૂ. શાખાબદીબસ્તુરી મહારાજ મનાકને કહી રહ્યા છે. અનાંતરજ્ઞાન ચાહક બાલ !

સિદ્ધ બનવા તારે અનાત ગુણ પ્રગટ · કરવા પડ્યે. અસંગ ગુણની પ્રાપ્તિ તારે મુદ્રાબેખ બનાવજે, તે જ તને આખરે સિદ્ધ અપાવશે. સંગ કરવો પડ્યે પણ કોનો સંગ કરવાનો ?

મનાક ! બહુશુતની પર્યુપાસના કરવાની — બહુશુતની પર્યુપાસના વગર અસંગ ગુણ પ્રગટ ના થાય. અસંગની પ્રાપ્તિની પ્રથમાવસ્થા પર્યુપાસના .

ધ્યાલમાં રાખજે મેં તને ઉપાસના નથી કહી પણ પર્યુપાસના કહી છે.

શુ ઉપાસના એટલે નજીદીકમાં આસન રાખવું ? શુ પર્યુપાસના એટલે બહુશુતની ચારે બાજુ નજીદીકમાં આસન રાખવું ? આવા બહુ પ્રશ્નો આપણા જેવા વક અને જડના હોય.

શાખમાં સ્થળે સ્થળે જ્ઞાન—જ્ઞાનીની મર્યાદા બતાવી છે.

જ્ઞાની સાથે વાત કરાય પણ હાથ જોડીને.

જ્ઞાની સાથે તેમને કોઈ જતની તકલીફ ન થાય તેમ વર્તાય.

જ્ઞાની પાસે—ગુરુ પાસે કાર્ય અથે જરું હોય તો પણ ગુરુની આજ્ઞા લઈને જવાય.

બહુશુતની ઉપાસના નહિ પણ પર્યુપાસન એટલે શુ ?

માટે પણ થાય છે — અભ્યાસ ગુણ પ્રાપ્તિ અર્થે થાય છે. સંસ્કાર અલ્પજીવી હોય છે — અભ્યાસના સંસ્કાર સ્થિર શાસ્ત્રના અભ્યાસ કરી શાત્રમય જેમની બુદ્ધિ બની ગઈ બહુશ્રુતને અભ્યાસ હંમેશાં ઉપસ્થિત રહે છે. વાંચનાની વિરાગ છે. આગમ એટલે મૃળસૂત્રો જ નહિ. સૂત્ર—નિર્ણયકિત—ભા॥ —ટીકા એક આગમ ઉપર ઉપસ્થિત સધળું સાહિત્ય આત્મસ તે આગમ—અભ્યાસ, એક આગમ નહિ અનેક આગમવિદ અનુસાર. મહાપુરુષ રચિત શાસ્ત્રનો પણ વેતા.. તે બધાને જ બહુશ્રુત. બહુશ્રુત એટલે જીવંત શાસ્ત્રભંડાર.

મનક !

બહુશ્રુતની પર્યુપાસના આલોક—પરલોકતું હિત કરશો. : ગતિમાં લઈ જશો. તત્ત્વના નિર્ણય ટારા શ્રદ્ધાની શુદ્ધિ થશો. બહુશ્રુત માહાત્માઓનો અદનો સેવક બની. તારું અનંતજ્ઞ કરે. એ જ તારા શાનચાહક પિતાની શુભાશિષ્પ..



## ૨૭. ન તં ઉવહસે મુણ્ઠી



મા બાળકની નબળાઈ પર ક્યારેચ મશકરી કરે ! બદલુ નીકળતી હોય, પસ જરતા હોય એવા પણ દ્વીંને જોઈ ડોકટર મોહું ફેરવી વે છે?

મા તેનું નામ જે વાત્સલ્ય દ્વારા બાળકમાં શક્તિ પેદા કરે, ડોકટર તેનું નામ નિદાન અને દવા દ્વારા રોગ દૂર કરે.

જગતમાં જેટલો મહાન માણસ તેટલો તે સહાનુભૂતિ શીલ. કોઈ પાપાન્માની નબળાઈ પર મશકરી કરનાર, વ્યંગ કરનાર ક્યારેચ મહાન ન બની શકે ?

મનક ! વાત્સલ્યના દાન કરી તારે જગતજનની બનવાનું છે. આત્મગુણોના પોપણ કરી તારે જગતપિતા બનવાનું છે. આત્મગુણોની પ્રાચિન્માં સહાય કરી તારે જગતના ભ્રાતા બનવાનું છે. ઉચ્ચગુણોની પ્રેરણા આપી તારે પ્રેરણામૂર્તિ ભગીની બનવાનું છે. અજ્ઞાનતા અંધકાર દૂર કરી જાનના પ્રકાશ પાથરી તારે જગતુગુરુ બનવાનું છે.

જેને શિરે કર્તવ્ય છે, જવાબદારી છે, તે વ્યંગ કરે, ઉપહાસ કરે, મશકરી કરે કે આશ્વાસન આપે. ઉત્સાહ આપે. સહાય આપે શું કરે ? કહે જોઈ ?

સાધુ એટલે મહાત્મવજ્ઞાની, દેહના ઈંદ્રિયના હુંગરા આડે ફૂયાયેલ આત્મદેવના દર્શન કરનારો. કોઈના પણ ઉત્કર્ષમાં પુણ્યાર્થ અને પુણ્યને જુઓ. કોઈની પણ અવનનિમાં ભવિતવ્યતા અને નિકાયિત પાપનું પરિણામ જુઓ.

સેવા કર્દીક મેળવવા...

ઉપાસના ઈષ્ટ સિદ્ધિ માટે

પર્યુપાસના જ્ઞાનીની કૃપા પ્રાપ્ત કરવા. જ્ઞાનીને શીગવવા.

આલાગણનો પુત્ર એટલે લોહીમાં વિદ્યાના અંસ્કાર. પિતા વેદ  
ચેદાંગ અને આગમ પારગામી છીતાં બાલમુનિ મનાકને બહુશ્રુતની  
પર્યુપાસના કરવાની તો વર્તમાનના આપણા જેવા એ જ્ઞાનીની  
પર્યુપાસનમા કેવા લીન બનાવાનુ ?

બહુશ્રુતની સેવા તને સુખ નાહિ આપે..સુખના સાધનો નાહિ  
આપે. બહુશ્રુતની સેવાથી તને અનુકૂળતા નહીં મળે. પોતાની સુકુમાલતા  
નાહિ પોપાય. બહુશ્રુતની સેવાથી તારા શરીરની નિરોગિતા નાહિ  
જળવી શકે, બહુશ્રુતની સેવાથી તારી કીર્તિ દશદિશામાં નાહિ દેખાય.

પાતુ...સમસ્ત દુનાંકી વ્યક્તિન પાણે માંગવાથી કરગરવાથી વિનાવ-  
વાથી ને નાહિ મળે. ને બહુશ્રુતની સેવાથી મળશે. બહુશ્રુતની સેવા  
આદોકનું હિત કરશે. એટલે પ્રમાદથી દૂર રહીશ. બહુશ્રુતની સેવા  
પરલોકનું હિત કરશે એટલે નાચમાં દુષ્ટ આચરણ, દુષ્ટ વિચાર, ભયંકર  
અંધવસાય પેદા નાહિ થવા દે. બહુશ્રુતની સેવા તને મોક્ષપ્રાપ્તિમાં  
સ્વધારક થશે, મોક્ષ નાહિ મળો ત્યાં સુંદી બહુશ્રુતની સેવાના કાચેણે  
નારા કપાયો અદ્યાત્માવી અનુત્કટ અને અનુભંધ વિનાના થશે. શુભ  
અંધવસાય ભતત રહેશે. આત્મશરૂંગો મોળા પૂર્ણો...સંદગનિમાં  
દર્શિશ...હવે વિચારી કે બહુશ્રુતની પર્યુપાસના કેટલી અદૃગ છે.  
તાડું જીવન કેટલું ધન્ય બનાયો ?

પાતુ — એક વાત ખાસ વિચારવા જેવી છે...કર્દીક બોળા જીવો  
એવું માની બેઠા છે જેને ભાષુંતાં ન આવડે — જેની બુદ્ધિ ના હોય  
તેને સેવા કરવની — ભક્તિ કરવાની પાતુ શાસ્ત્રની રીત અનોખી છે.  
શાસ્ત્ર કહે છે. આગમના અર્થના હંદ્રા સ્પશ્ચી નિર્ણય કરવા છે,  
આત્મસ્પશ્ચી પરિસ્પત્રી પેડા કરવી છે. તેવા જ્ઞાનીને — બુદ્ધિમાનને

તો અવશ્ય ગુરુની સેવા કરવાની. કદાચ ગુરુ અલ્પમતિ હોય કે પણ ગુરુકૃપા હેમેશા જડમતિને મહામતિ બનાવે છે. ગુરુકૃપા કંઈ અલ્પમતિતા દૂર કર્યા વિના રહેતી નથી.

ત્રણે કાળમાં જ્ઞાનના આઈ આચારના પાલન વગર જ્ઞાનીની પર્યું ગાસના વગર જ્ઞાનની પ્રાપ્તિ થાય? જીવનમાં શાશ્વતના રહસ્ય—જ્ઞાનના ઔદ્યોગને સેળવવાનો મનોરથ છે તો પહેલાં બહુશ્રુતની પર્યું પાસનાને જીવનમાં વણી લે. બહુશ્રુતની પર્યું ગાસના જ જ્ઞાન આપી દેશે. ગુરુસેવા દ્વારા મળેલું જ્ઞાન સૂત્ર અર્થના રહસ્ય અને નિર્ણય-પૂર્વકનું હોય. સુવાચિત મોંદા અતાર જેવું છે. જેનું ઓક ટીપું પણ વખ્તને વાસિત કરી પરિમલના પમરાટથી ભરી દે છે.

મનક! હજુ ઓક ભૂલ સુધારી લે. જેની પાસે અધ્યયન કરવું તેની જ સેવા કરવી તે કદાચિનું સ્વાર્થની સેવા પણ બની જય. ગુરુની ય સેવા નહિ થાય અને ગુરુની સેવા પણ નહિ થાય માટે જ બહુશ્રુત માત્રને આરાધ્ય ઉપાસ્ય પૂજય માન-

બહુશ્રુત માત્રનો હું આરાધક—ઉપાસક સેવક દ્વારા મારું ક્રમભાગથી સમસ્ત બહુશ્રુતધારીની સેવા કરી શકતો નથી. પણ આજે હું જે જ્ઞાન પ્રાપ્ત કરું હું તેમાં ભૂનકાળના અનંત બહુશ્રુત મહાત્માની વર્તમાનના અનેક બહુશ્રુત મહાત્માને અને ભવિષ્યના અનેક મહાત્માને ઝેમરી—સ્તવી ઓક બહુશ્રુતનો આરાધના દ્વારા અનંતની સેવા કરીશ. મારું જીવનમાં જ્યારે જ્યારે બહુશ્રુતની સેવાનો વિરલ પ્રગતંગ આવશે ત્યારે હેઠાની અનંત ઊભી દ્વારા સ્વીકારીશ. -

આવું અનોખું વ્રત રાખીશ તો ગુરુનો ઉપાસક બની શકીશ નહિતર સ્વાર્થનો સાધક. તારે બહુશ્રુતની સેવા કરવી છે તો શક્તીય દાયિઓ બહુશ્રુતની વ્યાખ્યા સમજી લે.

બહુશ્રુત ઓટબે આગમવૃદ્ધ, જેમને શુતજ્ઞાનનો ખૂબ અત્યાસ કર્યો છે. આત્માસ અને વાંચન અંદર છે. વાંચન સમય પણ કરવા

માટે પણ થાય છે — અભ્યાસ ગુણ પ્રાપ્ત અથે થાય છે. વાંચનન્દાં સંસ્કાર અલ્પજીવી હોય છે — અભ્યાસના સંસ્કાર સ્થિર થાય છે. શાખના અભ્યાસ કરી શાન્તમય જેમની શુદ્ધિ બની ગઈ છે તેવા બહુશુતને અભ્યાસ હંમેશાં ઉપસ્થિત રહે છે. વાંચનાની વિરમૃતિ થાય છે. આગમ એટલે મુણસૂત્રો જ/ નહિ. સૂત્ર—નિર્યુક્તિ—ભાષ્ય—યૂણી—ટીકા એક આગમ ઉપર ઉપસ્થિત સધળું સાહિત્ય આત્મસાતું કરવું તે આગમ—અભ્યાસ, એક આગમ નહિ અનેક આગમવિદ्—આગમ અનુસાર. મહાપુરુષ રચિત શાસ્ત્રનો પણ વેતા. .તે બધાને જાણે ત્યારે બહુશુત. બહુશુત એટલે જીવંત શાસ્ત્રભંડાર.

મનક !

બહુશુતની પર્યુપાસના આલોક—પરલોકતું હિત કરશે. અને સદ્ગતિમાં લઈ જશે. તત્ત્વના નિર્ણય દ્વારા શક્ષાની શુદ્ધિ થશે. બસ હવે બહુશુત માહાત્માઓનો અદનો સેવક બની. તારું અનંતજ્ઞાન પ્રગટ કરે. એ જ/ તારા જ્ઞાનચાહક પિતાની શુભાશિષ્ય.



## ૨૭. ન તું ઉવહણે મુણી



મા બાળકની નબળાઈ પર ક્યારેચ મશકરી કરે ! બદલુ નીકળતી હોય, પસ જરતા હોય એવા પણ દર્દીને જોઈ ડોક્ટર મોઢું ફેરવી વે છે ?

મા તેનું નામ જે વાતસલ્ય દૂરા બાળકમાં શક્તિ પેદા કરે, ડોક્ટર તેનું નામ નિદાન અને દવા દૂરા રોગ દૂર કરે.

જગતમાં જેટલો મહાન માણસ તેટલો તે સહાનુભૂતિ શીલ. કોઈ પાપાન્માની નબળાઈ પર મશકરી કરનાર, બંગ કરનાર ક્યારેચ મહાન ન બની શકે ?

મનક ! વાતસલ્યના દાન કરી તારે જગતજનની બનવાનું છે. આત્મગુણોના પોષણ કરી તારે જગતપિતા બનવાનું છે. આત્મગુણોની પ્રાપ્તિમાં સહાય કરી તારે જગતના ભૂતા બનવાનું છે. ઉચ્ચગુણોની પ્રેરણા આપો તારે પ્રેરણામૂર્તિ ભજિની બનવાનું છે. અજ્ઞાનતા અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશ પાથરી તારે જગતુગુરુ બનવાનું છે.

જેને શિરે કર્ત્વ છે, જવાબદારી છે, તે બંગ કરે, ઉપહાસ કરે, મશકરી કરે કે આશ્વાસન આપે. ઉત્સાહ આપે. સહાય આપે શું કરે ? કહે જોઈ ?

સાધુ એટલે મહાત્મવજ્ઞાની, દેહના ઈદ્દિયના હુંગરા આડે દૂધા-ઘેલ આત્મહેવના દર્શન કરનારો. કોઈના પણ ઉત્કર્ષમાં પુરુષાર્થ અને પુણ્યને જુઓ. કોઈની પણ અવનનિમાં ભવિતવ્યતા અને નિકાયિત પાપનું પરિણામ જુઓ.

સાધુ કોઈની નભળાઈ પર મશકરી કરે તો સમુદ્ર મર્યાદા મૂકી દે. સહનશીલ પૃથ્વી ખળખળી જિંદે. સૂર્ય ચાદ્ર પણ નિયમિતતા છોડી દે. ધર્માત્માના તપ, ત્યાગ વડે જ પૃથ્વી સિથર છે. સમુદ્ર મર્યાદામાં છે. સૂર્ય ચંદ્ર નિયમિત છે. મુનિ જગતને પ્રૌઢતા અને ગંભીરતા શીખવાડે. જે મુનિ ઉપહાસ્ય—મશકરી કરે તો તેનું જ્ઞાન રીસાઈ જાય. તેથી સાધુતાની શુદ્ધિ અભડાઈ જાય.

સાધુ જીવનમા સ્વાધ્યાય કરતા પહેલાં કાજે લેવામાં જીનેશ્વરની આજ્ઞા જળવાય. જ્ઞાનાચારની શુદ્ધિ થાય. કાજે લેતાં અધ્યવસાયની વિશુદ્ધિએ મુનિને અવધિજ્ઞાન થયું. કેટલું નિર્ગણ અવધિજ્ઞાન...સૌધર્મા-સભાના સૌધર્માવતસ્ક વિમાનના દશ્યો આંખના સામેના પદાર્થની નેમ દેખાય.

એક મુનિએ સૌધર્મેન્દ્રને જાયાં. મુનિ જાનુતા હતા સૌધર્મેન્દ્ર પ્રભુના ભક્ત... જિનશાસનનો અનુરાગી.. શુદ્ધસમકિતી...ઈન્દ્ર સદૈવ ભક્તિમા મસ્ત પણ જ્ઞાનતો પળપળના ભાવો પ્રક્રિયા બતાવે. માળીને જ ખબર હોય કે પાનખરમાં વૃક્ષો કેવા બિગારા ગરીબ બની જાય છે. અને વસ્તોમાં વૃક્ષો કેવાં શીમંત બની જાય છે. શહેરી લોકો વસ્ત જાણે પણ પાનખર ન જાણે.

અજ્ઞાનમાં એક અવસ્થા જણાય, જ્ઞાનમાં અનેક અવસ્થા જણાય.

પેલા મહાત્માને દેખાય છે. ઈદ્રાણી રીસાયેલી છે. સૌધર્મેન્દ્રને કહે છે. તમે ઘોડો બનો. મને તમારા ઉપર બેસવા દો. તો જ મના-મણા—સૌધર્મેન્દ્ર ઘોડો બન્યા. ઈદ્રાણી મનાયા

સંસારના મનામણા રીસામણા મોહના નાટકથી દુર રહેલા મુનિને થયું. વાહ સૌધર્મેન્દ્ર! જેઈ લીધી તારી લડાઈ. અનેક દ્વેષ પર અખંડ આજીશ્વર્ય ધરાવનાર તું પણ ઈદ્રાણીને રમવાનું રમકડું! જ્ઞાનના સ્વામી મુનિ સૌધર્મેન્દ્રની વિવશતા પર મશકરીના ભાવમા હસી પડ્યાં. મુનિ મશકરી સમા હાસ્યથી હારી ગયા અવધિજ્ઞાન મુનિને તાળી દઈ ક્ષણ-વારમાં દુર—સદૂર ચાલી ગયું.

કાજો કાઢતો મળેલું અવધિજ્ઞાન એક મશકરીના હાસ્ય દ્વારા દૂર  
ભાગી ગયું કારણ શું ? જ્ઞાન ગંભીરતામાં રહે. જ્ઞાન દ્વારા આત્મ  
શક્તિના દર્શન કરવાના, જ્ઞાન દ્વારા કર્મના જુલ્મ જાણી તેને દૂર  
કરવાના, ઉપાય વિચારવાના, બૌતિકવૃત્તિમાં હાર ખાતાને બચાવવાના,  
બચાવાય એવું ના હોય ત્યાં કર્મના કે ઉપેક્ષા પણ મશકરી પૂર્વકનું  
હાસ્ય કર્યાંય નહિ.

મુનિ મશકરી પૂર્વક હસે એટલે ને મોહને ત્યાંયો છે તેનો  
પુનાં સ્વીકાર

મુનિ મશકરી પૂર્વક હસે એટલે સાધુવતની વિરાધના.

મુનિ મશકરી પૂર્વક હસે એટલે જ્ઞાનની આશાતના

મુનિ મશકરી પૂર્વક હસે એટલે અજ્ઞાનની સમીપતા.

મુનિ મશકરી પૂર્વક હસે એટલે જગતુત્ત્વનું અયમાન.

હારય અને ઉપહાસમાં બહુ અંતર છે. વિનોદ અને પરિહાસમાં  
બહુ અંતર છે. હાસ્યમાં બીજાની અદ્ભુત શક્તિનો સ્વીકાર છે. બીજાની  
શક્તિમાં આનંદની અનુભૂતિ છે. ઉપહાસમાં પારકાની નબળાઈનો ધીમો  
નિરસ્કાર છે. બીજાની નબળાઈમાં ખુશી માનવાની ખરાબવૃત્તિ છે.

મહાભાગ ! ચારિત્ર તને મોહનીય કર્મના ઉદ્યે મળ્યું કે કયો-  
પશ્મમથી ? પથાખ્યાત ચારિત્ર કયા કર્મના કયથી મળશે ? જરા વિચાર—  
તું ઉપહાસ કરે કોને સન્માને છે ખબર છે ? અજ્ઞાનને—મોહને ? મોહ  
તારા જ્ઞાનને ભગવાવી દેશે. નેમ પવન ધનઘોર ધટાને વિઝેરી નાખે  
છે તેમ મોહ તારા જ્ઞાનને કણવારમાં વિઝેરી નાખશે.

બોલ, તું જ્ઞાન—દર્શન—ચારિત્ર ડૃપ રલ્નત્રયનો સાધક કે  
વિરાપક ?

ભલા ! કોઈની નબળાઈ પર ઉપહાસ કરવો એટલે અનંત  
શક્તિના સ્વામી આત્મદેવનું અયમાન તારી ખુદની જત પોથા પંહિત

છે. તેનું પ્રદર્શન સાચે તારું ધર્મ અને ધર્મનું જ્ઞાન અપૂર્વા હોય તો તું કોઈની મશકરી કર, ટોઝખળ કર,

સાચો જ્ઞાની અહાનુભૂતિ આપે, આશ્વાસન આપે, ધોર્ય આપે, કોઈની નબળાઈ ઉપર ઉપહાસ ના કરે તો તું સાધુ.

સજજન માણસ તેનું નામ કે કોઈનું અંગ ઉધાડું હોય તો દાંકે. પણ સજજન કોઈંદિ કોઈના ઉધાડા અંગ ગર અંગળીના ચીંધે એ બધા વાનરવેદા દુર્જનના.....

તું સાધુ જગતનો અર્વાશોઠ સજજનુ ! તોતડા બોખડાને બોલતાં ચાંબળે તેના મુખના આકારો, હાથના ચાળા, ત....ત....પ....પ....પ...દેખીને તને હસવું આવે કે જ્ઞાનાવરણીય કર્મનો ભયંકર જીલ્લમ દેખાય. બિચારાએ કચા જન્મમાં આવું તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધું હશે ? લાવ તેને જ્ઞાનની આરાધના બતાવું. કેટલાક સજજનો ઘરે બેઠા કેટલાયને દિવા પહોંચાડે છે. તો હું મારા પરિચયમાં આવેલાનો અજ્ઞાનરોગ દૂર ના કરે ? આ લાવ થાય કે વિપરીત—જે તને હસવું આવે છે તો સમજી લેને એ ચેપીરોગના કીટાણું તને વળ્ણા, જેથી તે ધૂણા કરી. મશકરી કરી તો તોતડા બોખડાપણાના રોગને તે આમંત્રણ આપી દીધું. આ જન્મમાં નહિતર કોઈ જન્મમાં પણ એ રોગનો ભયંકર હુમલા તારી ગર થઈ જશે. લદા...સાવધ થા...

મનક ! તું તીર્થંકર પરમાત્માનો સાધુ, તને પ્રથમથી જ ઓદ-ગ્રિકભાવ, જ્યોપશમભાવ, જ્ઞાયિકભાવ, પાચિયુભિકભાવ સમજવત્તમાં આવેલા છે. જ્યોપશમભાવ ઓટલો વિચિત્ર છે. જ્યારે તેની દુનિઃ લથે, શુદ્ધિનો પ્રકર્ષ હશે ત્યારે છભસ્થ છિતાં તું શુન્તજ્ઞાનના અહારે કંઈક અંશે ડેવજ્જાની સમાન જગતુ તરવને જાપું શકીશ. પ્રતૃપી શકીશ. પણ જ્યોપશમ ઓકદમ ચામાન્ય થઈ જશે ત્યારે તારી જાતને પણ ઓળણી શકીશ નહિ. તારા નામને પણ જ્ઞાનળી શકીશ નહિ. કદાચ રોગની દેશી અસર મગજ ગર નહિ થઈ હોય તો સમજ બધું શકીશ ગણ એક ગાંધર બોલવાની શક્તિ તારી પારો નહિ હોય.

કહેવાય છે કોઈ બંગલાનો એક લેખક હતો. જેને પોતાનાં  
પુસ્તકનો સાહિત્ય અકાદમીનો એવોઈ મળ્યો છે. એવોઈ કંઈક બાર  
વર્ષો મળ્યો. શહેરના અનેક વિદ્યાનો તેનું સંમાન કરવા આવ્યા. ત્યારે  
ખબર મળ્યા. બાર વર્ષથી તે સાહિત્યકાર સૂનમૂન છે. અનંત આકા-  
શાને તાકતાં એક જ જગ્યાએ બેસી રહે છે. કેવી લયંકર છે ક્ષ૟ો-  
પથમની વિચિત્રતા...આજનો જ્ઞાની આવતી કાલનો દયાનો પાત્ર.

ભાપા શાખનો નિષ્ઠાત, જ્ઞાનવિજ્ઞાનનો પારગામી ચૌદ્ધૂરી  
પણ જે તેતદાય. તેની પણ વાણી અવલદ્ધ થાય શબ્દ વચન લિંગ  
કાળ વિભક્તિનો વિપર્યાસ થાય તો પણ ઉપહાસ ન કરાય, મશકરી  
ન કરાય.

કોઈની ભૂલ કાઢવી તેમાં કરુણાભાવ છે. પણ કોઈની ભૂલ ઉપર  
ઉપહાસ કરવો તે કુરભાવ છે. ભૂલ સુધારવામાં જ્ઞાનાવરણીય કર્મની  
.નિર્જરા. કોઈની ભૂલ ઉપર મજાક કરવામાં અજ્ઞાન અને મોહને  
આવકાર.

પ્રભો ! અમે અજ્ઞાની, ઘણીવાર ઉપહાસ કર્યા. અમારી ભૂલ  
પર નહિ. બીજાની ભૂલ પર તેમાં પણ તોતડા બોબડા બહેરા મુંગાની  
ખૂબ મજાક રી કોઈ વિદ્યાન કોઈ જ્ઞાનીના વ્યાખ્યાનમાં ભાપા ફરુક  
થયો બસ પછી તો કેટલાયે દિવસ સુધી તેની પઢી ઉતાર્યા કરી પણ  
આજે ઉપહાસ કરીએ છીએ. અમારા અજ્ઞાન પર રે પામર 'કોઈની  
મશકરી તો થઈ કે નહિ પણ તારા જ્ઞાન અને ચારિતનો ઉપહાસ  
દ્વારા તે કુર પરિહાસ કર્યો. મહાત્મા મનકના જેવો ઔદાસીન્ય ભાવ  
અમને પણ આપો. અમને પણ તારો. ઉદ્ધારો ગુરુદેવ ! અમે  
ઉપેક્ષા યોગ્ય નથી. આપની કરુણાના પાત્ર બનાવો.



## ૨૮. ગુરુપસાયાલિમુહે રમેજજા



ધનનો અભિલાષી ધનિકની સેવામાં તત્પર રહે.  
વિદ્યાનો અભિલાષી વિદ્વાનની સેવામાં સ્થિર બને.  
મોક્ષનો અભિલાષી ગુરુ સેવામાં તત્પર બને.

આ ત્યાગ પ્રધાન ભારતીય સંસ્કૃતિ છે. રાજ મહારાજઓ પણ વિદ્યા મેળવવા માટે ગુરુને પ્રસન્ન કરે ભારતીય જ્ઞાન ધનથી ના મળે... જ્ઞાન સત્તાથી ના મળે જ્ઞાન તો ગુરુની કૃપાથી જ મળે.

પણ એક સત્ય ના વિસરતો... આ સંસ્કૃતિમાં આ શાસનમાં ગુરુદેવો કચ્છારે પણ સત્તાની શેહમાં તળાયા નથી. સંપત્તિના એમને કોઈ મૂલ્ય નથી. ખુદના દેહની માયા નથી એટલે સેવા શુદ્ધિપાની અભિલાષા નથી. પાત્ર જુઓ તો હેઠાનાં હીર આપી દે. ખુદનો પુત્ર હોય પણ આપાત્ર દેણે તો તેને પણ જ્ઞાન ના આપે..

ગુરુજનો નિરાણા છે...નિરાલિમાની છે..નિરાલિ છે..ફક્ત તેમના હેઠામાં શાસન કાને સુયોગ્ય આત્માની જંખના હોય છે. ગુરુ સુયોગ્ય આત્માને જુઓ એટલે સુયોગ્ય શિષ્યને કલ્પનાથી પણ અધિક જ્ઞાન આપી દે. પણ ગુરુ જુઓ જ્ઞાન બાદ તેનામાં શું આવ્યું? ગંભીરતા. પ્રોઢતા... ઉદારતા... અકૃતૂહલવૃત્તિ... સમભાવ આ ગુરુએ ન જૂઓ તો વિદ્યાના દાન બંધ..

જુભુદ્ય !

મોક્ષની અભિલાષાએ માતા પિતા છોડયાં... સમસ્ત સંસારને લાન મારી.. ત્યાગના કંટક ભર્યા માર્ગ ચાલ્યો.. કંચન અને કામિની

છોડયા. પણ... હવે કીર્તિની આશા, નામની લાવસા તારા મનમાં  
ઉદ્યમાત મચાવે છે. પ્રભુના શાસનમા તપ, ત્યાગ અને ધ્યાન કરવાનાં  
તો તદ્દન વાત સાચી છે.— બરાબર છે. શાસ્કની આજ્ઞા મુજબ ચાલ-  
વાનું તે વાત પણ બરાબર... ગુરુની નિશ્ચા જોઈએ તે પણ બરાબર ..  
પણ... જીંદગીભર નાના મોટા પ્રત્યેક કાર્યમા ગુરુની મહેરભાની...  
ગુરુની કૃપાનો જ વિચાર કર્યા કરવાનો?

અમારી પણ ઉમર વધે છે તેમ અનુભવ પણ વડ્યો. હવે તો  
થાડી વિચારવાની શક્તિ આવે.. જીંદગીભર કોઈ નિર્ણય ન કરીએ તો  
અમારી નિર્ણયશક્તિ પણ મુરજાઈ જાય ને? ગુરુને અમને શાસ્કો  
ભાગાવ્યા છે. કોઈ પ્રશ્ન—સમસ્યા આવશે તો જોઈ લઈશું.. ઇતાં ય  
નાખ સમજાય તો ગુરુને પૂછી લઈશું.. ગુરુ કંઈ ઓછા રીસાળ છે  
કે અમને સહાયક નહીં બને.! પણ જીંદગીભર ગુરુકૃપા તરફ તાકયા  
કરવું એ તો કેવી રીતે થાય?

અમનો યુગ અલગ.. અમારો યુગ અલગ

અમની બુદ્ધિ અલગ.. અમારી બુદ્ધિ અલગ...

અમની સમૃતિ અલગ.. અમારી સમૃતિ અલગ...

અમની શિષ્યસંતતિ અલગ પ્રકારની... અમારી શિષ્યસંતતિ  
અલગ પ્રકારની.

અમના ભક્તો અલગ પ્રકારનાં અમારા ભક્તો અલગ પ્રકારના...

દરેક બાબતમાં અમે જો તેમનું અનુકરણ કરીએ તો અમે નામ-  
શૈપ ન થઈ જઈએ?

ગુરુજીનું પુણ્ય કર્યાં? અને અમારું પુણ્ય કર્યાં?

અમે અમારા પુણ્ય મુજબ અમારું જીવન ગોઠવીએ... ગુરુની  
કૃપા જોઈએ.. એ વાત સાચી પણ જીંદગીભર. ગુરુકૃપા તરફ જ  
જોવું એ કેમ બને?

અરે સાધક આત્મા !

આવા તો તારા એક નહિ એકેતેર પ્રશ્ન હોઈ શકે ! એક નહિ તારી પણ લાખો સમયા હોઈ શકે ! પણ...એકવાર તું સાચો જવાબ આપ. સાચે જ તરે મોક્ષ જોઈએ છે ? શાશ્વત સુખ જોઈએ છે ? તો ભલા સંભળ...

મોક્ષ ગુરુકૃપા વગર ના મળે..નારી પાસે નારા પ્રશ્ન છે તો હવે તું શાંતિથી ગુરુકૃપાના મીકાફણને પણ વિચાર...

ગુરુકૃપા દ્વારા બુલિ જ નહિ, નિર્ગીળ બુલિ વધે છે.

ગુરુકૃપા દ્વારા સમૃતિ જ નહિ સાથે સ્વાધ્યાય શક્તિ વધે છે.

ગુરુકૃપા દ્વારા જડની રૂચિ ધટે છે .તન્વરૂચિ પ્રગટે છે.

ગુરુકૃપા દ્વારા રાગીની મમતા ધટે છે. વીતરાગની મમતા જગે છે.

ગુરુકૃપા દ્વારા અવિવેક નાથ થાય છે.. વિવેક પ્રગટે છે.

ગુરુકૃપા દ્વારા મિથ્યાત્વ નાથ થાય છે...સમ્યકત્વ પ્રગટે છે.

ગુરુકૃપા દ્વારા અજ્ઞાન ભાગે છે. જ્ઞાન લાધે છે.

ગુરુકૃપા દ્વારા સંસાર અકારો લાગે છે...સંયમ ખારો લાગે છે.

ગુરુકૃપા દ્વારા પ્રમત્તાભાવ નાથ થાય છે..અપ્રમત્તાભાવ પેદા થાય છે.

ગુરુકૃપા દ્વારા દુર્ભાગ્યનામકર્મ દૂર થાય છે. સૌભાગ્યનામકર્મ પેદા થાય છે.

ગુરુકૃપા દ્વારા પુણ્ય પ્રબલ થાય છે. સર્વસાનુકૂળ જંયોગો પ્રદક્ષિણા દે છે .

ગુરુકૃપા દ્વારા યશકીર્તિનામકર્મ ઉદ્યમાં આવે છે...અને સમર્પિત ભક્તો મળે છે.

ગુરુકૃપા દ્વારા આદેયનામ કર્મ પેદા થાય છે. સુવિનીત શિષ્યો મળે છે.

ગુરુકૃપા દ્વારા પરાધાત નામકર્મપેદા થાય છે...અને તે શાસન-  
પ્રભાવનમાંથી સહાયક બને છે.

ગુરુકૃપા દ્વારા આત્મગવેપક બનાય છે અને...

આત્મોનતિની જંખના જગે છે.

ગુરુકૃપા દ્વારા સાધનામાં સફળ થવાય છે અને સિદ્ધિ મળે છે.

ગુરુકૃપાની ચાહના પ્રશસ્ત ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની સહાયથી થાય છે. ગુરુકૃપાની પ્રાપ્તિ થતાં પ્રશસ્ત ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ સાથે સૌભાગ્યનામકર્મનો ઉદ્ય પ્રાપ્ત થાય છે. ગુરુકૃપાની પ્રાપ્તિમાં આત્મક્ષોભયતા સાથે પુણ્યનો પણ સાથ જોઈએ જ્યારે ગુરુકૃપાની તત્પરતામાં આત્મક યોગ્યતાની જરૂર છે. સાધક તો પુરુષાર્થી છે. પુરુષાર્થી હારે પણ નહિ...થાકે પણ નહિ..

‘આ દુનિયામાં કોઈ વિદ્યા..કોઈ મંત્ર .કોઈ સિદ્ધિ એવી નથી કે જે ગુરુકૃપા દ્વારા ના મળે...

આધ્યાત્મિક દુનિયાનું ગણિત અલગ છે. ત્યાં તો ગુરુકૃપાની જંખના ન જગી ત્યાં સુધી માયાવી...કૃપટી...

આધ્યાત્મિક દુનિયાનો એકડો ગુરુકૃપાથી જ પ્રારંભ થાય.

ગુરુકૃપાની જંખના એટલે.. લીતરાગને સમર્પિત, શાસનકાજે સર્વસ્વ સમપીં ચૂકેલ શાંત...મહાશાંત... દીર્ઘ સંયમી. મહાશાની .. આધ્યાત્મિક. મહાસાધક મહાત્માના ચરણે વિનંતિ...

આપ સમસ્ત વિશ્વના તન મનનાતાપ હરે તેવા કલ્પવૃક્ષ છો. અમે કલ્પવૃક્ષના બની શકીએ ..પણ કલ્પવૃક્ષની છાયાના પિપાસુ મુસા-ફર બની શકીએ. આપ કલ્પવૃક્ષ છો તેથી આપની છાયામાં જે સંકલ્પ કેરોણું તે સિદ્ધ થશે. સફળ થશે. અમે પણ મોકના અભિ-લાધી છીએ. આપ તેના આમ્નાય વિદુ છો. સફળ મંત્રવિદુના સાંનિધ્યમાં સાધના વગર મંત્ર સફળ થાય તેમ આપના સાંનિધ્યમાં સહજ અનાયાસે મોક પ્રાપ્ત થાય ..

મારા માન કપાયને કાબૂમાં લાવીશે...માન કાબૂમાં આવશે...  
નમ્રતા નિત્ય સહયરી થણો.. પછી આપની કૃપા જે...મારી ઈચ્છા ..  
જ ખના .એપણા.. અભિલાપા બનશે. કબૂલાત કરું દ્યું કરું ઈક ભૂલ  
થઈ હોય તે અહેંતા કારણે.. હવે હું ‘અહે’ અને ‘મમ’ કારણું  
વિસર્જન કરીશ. ચાતક જે આતુરતાથી મેધને જૂયો.. તેના કરતાં  
અનેક ગુણી અભિલાપાએ ગુરુકૃપાને જંખીશ. સમજાય છે ગુરુકૃપા  
આગળ સમગ્ર વિશ્વની સપત્તિ તુચ્છ છે.

ગુરુદેવ ! તાકાત આપો. સારા યે વિશ્વની અભિલાપાને  
તિરસ્કારવાની.

ગુરુકૃપાના ચાહુક એક શિષ્યને ગુરુદેવ ‘આચાર્યપદ’ અપ્સુ  
કરી રહ્યા હતાં. કિયા પ્રારંભાઈ સભા શિષ્યને નિહાળી રહી હતી ..  
અને શિષ્ય ગુરુદેવને નિહાળી રચા હતાં. ગુરુદેવ ભાવિને નિહાળી  
રહ્યા હતાં. ગુરુદેવના મુખની રેખા તંગ થવા લાગી...કાનની બૂટ  
લાલ થઈ ગઈ... ખુલ્લી મુઠી બંધ થવા લાગી. જણો...અજાણો હોઠ  
કુફુડવા લાગ્યા. શિષ્યથી આ સહન ન થયુ. શિષ્ય બાળકની જેમ  
દોડ્યા ગુરુચરણમાં ઝૂક્યા. અંસુથી ગુરુના ચરણ પ્રક્ષાલ્યા .

ગુરુદેવ ! મારે પદ ના જોઈએ. મને આપની કૃપા જોઈએ.  
શ્રીને મારે હારવું નથી...બસ આપના ચરણોપાસકપાણું મારે મન  
સર્વોત્તમ છે.

ગુરુદેવ ! ગુરુદેવ !

આપ આ બાલક પર નારાન/ કેમ ?

વત્સ ! તારું પુણ્ય પ્રબળ છે!

ગુરુદેવ ! ગુરુદેવ ! ઓ મારા ગુરુદેવ !

એવું ના બોલો. મને ના રહાવો.. પુણ્ય ‘મારું’ પણ, કૃપા તો  
આપની જ ને. ?

## ગુરુદેવ ! ગુરુદેવ !

આપતો તારક છો...રક્ષા છો..રક્ષા કરો ભવભવથી...મને આપો  
જુંદગીભરના છ વિગઈના ત્યાજનો નિર્યામ ..ગુરુ હારી ગયા...આપ  
જતી ગયા ..મને આપો આપની અનુગમ ભાવના..

પૂ. શાખાભવસૂરિ મહારાજે બાલમુનિ મનકમાં નાની ઉમરમાં  
મોક્ષની અભિલાપા પેદા કરી. અને મોક્ષાભિલાપને પૂર્ણ કરવા ગુરુ  
કૃપા સુન્મુખ કરી દીધા...અમને શક્તિ આપો.

સૂર્યમુખીનું કૂદ સૂર્ય જે દિશામાં ફરે. જે દિશામાં સૂર્ય જાય  
તેમ ફરે, તેમ અમે પણ તેની જેમ ગુરુકૃપા...પ્રસન્નતા જે રસ્તે મળે  
નેને અનુસરીએ...ઓવા વરદાન આપો.

ગુરુના વરદાન શિષ્યના અરમાનને સહૃદાય કરયો.



## ૨૬. અણુંતનાણોવગાઓ વિ સન્તો

જગતમાં અજ્ઞાની મર્યાદાનો લોપ કરે,  
પૂજયની પૂજાનો વ્યતિકમ તુચ્છવૃત્તિવાળો કરે,  
પણ સાચો જાની કયારે પણ મર્યાદાનો લોપ ના કરે... પૂજયની  
પૂજાનો વ્યતિકમ ના કરે.. તુચ્છવૃત્તિતા ના કરે ...

અજ્ઞાની, અલ્પજ્ઞાની, મૂર્ખ જિંદુની પ્રાતિમાં સિંહુની પ્રાપ્તિ  
સમજી લે... અને માને હું કંઈક હું, ત્યારે જ્ઞાનીને જેમ જ્ઞાન પ્રાપ્ત  
- થાય તેમ નમ્ર - વિનમ્ર શાંત બને. ગુરુચરણનો ઉપાસક બને. તેને થાય  
ગુરુદ્વારા પ્રાપ્ત ન થઈ હોત તો આ રહસ્ય કયાંથી પ્રાપ્ત થાત. સાચે  
ગુરુએ મારા પર કૃપા કરી તો જ્ઞાન મળ્યું, પણ જે જ્ઞાન પ્રાપ્ત થયા  
પછી અતિમાન આવે તો કહેવું પડે - આ તો દવાથી દદ વધ્ય.  
જ્ઞાન તો સર્વમદહર છે. .... જ્ઞાન મેળવીને માન પછી કોઈ દવાથી  
તેનું દદ દુર થાય નહિ, અભિમાન ઓ તો ભયંકર રોગ.

અભિમાનનો રોગ ગુરુસેવાના અભાવે થાય છે.

અભિમાનનો રોગ પૂજયોની ભક્તિના અભાવે થાય છે.

મનક ! તોએ ગુરુ સેવાથી ધન્ય બનવાનું, ગુરુટેવોની ભક્તિથી તારે  
આત્મક શક્તિની અભિવૃદ્ધિ કરવાની, પણ તારો પ્રક્રિયા રહેશે ભક્તિ  
કરું પણ તેની મર્યાદા તો હોવી જોઈએ ને ?

બધા કાર્યમાં સમયની મર્યાદા પણ ભક્તિમાં સમયની મર્યાદા નહિ  
... કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તો પણ ભક્તિ છોડવાની નહિ. “ અણુંત-  
નાણોવગાઓ વિ સન્તો ” ભક્તિ જ્ઞાન મેળવવા કરવાની પણ જ્ઞાન મળી  
જાય એટલે ભક્તિ છાડી નહિ દેવાની. કારણ તું ગુરુપદ ભક્ત-ગુરુનો

સેવક, હવે ભક્તિ તો તારું વયસન બની ગયું, ભક્તિ વળર તને ચેન ના પડે. ભક્તિથી કંઈ પ્રાપ્તિની પણ જંખના ચાલી ગઈ.

ગુરુપદ ભક્તિ તું નિરીહ બનીને કર. નિર્સમૃહ બનીને કર, ફરૂત પૂજય છે, ઉપાસ્ય છે, આરાધ્ય છે.—હું સેવક છું, ભક્ત છું, માટે ભક્તિ કરું છુ.

જે ગુરુકૃપા દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે ગુરુની ભક્તિ કેવલજ્ઞાની બન્યા બાદ પણ કરવાની તો મનક વિચાર, આપણે ગુરુભક્તિ કેવી રીતે કરવાની? કેના માટે કરવાની? આ ભાવો વિચારવાની જરૂર છે.

ગુરુની ભક્તિ આપણામાં નમૃતા પેદા કરવા, મહાગ્રતોની શુદ્ધિ કરવા, આત્માની ઉન્નતિ કરવા, ચારિત્રધારી અનુમોદના કરવા, આશાનાપેદનીય કર્મ હટાવવા, થાસનસેવક બનવા, શાસનરક્ષક બનવા, શાસનપનિ બનવા કરવાની છે.

બોલ તું તારી પ્રગતિને—તારી પ્રતિષ્ઠાને—તારી શાશ્વત ક્રીતિને જંખે છે તો આ ભાવોથી ભક્તિ કરવાની.

જ્યાં પોતાની કંઈક પ્રાપ્ત માટે સાધના થતી હોય ત્યાં દિવની ઉર્મિ કેવી ઉછ્છે?

જગતમાં બધા શાસ્ત્રો બધાને શીખવા પડે પણ માતાને વાત્સલ્યના પાન કેવી રીતે કરાવવા તે શાસ્ત્ર શીખવા જવા પડે? માને પણ કો વાત્સલ્યશાસ્ત્ર ભણું પડે તો તે સંગી મા નહિ ..... સાવકી મા. મા એટલે જ વાત્સલ્ય શાસ્ત્ર તેમ શિષ્ય એટલે જીવંત ભક્તિયોગ. તેને વળી ભક્તિનું શાસ્ત્ર ભણવા જવું પડે? ગુરુની પાંજે રહી ગુરુનું જ્ઞાન મેળવી તેમની ઈચ્છા—આશા—અલિલાપા—અભિપ્રાય સમજી ગયેલ શિષ્ય ગુરુની અંતરિક વૃત્તિને જાણે તો ગુરુની શારીરિક પ્રકૃતિ ના જાણે એ કેમ બને?

અમારા પૂ. ગુરુદેવ પાસે જ્યારે ગુરુદેવની વાત નીકળે ત્યારે આંખોમાં અશ્રુ સાથે અંજલિ જોડી નત ભરતકે ગુરુદેવ બોલે ભાઈ ! મારા તો એવા સદ્ગ્રાહ્ય કે મને તીર્થંકર સદૃશ ગુરુ મહારાજ મળ્યા હતા. તેમના હૃદયના એક ખૂણામાં સ્વાર્થ નહિ, માયા નહિ. તેથી જ ગુરુદેવની જેવી આંતરિક પ્રકૃતિ તેવી બાધ્ય પ્રકૃતિ. આહાર-નિહાર જધું નિયમિત દરેકમા સાત્ત્વિકવૃત્તિના દર્શન થાય. પૂ. ગુરુદેવ જ્યારે જ્યારે તારકની વાત કરે ત્યારે લાગે જામે પૂ. શ્રીને ગુરુદેવેશજ દેખાય છે અને બોલી રહ્યા છે.

સાચા ગુરુભક્તને મન ગુરુના દેહનો વિયોગ સામાન્ય ચીજ છે, પણ ગુર્વાજ્ઞા દ્વારા ગુરુભક્તિ સર્વોવ કરાશીય છે.

સાચો શિષ્ય ગુરુભક્તિ દેહભક્તિમાં સીમિત ના કરે. પણ આવા-પાલન રૂપ ભક્તિ દ્વારા ગુરુભક્તિને અત્યંત વિસ્તૃત કરે. તેનું ગુરુભક્તિનું જોત્ર વિશ્વાણ બને ભક્તિના માર્ગો વિવિધ બને.

સાચા શિષ્યને ખુદના નિષ્કલંક ચારિત્ર પાલનમાં પણ ગુરુભક્તિના દર્શન થાય. સાચા શિષ્યને સુપાત્રમાં પણ વાત્સલ્યવહાનતા ગુરુભક્તિના દર્શન થાય.

કાઈ કહે આ શુ ? સાચો શિષ્ય કહે ભાઈ હું તો દોડ જેવો હતો—કપાયો મારા સંયમને દુપિત કરતાં પણ ગુરુદેવના વાત્સલ્યે મને સાધુ બનાવ્યો. આ આત્મા પણ ધ્યાન બનશે. સાચા શિષ્યને પ્રત્યેક સફળતામા ગુરુભક્તિના હૃળ દોખાય. તેવો શિષ્ય શું જ્ઞાની બને, વિદ્વાન બને, વ્યાખ્યાનકાર બને, ગ્રંથકાર બને—વાદી બને—શાસન પ્રભાવક બને તો ગુરુનીભક્તિ બૂલે ? ના. ના. જેમ જેમ વ્યક્તિત્વ વિકાસ પામે તેમ તેમ કપાયો અહ્વય થાય. સદ્ગુણોની અભિવૃદ્ધિથાય. સદ્ગુણો સંત્સર્ગમાં રાખે કે અસંત્સર્ગમાં ? સદ્ગુણો જ્ઞાનીની ઉપાસના કરાવે કે અજ્ઞાનીની ?

અજ્ઞાનના કારણે આશય ના સમજય... અજ્ઞાનના કારણે આશાતના થઈ જાય... પણ જ્ઞાન જેમ અભિવૃદ્ધિ પામે તેમ સૌના આશય—

અભિપ્રાય સમજવાની શક્તિ આવે, તો હિતકારો—ઉદ્ઘારક—તારક ગુરુદેવનો અભિપ્રાય કેટલો સમાચય? જ્ઞાન ગુરુદેવના હદ્યના દર્શન કરાવે તેથી જેમ જ્ઞાન વધે તેમ ગુરુ સેવા ગુરુભક્તિની અભિવૃદ્ધિ થાય.

જો જ્ઞાન પ્રમ થયા બાદ ગુરુભક્તિ ધટે તો સમજવું જ્ઞાન નહિ પણ ભળતું જ કંઈક મેળવ્યું...

આર્યા મૃગાવતી ચંદ્રનભાવાએ ઉપાલંભ આપ્યો. આર્યા મૃગાવતીએ ગુરુના ઉપાલંભને સિદ્ધશૈલ આરોહણની તળેટી બનાવી અને કેવલજ્ઞાની બન્યા. પણ ગુરુ સાનિધ્ય—ગુરુ સેવા ના છોડયા. નિદ્રાધીન ચંદ્રનભાવાના દેહની ભક્તિમાં કેવલજ્ઞાની શિષ્યા રત રહ્યા. કેવલજ્ઞાની પણ ગુરુના દેહની ભક્તિ ના ચૂકે. ધનધોર રાત્રિમાં સાવ આવ્યો. અનંતજ્ઞાની શિષ્યાએ નારકના હાથને સર્પથી દૂર કર્યો. શા માટે? આ મારા તારક હતા, ઉદ્ઘારક હતા—આ ગુરુના ઉપાલંભે મને કેવલજ્ઞાન આપ્યું.

લોકોએતર જ્ઞાનીની વ્યવહાર પણ સર્વોશ્રોતું હોય.

આપણા જેવાનું ચારિત્ર જહાજ અવિનય—ઉદ્ઘતાઈ—કૃપાયની ભંવરીમાં ક્રયાંય અથડાઈ ના જય તે માટે મહાપુરુષોના જીવન વ્યવહાર દીવાદારી સમાન હોય છે.

અનંતજ્ઞાનીને હવે કોઈ પ્રાપ્તિની જાખના નથી, કોઈ અવગુણ દૂર કર્યાના નથી. છતાં ગુરુપ્રદની ભક્તિ..જેમ નદીમાં કંકર નાંખો, પ્રથમ તરંગ તમારા કંકરથી પણ પદ્ધો એક તરંગમાથી બીજ નરંગ સહસા—ભક્તિ દ્વારા કેવલજ્ઞાન મેળવ્યું છે એટલે કેવલજ્ઞાન બાદ પણ સહજ સ્વભાવથી ભક્તિનું આચરણ થઈ જય છે.

મનક! ભક્તિ જ્યારે તારે સ્વભાવ બની જશે ત્યારે તને ગુરુસાથે અભેદભાવ સિદ્ધ થઈ જશે. ભક્તિ લોકલોકપ્રકાશી જ્ઞાની સ્વીચ છે.

ભક્ત અને ભગવાન અલગ હો દેહભાવની દિલ્લિઓ....

શિષ્ય અને ગુરુ અલગ હો શારીરિક દિલ્લિએ.

બાકી સાચી ભક્તિ દ્વારા શિષ્ય ગુરુના આધ્યાત્મિક સ્થાનો અનુભવ કરે છે—ગુરુના રવભાવના—જીવનના શિષ્યમાં થાય છે.

પ્રભુના શાસનમાં ગુરુ મહામર્યાદાશીલ છે, તપચૂલીનો પા વિનય કરે છે. શાસન પ્રભાવકને પણ સંભાળી લે છે.

તો અનંતજ્ઞાની પાસે સેવા—શુશ્વપા કરાવે ? ન કરાવે શિષ્ય તો અનંતજ્ઞાની બને તો પણ સેવા ના છેડે.

બસ મનક !

ગુરુભક્તિ દ્વારા અનાદિના ધાતીકર્મને હટાવ. તને જ્ઞાની મને મજા નહિ આવે પણ ગુરુભક્ત કહેવામાં અતિપ્રસંજ્ઞતા પે છું તારી પાત્રતા જેવા માંગુ છું. પાત્રતા વિકસિત કરવા ઉપદે છું. તારી પાત્રતા સહજ વિકાસ પામો.

ગુરુદેવ !

મહાત્મા મનક ગુરુભક્ત જતા. તેથી તો પળનો એ વિલ વગર આપને ચરણે સમર્પિત બન્યા અને સાધુ બની ગ્રહણ આસેવન શિક્ષા પ્રાપ્ત કરી. સાધનામાં સ્થિર બન્યા

અમે માન—સન્માનનાં ગેલમાં ન આવી જઈએ, તેવા આપો. એ વરદાન મલથે તો એ ગુરુપુદ ભક્ત બની શકીશું. ભક્ત બનીએ તેવા આશ્રિપ આપો.



## ૩૦. તેસિં સિકુખા પવર્કૃતિ



આધ્યાત્મિક દુનિયામાં આગળ વધેલો શુક્લધ્યાનના સહારે અંતમુહૂર્તમાં કેવળજ્ઞાની બની શકે છે...પણ શ્રુતજ્ઞાન તો તેના નિયમના આધારે જ આગળ વધે છે.

મનક ! આ દુનિયામાં અજ્ઞાની અથડાય છે. જ્ઞાનના અભાવે કારમા ક્રપાયો કરી વૈરાનુભંધ કરે છે. તેથી જીવનમાં જ્ઞાનની અતિ અગત્યતા છે. જ્ઞાનનો પિપાસુ બનતાં પહેલાં એક આ સૂત્ર ગોખીલે...

વિનય વગર, નમૃતા વગર, સેવા વગર ગ્રહે કાળમાં જ્ઞાન પ્રાપ્ત નહિં થાય.

પુસ્તકની માહિતી જુદી છે અને જ્ઞાન જુદું છે.

પુસ્તકની માહિતી ગર્વ પેદા કરે છે.

જ્ઞાન પાપથી પીછેઠં કરાવે છે.

બોલ તારે પુસ્તકનો કીડો બનયું છે કે જ્ઞાની બનયું છે ? સાથું પુસ્તકનો કીડો ના હોય, સાથું જ્ઞાનનો ઉપાસક હોય.

જ્ઞાનના ઉપાસકના બે અસિધ્યારાપ્રત છે. બે અસિધ્યારાપ્રતના કંદોર પાલન વગર જ્ઞાનના દર્શન પણ દુર્લભ ! બે અસિધ્યારાપ્રતના પાલનદ્વારા જળથી સીંચેલા પુષ્કો નેમ નવપદ્ધતિ થાય તેમ તારું જ્ઞાન અનેરું વૃદ્ધિ પામશે ! નહિં ભાગેલા શાસ્ત્રના પદ્ધાર્ય—રહસ્યો ઓમને એમ ઉકલી જશે ! તને લાગશે આ તો ગઈકાલની વાત જેણું શાસ્ત્ર યાદ રહી ગમું છે.

મનક ! મારા મનક !

દું તારો મોહી પિતા નથી, દું તારો ત્યાગી ગુરુ છું મોહી શરીરને જુઓ, ખુશીને જુઓ. સુકુમાલતાને જુઓ.

ત્યાગી આત્માને જુઓ, આત્માની ઉન્નતિને જુઓ, શાશ્વત પ્રગતિને જુઓ, કહું પણ સત્ય તને સમજવાનું પડશે.

મનક ! તારે જ્ઞાન પ્રાપ્ત કરવું જી જેઈએ...તારું જ્ઞાન “દિન દોગુણા રાત ચોગુણા” ની જેમ વધવું જી જેઈએ. તારા જેવા રંસાર ત્યાગીનું જ્ઞાન ના વધે તો કોણું વધે ? પાપુ ભલા સાધક ! બે અસિધારાવ્રતનું પાલન, આરાધન, કરવું પડશે. આ બે અસિધારા વ્રતો છે.

શુશ્રૂપા અને આજ્ઞાપાલન.

કોની સેવા કરવાની ? કોની આજ્ઞા માનવાની ?

સાધક !

પહેલી ભૂલે સુધાર સેવા કરવાની નથી, પણ સેવા દ્વારા ધન્ય બનવાનું છે. આજ્ઞા માનવાની નથી. પણ મરણાંત કષ્ટ આવે તો પણ જીવ કરતાંય જાળેરા જતન કરી પાલન કરવાની છે. જ્યાં સેવા કરી એવું થાય છે. ત્યાં ઊંડે ઊંડે એવું થાય છે કે હું સહાયક થયો. કંઈ નહિ આપણે પણ ગ્રાગુ ફેરી દીધું. ગુરુએ જ્ઞાન આપ્યું. આપણે સેવા કરી. બન્ને પાસા સમાન થઈ ગયા.

જ્ઞાન બાદ સેવા એ સંસારીની પદ્ધતિ

સેવા બાદ જ્ઞાન એ સાધુની સ્થાધના

જ્ઞાન ઓપ્યું તેનું ભાનવું એ હુનિયાદારી

આજ્ઞાપાલન કરીને જ્ઞાન મેળવાય તે અધ્યાત્મમક્તા

સેવાના મર્મનિ સમજ, સેવા એટલે સહાય નથી, મદદ નથી પણ જ્ઞાની ગુરુ સાથે અલેદ સાધવાની અનેખી પદ્ધતિ છે. જે સેવા

કરે તે ગુરુની છાયા બનીને રહે. તેથી સેવક પર ગુરુના દિવ્ય  
પરમાણું ફેલાય.

જે સેવા કરે તે ખુદની અનુકૂળના ભૂલી જાય. જેની સેવા  
કરવાની તેની અનુકૂળતા પ્રતિકૂળતામાં આપણા આત્માને સીમિત કરી  
દેવાનો, સેવકને બહુધા મૌનગ્રંથ હોય એટલે શાંત સ્વસ્થ ચિત્તો  
સદ્ગુરુની વાણી સંભળાય, ગુરુના વ્યવહારમાં, વાતમાં, વર્તનમાં,  
સદા હિન ભર્યા હોય તેવું જોવા મળે. સેવકનું તુચ્છ નામ પણ  
ઘરી ઘરી ગુરુ મુખે ચઢી ગુરુની પવિત્રતા દ્વારા મંત્ર તુલ્ય બની જાય.

**જ્યારે...**

સેવકે ગુરુની પ્રતિકૂળતા દૂર કરવા પ્રયત્ન કર્યો.

સેવકે ગુરુની અનુકૂળતા પ્રાપ્તિ અંગે પ્રયત્ન કર્યો.

સેવકે ગુરુની અપ્રસન્નતા નિવારવા પ્રયત્ન કર્યો.

સેવકે ગુરુની પ્રસન્નતા મેળવવા પ્રયત્ન કર્યો.

**ત્યારે...**

ગુરુદેવે અનંતના તાળ માપતા હેઠામાં સંગ્રહી રાખેલ જ્ઞાનની  
તિજેરીની આવી — ગુરુદૃપા સેવકના હાથમાં આપી દીધી. જ્ઞાનદ્વારા  
શિષ્ય પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તન કરી શકે છે. જ્ઞાન દ્વારા  
શિષ્ય અપ્રસન્નતામાં પરિવર્તન કરી શકે છે. ગુરુદૃપા દ્વારા મેળવેલ જ્ઞાન  
ઓક અમોદ ઔપધિ છે. દુઃખ, શોક, આહંકન, અણુગમો તેની પાસે  
આવી શકતા નથી.

મનક...જ્ઞાન મેળવણું છે. તો સેવાનું અસિધારાગ્રંથ સ્વીકાર.  
સ્થળ, સમય, કાર્ય અને ઈચ્છાની મર્યાદા કરી તો કૃપામાં મર્યાદા  
થઈ જશે. કૃપામાં મર્યાદા થશે તો, જ્ઞાનમાં મર્યાદા થશે.

૨૦૦૦ શિષ્યના ગુરુદેવ ચિંતિત છે. ગરીર વૃદ્ધત્વના આરે

ઉભું છે. પટનાયક કોને સ્થાપવા ગુરુ સૂરિમંત્રની સાધનામાં લીન બન્યાં. અધિકાર્યક દેવે સૂચના કર્યું. પ્રાતઃકાળે ૨૦૦૦ સાધુના ગરુદનાયકના દર્શન માટે આતુર છે. ત્યારે ગુરુદેવ એક પાણી ભરી રહેલ શિષ્ય પર ગરુદનાયકનો વાસક્ષેપ કરે છે. સૌ નતમસ્તક બની ગયા, ગુરુ કહે સેવા દ્વારા ધન્ય બની ગયો. શિષ્ય કહે આપની કૃપાએ વામને વિરાટ બનાયો. હવે એ ગદની જવાબદારી ઉદ્ઘાવવાની શક્તિ આપો. મારે મન સેવાથી અધિક આ પદ નથી.

સેવક ત્યારે જ સર્વોત્કૃષ્ટ બને સેવાના બદલામાં કંઈ જાયના ન કરે. સેવા ત્યારે મૂલ્યવાન કહેવાય સેવાથી અધિક જગતમાં કંઈ ના લાગ. સેવામાં જે લયલીત બને છે તેનું જ્ઞાન તેની શિક્ષા પ્રતિ-દિન વૃદ્ધિ પામે છે.

મનકં...

સેવા તો પગથિયા વિનાનું સીધા પહડનું ચઢાણ છે. આજ્ઞા-પાલન ચીકણા પહડ પર જોળ જોળ ચઢવાનું છે,

સેવામાં તું નહિ બોલે પણ તારી સેવા — ભક્તિ તો બોલશે. આજ્ઞાપાલનથી ક્યારેક ગુરુને દૂર રહેવાનું પણ આવશે. દૂર રહી કરેલ આજ્ઞાપાલનમાં ક્યારેક આગ્નસમજુતી પણ પેદા થશે. ક્યારેક તેની કઠીનતા, કઠોરતા, ભયંકરતા નહિ પણ સમજય. તેથી રોજ ગુસ નવો નવો આદેશ કરશે, ત્યારે મનમાં સમરંગણ નહિ પેદા થાયને ! ગુરુ તો હુકમ કરે છે. તેમને ક્યાંથી કઠીનતાની ખબર હોય...જે આ ડંદ્દો જીતીશ, તો જ આજ્ઞાપાલનમાં વિજયી બનીશ. યુદ્ધે ચઢેલા ક્ષત્રિયને પ્રિયતમાનું મુખ યાદ આવે તો તલવાર તો ચાલે પણ હાથ ઢીલેલા પડે. જ્ય પરાજ્યમાં ફેલાય, તેમ ગુરુનો આદેશ શેઠશાહીનો હુકમ લાગશે તો ગુરુ આજ્ઞા પાલન છતાં પણ લાભ તને કાર્યકરનો, શિષ્યત્વનો નહિ. આજ્ઞામાં એ અપેક્ષા રખાય નહિ. અમુક સમયે

કહે, અમુંક રીતે કહે, એ બધી સોદાબાજી વેળું દેણીના સંબંધો. આજ્ઞાપાલન એટલે સંખૂર્ણ સ્વીકાર. સ્વીકાર બાદ કાર્ય તત્પરતા.

તેથી જ કલ્યું જ્ઞાન મેળવવા બે અસિધ્યારાગ્રત પાળવા પડ્યો. હવે તારો પ્રક્રિયા હતો. કોની સેવા કરવાની? કોની આજ્ઞા પાલવાની? તેનો જવાબ સાંભળ...

આચાર્ય ભગવંતની — ઉપાધ્યાય ભગવંતની મને ખબર છે આ જવાબથી ખુશ થઈ જવાનો, તારું મોહી હૃદય કહે છે સમુદ્દરમાં એક આચાર્ય, એક ઉપાધ્યાય — શિષ્યો અનેક સૌને ક્રાંતિ સેવા મળવાની? સૌને આજ્ઞા ક્રાંતિ કરવાના? આપણી આ ભાવના પૂર્ણ હરિલદ્રસૂરિ મહારાજ જાણે છે. તેથી કહે છે.

આચાર્યનો અર્થ બોલ...

આચાર્ય એટલે સૂત્રાર્થના જાળકાર અને ગુરુ પ્રદાતા. પદાધિકારી ના...ભાઈ...ના...આટલો સીમિત અર્થ નથી કરવાનો.

સૂત્ર અને અર્થ બંનેના જાળકાર તે આચાર્ય.

સૂત્ર પ્રદાતા તે ઉપાધ્યાય.

ગુરુએ પદ ઉપર સ્થાપ્યા કે નહિ પણ જેટલા જેટના સૂત્રાર્થના જાળકાર તે આચાર્ય ખૂબ દીર્ઘ વિચાર કર — સૂત્રનું તને જ્ઞાન આપ્યું કે કોઈને પણ જ્ઞાન આપ્યું છે ઉપાધ્યાય.

સૂત્ર અર્થદ્રૂપ જ્ઞાનની પરંપરા દ્વારા જ શાસનની સ્થિરતા. શાસનનું અસ્તિત્વ એટલે શાસનના અસ્તિત્વ અંગે જેણે સૂત્ર — અર્થના પ્રદાન કર્યું તે આચાર્ય ઉપાધ્યાય — આવા જ્ઞાનની સેવા આજ્ઞાપાલન ને કરે છે તેની શિક્ષા ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા બંને જલથી સીચેલા વૃક્ષની જેમ નવપદ્ધતિત થાય છે.

સેવા અને આજ્ઞાપાલન દુરાં તું જ્ઞાનમાં પણ પારગામી બર્ન  
અને ડિયામાં પણ પારગામી બનીશ. સિદ્ધિની આકંક્ષા તારે ના  
કરવાની સિદ્ધિઓ તારા ચરણે આળોટશે. પ્રસિદ્ધ માટે ફાંઝા ના  
મારવા પડે. પ્રકૃષ્ટ સિદ્ધિ શુદ્ધાત્મ દશા સહજ પ્રગટ થશે.

નાનકડા ભનક ! મહાન બનવા મહાન કાર્ય કરવું જ પડં  
સાધનાના માર્ગે ઉગલર અંતરના આશિષ છે. અસિધ્ધારાવ્રતન  
પાલનમાં સકૃણ બન.



## ૩૧. વચ્ચેજજ ન પુણોત્તિય



ભૂલનોં સ્વીકાર ન કરે તે અશ. ભૂલનો સ્વીકાર કરે તે સુશુપુનઃ ભૂલ નહિ કરું તેવું કહે તે પ્રાશ અને કયારે પણ ભૂલ ન થાય તે સર્વજ્ઞ.

જ્યાં સુધી સર્વજ્ઞ થયા નથી ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની ભૂલ થાય એ સહજ છે. પણ ખુદની ભૂલનો સ્વીકાર કરવા માટે પણ આંનરિક યોગ્યતા જોઈએ.

મનક ! તું શ્રવણ નિયંથ જ્ઞાનપુત્ર મહાવીર પ્રભુનો સાધુ... નમ્રતાના પાઠ તને ગળથૂંથી મળ્યા.. પ્રતિકમણ તારી ઉભ્યટંકની આવશ્યક કિયા...મિચ્છા “મિ” દુક્કડ એ તો સાધુમાત્રનો જીવનમંત્ર. પણ... તું શીધ્ર મોક્ષગામી તારી પ્રગતી સૌથી શ્રેષ્ઠ...તું મારી ભૂલ થઈ છે મને માફ કરો.’ એટલું જ ના કહે તારા અંતરનો અવાજ અનેએ ..હોંથ...

‘ ‘ખમેહ અવરાહ’ મે વચ્ચેજજ ન પુણોત્તિય’...

મારો અપરાધ ક્ષમો કરો હવે પુનઃ આવું નહીં થાય...આ વાત પણ નમ્ર અને સજગ સાધક કરી શકે...પણ તું તો પ્રગતિપથનો પ્રવાસી. તારી રહેણી કરણી વિચારસરણી જગતના કોઈ જીવની સાથે તુલના ન પણે.

હવે પુનઃ એ પાપ. એ અપરાધ...એ ગુન્હો એ ભૂલ ફરી નહીં કરું.

ભૂલનો સ્વીકાર કેટલીવાર સમાજની મર્યાદાના કારણે પણ થાય છે. નહીં સ્વીકારીએ તો હજાર પંચાત ઉભી થશે. અનેકવાર સાંભ-

ળણું પડશે. આના કરતાં તો એકવાર કહી દીધું કે ‘મારી ભૂલ માફ કરો’ અટલે સેકંડમાં પતી ગયું કારણ કે જિનશાસનમાં ગુરુ જ્ઞાની અને શાખપ્રતિબદ્ધ હોય છે. એકવાર જેણે વે ભૂલની માફી માંગી તેની તે ભૂલ ફરી થાં ન કરાય. ગુરુ તે ભૂલ કરે તો શિષ્યમાં નિર્ધૃણતા પેદા થાય તેનું પાપ ગુરુને લાગે, બસ... ભૂલનો સ્વીકાર માફી માંગી લીધી ઓટલે ગંગાનહાયા..

ભૂલનો સ્વીકાર જેણે આત્માની શુદ્ધિમાટે કર્યો છે તેની મનોદશા આટલી હલકી ન હોય. આંખમાંથી ઊના આંસુ સાથે વિનંતિ કરે કે ફરી ફરી આ ભૂલ નહીં કરું.

‘ભૂલ માફ કરો’ કહેવામાં વિવશતા છે! દીનતાં છે!

‘પુનઃ નહીં કરું’ કહેવામાં પ્રાયશિંત છે! પ્રભુમાર્ગનું બહુમાન છે.  
મહાનતા છે!

‘ભૂલ થઈ ગઈ માફ કરો’ કહેવામાં નમૃતાયુક્ત આત્મસંશોધન પણ હોઈ શકે છે.

‘પુનઃ ભૂલ નહીં કરું માફ કરો’ કહેવામાં નિર્ણયુક્ત આત્મશુદ્ધિ છે.

‘પુનઃ અપરાધ નહીં કરું’ કહેવામાં ખૂબ તાત્પર્ય છે.

ગુરુદેવ! અજ્ઞાની હતો ભૂલ થઈ.. જ્ઞાનીના સમાગમે ભૂલ સમજાઈ. જ્ઞાનશીલ મહાત્માઓના પરિચયે ભૂલની ક્ષમાં માંગતા શીખ્યો. આપના ત્યાગપૂત વાતાવરણે મારામાં શક્તા પેદા કરી. તેથી કશ્યું ફરી ભૂલ નહિં કરું સે માફી માગી એટલે આપે મારી માફી સ્વીકારવા દ્વારા મારા ઉપર કૃપાના વૃદ્ધી કરી. આપની કરુણા યુક્ત નજરમાં મને અતસના આશ્ચર્યાસન મળ્યા. થથું કે હવે તો આપનો કૃપા પાત્ર બન્યો. આપનાં ઉપદેશના પ્રભાવે મારા અજ્ઞાન દૂર થશે. જ્ઞાન અને અજ્ઞાની-ઓનો પરિચય રહેશે. આપ જેવા નિસ્પૃહી મહાત્માની સેવા દ્વારા મારો. પણ સ્વાર્થભાવ દૂર થશે. મારામાં પણ નિરીહતા નિર્બિદ્ધતા

નિઃસ્વાર્થ વૃત્તિ પ્રગટ થણે તેથી ભૂલ થવાનો સંભવ નથી. સંભવને મારો ભાવિ વિજ્ય માની આપની ઓથે બેસી કહી દીધું ‘ ફરી નહીં કરું ’

હજુ મારા દિલની સાચી વાત કહું આજ સુધી જે કંઈ પણ એકશર કર્યા...સ્વીકાર કર્યા હતા તે શરમના કારણે...સમાજના કારણે કારકીદીં જમાવવાના કારણે. તેથી હદ્યમાં પાપ, અપરાધ, ગુન્હોં, અવજ્ઞા આશાતના માટે. વિરાધના માટે ધૂણા પેદા થઈ ન હતી.

પણ...હવે આપે આરાધના અને વિરાધનાના બેદ સમજાવ્યા... શુદ્ધ અને અશુદ્ધના પ્રકર્ષ સમજાવ્યા..સરળતા અને માયાના સ્વરૂપ સમજાવ્યા ત્યારે અંતરમાંથી અવાજ ઉઠ્યો. ભવ વૈદ્ય ગુજરાતે મહિયા છે તારા તા કરોડ રૂવાડામાં રહેલા પાપને નિયોગી નાંખ તારા વચ્ચન દ્વારા થયેલા ક્રોંભાંડેને રજુ કરી દે. સમસ્ત જગતુ જેનાથી અજ્ઞાત છે તેવા તારા ભાનસિક પાપોને રજુ કરી દે. અનંતા સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખી. તારા ગુરુમાં તીર્થંકર પદ આરોપી ગૌતમસ્વામી જેવા સરલભાવે કહે, પ્રભુ ! ગુરુ ! પાપના ફળોથી થકીને નહિ પણ પાપવૃત્તિથી થાક્યો છુ માફ કરો...ગુરુ ! આપ તો જ્ઞાની છો..અંતર્યામી છો. સહુનાં પાપ જાણો છો છતાં નથી કોઈના પ્રાણે તિરસ્કાર...ધૂણા...અનાદર.. આપ તિરસ્કાર કરો તો પાપનો જ. પણ પાપી ને તો આશાસન જ આપો. આપના હેયામાં કરુણા હોય...અધ્યવસાય હોય. આપ કંઈ મારી મહિન વૃત્તિ જોઈને ગલ્ભરાઈ નથી જતા. ઉભગી નથી જતાં. આપ તો સ્વયં ભૂરમણ સમુદ્ર જેવા ગંભીર છો ! નથી તો આપ હર્યાધીન ...કે નથી તો આપ શોકધીન...કૃક્ત આપ છો જ્ઞાનાનંદમાં લીન.. તેથી જ આપની પવિત્રતાએ મને આકષ્યો અને કહું છુ પ્રભુ મારા પાપો માફ કરો. આપ માફી આપણો એટબે મારો આત્મા ઉન્નતિના સોધાન પર આકૃષ થવા લાગશે ગુરુકૃપા વગર આત્મા અપુર્ણબંધક-

દર્શાને કયાંથી પામી શકે? મને વિશ્વાસ છેખગુરુની પાસે ક્ષમા માગ-  
વાથી જ ચાર શરણનો સ્વીકાર.. દુષ્કૃતની ગર્હા સુકૃતની અનુમોદનાનો  
ભાવાર્થ જળવાય છે. સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગર્હાના જેરે  
તો કથ્ય કે ‘પુનઃ નહિ કરું’

પુનઃ અપરાધ નહીં કરું એ કહેવામાં હે ગુરુ! આપના ગુરુઓની  
યશોગાથા ગાઉં છુ. આપના શરણે ન આવ્યો ત્યાં સુધી પાપી...  
આપના ચરણને પામી હુદાન્યાત્મા બની ગયો. ગુરુ મારા હદ્ય સિંહ-  
સન પર બિરજયા. ગુરુદેવની હાજરીમાં પાપને પ્રવેશ મળતો નથી.  
અશુભ વિચારેને અવકાશ પ્રાપ્ત થતો નથી. મારા ગુરુના સાનીધ્યમાં  
સર્દેવ શુભવિચારોનું શુદ્ધ અધ્વરસાયનું સામ્રાજ્ય હોય છે. તેથી આનંદ-  
માં મસ્ત બની કહી દીધું કે હવે પુનઃ અપરાધ નહીં કરું.. પણ ખરે-  
ખર મારો આંતરિક ભાવ એવો છે. આપ એવા રક્ષક છો. આપની  
શીળી છાયામાં મારી આત્મશુદ્ધિના સંરક્ષણ થશે. તેથી પાપોનું આચરણ  
કયાંથી થશે?

ગુરુદેવ!...પાપ નહીં પણ પાપની પુત્રરાવૃષ્ટિ જ ભય કર હોય  
છે. ક્ષતિ નહીં.. પણ ક્ષતિની વારંવાર આવૃત્તિ જ વ્રતનો નાશ સર્વો  
છે.! અને તેથી જ હું માંગી રહ્યો છું.. ન પુણોત્તિય હે પ્રભે! પાપ.  
સ્વખલના વ્રતાતિચાર...હું પુનઃ નહીં કરું હે દેવ! મારો સંકલ્પ અને  
આપની કૃપા...આપના બતાવલે અપુર્ણભાવના પ્રભાવે અપુનરાગતિ  
જેવો મોક્ષ પામીશ જ!



## ૩૨. અસંવિભાગી ન હું તરસ્સ મોક્ષો

કુવામાંથી જલ સીંચો તો નવું જળ આવે — વૃક્ષો પરથી ફળ  
લો તો નવા ફળો આવે — છોડ પરથી ફૂલ ચૂંટો તો નવા ફૂલો  
આવે. દાન આપો તો દાનદેવાના સાધન રૂપ પુરુષ મળે.

લાભ પ્રક્રિયા પ્રદાનને આભારી છે. પ્રામિ — અભિવૃદ્ધિ અથે  
પ્રદાન કરે તે સંસારી.

પરિગ્રહની શુદ્ધિ માટે પ્રદાન કરે તે શાલક.

પોતાના માટે જ શાસ્ત્રાજ્ઞાથી પ્રામિ થયેલ સંયુમ યોગ્ય સામગ્રીનો  
સૂવિભાગ કરે તે સાધુ.

મનક ! કેવો ધન્યાત્મા છે. તારા મન, વચ્ચન, કાયાના યોગો  
જિનકાને આધીન છે, મોક્ષ તારું ધોય છે, અકિંત નારો માર્ગ છે.  
શુદ્ધ તારી સખી છે. અમારા જેવા વૃદ્ધો અને પ્રૌઢો જોતા ગુણેશે.  
અને તું સંસાર અટવીને પાર પામી જઈશ. તારું જીવન અનુમોદના  
કરાવે છે. તારું જીવન પ્રેરણા આપે છે. તારી વય અને તારું સાહસ  
જીતાં શિખામણ આગવાનું મન થઈ જાય છે.

બેટા ! જેમ કેધી, માની, માયાવીને મોક્ષ ન મળે તેમ અસં-  
વિભાગી નહું તરસ્સ મોક્ષો, જે બીજનો વિભાગ ન કરે તેને મોક્ષ  
ના મળે. મનક ! ધ્યાન પૂર્વક સમજ. તારું પુરુષ છે, તને વસ્ત્ર,  
પાત્ર, આહાર વસ્તુઓ સુલલ છે. પણ જો મળેલા સાધન — ઉપ-  
કરણમાં તારા સાધમિક સાધુઓનો ભરામર ત્યાગ નહિં કરે તો મોક્ષ  
નહિં મળે.

કોણ સંવલાગી સારી રીતે ત્યાગ ન કરે તને ખબર છે ?  
 જેને પોતાના પુણ્ય ઉપર વિશ્વાસ ન હોય તે —  
 જેને ભક્તિનો ભાવ ન સમજયો હોય તે —  
 જેને વડીલોમાં પૂજયતા ન લાગે તે —  
 જેને લધુપ્રત્યે વાત્સલ્ય પેદાન થાય તે —  
 જેને લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ પર ભરોસો ન હોય તે —  
 જેને તીર્થંકર બનવાની અભિલાષા ન જગી હોય તે —  
 જેને જીવમાન્ત્રમાં સિદ્ધત્વના દર્શન ન થાય તે --

બોલ તું પુણ્યશાળી ? તું નિઃસ્વાથી ? દાનધર્મ પ્રત્યે શાષ્ટ્રાળું ?  
 ભક્તિ મોક્ષનો માર્ગ માનનારો ? પૂજયોનો પૂજક ? વાત્સલ્ય મૂર્તિ ?  
 લાભાંતરાયનો ક્ષયોપશમી ? તું દિવ્યદિસ્યનો સ્વામી ? જે આ ગુણો  
 તારામાં હોય તો તું સર્વ સમુદ્દરાયમાં રહેતા પૂજયોની ભક્તિમાં  
 તત્પર રહે. બાલ—વૃદ્ધ—ગ્રલાનની સેવામાં સમુત્સુક રહે સહવનીઓના  
 ચર્ચયા વિભાગ કરવા સમુત્સુક રહે. કયારે પણ સ્વાથી બની એકલો  
 પેટ ના ભરે. તું મુનિમાન્ત્રમાં મોક્ષની ભાવના જુઓ. તેમના મુમુક્ષ-  
 ભાવમાં સહાયક થવાની તને અભિલાષા રહે તું મુનિઓના ચર્ચાનું  
 મસ્તક મૂકી વિનંતી કરે મને લાલ આપો. તમે લાલ આપશો ? એ  
 રીતે તમારા મુમુક્ષુભાવનો મને ભાગીદાર બનાવશો. ? આરાધના તમારી,  
 અનુમોદના મારી. હું અને તમે સહીયારા વેપારી. તમારા લાભમાંથી  
 મને પણ કંઈક આપો. આ ભાવનાથી જે સમયે જે યોગ્ય હોય તે  
 આહાર, વલ્લ, પાત્ર, ઉપધિનો તું સહુનો વિભાગ કરે. સાચે વલ્લ  
 પાત્રના વિભાગ દ્વારા તું તેમની સાધનામાં તારો વિભાગ કરી વે.  
 વાહ ! છોકરા ! વાહ ! ખરો હોંશિયાર ! અશાશ્વત આપીને શાશ્વતના  
 સંબંધ બાંધનારો.

માની વે કે તું પુણ્યશાળી છે. તને સુંદર—વલ્લ—પાત્ર. ઉપધિ  
 મળે છે. જલ્દી મળે છે. શું બીજાને મળવાના નથી ? સૌને સૌના

પુણે અનુકૂળ મળી જશે, પણ જે તું વિભાગ નહિ કરે તો તારી પરિગ્રહસંજ્ઞા જેર કરી જશે. આસક્તિ અહું જમાવશે. નિષ્પરિગ્રહ મહાધ્વરતનો ધારક તું તારા પ્રતથી ચુક્કી જઈશ. બોલ હવે મોક્ષ નજીક કે દૂર? તું મોક્ષનો સાંખ્યક રહીશ કે જન્મમરણના ચક્કમાં ફસાઈ જઈશ? લાભાંતરાયના ક્ષયોપશમ સહિત પુણ્યના ઉદ્યે મળેલ સામગ્રીને છોડતાં શીખ—ખરેખર શાખકારોએ કમાલ કરી છે. તને લાગે મેં અન્ન પાણી છોડ્યાં પણ સાચે તને મોક્ષમાં જોડ્યો. તારો દૂર મોક્ષ નજીક કર્યો.

સાધુ મહાત્માનો સંવિભાગ ઓટેવે સાચી કબૂલાત. તમે આરાધક હું અધ્ય પુણ્યાત્મા. તમે સમસ્ત સંસારને ભૂલી અપ્રમત્ત ભાવે શાનનેઅર્જિત કરો. હું તમારા સૌના માટે આહાર — પાણી સંપાદન કરું. તમે તપ કરો. હું આસક્ત પારણાં કરાવું. મારા લાવેલા આહાર ગ્રહણ કરવા તમારી આરાધનામાં મારો ભાગ નોંધી લો. મારો મોક્ષ થશે તે અભર નથી, પણ આપ શીધુમેક્ષગામી છો. જે મને તમારો ભાગીદાર બનાવશો, તો હું જલ્દી મોક્ષ પ્રાપ્ત કરી શકીશ મારો ભાગ કરો. બહાના—ખત સહીના રૂપનાં આ વસ્ત્ર પાત્ર સ્વીકારો, જેથી સદ્ગુરી સમૃતિ રહે.

મનક !

બાહુભલીજુ અને ભરતજીએ પૂર્વ જન્મમાં ૫૦૦-૫૦૦ મહાત્માની અભિગ્રહ લીધિલા. અને એ અભિગ્રહ પૂર્ણ કર્યો. તું કોઈના માટે નહિ કરતો પણ ફરત તારી પાસે જે છે તેમાંથી ભાગ પાડજો. મહાત્મા! મારું આ પુસ્તક તમે વાપરો અને મને શાનમાં સહાયક બનાવો. તપસ્વી! તમે આ પાત્ર વાપરો અને મને તમારા તપનો લાભ આપો. બાલમુનિ! જરા તો આહાર ગ્રહણ કરો. તમે ભાવિના શાસનપ્રભાવક, મને શાસન સેવાનો સદ્ગુરી બનાવો, જ્વાન મહાત્મા! ભયંકર અશાતાના ઉદ્યમાં પણ તમે સમભાવે જીવન વિતાવી રહ્યા

છે. રોગ તમારા શરીરને કૃશ કરે છે, પણ તમો સ્વાધ્યાય દ્વારા તમારા આત્માને પુષ્ટ કરો. તમારી સેવાનો મને લાભ આપો. મને કર્મ નિર્જરામાં તત્પર બનાવો.

**બોલ મનક !**

તેં મહાત્માઓને આપ્યું કે મહાત્માઓએ તને આપ્યું ? મોક્ષનો ચાહક ! મોક્ષનો આરાધક ! મુમુક્ષુના વિભાગ ન કરે તો મોક્ષ મેળવી શકે ? સંવિભાગ મુમુક્ષુનો ધર્મ છે. કોઈ વિકિત, કોઈ પંથ કે કોઈ દેશવાસી, કોઈ ધર્મવાસી તેના ઉપર અધિકાર જમાવી શકતા નથી, પણ સંવિભાગ દ્વારા સૌ ધન્ય બની શકે છે.

એક સંસારીને સંસારમાં જીવવા હજરોની ચાપલૂસી અને કદમ્બોસી કરવી પડે છે. જાણો અજાણો કંઈક અયોગ્યની પણ યોગ્યતા બોલવી, કહેવી અને વર્ણવી પડે છે, ત્યારે સાધુનું પવિત્ર મસ્તક પવિત્રાત્માના ચરણમાં નમે. સાધુને શામ સ્વાર્થી બનીને નહિ, નિઃસ્વાર્થી બનીને કરવાનો, શ્રેણિક મહારાજ જેવા ક્ષાયિક સમકિતીનું રાજ્ય પણ કોણિક જેવા પાપાત્માના હાથમાં.

ત્યારે સાધુ ! તારું મમત્વ કોઈ ચીજ ઉપર નહિ, પણ તારા ઉપકરણ સાધન. તેમાં પણ કોનો વિભાગ ? સાધકનો.

સાધકના વિભાગ દ્વારા સાધનાની સિદ્ધિ.

**મનક !**

સંવિભાગનો વિસ્તૃત અર્થ કર્. કાર્યનો બોજ મારા શિરે, પાત્ર થશ ઓને વહેંથી આપવો. સદ્ગુરી સૌની સ્મૃતિ...તો સમ્યગ્ર વિભાગ સંપૂર્ણ વિભાગ થશો. નહિતર જેમાં છૂટકો નથી તેમાં સૌના ભાગ. બાકી બધું મારા કાયણું — મને — મારાથી મારા પ્રભાવ માટે આ તારી વાત ના હોય.

મહાત્મા !

વખ્ય પાત્રમાં સહવતીઓનો સંવિભાગ કરવો તે કંઈ દુષ્કર કાર્ય નથી. એવું તો સંસારી પણ કરે, તું મહાત્મા તારી દથિ અને વિચારણા અનુપમ.

તને જે માન, સન્માન, યથ, કીર્તિ, ગુરુકૃપા મળે. તેમાં પણ સૌના સંવિભાગ કર, સમુદ્ધાયમાં જે ગુણો શીખ્યો છું, તે સંસ્કાર દાન મારા સહવતીઓને આભારી છે. આ બધું તેમને ફાળો જય છે.

તું વિદ્વાન બન્યો. અનેક ગ્રંથોનાં સર્જન કર્યા પણ લેખક — સાહિત્યકારના પદનો પણ સંવિભાગ કર મારા ગુરુદેવે જ્ઞાન આપ્યું, અનેક શાખકારોની રચના જોઈ. ગ્રંથ રચનાની પ્રેરણા મળી. સેં લખ્યું, કોઈએ સુધાર્યું, કોઈએ પ્રતિલિપિ કરી, કોઈએ ભક્તિ કરી મને સહાય કરી. આ બધાનો આભાર. મુક્ત મને કહેને, માનજે, પ્રસન્ન મને પુનઃ પુનઃ યાદ કરી ગ્રંથ ચુકવજે.

તેં ઉત્કૃષ્ટ વિહાર કર્યાં સર્વોત્તમ ચારિત્રના પાલન કર્યા. ઘોર તપશ્ચર્યા કરી. ઉત્કૃષ્ટ ચારિત્રી, ટ્રાપસ્લીના પણ સંવિભાગ કર. પૂર્વ મહાપુલ્યોના આલંબને મારા ગુરુદેવના જીવન દ્વારા અંગેડ પ્રેરણા-મૂર્તિ દ્વારા તથા સહાયે — હું તો મંદિરની ધ્વજ જેવો પણ સાચે આ બધા પાયાની શીલા સમા છે.

ગુરુકૃપા એ તું શાસન રક્ષક બન્યો. શારાન પ્રભાવક બન્યો, જગત આપ્યું તારા ગીત ગાય, સારા વિશ્વમાં તારો યથ ગવાતો હોય, ત્યારે કહેને પછી હું તો થારા ગુરુની ઠોરીસંચાર કક્ષપૂતળી જેવે શોભાનો રાજ છું. બાકી મારા સહાયકો ઓટલા છે જેમની નોંધ કરું તો એક ગ્રંથનું સર્જન થાય. આમ સર્વત્ર — સર્વ પ્રસંગે સંવિલયાગ કરે તો મોક્ષ મળે.

મનક !

શીધુ મોક્ષ મેળવ અને નિગોદમાં રહેલા એક જીવને બહાર  
કાઢી તેનો પણ સંવિભાગ કર એ જ આશિષ.

શયંભવ સ્ત્રી મ. અમે પણ તમારા સધારિંક છીએ.

અમારો પણ હિતશિક્ષામાં વિભાગ કરો એ જ વિજંતિ..



## ૩૩. નિહેસવતી પુણું જે ગુરુણું

વિશ્વનો એક અદ્ભુતીયે કમ છે. જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને મહાત્મ બનવું છે, જેને સર્વોત્તમ બનવું છે, તેને ગુરુ જોઈએ, રાહબર જોઈએ. માર્ગ દર્શક જોઈએ.

અફાટ સમૃદ્ધમાં મુસાફરી પ્રારંભી. નૌકા છે, અનુકૂળ પવન છે, મને નૌકા ચલાવતાં આવડે છે, પછી મારે કોણી જરૂર? નાવિક ના જોઈએ...એ વાત કોઈ મૂર્ખની એ વાત કોઈ બુધ્દીની. સાચે જેને સમૃદ્ધને પાર કર્યો છે, તે નાવિકના—સુકાનીના પગ પકડીને કહેશે, તમે મારા કર્યાધાર બનો, આપ કર્શું નહિ બોલતા — હવેસા હું જ મારીશ — આપને તકલીફ નહિ આપું — કાર્ય હું કરીશ, પણ આપ માત્ર દિશા જ બતાવજો. દિશાનો જ નિર્દેશ કરજો.

મને કદાચ અનુભવ હશે — જ્ઞાન હશે, પણ તે શાંત સમૃદ્ધને પાર કરવાનું. પરંતુ પ્રલયકાળના તાંડવમાં જહાજનું સુકાન સંભાળવાની મારી તાકાત નહિ. નાવિક! તમે હો તો પ્રલયકાળનું તાંડવ નૃત્ય જ ન આવે. કદાચ દિશા ચુકાય, નાવ અટકી જાય તેવું થાય તે પહેલાં જ આપના ચક્ષુના દ્વિષ્ટ તાપ જોઉં અને મારી ભૂલ સમજઈ જાય. કદાચ હું મૂર્ખ આપની આંખને ના સમજ શકું, પણ આપ મારી શરણાગતિ એળે ના જવા દો. મારા પહોંચને ના ડૂબવા, દો આપ મારા તારક અને રક્ષક બનો. આ એક જલપ્રવાસીનો એકરાર છે. દરિયાલાલ કચારે રૂઠ તે ન કહેવાય. ભરતી અને ઓટ કચારે પરિવર્તન ચામે તે હું ન જાણો શકું, પવન કઈ દિશાનો છે તે મને ના ખબર

પડે, સઢનાં સુકાન કયારે એંચવા ને કચારે દીલા મૂકવા એ મને ના આવડે. ખારવાનું જોઈ બે હલેસાં મારું એટલે કૃત્તાન ના થઈ જવાય.

મારી સમુદ્ર સહ્યર કયારે સહ્યળ થાય? સુકાની સુંદર હોય તો? કે હું સુકાનીના નિર્દેશ મુજબ આચરણ કરું તો?

ભૂલ...ભૂલ એકવાર નહિ લાખ વાર

આપમાં મજબૂર હેડીને કિનારે લાવવાની તાકાત હતી, ત્યારે તો સુકાની બન્યા. સુકાની એટલે જ સુંદરતા, સુકાનીના માર્ગદર્શન મુજબ ચાલું તો જ મારી નૈયા આગરને પાર પહોંચે. સંચાર સમુદ્રને પાર પામવા ચાહતા મુસાહિર મનક!

જલસમુદ્રને પાર પામવા મુસાહિરને સુકાનીના માર્ગદર્શનની જરૂર પડે તો ભવસમુદ્રને પાર કરવા તૈને ગુરુની, ગુરુ અંજાની કેવી અને કેટલી જરૂર પડશે, તે તું વિચાર! ગુરુનિશ્ચાં અને ગુરુઅંજા વગર કોથ — માયા — લોલ — ઈધર્યા — અસ્રૂયા — મત્સરની લંઘરીને તુ કેમ પાર કરીશ? કોથ — માન — માયા લોલ બહુરૂપીની માયાજળ છે.

કોથ પરહિતનું એવું સોહામાણું રૂપ લઈને આવશે કે હું ક્યાં ગુસ્સો કરું છું? હું તો સાચી વાત કહું છું. મારે શું છે! હું તો તેમના હિત માટે જ કહું છું. પણ વડીલના નાતે સત્તા જોર જમાવી જશે. મોહક રૂપ પણ દેખાડશે. જે લાલ અંખ કરીશ તો જ બધા સમજ જશે. તને સમજશે નહિ અને ધીમે ધીમે ગુસ્સો તારામાં ધર કરી જશે.

ગુરુ વગર તારા દિલમાં શાંતિના સામ્રાજ્ય કોણ સ્થાપશે? માનની મેલ્લી વિદ્યામાં ધૂરંધરો પણ આવો ગયા. ધર કરીને રહેલ અભિમાન એવું મનમોહક રૂપ લઈને આવશે કે આપણું માન — સન્માન નહિ, પણ સાધુનાનું અપમાન થવા દેવાય?

ન્રિલોક પૂજય દેવાધિદેવની સાધુતા સર્વ વંદનીય જ રહી છે. કોની તાકાત છે સાધુ સાધુતાની મર્સ્તીમાં હોય અને એનું અપમાન કરે?

જતનાં માન — સન્માન ભૂલવા મર્યોશ — ત્યાં સમુદ્દાય અને શાસનના સન્માનની વાત અને માન તારા કાનમાં કહેશે, ભાઈ ! શાસન કાંજે તો કાંઈક કર. તેના માટે કેમ સાંખી લે છે ?

ત્રિકાલાબાધિત પ્રભુશાસન અને તેની આરાધના એ કોઈ વ્યક્તિનો દાવો નથી. આર્થ લોહગુપ્ત શાસનની ભાવના કાંજે ગયા. ત્રિરાશી-મતની સ્થાપના કરી આવ્યા. લોકોની વાહ વાહ તેમને એવી રૂપશી ગઈ કે ગુરુએ કીધું ભાઈ ! હવે ભૂલ સુધાર. ભૂલના સુધારી...ગુરુ તજ્યા, શું મેળવ્યું ? ભવપતન, જન્મમરણના ચક.

મનકું !

સાધુતાની સાધના માટે ગુરુ આજાનું અનુસરણ અનિવાર્ય. ત્યાં શા માટે ? શું લાભ ? શું નુકસાન ? આ બધા પ્રશ્નો તારી શરણાગતિને લન્દવણો. લાભ જંડી જુઓ. તરત ઝક જા...કેમ ? જોવો દે. શું થાય છે ? એ પ્રશ્નો કરવા રહે, એ મર્મને સંશોધન કરવામાં સમય બગાડે તો બજુ જેલ ખલાય.

ગુરુની આજા સદૈવ અલંઘનીયા. ત્યાં પ્રશ્ન જ કરવાનો નહિ. ગુરુના ઉપકાર માટે નહિ, પણ તારા ખુદના મોટા ઉપકાર કાંજે. ગુરુ ગૌતમ પણ પ્રભુની આજા શિરસાવંદ્ય કરે, તો પછી તું ક્યો શાખ-પારણામી ?

શાશ્વતાન — વિદ્વતા — બુદ્ધિમત્તા સદૈવ વિનીત બનાવે, નમ્ર બનાવે, આજાની શરણાગતિ શીખવાડે. ગુરુ આજાનું જે અનુસરણ કરે તેને જ તેની તારકતાના રહસ્ય સમજાય.

લીલીજંડી થઈ દોડવાનું, કેમ દોડવાનું એ પૂછવાનું નહિ. ઝક જ માટે લાલજંડી, આગે કદમ માટે લીલી જંડી કેમ ? રંગ તો બધાના સમાન છે. મને આ રહસ્ય સમજાવો, પછી અનુસરું. આ પ્રશ્ન કોના ? મૂર્ખના. બુદ્ધિમાન કહેશે વિશ્વના અકાટ્ય સિદ્ધાંત સામે

પ્રશ્ન ના હોય, તેને અનુસરવાનું હોય. તેવી રીતે તારક — ઉદ્ધારક ગુરુવચન સામે પ્રશ્ન ન હોય, પ્રશ્ન થાય તો આપણે ભારેકમીં. ગુરુવચન મુજબ જીવન બને તો સમજવું ભવસમુદ્રના પાર પામવાના દિવસો ગગનીના છે.

અનંત ઉત્સાહી, અનંત અવસાહીમાં અનંત ભવ્યાત્મા મોક્ષ પામ્યા છે. પાભી રહ્યા છે અને પામગે. પણ સૌનો મુખ્ય સૂર મુખ્ય આરાધના ગુર્વાણાની આરાધના.

મનક !

ગુર્વાણનું સતત કવચ ધારણ કરીશ, તો રાગ દ્વેપના સમરાંગણમાં વિનયી બનીશ. મુક્તિંત તારાં સંન્માન કરવા આતુર છે.

બાલવીર ! ધીર બની ગુર્વાણા પાલન દ્વારા ધન્ય બન. આ છે પૂ. શયંભવસ્તુરિ મહારાજની સામસ્ત મુમુક્ષુને. હાઈક હિતશિક્ષા.



## ૩૪. બે છન્દ મારાહુયજ સુ પૂજને



રાજનો ભૂગક જન્મ લે ત્યારથી રાજપુત્ર કહેવાય, છતાં તેને સાચા રાજ બનવા શાખ, શામ, દામ, દંડ, લેંદ શીખવા જ રહ્યા. રાજનીતિમાં પારંગત બનવું જ જોઈએ.

પક્ષીના બચ્ચાના વોહીમાં આકાશમાં ઉડવાની શક્તિ છે, પણ તેને ઉડવાની હિંયા શીખવી જ જોઈએ. તેમ પ્રત્યેક સાધુ મહાવ્રત લીધા ત્યારથી પૂજય છે, પણ સાચે પૂજય બનવા તેને એક અનોખી આગવી અદ્વિતીય આરાધના કરવી જોઈએ.

પ્રયત્ન વગર કોઈ પૂર્ણ ના બની શકે !

આરાધના વગર કોઈ આરાધ્ય ના બની શકે !

ઉપાસના વગર કોઈ ઉપાસ્ય ના બની શકે !

પૂજયની પૂજ વગર કોઈ પૂજય ના બની શકે !

જેને પૂજય બનવું હોય તેને પૂજયની પૂજાની આરાધના કરવી જ રહી. શિક્ષક બનવું હોય તો અધ્યૂરો શિક્ષા ન ચાલે. પૂર્ણ શિક્ષા વેવી જ રહી.

જેટલો વિપ્ય મહાન હોય તેટલી તેની સાધના કઠિન હોય. આર્ટનો સટુડન્ટ. ( કલાનો વિદ્યાર્થી ) ૫૦ ટકા માર્ક લાવે તો ચાલે. પણ સાયન્સનો સટુડન્ટ ( વિજ્ઞાનનો વિદ્યાર્થી ) ૫૦ ટકા માર્ક્સ પાસ ના ગણાય. હોમ સાયન્સ ( ગૃહવિજ્ઞાન ) નો વિપ્ય લેનાર ફેંટ્ચ ૬૦ ટકા

માર્ક પાસ થઈ જય પણ મેડીકલ અને એંજિનિયરીંગ માટે તેટલા પર્સન્ટ (માર્ક) ચોંચ ન ગણાય.

વિશ્વની દરેક સત્તા — સ્થાન — મેળવવા કદાચ ૫૦—૬૦ ૭૦—૮૦ ટકા માર્ક ચાલે પણ. પૂજય બનવા.. આરાધ્ય બનવા કંડકમાં કંડક પરિણામ (રીજલ્ટ) જોઈએ. આઈ સી. એસ. ના વિદ્યાર્થી એમની કહી શકે : તમે અમને ને વિપય કરાવ્યો છે, તેમાંથી પૂછો. આઈ. સી. એસ. ના વિદ્યાર્થીને જે પ્રશ્ન પૂછે તેનો તત્કાળ જવાબ આવડવો જોઈએ. તેમાં ઢીલ પણ ના ચાલે, ઢીલો જવાબ પણ ના ચાલે. તેમ જેને પૂજય બનનું હોય તેનું શિક્ષણ અલગ, તેની તાલીમ અલગ, તેની પૂરીક્ષા પદ્ધતિ અલગ — કારણ પૂજયનું સ્થાન અલગ છે. જે સ્થાન પાસે વિશ્વના માધ્યાત્માઓ વામણા છે, જ્યાં સંપત્તિના કોઈ મૂલ્ય નથી. જ્યાં શિક્ષણની કોઈ ગણતરી નથી, જ્યાં ભૌતિક વિદ્યાની કોઈ લાગવગ ચાલતી નથી, જ્યાં મર્મકારની ઉપાસના ચાલતી નથી, જ્યાં અહે કારની કયારેય આભડછેટ લાગતી નથી, ત્યાં પૂજયપદ છે. આવા પૂજયપદને તારે પ્રાપ્ત કરવું છે? આવા પૂજયપદની તને ચાહના છે?

પૂજય બનવાની ચાહના કોને ન હોય ?

મહાન બનવાની અભિલાષા કોને ન હોય ?

સાચી અભિલાષા હશે તો સાચી આરાધના — કપરી સાધના, કઠોર પરિશ્રમથી તું કંટાળીશ નહિ, ત્યાળીશ નહિ. અધૂરી આરાધનાએ બિસ્તરાપોટલાં બાંધીશ રવાના થઈશ નહિ. એકવાર નહિ, એક લાખવાર વિચાર કરી લે. નિર્ણય કરી લે પછી તને પૂજય બનવાની પ્રક્રિયા સમજવું.

હા .એ પણ તારી નિત્યનોંધમાં લખી લે. પૂજય બનવાની આરાધના અવશ્ય કહીન છે, પણ અશક્ય નથી. પ્રયત્ન સાધ્ય છે, પણ અધ્ય પ્રયત્નથી પ્રાપ્ત થાય તેવી નથી.

રાજમહેલના વિશાળ રાજભવનમાંથી તુદનનો અવાજ આવી રહ્યો છે. કોણ રીતી રહ્યું હોય? કોણ બિચારો ગુનહેગાર હોય? કોણ તેની ઉપર જુલ્સ ગુજરતું હોય? દશ્ય આંખ સામે દેખાય છે, છતાં આંખ અને હદ્ય માનવા તૈયાર નથી. રાજપુત્રનું તુદન, કડક સત્તા-વાહી સ્વરે કદોર અનુશાસન કરનાર રાજમાતાને પ્રેક્ષકો વિનંતિ કરી રહ્યા છે. માતા, આપ તો કુલથી પણ કોમળ છો અને આ શું? આ ગાણ વર્પના માસૂમ બાલક ઉપર આ ભયંકર અત્યાચાર, ભયંકર તાડના, તર્જના? તેનાં વસ્તુ ક્યાં? પ્રજાનનો! વચ્ચે ના આવો, તમે સામાન્ય છો. તમારાં શિક્ષણ, તમારી તાલીમ સામાન્ય હોય. આ મારો બાળક ભાવિનો સમ્ભાટ છે. જેને સમ્ભાટ બનવું હોય તેના માટે શિસ્ત — કડક અનુશાસનનું પાલન જરૂરી છે. જો કડક અનુશાસન દ્વારા ઘડતર નહિ થાય, તો સારા દેશની જવાબદારી તે કેવી રીતે ઉઠાવી શકશે? તમને તેનું વર્નમાન દેખાય છે. મને ભાવિ દેખાય છે. તમારી દાખિએ તે બાળક છે, મારી દૃષ્ટિએ સમ્ભાટ છે, તેથી હું તેનું ઘડતર તે રીતે કરું છું. એક સમ્ભાટની માતા કડક અનુશાસન કરી શકે અને જેને સમ્ભાટ બનવું છે તે કડક અનુશાસન સહી શકે

**મહા મુનિ મનક!**

તારે પૂજ્ય બનવાનું છે, તો પૂજ્ય બનવાની તાલીમ લેવી પડ્યો. સમ્ભાટની માતા કડક કાયદો કરી શકે તો પૂજ્યનો પિતા પ્રેરક પાઠ ના ભાગાવી શકે?

**મહાત્મા!**

મારે પૂજ્યની પૂજા કરવી છે. મને દર્શાવો પૂજ્યપૂજની પદ્ધતિ.. જરૂર હું સ્વીકારીશ. અને પૂજ્યની કૃપાનો પાત્ર બનોશ. સાંભળ ! આજીાનું પાલન રાજ્યકુળમાં, પણ. મુનિકુળમાં તો ગુરુના અભિપ્રાયને, ઈચ્છાને, આણસારને અનુસરવાનું જ નહિ, પણ તેની આરાધના કરવાની. આરાધના આરાધની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચાલું રાખવાની. મુનિની આરાધના ક્યાં સુધી ચાલે ? દેહ બદલાય, ભવ બદલાય,

પાત્ર બદલાય, પણ કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અખંડ આરાધના ચાલુ રાખવાની. આરાધના ફક્ત ગુરુના નામમંત્રની જ નહિ કરવાની, આરાધના ફક્ત ગુરુની મૂર્તિની જ નહિ કરવાની, આરાધના ફક્ત ગુરુના દેહની જ નહિ કરવાની, આરાધના ફક્ત ગુરુની આજ્ઞાની જ નહિ કરવાની, આવું તો ઘણા કરે. તારે પૂજય બનવું છે. તારે પૂજયના અભિપ્રાયની આરાધના કરવાની ઈચ્છાની આરાધના કરવાની.

મને ખબર છે તારા મનના અટપટા પ્રશ્નની. તું શાસ્ત્રના ઓથે દલીલ કરવાનો. હું તો મારા ગુરુના અભિપ્રાયની આરાધના કરવા તત્પર છું, પણ શું કરું? છભસ્થ છું. કેવળજ્ઞાની નથી. કેવી રીતે મનના ભાવને જાણું? ગુરુના ભાવને સમજું તો; આરાધના કરું ને?

આ વક્તા છોડ. કોઈ તને કંઈ કહે છે ત્વારે તો સ્પષ્ટ બોલે છે. તમારી વાણી જુદી છે. તમારું મન જુદું છે. તમારું વચન ભરે સારું કહે, પણ તમારી આંખમાં પ્રેમ દેખાતો નથી. વચન મીઠું છે, પણ વચનમાં સંભ્રમ દેખાતો નથી. તમે મુખેથી મીઠું બોલો છો, પણ તમારા મુખ ઉપર હાસ્ય દેખાતું નથી. તમે મારી સાથે વાત કરો છો, પણ તમારી દૃષ્ટિ વારંવાર ભૂમિ ઉપર જાય છે. એટલે કંટાળો આવે છે. વચનોથી સ્વાગત કરો છો, મારા સાન્માનમાં બધી યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરો છો, પણ તમને બગાસાં આવે છે, તેથી તમને આનંદ નથી.

સમસ્ત સંસારને સમજવા માટે તુ માનસશાસ્ત્રનો વેતા છે. જ્યાં જાય છે, ત્યાં શરૂદ્ધથી બોળવાતો નથી, પણ જસૂસવૃત્તિ કરી સૌના મનનો તાણ મેળવે છે. તો ભલા જાધક! છભસ્થ છું, અજ્ઞાની છું, હું શું જાણું આવી વકના છોડી દે. તારી પાસે માનવના મનને જાણવાની શક્તિ છે.

કદાચ માનવભાધાદ્વારા પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખી શકે છે, પણ આકાર — ઈંગિત — નેત્ર મુખ હાથ ભાવવડે તનો અભિપ્રાય પ્રગટ થઈ જ જાય છે.

જો તારે ગુરુના અભિપ્રાયની આરાધના કરવી જ હોય, તો તેઓનીઃ છાયા બનીને રહેણે. તારા હૈથાની શુભ ભાવનાથી તું ગુરુના હાવ-ભાવ — આકાર — ચેષ્ટા સમજી શકીશ અને તે દ્વારા તું તારા હૃદયમાં રહેલ અભિપ્રાયને સમજશ. અભિપ્રાયની આરાધનાથી જ ગુરુની સેવા-ભક્તિ કરી શકીશ.

કારણ...તું એક મહાત્માનો સેવક છે. જ્ઞાની અને ત્યાગીનો સેવક છે. મહાત્મા જ્ઞાન અને ધ્યાનમાં રત રહેશે. તેથી પાણીની જરૂર હો, બોજનની જરૂર હો, તો પણ બોલશે. પુસ્તક લાવો, કમલ લાવો, આરામ કરવો હોય તો પણ બોલશે. પાઠ લેવો છે ને? પણ તારે આજ્ઞાનું નહિ. અભિપ્રાયનું આરાધન કરવાનું છે. એટલે સમજવાનું મુખ સુકાય છે, તેથી પાણીની જરૂર છે. પગ લાંબા થઈ ગયા છે, એટલે આરામની જરૂર છે.

શર્ષદના સેવક બન્યા વગર ગુરુના અભિપ્રાયનો જે આરાધક બને છે તે સાચે પૂજય બને છે.

મનક!

મહાત્મા બન્યો, પરમાત્મા બનવા ગુરુના અભિપ્રાયની આરાધના કર અને સંકળ બન.

ગુરુદેવ!

મનક તો છ મહિનામાં કલ્યાણ કરવા આપના અભિપ્રાયને સમજ્યા તો જ દીક્ષિત બન્યા. અને શિક્ષિત બન્યા. હવે આશિષ તો અમને આપો. અમે પૂજયોના અભિપ્રાયની આરાધના કરીએ. આપ તો હૃપાળ છો. એક વરદાન આપો ને. પૂજયોના અભિપ્રાયના આરાધક બનવાનું!

સાચું કહું છું, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. બીજું કંઈ પણ નહિ. માગું.

બસ, આપના વરદાનની આશાએ વિરમું છું.

## ૩૫. અક્રોધિદલે સથા સુ પુજારો

ઘેડૂત વરસાદ પરથી ધાન્યની ઉત્પત્તિનો નિર્ણય કરી લે. ઐનરમાં પાક આવ્યા પછી તેને હાયવોય કે હુએ ના થાય, કારણ પાક કેવો આવશે તે તેણે જાણી લીધેલ, ઉદ્યમાત તો વેપારીને થાય, ઘેડૂતને નહિ.

સંસ્કારી માતા બાલક ગર્ભમાં આળો અને શું સ્વખન આવ્યું તેના પરથી ભાવિનો નિર્ણય કરે. જન્મ બાદ મુખ જોઈને તો બોકો નિર્ણય કરે...મા નહિ. ‘મા’ તો સ્વખનની સાકારતા દેંણે.

સાધક મનક ! તેં પ્રભુશાસનનું જ્ઞાન મેળવ્યું. જીવ અને અજીવના ભેદ જાણ્યા, પાપ અને પુણેના ઉદ્ય સમજાયો ? આશ્રવદ્ધિયાને સંવર-ક્રિયાથા સવરૂપને સમજાયો ? કર્મબંધનનાં કારણો અને આત્માના મોકાનો ઉપાય સમજાયો ? કોધમાનના રૌદ્રકૃપો વિચાર્ય વિપ્ય અને વાસનાના કારણે આત્માની થતી અધોગતિ જોઈ. સર્તા અને અધિકારનાં તોઢાનો જેણાં...ઓકાન્તવાદ અને અનેકાંતવાદનાં રહસ્યો મેળવ્યાં. સુદેવ—સુગૃહુ સુધર્મના રવરૂપને સમજાયો. કુદેવ કુશુરુ—કુધર્મનના સ્વરૂપને વિચાર્યો. સત્તુ સમાગમ અને દુર્જનના પરિયયને સમજાયો, દેહપિપાસુ અને જ્ઞાનપિપાસુના ભેદને સમજાયો. પત્નીભક્ત અને પિતુભક્તની—પ્રવૃત્તિને સમજાયો. અહેવાદ અને ઓત્મવાદને સમજાયો.

જિનેશ્વરભગવંતે ફરમાવેલ ચારે અનુયોગમાં નિષ્ણાત બન્યો. ચારે અનુયોગમાં દુનિયાનો એવો કયો પદાર્થ છે ? કયો એવો ભાવ છે, ક્રયું એવું પાત્ર છે કે જેનાં વણનો તને જાણવા ન મળ્યાં હોય. જગતની કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ ભાવ, કોઈ વિદ્યા, કોઈ મંત્ર, કોઈ ચમત્કાર એવો છે કે તને આકૃતી શકે ? તારીં આરાધના સાધના-માંથી તારા સ્વાધ્યાયમાંથી તને બહાર લઈ જઈ શકે ! નાટક તને ખુશ ના

કરી શકે ? કોઈ બુદ્ધિમાનને ખુદની મંજુરી પસંદ આવે ? નાટક તારા જ  
જન્માંતરમાં મોહને આધીન બની કરેલાં ભાવોનું હૂબૂહૂ વર્ણિન છે.  
નાટક જેતાં તું લાજુ મરે ? તો સાધુ નાટક કરે એ સ્વભન્મા પણ  
કુયાંથી બંને ? આંખ ચઢાવવી ..મુખ મચકોડવું. ચાળા પાડવા...નકલ  
કરવી...આ બધાં કુતૂહલવૃત્તિનાં તોક્ષાન છે, તેથી તેવું કરવામા કોઈ  
ભલીવાર તથી, તેવું જોવામાં કશો લાભ નથી.

સાચા સાધુ અકૃતૂહલી હોય છે. સાધુને કુતૂહલ આકર્ષે નહિ...  
સાધુ કુતૂહલ કરે નહિ.

કુતૂહલ 'જોવાની ઈચ્છા આત્માથી'માં થાય નહિ.

કુતૂહલ જોવાની ઈચ્છા જ્ઞાનાથી'માં થાય નહિ.

કુતૂહલ એટલે લેકેને જેંચવાની એક પ્રક્રિયા સત્યને આકર્ષિત  
ના પડે. જૂઠને સૌને નિમંત્રવા પડે.

કૂલે કયારે પણ કહ્યું છે, મારી સુગંધ લેવા આવો, મારું સૌંદર્ય  
જોવા આવો. કૂલ તો કહે છે, આંખ છે તેને મારું સૌંદર્ય દેખાઈ  
જશે. નાક છે તેને મારી સુવાસ બોલવવી લાવશે.

સાધનાનો કપરો માર્ગ સ્વીકાર્ય બાદ જગતતત્ત્વને સમજ્યા  
બાદ કુતૂહલ કેમ પેદા થાય ? કુતૂહલનું કરતૂન જાણ્યા બાદ તેના આક-  
ર્ષણ કેમ થાય ! જગતનો કયો એવો ભાવ છે કે ઉત્સુકતા પેદા કરી  
શકે કુતૂહલ અજ્ઞાની અને મોહને થાય. જ્ઞાનીને જિજ્ઞાસા થાય, રહસ્ય  
મેળવવાની જિજ્ઞાસા થાય, તે પણ સ્વ અને પરની એકાંતે હિતકર  
હોય તેવી વાત માટે જ.

મનક ! તું જ્ઞાનનો પિપાસુ, જાણે — અજ્ઞાણે કંઈક જાણી લેવાની,  
કંઈક જોવાની — કંઈક ચમત્કાર સર્જવાની, કોઈક હાસ્ય પ્રયોગની,  
કોઈ જદુ કરવાની કોઈ ખેલ કરવાની ઈચ્છા જોગી, તો સમજ લે ને.  
તારો આત્મસ્વભાવ પરાજ્યના પદ્ધતિમાં બેસી રહ્યો છે. તારું જાન-

જોખમમાં છે. તારું અજ્ઞાન - તારા પર આકર્ષણ...મોહની વિદ્યા જમાવી રહ્યું છે. તેથી જ કહું છું. અકૃતૂહલી બને છે તે જગતું પૂજ્ય બને છે. તું તીર્થંકર પરમાત્માનો સેવક અને કૃતૂહલવૃત્તિ તારામાં પેદા થાય ? ચારિત્રરાજના - મહેલમાં મોહની ગુંડાગીરી. સાવધ બની જા... મોહ તારા શજ્યમાં પ્રવેશ કરી ખેદાન મેદાન કરે, તે પહેલાં તારા જ્ઞાનદુર્ગને મજબૂત કરી લે.

આજે પણ કેટલાય શાખીય સંગીતકારો કહે છે. અમારે ત્યાં ત્રણ ત્રણ પેઢીથી સંગીતની સાધના થઈ રહી છે અને તાલ - લય મૂર્છનામાં એવા લીન બની જઈએ છીએ, તેમાં અમે જત અને દુનિયાને ભૂલી જઈએ...અમારાં બાળકો એમ. એ. બી. એ. ઈન્જનેર છે, પણ તેમણે દ્રિલ્લમ જોઈ નથી. નોવેલ વાંચી નથી. એમ નહિ તેઓને મન થતું નથી. કહે છે સત્ય છોડીને અસત્યને કયાં જોઈએ !

આઈન્સ્ટાઈનને પૂછજો, તમે કેટલા ખેલ નાટક સર્કસ જોગેલાં ? જવાબ શું આપશે હા કે ના ? આઈન્સ્ટાઈન કહે કંદાચ મને તમે ત્યાં લઈ ગયા હો તો મારું શરીર ત્યાં હોય, પણ મારું મન તો મારી વિચારણામાં જ હોય.

જે તત્ત્વજ્ઞાનનો વિદ્યાર્થી છે, કે જે જિનનો ભક્ત છે, જે ચુગુનુંનો વિનીત શિખ છે, જે સાધુ જિતેન્દ્રિય છે, તો તેનામાં કૃતૂહલતા પેદા કેમ થાય ? કૃતૂહલ એટલે ઉદ્દેશ્ય વિનાની ઉત્સુકતા સ્વને ભૂલાવે છે. સ્વ ભૂલાય છે, એટલે મોહને છૂટો દોર ભળે છે, મોહનું તોદ્ધાન થડું થયું એટલે ઈન્દ્રિયો તેની અનુયરી દાસો બની જથે. બેકાબૂ ઈન્દ્રિયો વિપ્યમાં વિવશ બનશે. વિપ્ય ક્રપાયને નોંતરથે..અંતે સાધકનો વિજ્ય હારમાં પલટાઈ જાય છે.

સાધકને જ્યાં વિપમભાવ દેખાય ત્યાં કરુણા પેદા થાય, સાધકને જ્યાં ઉત્તીત ભાવ દેખાય ત્યાં પુરુષનો પ્રભાવ ખ્યાલમાં આવે. સાધુને

તો ખુદને મળતાં સંયોગો કે વિયોગોમાં પણ હરખ — ઘેલાકે બેબાકળા બનવાનું નથી, તો વિશ્વના ભાવો જેઈને શું થાય? કંઈ જ નહિ.

મન્યતે જગત् તત્ત્વ ઇતિ મુનિ પૂ. ઉપાધ્યાય યશોવિજય મહારાજે આ સૂત્ર દ્વારા સાધુ સ્વભાવનું મનોહર વર્ણિન કરી દીધું છે. જગત તત્ત્વનું મનન ચિંતન કરે તે મુનિ.

જગતું તત્ત્વોને જોવા દોડ ભાગ કરે..કૂદાકૂદ કરે — ઊંચો નીચો થઈ જાય તે મુનિ નહીં...

એક વિચારક કહે છે કે જેઈને સાચું માને તે પણ જે વિચારોને સાચું માને તે મનુષ્ય. પણ પણે ફક્ત જોવાની શક્તિ છે — માનવ પણે વિચારવાની શક્તિ છે — વિચાર જેવી અદ્ભુત શક્તિના સ્વામિને આમ કુતૂહલ નારક ખેલકૂદમાં સમય બગાડવો પાવવે !

પ્રભુના તત્ત્વ જ્ઞાન દ્વારા બધું સમજી ગયો છે — દેવ અને નારક નહિ, પણ ચૌદ રાજલોક મારી મનોસૃષ્ટિ સામે છે. છ ઇવ્યના ગુણો અને અનંત અનંત પરયિયા જાણ્યા છે. પ્રભુના શાસનમા ચેતન વિજ્ઞાન અને જગતવિજ્ઞાનમાં મને એવી રસવૃત્તિ પેદા થઈ છે. આ દુનિયામાં કંઈ જોવા જેવું લાગતું નથી.

મનક! અકુતૂહલી આરાધક બને છે. આરાધના દ્વારા સદા પૂજણ બને. હું તને અકુતૂહલી બનવા દ્વારા પૂર્ણતાની કેવલજ્ઞાની બનવાના આશિષ્ય આપું છું આત્મસ્વભાવના પ્રગટીકરણના આશિષ્ય આપું છું.

આ છે હિન્દુનો પૂ. શાયંભવસ્તુરિ મહારાજની હર્દિક ભાવના.

પ્રભો? મોહ અમને સત્તાવી જાય છે. કોઈવાર મારી પણ જાય છે — અને કોઈવાર..વિજયી પણ બની અમને કરાવી પણ જાય છે. આગમના અત્યારસની અદ્ભુત જિજ્ઞાસા પેદા થાય તેવા આશિષ્ય આશિષ્ય, આપો. નહિતર અમારી કુતૂહલવૃત્તિ શાંત થશે નહિ — મન-કુને વિજયી બનાવ્યા..અમને તેમના સદ્ભાગી બનાવો એજ વિનંતિ...



## ૩૬. ગોણહાહિ સાહુ ગુણુ મુંચ અસાહુ

વ્યાખ્યાનકારોને પ્રવચનકારોને પૂછી આવજો. તમે સદ્ગુરુ વક્તા કેવી રીતે બની શક્યા છો? લેખકોને ગ્રંથકારોને પૂછી આવજો. તમે સદ્ગુરુ સાહિત્યકાર કેવી રીતે બની શક્યા છો?

બધાનો એક જ જવાબ “અલ્પ અક્ષરોમાં સારગ્રાહી કહેતાં લખતાં આવડયું તો.”

કલાકો સુધી સાંભળવાની કોઈને ફુરસદ નથી. અને કદાચ ચરમના માર્યા સાંભળે તો સમય ક્યાંથી લાવે? short and sweet નો જમાનો છે. જમાનાની વાત દૂર રાખો. આયુષ્ય અલ્પ, અન્તસમાગમ અલ્પ, બુદ્ધિ અલ્પ, સમૃતિ અલ્પ, વધુ સાંભળે વધુ વાચે તો પરિણામે કશું યાદ ન રહે. અવસર્પિણી કણના માનવની આ વ્યથા છે.

પુ. શય્ય ભવસ્સુરિ મહારાજ જાણના હતા. બાલમુનિ મનકનું ફર્જિત છ મહિનાનું આગુષ્ય છે. છ મહિનામાં અનાદિ કર્મના સંસકર ભૂ સવાના. છ મહિનામાં સાટિ અનંત ભાવેના સોણલાં પેદાં કરવાનાં. સાધુપુત્ર, પણ શરીર તો બાલકનું. એની કોમળ બુદ્ધિમા સમજાય અને પ્રનિકાણ જિનવચનનો ધંટ રણક્યા કરે તેવું જ્ઞાન ઓપવું જોઈએ.

પુ. શય્ય ભવસ્સુરિ મહારાજના હેયામાં ‘એકાંત હિતભાવના’ છે, તેથી તો આગમશાસ્ક્રનાં દોહન દશવૈકાલિક સૂત્રમાં ઉતાર્યો. દશવૈકાલિકનું દોહન નવમું અધ્યયન છે. નવમા અધ્યયનનું દોહન અગીયારમી ગાથા છે. અને અગીયારમી ગાથાનું દોહન અગીયાર અક્ષરોમાં છે. બે વાક્યો છે કેવાં મનોહર! શબ્દો વાંચતાં હેયામાં સોંસરા ઉતરી જાય તેવાં.

બેટા !

તને સર્વશાસ્ક ભાણાવું ? સૂત્ર અર્થનો પારગામી બનાવું, પણ આગમ અપાર છે અને તાડું આયુષ્ય અવ્યપ છે. થોડામાં ઘણું કહી દઉં.

જો ઓધા મુહુપત્તિ લેવા માત્રથી સાધુતા આવતી, તો પરમા-માઝે ના ફરમાવું હોત કે મહાનુભાવ ! મેરુપર્વત જેટલા ઓધા મુહુપત્તિ લીધા, પણ તેના દ્વારા તારા દેહ સાધુ બન્યો. હવે મનને સાધુ બનાવ. આત્માને તારી ચામે ચારું દશવૈકાલિક સૂત્ર રાખી રૂધીધું. જેને ફક્ત એટલું જ કહું છું.

ગોણહાહિ સાહુ ગુણ મુંચ અસાહુ.

સાધુ યોગ્ય ગુણ ગ્રહણ કર. અસાધુ યોગ્ય દુર્ગુણ છોડ. છોડવાની અને લેવાની બે કિયા સાથે જ કરવી પડશે.

ગંદું પાણી ઘડામાંથી ફેંકે નહિ તે જુદી વાત, પણ તેમાં જ ચોખખા પાણીને સાથે રાખવાથી શું ફાયદો... ગંદું પાણી ફેંકી દે અને ખાલી થડો રાખો તો પણ શું ફાયદો ?

રાજ બને અને અન્યાયીને દેશપાર ન કરે તો ચાલે ?

રાજ બને અને પ્રમાણિકને પ્રોત્સાહન ના આપે તો ચાલે ?

મનક ! તું તારા આત્મસ્વભાવનો રાજ બન્યો છે. આધ્યાત્મિક ભાવ તારો મંત્રી છે. છઘલોક તારો દેશ છે. નિત્ય કિયા — તપ — જપ સ્વાધ્યાય તારી ચતુરંગી સેના છે. ચિન પ્રસંનતા તારી નગરી છે. હવે નારે કોને તાડું નાગરિકપદ આપવું છે ? કયા અદ્દો જમાવી બેઠેલા દેશદ્રોહીના નાગરિકત્વના પરવાના રદ કરવાના છે ? વિચાર.. કોઈના કહે ના ચાલતો, કોઈની સલાહ ના સ્વીકારતો...

દુનિયામાં કરેઠો દવા હોય અને કરોઠો મંત્ર હોય, પણ પોતાને ચોગ્ય શું ? એ તો ખુદે જ વિચારવું રહ્યું. હું તો તને પુનઃ પુન. બે જ વાક્ય કહું શું.

સાધુ યોગ્ય ગુણ તને જે જે લાગે તે ગ્રહણ કર.

અસાધુ યોગ્ય અવગુણ તને જે જે લાગે તે છોડી દે. શેઠની સલાહ 'પણ જાંપા ચુંધી સ્વીકારવાની. પછી ખુદે વિચારવાનું.'

ગુરુ તો અજ્ઞાનનાશક — મહાઅર્થીપદ્ધિ તુલ્ય જ્ઞાન આપશે — પણ જે તને જ્ઞાનથી પણ અભિમાન આવતું હોય તો છોડ. અને ભવે જેને દુનિયા કામ કરે છે, તે કરતાં તને એમ લાગતું હોય કે હું તરી રહ્યો છું તો તું ભક્તિ સ્વીકાર...

ધોમ ધખતા તહીકામાં ગોચરી જ/તાં વિચાર આવે. શાલિભદ્જલાં તપ્તશિલાપર અણસણ કરેલ. હું કયાં તેવું અણસણ કરવાનો સૌભાગી? પણ તેઓના ભાવનો સ્પશ્ય થાય તે માટે આનંદથી ગોચરી જઉં અને પરિપહ્નની મોજ ઉડાઉં !

જ્યોતિપ વગેરે રહસ્યમય શાશ્વો પચાવી શકે તો જ સ્વીકાર અને તેના રહસ્ય ન પચાવી શકે. આગાહી કરવાનું દિલ થાય, ભક્તોનું ટોળું લેગું કરવાનું મન થાય, તો એ શાશ્વો તારા માટે પાપથાત્ર સમજી દૂરથી નવગજના નમસ્કાર કરી દેજે.

પ્રભુ શાસનના તપત્યાગ દ્વારા તારા આત્મામાં અપૂર્વ લભિયાં — અચિંત્ય શક્તિ પેદા થશે, પણ દિલના એક ખૂણામાંથી પણ જવાબ આવે મારામાં સ્વાર્થ છે. વાહવાહની ભાવના છે. કોષ પર કાબૂ નથી આબ્દો તો શાસનદેવ પાસે શાપ અને વરદાન સાથે જ માંગજે. શાસનદેવ, તમે પ્રસન્ન હો તો મારા વચ્ચનમાં નિષ્ફળતા આપો. તમે પ્રસન્ન બનો અને આંતરિક આરાધનાનું વરદાન આપો.

પ્રભુનો ત્યાગાંખર્મ, તેની વ્યવસ્થા, તેના નીતિનિયમો કોઈ અલગ છે. રાજ મહારાજાઓ ચક્કવર્તીને જે માન — સન્માન ન મળો તે તને મળશે, પણ જે વિચાર આવે તો મને નમે છે, મને પૂજે છે. મારા કેટકેટલાં સન્માન થઈ રહ્યાં છે. આ વિચાર આવે તે પહેલાં પવિત્ર

ભાવોના પવિત્ર આશયની કિયાથી તું દૂર જતો રહેજે..કહી ટેજે...ધી  
આરોગ્ય આપે, પણ હું ભયંકર બીમાર છું. મને ધી વિષ બને. તેમ  
વંદન સુખશાતીની કિયા ભાવ સાધુતામાં પ્રેરક, પણ મને પાપીને અહં  
ચેદા કરે છે. મને જવા દો.

ને વિચારથી ..ને આશયથી — ને વચ્ચનથી, ને વાતથી, ને પ્રવૃ-  
ત્તિથી — ને આચરણથી — તારું ભાવ સાધુ જીવન મહિન થતું હોય.  
તે સર્વ દૂરથી ન છોડી દે, છોડતાં કાણોના પણ વિલંબ કરતો નહિ.

સાઈ !

શરીર ગમે તેટલું સુંદર હોય. પંચેન્દ્રય પૂજા હોય તો પણ સંસારી  
લેકો તેને જેમ આભૂષણુથી શાળુગારે છે, તેમ હે મહાત્મા ! તારા  
મહાપ્રત નવકોટિ શુદ્ધિ, અખંડ, અપૂર્વ અધ્યવસાય યુક્ત હોય તો  
પણ ઉત્તર ગુણો રૂપ આભૂષણુથી સંયમદેહની શોભા વધારજે. પ્રભુનું  
ચારિત્ર સ્વીકાર્ય તે જિનરાગે રંગાઈને જિન ભક્તિથી પ્રેરાઈને પણ  
પ્રતિદિન જ્યાલ કરજે. મારા ભમકિનને શોભાવનારા લિંગલક્ષ્મણ કેવા  
છે ? પાંચભૂષણુથી હું શોભું છું. ? શાલા નિર્મળ કરનાર તીર્થ સ્થળોની  
ચારણરજ શિરપર ચઠાવજે શાલાપૂત્ર મહાત્માનો સહૈવ સંગ કરજે.  
ચારણરજ પરમતના પરિહંગણ કાને સમૃતિ — તર્ક જેવા  
સ્વમતના સિથરીકરણ પરમતના પરિહંગણ કાને સમૃતિ — તર્ક જેવા  
અલોકિક ગ્રંથને આત્મસાત કરજે તારી શાલા મેળુપર્વત શી અડોલ થશે.

સાધુ છું, પાંચ પ્રતિકમણ આવશ્યક કિયા વ્યાખ્યાન વગેરે આવડે  
છે, પણ તેટલાથી આત્મગુણ ના પ્રગટે. આત્મગુણ પ્રાપ્ત કરવા જીનના  
આઈ આચારના પાલન પૂર્વક પ્રતિદિન પાંચ પ્રકારનો સ્વાદ્યાય જીનત  
દ્રવ્યાનુષોગનું ચિંતન કેઠાઈ. દ્રવ્યાનુષોગના ચિંતનમાં સમસન વિશ્વના  
વૈપુણ્યક ભાવોને ફૂક્ત પદાર્થ વિજ્ઞાન રૂપે જોવાની શક્તિ મળશે હુનિયા-  
નો કોઈ ભાવ તારી સાધનામાં વિક્ષેપ નહિ પાડે. પુદ્ગલ સ્વરૂપનું  
પૂર્ણ જીન આત્મ સ્વરૂપમાં અભિગુણ પ્રગટાવશે.

અલિનવ જ્ઞાનની આરાધના જોઈએ. શાખનો અભ્યાસ પૂર્વચાર્યોની તીક્ષ્ણ બુદ્ધિ કુશળતા જોઈ તેમનો ચરણોપાસક બની જઈશ. નમ્રતાથી તારું જીવન મધ્યમધી ઊઠશે. મુનિ છે. ચરણસિતરી, કરણ સિતરીનું પાલન કરીશ, પણ પ્રભુના ચરણકરણાનુયોગ વિશુદ્ધ વીતરણ ચારિત્ર તરફ જેંચણે. સરણ ચારિત્રમાં છીએ, પણ ચાહક વીતરણ ચારિત્રના છીએ, જેમાં કપાય મોહનીય કે નોકપાય મોહનીયના જરા પણ તોક્ષાન ન હોય. ધર્મધ્યાનમાં છે, પણ શુક્લ ધ્યાન માટે આતુર બની જો.

અદ્ય કપાય હોય, પણ જીવનમાં ભાવ રાખ. હું અનંત ચારિત્રનો માલિક, રવભાવમાં રમણતા એ મારો ગુણ. તે પ્રાપ્ત કરવા તત્પર બનું...વધું શું કહું ?

જે વિચાર...જે આશય...જે વચન...જે શાખ...જે પ્રવૃત્તિ...જે વર્તનથી તારા ગુણો વિકસે તે મેળવ.

### મુખુલુ !

મારે તો એટલું જ કહેવું છે. ગુણથી સાધુ, અવગુણથી અસાધુ, તો સાધુ યોગ્ય ગુણ ગ્રહણ કર. અસાધુ યોગ્ય દુર્ગુણ દૂર છોડ. પૂશથ્યંભવસ્યરિ મહાત્રાજ આપના હિતોપદેશે મહાત્મા મનકને સાધુ નહિ, મહાસાધુ યોગ્ય બનાવ્યાઃ હવે અમે છીએર્ઝુઆપના ચરણોપાસક, બનાવો આપના કૃપાના પાત્ર, આપ સાધુ ગુણના જદુગર છો. અમારા પર પણ ગુણનાં જદુ કરો, અમે પણ આપના જ છીએ. સ્વીકારો આપના ચરણો.



## ૩૭. પેહેઠ હિયાગુસાસાણ



મોક્ષાભિલાધી ?

મોક્ષની અભિલાધા પૂર્ણ કરવા જિનોપદેશિત માર્ગે નક્કર પ્રગતિ કરવી પડશે. આ શાસનમાં શિષ્ય થયા વગર કચારે પણ પ્રવેશ મળતો નથી. જે શિષ્ય બને છે તે જ જિન — શાસનના રાજમહેલમાં પ્રવેશ કરી શકે છે. કદાચ કોઈ પાછવા બારણેથી — એટલે પુણ્યના જે શિષ્ય બન્યા વગર ધૂસી જાય છે, તો તેની તરત ધરપકડ થાય છે. શાસના પરવાના તેને મલી શકતા નથી.

શિષ્ય એટલે શું ? માત્ર હાથ જોડીને બેસે તે ? નીચે બેસે તે માથું નમાવીને બેસે તે ? મુખથી હાજી હાજી બોલે તો ? ..ના ..ના. એ તો બધા નોકરનાં પણ લક્ષણો હોય. શિષ્યન્ન આટલું સહેલું નથી, આટલું હલકું નથી ..

“હિતશિક્ષાને ઈરછે તે શિષ્ય...“ પેહેઠ હિયાગુસાસાણ ”

ટોળા માટે કોઈ નિયમ, કોઈ સિદ્ધાંત, કોઈ આચાર કે પ્રણાલી ના હોય, પણ શિષ્ય માટે, સમુદ્દર માટે તો સુયોગ્ય નિયમો, અનુપમ સિદ્ધિઓ. અદ્વિતીય આચાર પ્રણાલી હોય.

“ આપણાથી કડક નિયમો ના પળાય, આપણાથી બંધન સહન ના થાય ” આ વિચારો જેના હોય તેને કહી દેવું ભાઈ, સાંઘ બનપાની આ જન્મમાં વાત કરતો નહિ, પણ હજી તો સર્કારું ક્ર્યુઝીયમમાં રહી શકે તેવો પણ પણ નથી. જંગલમાં જીવી શકે તેવો રાની

પશુ છે. મ્યુઝિયમમાં કે સર્કસમાં રહેવા માટે પશુને પણ કહક શિક્ષા સહવી જરૂરી છે, તો શિખ બનવા અનુશાસન કેટલું જરૂરી હોય તે તું વિચાર.

“ ગુરુ તેનું નામ જે શિખને ઉદ્ઘીર્તાળની અનુપમ પ્રક્રિયા દર્શાવે. ”

શિખ તેનું નામ જે હિતના અનુશાસનને ઈચ્છે, ચાહે, અભિલાષા કરે, પ્રાર્થના કરે.

હિતની ઈચ્છા એટલે ગુરુએ પોતાને સારી વાત કીધી હોય તે સ્વીકારી બેવી.

હિતની ચાહના એટલે ગુરુએ કોઈને પણ હિતથી વાત સમજવી હોય, તે સાંભળીને સ્વીકારી બેવી.

હિતની અભિલાષા એટલે જગતાં, બેસતાં, ઉઠતાં કથાંય કોઈની પાસે કોઈને પણ ગુરુએ જે હિતની વાત કરી હોય, તે સાંભળવાની સતત ઈચ્છા રહે અને મને જ હુકમ કર્યો છે, તેમ માની શિરસાવંદ્ય કરે. હિતની પ્રાર્થના એટલે ગુરુદેવ તથા સહવર્તીઓને વારંવાર લળી લળીને કરગરીને કહે, “ હું અજ્ઞાની છું. હું મૂર્ખ છું. હિતશિક્ષાનો ઈચ્છુક છું, મને વારંવાર કહેજો, મારી જરા પણ ઉપેક્ષા ન કરતા. મારી ગેરહાજરીમાં તમને પણ ગુરુ મહારાજે જે હિતશિક્ષા કહી તે સાંભળાવનો. ગુરુની આજ્ઞાને, હિતભાવનાને હું પણ સાંભળો, રવીકારી, આચરીને ધન્ય બનીશ. ”

મારા ગુરુના પ્રત્યેક આદેશો મારા સંપૂર્ણ હિત કરનાર — ગુરુની વાણીમાં ગુરસ્સો આવે — ગુરુની આંખ લાલ બને, પણ તેમના હૈયામાંથી મારા હિત માટે સતત અમૃતથ્યોત વહેતા જ હોય.

ગુરુનો પ્રત્યેક આદેશ — ચાહે એ કહકથી કહેલ હોય કે ઠંડકથી કહેલ હોય, પણ મારું હિત કરનાર જ.

ગુરુએ આંખમાં આંસુ સાથે વાંસો પંપાળતાં કહેલ વચન પણ

હિત કરનાર અને સત્તાનો વીજણો વીજના અમલદારની જેમ આંખમાંથી આગ વરસાવતા, બરાડો પાડીને પીડ ઉપર કોરડો મારીને કહેવ કઠોર આજા પણ મારું એકાંત હિત કરનારો.

આમ હિતના અનુશાસનને સ્વીકારું તો જ મારું શિષ્યત્વ સોણે કળાએ ખીલી ઉંડે. ગુરુના અનુકૂળ અનુશાસનમાં પ્રસન્ન રહું અને ગુરુના પ્રતિકૂળ અનુશાસનમાં ઉદ્ઘાસન બનું, તો મારું શિષ્યત્વ લાળ ઉંડે.

વિનય સમાધિના ચાર ભેદમાં પહેલો ભેદ હિતશિક્ષાની ઈચ્છા, ચાહના, અભિલાપાની પ્રાર્થના કરે.

માંગ્યા વગર મળેલ ચીજના મૂલ્ય ન હોય. કરગરીને વિનવીને જે ચીજ મળે તેનું આપમેળે જ રક્ષણ થઈ જાય.

પ્રાર્થનાથી જે મળે તેની પાછળ દિલ દેવાય.

દિલથી જે વસ્તુનાં જતન થાય, તેનાથી આત્માની જ્યોનિ પ્રગટે. પુનઃ પુનઃ વિચાર કરી લેજે ..ગુરુને બોલવામાં મજા નથી આવતી. ગુરુને રકમક કરવાનો કોઈ રસ નથી, ગુરુ કોઈ હુકમ કરવાના એદી નથી. ગુરુને અખંડ ચૌશર્યના સ્વામી કહેવરાવવાની કોઈ ભાવના નથી, પણ મારા ચરણે, મારા શરણે આવેલો ધન્યાત્મા પ્રભુ શાસન-દ્વારા મહાત્મા બની જાય એવી ભાવકરુણતા — ભાવદ્યા છે

અવેરી શાકભાજીની સભાળ રાજે ? અવેરી તો રત્નોની પરીક્ષા કરે અને રત્નના મૂલ્ય કરે. ગુરુ દેહની કાળજી ના કરે તેમનું કર્તાય દેહનાં લાવન — પાલનમાં સીમિત નથી. ગુરુ કે શેઠ પાણે પહેરેગીરનું કામ ન કરવાય. ગુરુ પાસે દેહની કાળજીની જ માત્ર વાત ના ઉચ્ચારાય.

ગુરુ આત્માની પરીક્ષા કરે, આત્મગુણોનું મૂલ્યાંકન કરે અને આત્મગુણોની અભિવૃદ્ધિ થાગ તેવાં શિક્ષણ આપે. યુનિવર્સિટીમાં એક

બે — ત્રણ — ચાર શીખવા ન જવાય. ત્યાં પ્રોફેસરને ન કહેવાય મને વાંચતાં શિખવાડો...ત્યાં સ્નાતક થંબા જવાય. શોધન કરવા જવાય. અને પી. એચ. ડી થવા થીસિસ લખવા જવાય. તેમ ગુરુ પાસે દેહની કોમળતા, દેહના લાલન — પાલનની વાત કરવી તે પણ અધ્યાત્મભાવેથી નિરપેક્ષ હોય તો ન જ શોલે.

ગુરુ પાસે તો એક જ પ્રાર્થના થાય જગતમાં દેહના વૈઘો ધણા હતા. ધનના કીમિયાગરો ધણા હતા, પણ એ બધાને છોડી દુનિયામાં જે ન મળે તે હિતનું અનુશાસન, હિતની શિક્ષા, હિતની ભાવના વેવા આપની પાસે આવ્યો છું.

હું મોહનો દાસ, કદાચ કોઈવાર આપના હિતના અનુશાસનની. ઉદ્ઘતાઈ, ઉપેક્ષા કરી દઉં — પણ તારક ! આપના ચરણમાં મારી એક જ પ્રાર્થના છે, મારા હિતની કથારે પણ ઉપેક્ષા નહિ કરશો. મને સારા ગુરુ નથી જોઈતા, સાચા ગુરુ જોઈએ છે. આલોકનું — આદેહનું હિત કરનારા માતાપિતા છોડ્યા છે. પરલોકનું આત્માનું હિત કરનારા આપ જ છો, તેથી આપના ચરણમાં આવ્યો છું. મારી ભૂલ થાય તો સુધારજો. આપ કહો 'અને સુધરું નહિ તો ઠપકો આપજો, ઠપકો સાંભળું' નહિ તો મારી નિર્ભર્ત્સના તિરસ્કાર કરજો. તિરસ્કારથી રીઢો બનું તો તાડના કરજો, પણ મને આપના તારક ચરણોથી કથારે ય દૂર ના કરશો. દુનિયામાં મને સારા કહેનારા ધણા મળવાના, પણ સાચો રાહ બતાવનાર કોઈ નહિ મળે. આપ જ મને શિલામાંથી મૂર્તિ રૂપે કંડારી થકો. હું આપની કલાનું એક શિલ્પ બનું તો પણ ધન્ય બનું.

પ્રભુ ! મને સારણ — વારણ — ચોયણા — પડિચોયણાથી ધન્ય બનાવજો. આપના પવિત્ર સમ્પ્રાણ્યમાં આપનાં તપ, ત્યાગ, જ્ઞાનની દિવ્ય જ્યોતિ મારા અંધકાર ભર્યા અંતરમાં જ્ઞાનના પ્રકાશ પાથરશે.

ગુરુદેવ ! હું દેહ કામી નથી — સુખ ઈરદ્ધક નથી. શાત્રા ઈરદ્ધક  
નથી, માન ચાહક નથી, સત્તાનો અભિવાપક નથી, પદને પ્રાર્થનો નથી.  
તારક ! આપના ચરણમાં આપના અદના સેવકની હેયાની  
આરજુ સાથે એક જ વિનવળી, કાકલૂટી, પ્રાર્થના છે. હું હિતના  
અનુશાસનની આપની પાસે પુનઃ પુનઃ પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના  
સાભળજો, સ્વીકારજો અને આપના શિખ્યનું સમર્પણ સંભળજો.  
સાધક બનાવી સિદ્ધ સમેં બનાવજો.



## ૩૮. વિચારણા | અરપગમરપગોળું

હુનિયામાં બની શકે કે સમાનવર્ષ, સમાન ઊંચાઈ, સમાનવય જોઈ કોઈ કોઈનામાં સમાનગુણ કલ્પી લે, પણ પ્રત્યેક વ્યક્તિએ પોતાના મૂલ્ય પોતાની શીરે જ વિચારવા જોઈએ.

હુનિયાના પ્રમાણપત્રો કોઈ દિવસ સાચા નથી હોતા. મોટાભાગે સમાજમાં સ્થાન મેળવવા પોતાનો પરિયય આપવા પ્રમાણપત્રો અપાય છે.

હુનિયા આને જેને સર્વકોઇ કહે છે, તેને જ આવતી કાંખે કહેશે કે આના જેવો કોઈ અયોગ્ય મેં જેણો નથી.

સ્વાર્થી વ્યક્તિઓ સાચા/દિલથી કોઈની પ્રશંસા — અનુમોદના કરતા હોતા નથી. જે આપણે કોઈનું ખરાબ બોલીએ તો આપણું પણ કોઈ ખરાબ બોલે; અને આપણે જે કોઈની પ્રશંસા કરીએ તો તે આપણી પ્રશંસા કરે. સ્વાર્થ જગતમાં ગુણ કોઈને ગુણી જોઈને કોઈ પ્રશંસા કરે છે, તેવું માની બેવાની અભિષે પણ ભૂલ ના કરી બેવી.

શિયાળ કાગડાભાઈના સ્વરની પણ સુંદર પ્રશંસા કરે છે. બિચારે બોણો કાગડો સુમજે છે, આ ભાઈ મારા સ્વરનો રચિયો છે, લાવ મારું જીંગીન જુંબળાવું, પણ જ્યાં કાગડો મુખ જોખે છે...ત્યાં શિયાળ કયાંક દોડી જથ્ય છે, કાગડો વિચારે છે, શિયાળ કયાં ગધું ?

તરત ભાન આવ્યું, શિથાળ તારું સંગીત સાંભળવા ખરેખર ઈચ્છિતું ન હતું. આતો મારા મુખમાંથી સહેલાઈથી પૂરી મેળવવાની તરકીબ.

સંસારી, દુનિયાદારી સ્વાથી માપણ આપણી પાઇળ આંટાફેરા કરે.....આપણને જ કહે : તું સર્વ શ્રોષ્ટ .....શું તારી શક્તિ, ત્યારે ખરેખર સાવધ બની જવું. પ્રશંસાના અનુપમ સુંવાળા બંધનમાં બાંધી તમને તેના કાર્યના કયાંક એવો હથો બનાવી દેશે કે તમને ખબર પણ નહિ પડે. બંધાયો, ફૂસાયો અને હવે આ પ્રશંસકનો શરણાશ્રિત બની ગયો...હવે બુદ્ધિ-શક્તિ સામર્થ્ય તારાં, પણ તું તેની દોરી સંચારથી ચાલતાં એક કઠપૂતલી સમે. પ્રશંસાની જંખનાઓ તારા હિતસ્વી આપણનોને દૂર કર્યા. નિઃસ્વાથી કયારે પણ પ્રશંસા નથી કરતાં, પરંતુ પ્રોત્સાહન આપે છે. આપણી ભૂલ સુધારે છે. પ્રશંસાની ભૂખ આપણને આપણાથી ઉચ્ચવાતાવરણમાં ઉચ્ચ વર્તુળમાં જવા દેતી નથી. પ્રશંસાની ઝેવના આપણને ઉચ્ચ આદર્શો, મહાનધ્યેયથી દૂર રાખે છે.

પ્રશંસાની ચાહના આપણને તુચ્છ વાતાવરણ, તુચ્છ વર્તુળ, તુચ્છ આદર્શો અને તુચ્છ મનુષ્યોની સમીપમાં લઈ જય છે. કોઈની પ્રશંસાનો ફૂટકો વાગે અને આપણે રહખરના દડાની જેમ ઊંચે ઊછળી-એ છીએ, હિતસ્વીને અવગાણીએ છીએ.

ખુશામત દ્વારા નવા સાધકની પ્રગતિ રોકાય છે. નવા સાધકને નિંદા તિરસ્કાર હતાશામાં નાખી દે છે. કોમળ બુદ્ધિવાળો બિનઅનુભવી કયાંથી ખુશામત અને નિંદાના વિશ્લેષણે કરી શકે ? વિવેક શક્તિ વિકાસ પાસી નથી, એટલે બે મીઠા શબ્દો દ્વારા કુલાઈ જય છે. બે કડવા શબ્દો દ્વારા તેની ભાવનાઓ કરમાઈ જય છે.

અહ્વયજ્ઞાની પ્રશંસા અને ખુશામતનું પૃથક્કરણ કેવી રીતે કરો.

શકે ? અદ્વિજ્ઞાની કહે અનુશાસન અને તિરસ્કાર, નિંદાનું પૃથક્કરણ  
કેવી રીતે કરી શકે ? મને સારો કહે તે મારા. મને ખરાબ કહે તે  
પરાયા.

ભલા ! પ્રશ્નસા તો સ્વરૂપની આત્મ પ્રગતિ માટે કરાય છે. ખુશામત  
સ્વની સ્વાર્થની વિલિ માટે કરાય છે. નિંદા સારાને પણ હવકો  
પાડવા કરાય છે. ભૂલનું સંશોધન સુધારવા માટે થાય છે. તારી પાસે  
આ દિવ્યદિષ્ટ ક્ર્યાંથી આવે ? તેથી તને થોડામાંજ ધાણું સમજવવું  
પડશે.

મનક ! તું પોતે જ તારા આત્મા વડે તારા આત્માને ઓળખ,  
સવદ્વારા સ્વનું સંશોધન.

વિદ્યાર્થી પણ તું અને શિક્ષક પણ તું. પરીક્ષાપત્ર પણ તારે  
જ કાઢવાનું, અને ઉત્તરપત્રમાં ગુણ પણ તારે જ મૂકવાના. તારા  
ગુણની પ્રશ્નસા પણ તારે કરવાની. તારા અવગુણની નિંદા પણ તારે  
જ કરવાની.

જેમ ખાનપાનમાં તારી પસંદગીને મુખ્ય રાખે છે, તેમ જીવન-  
પ્રગતિમાં પણ તું જ ગુણદોપનાં મૂલ્યાંકન અવમૂલ્યાંકન કર. તારો  
શિક્ષક કોઈ નહિ, પણ તારો ગુણપ્રેમી આત્મા જ, તારી નિંદા કર-  
નાર કોઈ નહિ, તારો જ તટસ્થ મધ્યસ્થ આત્મા.

જગતના પ્રમાણપત્રો ગમે તેટલા હો, પણ તેમાં સ્વની સાક્ષી  
સંમતિ ન મળતી હોય, તો એ બધા તો સુગંધ વગરના પુષ્પ, કુક્ત  
જોવાનાં અને ખુશ યવાનું, મેળવવાનું કંઈ નહિ.

જગતે ગમે તેટલો કાદવ ઉછાળ્યો, ધૂળ ઉડાડી, પણ સૂર્યને શું  
નુકસાન ? જેને ધૂળ ઉડાડી તેના ઉપર જ પડી. ભલા ! તું શુદ્ધ-

નિર્દેખ પવિત્ર છે, પણ જગત ક્યાંથે ચીંથે વીંટેવા રત્નનું મૂલ્ય સમજે ?

જગતના બહુધા જીવો કસ્તૂરી અને માર્ટીના અંતર ક્યાંથી જાણે ? એ તો કાળી એટલી માર્ટી અને કાળી એટલી કસ્તૂરી આવું જ માનનારા.

જગતમાં મુખ્યતથા એ ગુણ—દોષનાં પરીક્ષણ હોતાં નથી. બહુધા અનુકરણ હોય છે. ટોળાના નાયકે સારું કણું તો સૌ સાડું કહેશે. ટોળાના નાયકે ટીખળ કરી તો સૌ ટીખળ કરશે.

જગત એટલે મુખ્યતથા મૂર્ખ લોકનું ટોળું. તેમની કલ્પના, ભાવના, જ્ઞાન, બુદ્ધિ મુજબ લાગે તે સર્વોષ્ઠ. તેનાથી વિરુદ્ધ તેમની કલ્પના, ભાવના, જ્ઞાન અને બુદ્ધિમાં ન આવ્યું તે ખરાબ. ખુદનો ન્યાય ખુદની પાસે જ કરાવવો તે સાધનું પરમ કર્તવ્ય છે. જરાપણ લોગો ન થઈશ. જરાપણ કોમળ ન થઈશ. જેમ જગતના પ્રમાણપત્ર વડે આત્માને જાણવાનો નથી, તેમ એકવા તારા જ્ઞાન—ધ્યાન—તપ ત્યાગથી તારે તારા આત્માના સત્કાર સંસ્મારન કરવાના નથી, પણ કઠોર શિક્ષકની અદાથી આત્માને ઓળખવાનો છે. બેચાર પ્રશ્ન પૂછીએ એટલે જેમ જોટો માણસ પકડાઈ જય તેમ આપણો આત્મા પણ પકડાઈ જાય.

દુરેક પ્રેશનને અંતે પૂછજે, રાજ તને સત્તાવી નથી ગયો ને ? દુરેપ તને રુદ્ર બનાવી નથી ગયો ને ? બધું જ કર્યું, પણ તારો આત્મા આ પ્રેશનના જવાબમાં ગલ્લાં મારે, હા—ના કરી આમ ગડબડિયો જવાબ આપે, તો સમજજે—તારા આત્માના ચોપડાનાં પાનાંને પાનાં ભરેલાં છે. ક્યાંય જગા નથી, પણ એકજ ભૂલ છે. ક્યાંય એકડો નથી, એકડા વગરનાં મીંડાં છે. એક મીંડું નહિં, એક લાખ મીંડાં છે,

પણ એ બધાં મીડાં કહે છે, અમને કેમ નિષ્ઠળ બનાવો છો? અમારું શા માટે અવમૂલ્યાંકન કરો છો? અમે ઓટાં શા માટે? ભૂલ તમારી છે, તમે એકદો ન કરો. જે એકદો કર્યા બાટ મીંડાં મુક્યાં હોત, તો એક એક મીંડાંની — શૂન્યની કિંમત દશ ગણી થાત.

તારું મન જ તારી પ્રગતિ જાણો. બહારના લોકો બહારની વાત જાણે, તેઓ તેના વડે પ્રમાણપત્ર આપે એટલે જ શાખનો સાર છે “વિયાણિયા અખ્યાત મખ્યાણેણું” આત્મા સાક્ષી આપણે— હું તો નિન્ય સાક્ષી છું, તેથી તારી પ્રત્યેક પ્રવૃત્તિને જાણું. આત્મા કહેણે, હું તો તારી સાથે નિન્ય રહેનાર છું, અંતરનો અધિષ્ઠાતા છું એટલે પ્રવૃત્તિનો પડ્દો ચીરી વૃત્તિને નિહાળું. જગત પ્રવૃત્તિના સત્કાર કરે. તેને તે દેખાય અને આપણને આપણું બધું જ દેખાય. એટલે આપણે આપણને કહીએ : મારે તો વૃત્તિને જાણવાની છે—મને ક્યાંય રાગદ્વોપ ન સ્પર્શવા જોઈએ. રાગદ્વોપના એઠે આભડ્યા તો મારી બધી અમૃતસમી ધર્મક્રિયા વિપમય બની જાય.

પુ. શાખાંભવસ્ત્રરિ મહારાજ કહે છે : જે આત્માને આત્માથી જાણી રાગદ્વોપમાં સમાન રહે છે, તે પૂજાય બને છે, પણ પવિત્રતા વગર પૂજ્યતાને કોશોનું અન્તર છે. તેથી મારા મનક! તું પવિત્ર બન. આત્મસાક્ષીથી પવિત્ર બને, તેના જીવનમાં રાગદ્વોપના પ્રસંગ આવે, પણ સમૃદ્ધની રેતી જેવા. સમૃદ્ધની રેતી શરીરને સ્પર્શ ગણું ચાંટે નહિ, ઉલ્લા થાય એટલે ત્યાંજ ખરીદુંઝાય.

આ કળા ચિદ્ધ કરી પૃથ્વીચદ્ર ગુણ સાગરે દેહના મિલનમાં પણ આત્મા વડે આત્માને જાણ્યો. રાગના ભયંકર પ્રસંગમાં પણ હાથને હાથ મળે ત્યાં વિચાર થાય. આ ચીનો હાથ નહિ, આ પુરુષનો હાથ નહિ, ચૌતન્ય સાથે ચૌતન્યનું મિલન, બસ રાગદ્વોપની ઉપેક્ષા ચૌતન્યનું ઉદ્વીકરણ થયું.

મનક ! બસ એક જ કહું છું : જે આત્માવડે આત્માને સમજી  
ચૈતન્યનું ઉધ્વીકશણ કરે છે, તે પૂજય બને જ છે. તું ખુલ્હ બન,  
સિદ્ધ બન. એ જ આશિષ.

આચાર્ય ભગવત.....

મહાત્મા મનકને આત્મનિરીક્ષણ શીખયું. શું આપ અમારા  
જેવા વિદ્યાર્થીના શિક્ષક ના બનો ? અમ સમા અજ્ઞાની શિષ્યના  
દ્વાન દીપક ના બનો, શીખવો અમને પણ આત્મ-નિરીક્ષણની કલા.

જ્યારે આત્મા દ્વારા આત્મનિરીક્ષણ કરતાં શીખીશું, ત્યારે લોક  
સંજ્ઞા, ક્રીતિં દૂર સુદૂર ચાલી જશે અને જિનેશ્વરની આજ્ઞાપાલન  
દ્વારા ન ઈચ્છિયા છિતાંય પુરુષ પ્રબલ થશે. કરજો કરણા કૃપાનાથ !



## ૩૮. નાત્રથ નિજજરદૂયાએ તવ મહિટુજળ



ને ચંદ્રનકાપ દ્વારા દેવમૂર્તિનાં નિર્માણ થાય તે જ ચંદ્રનકાપનો  
કોઈક મૂર્ખ રહ્યો એ બનાવવા બળતણું તરીકે ઉપયોગ કરે અને કહે શું  
મેં ચંદ્રનકાપનો ઉપયોગ કર્યો નથી ?

ને પુરતકો દ્વારા હજરો વ્યક્તિત્વ જ્ઞાન મેળવી શકે, તે જ પુસ્તકનાં  
પાતાનાંને ફાડી ફાડી કોઈ અજ્ઞાની પડીકાં બાંધવા ઉપયોગ કરે, તો તે  
ઉપયોગ કર્યો કહેવાય કે દુરૂહપ્રયોગ કર્યો કહેવાય ?

પદાર્થમાનનાં મૂલ્યાંકન પદાર્થની દર્શિએ થાય અને તે ગોંધ  
રથણો, ગોંધ હેતુથી, ગોંધ વ્યક્તિત્વ કાજે વપરાય તો ઉપયોગ નહીં પાણું  
સહૃપ્યોગ. બાકી બધાં દુરૂહપ્રયોગ જ.

મનક ! તું સમજે અહિંસા, સંયમ અને તપ વગર ઉત્કૃષ્ટ  
ધર્મની આરાધના ન થાય. તારી ભાવના સનત સર્વેત્તામ ધર્મની આધનાની  
હોય. ભર્વથા—પ્રાણાનિપાત વિરમણ મહાપ્રાનના સ્વીકાર કરવા દ્વારા  
તું અહિંસક બન્યો. જોજાળવની કરેભિઅંને સ્વીકારી સંયમી બન્યો.  
હેવે તારા મનોરથ તપના. તું જ્ઞાની. તું વિદ્યાન. તું વિવેચક. જોજનના  
ત્યાગડ્રષ્ટ એક જ તપનો તું આરાધક ના બન. પ્રભુએ ફર્માવેલાં  
છ પ્રકારનાં બાબ્દ તપ અને છ પ્રકારનાં અભ્યંતર તપ દ્વારા સંયમી  
જીવનને સુશોભિત કરે.

પ્રભુની દર્શિએ આહારનો ત્યાગ પાણું તપ અને ઓછું ખાલું એ  
પણ તપ. જોજનમાં સરસતાનો ત્યાગ એ પાણું તપ... જોજનમાં ચીજો

ઓળી ખાવી એ પણ તપ... એક જગતાએ અંગોપાંગ સંકોચીને બેસવું એ પણ તપ... લોચ કરવા અને વિહાર કરવો એ પણ તપ... બહાર દેખાય તેવા તપની જેમ તારે મન તો અંતરની સાક્ષીએ થતાં એ પણ તપ. હદ્યની શુદ્ધ, શાસ્ત્રની ચર્ચા... શાસ્ત્રનું પુનરાવર્તન, શાસ્ત્ર-અર્થનું ચિંતન અને શાસ્ત્ર સમજવતાં પણ તપ... ધ્યાન અને કાઉસ્ટ્રેગ પણ તપ.

શાસનની દિલિએ બાર પ્રકારના તપમાંથી એક પણ તપનો આરાધક તે તપસ્વી. શાસન સમજેલ બારે પ્રકારના તપની આરાધનામાં ઉદ્ઘત રહે અને બારે પ્રકારના તપસ્વીને નમે, વંદે, પૂજે અને બહુમાન કરે.

પણ જગત તો તપસ્વી આકારના ત્યાગીને જ કહેશે. બીજાં બધાં તપ એવાં છે, સાંદર્ક ગુપ્ત રીતે કરી શકે, પણ અલુસણ એટલે ઉપવાસ એવું તપ છે કે દેહ તુરત ચાડી ખાઈ જય. શરીરસમાં અત્ત ન જય એટલે એકબે છેવટે નીજે દિવસે તો સુકાવા લાગી જાય. પરસે વરસે તપમાં આગળ વધતા જય. આત્મગુણોની અલિનૃદ્ધિ થાય, પણ શરીર તો ધસાતું જય. લોહી અને માંસ સુકાયાએટલે હંડકા ગળવાં લાગે. તપ દ્વારા પુણ્ય પ્રભળ થાય. હજરો લોકો દર્શનાર્થે આવે. જગત બીજા તપસ્વીને જેઈ ના શકે, પણ ભૂખનું દુઃખ એવું છે કે ગાંડા અને ડાઢા સૌને ખબર પડે.. જેમાન અવરુદ્ધમાં પણ આહાર પચાવી જય.

આહાર સંજ્ઞાને વશ થયેલ જગતના જીવો ઉપવાસી તપસ્વીને જુએ અને તેમના શિર ઝૂકી જય એક કલાકમાં એક હજરવાર લોલની થાદ આવે. એક દિવસમાં સો વાર ખાઈએ તો પણ બીજે દિવસે પાછા ભૂખારવા ! ધૂન્ય છે આ સુહાત્માને. સંયમ સાથે તપ... ધના અલુગારના ભાઈબેન જેચાં... તપસ્વીના વંદન કરે, પૂજન કરે,

સતકાર કરે, સન્માન કરે, તેમની સુનુંતિ કરે, તેમની કીર્તિના ગુણ-ગાય. જગત જ્યારે તપસ્વી દ્વારા ધન્ય બની રહ્યું છે, ત્યારે તપસ્વીએ સાવંધ બની જવાનું... બીજા કોઈને કોઈક વાર પરિષ્ઠ ઉપસર્ગ આવે ત્યારે તપસ્વીને સહેલ સતત પરિષ્ઠ ઉપસર્ગ આવે.

સારી દુનિયા શિર ઝૂકાવતી હોય, ગુરુ સુખશાતા પૂછતા હોય, ત્યારે નપસ્વી પોતાના આત્માને પ્રશ્ન પૂછી રહ્યા હોય, સાધુ ! તેં તપ થા માટે કચ્છું ? આલોકના માન સન્માનની ભૂખે ? સૌ થાતા પૂછે માટે ? સૌ ગૌરવ કરે માટે ?

પુણ્ય વધે તો સૌભાગ્ય નામકર્મ ઉદ્યમાં આવે માટે ? શરીર સૂક્ષ્વવા માટે ? શરીર નીરોગી બનાવવા ? તપ દ્વારા લભિધારો પ્રાપ્ત થાય અને પ્રભાવક થવાય માટે ? તપ દ્વારા વચન સિદ્ધ થાય માટે ? દુશ્મન પણ ચરણમાં ઝૂકે માટે ? બિલુદ મળે માટે ? ઉત્સવ મહોત્સવ થાય, કંકોત્ત્રીમાં નામ આવે માટે ? બધાં ગૌરુ બની તારી મુખ્યના થાય તે માટે ? આ લોકનો કયો હેતુ સિદ્ધ કરવા તપ કચ્છું ? તું આસ્તિક છે ? જન્મ અને મરણ સ્વીકારે છે ? પાંપ અને પુણ્યને સ્વીકારે છે, તેથી પરલોકની સ્થાન અર્થે તપ કચ્છું ? આ જન્મમાં તપ કરીએ તો બીજા જન્મમાં રાજ, ચક્રવર્તી, ઈન્દ્ર બનાય માટે ? બીજા જન્મમાં સૌંદર્ય મળે, સૌભાગ્ય મળે કાંતિયુક્ત દેહ મળે માટે તપ કચ્છું ? યથાં કીર્તિની કામનાથી તપ કચ્છું ?

રહ્યેટો એક હોય છે, ઝૂપણ સૌના ધ્યેય અલગ હોય છે. બોલ આત્મનું ! આજ મારી સાથે વાત કર. હાંડકાં ઓગળી નાખે એવું દુષ્કર તપ છે. ધણી વાર તો મને જ પ્રશ્ન થાય છે. આ શરીરે તપધર્મ આચરવામાં આટલી મદદ કરો. કલ્પનામાં નથી આવતું કે આહાર કેમ દૂધયો ? શું પારણુંમાં સુંદર આહાર મળે માટે ? ગોચરી જવાની માથાકૂટના કરવી પડે માટે ? જો આ બધા તારા ઉદ્દેશ હોય તો

કહેણું પડે કે તે માનવજનમનો સદ્ગુપ્યોગ નહિં, દુરુપ્યોગ કર્મો. લડત  
થડી રહ્યો છે, પણ ઉદ્દેશ ભૂલીને!

ભલા સાધક! ઓ મહાતપસ્વી! તું તો યુધ્ઘની લેરી જેવો  
ચુંબકાર કરે? ચુપ થા. મારો પાસે આવી હલકી વાત ના કર.  
પ્રભુએ ફરમાવ્યું છે... નન્નતથી નિજજગ્યાએ તપ મહિંગાજ” કર્મ  
નિજજરૂના એક પવિત્ર ધ્યેય સિવાય બીજ કોઈ પણ ધ્યેયથી તપ  
કરવાનું નહિં.

જગતમાં નામ, ક્રીતિ, વંદન, પૂજન મેળવવાના અનેક રૂપ્તાઃ  
છે. શરીરને સૂક્પવવાની અનેક પ્રક્રિયા છે. પરલોકમાં સુખ મેળવવાના  
અનેક ઉપાય છે. આ બધાં તુચ્છ સાધનો માટે તુચ્છ વાસનાની પૂર્ણ  
માટે નપથમનો ઉપયોગ ન થાય... તપતો આત્માની શુદ્ધિ માટે, વિચા-  
રોની પવિત્રતા માટે, આહારની આસક્તિ દૂર કરવા, આહારારી સિલ  
પરમાત્માના મિલન માટે કરવાનું, કર્મરજને હટાવી પરમાત્મપદની  
પ્રાપ્તિ માટે કરવાનો.

પરમાત્મા મહાવીર ભગવંત મારા આરાધ્ય દેવ છે. તેમનું જીવન  
ચરિત્ર મારે સદા આદરશીય છે. તદ્વભવ મોક્ષગામી પરમાત્માએ  
નિકાયિત કર્મો સામે જ'ગ જોલવા સાડા બાર વર્ષ તપ કર્યું, તો મારા  
તો અનંત અનંત જન્મનાં કર્મો બાકી છે. મારી મુક્તિ આ ભવમાં  
નથી, એ નિશ્ચિત છે; એટલે મારે તો ભગવાનનું શરણ લઈ કર્મ  
ક્ષય માટે અવશ્ય તપમાં અધિષ્ઠિત બનવાનું. તપ—ધર્મમાં સ્થિર  
બનવાનું.

હું કંઈ તાપસ નથી, શરીર સુકાવવા તપ કરું. હું તો સંયમી  
છું. નિર્જરાનો ઈચ્છુક છું. તેથી કર્મણ તપનાત્ મારા કર્મને તપા-  
વા તપ કરું.

હું આહારનો ત્યાગ આહારના ભર્યકર તોઢાન સમજુને કરું,

ઉપવાસ કરું, તેથી ગુણો સાથે વાય થાય, દોપોનો નાશ થાય. આ ભાવનાથી તપ કરું.

જિનશાસનમાં સાધુ તપસમાધિમાં અધ્યિગિત બને. મારી તપ-સમાધિ એટલે મને તથા દુઃરા મંગલની પ્રાપ્તિ થાય. તપ દુઃરા આત્મિક સ્વારથની પ્રાપ્તિ માટે હું તપમાં સ્થિર બનું છું.

મનક ! મોક્ષે જવા શુક્લધ્યાન નામનું ચર્ચાશ્રોષ તપ જેઠીએ એટલે બાહ્યતપ દુઃરા અભ્યંતર તપનો આરાધક બન. નારો તપધર્મ તારી નપસમાધિ બનો.

ગુરુદેવ ! આધિ, વ્યાધિ અને ઉપાધિ છોડયા .. પણ મનમર્દીને સાધુજીવનમાં પણ એક નવી દુનિયા દિલ્લી કરી દીધી છે. આપના આશિવર્દિ સર્બયજુ આધિ સુયોગ્ય વિચારમાં સ્થિર બનાવે.

જગતના કોઈ પણ ભૌતિક હેતુથી નહિ, પણ કર્મ નિર્જરાના પ્રધાન હેતુ દુઃરા તપના આરાધક બનીએ તેવી દૂરા કરો. અનુગ્રહ કરો. આપની મહેરભાનીએ અમારા મનોરથ પૂર્ણ થાય.



## ૪૦. ક્રુબજેગી



પૌળું એટલું સોનું નહિ. કાળી એટલી કસ્તૂરી નહિ. કાળા તો મરી પણ હોય. પુસ્તક પાસે હોવા માત્રથી વિદ્યાર્થી નહિ. એ તો અભિષ્ટ ફેરિયો પણ હોય.

પુસ્તકોનો ગંજ કોઈ ગ્રંથપાલ ( વાઈબ્રેશિન ) પાસે પણ હોય અને કોઈ પુસ્તકવિકેતા પાસે પણ હોય.

માથું મૂહેલું કોઈ બાલ્યાનું પણ હોય અને શ્રમણાનું પણ હોય. બિધુ મનક !

તું નિગ્રંથ શ્રમણ પરમાત્મા મહાવીરનો સાધુ છે. તારે સામાન્ય જેગી, યતિ, બિંગિયાની જિંદગી જીવાની નથી. તારે તો આત્મામાંથી પરમાત્માપદે જવાનું છે. તારી જિંદગીનાં મૂલ્ય કદાચ તું ના સમબે, પણ હું તો સમજું છું. માનવીની જિંદગીના એક અંતમુંહૂર્તનું તને મૂલ્ય સમજાય છે. ? બેટા ! એક અંતમુંહૂર્તમાં તું ક્ષપકશોણી પ્રાપ્ત કરો શકે છે. એક સમયમાં સાત રજજુ ઊંચે જઈ શકે છે. શાશ્વત નિવાસી બની શકે છે. તારી શક્તિ નિહાળી છે. તેથી જ એ શક્તિ એળે ના જાય. એ શક્તિ કેંદ્રિત થાય તે પહેલાં તેની અંદર આનંતનાં બીજા રોપી બાંન.

કેરીનો ગોટલો ઉકરડામાં નાખો, તો પડયો પડયો સુકાય જાય છે. કેરીના ગોટલાને જેતરમાં નાખો તો એકમાંથી અનેકને પેદા કરે, યાત્રા-

એના તાપ હરે, ભૂપ્યાની કૃધા હરે, રોગીના રોગ હરે અને સહુને સ્વાસ્થ્ય આપે. આ શક્તિ યોગ્ય સંસ્કારને અભાવે વિનાશ પામે.

ઓ મનક ! તારામાં પણ સંસારીના સંતાપ હરવાની શક્તિ છે. તારામાં પણ અનેક જ્ઞાનપિપાસુઓની જ્ઞાનપિપાસા પૂર્ણ કરવાની શક્તિ છે. તારામાં પણ ભવરોગ હરભાની શક્તિ છે. તારામાં પણ આત્મિક સ્વાસ્થ્ય પામવાની પમાડવાની શક્તિ છે.

પણ એ શક્તિ સહજમાં વિકસતી નથી. જેમ સો વાર ફીણ્યા વગર ધી વિષમારક ના બને, ધીને વિષમારક ઔષ્ણ બતાવવું હોય તો સો વાર ફીણવું જ પડે, તેમ સાધુ તારે તારા લક્ષ્યને શાસોચ્છ્વાસમાં ધૂંટ્યું જ રહ્યું !

બળદગાડીનો ચલાવનારો નીંદ બેતો જાય અને ગાહું ચલાવે, તો ચાલે, પણ મોટરનો ડ્રાયવર ગાડી ચલાવતાં નીંદ બે તો શું થાય ? આગળ વિચાર. મોટરની ડ્રાયવર ગાડી ચલાવતાં આગળ પાછળ જતાં આવતાં બોકેને જોઈને તો ચલાવે, પણ વિમાનનો ચાલક જરા અસા-વધાન બને તો શું, થાય ? વિચારતાં જ ભયંકર હોનારત થાય.

સાધુ એટલે ચૌદરાજલોકના જીવનો અભયદાતા. તારા મનમાં, તારા વચનમાં, તારી કાયામાં કંઈક ઉથલપાથલ થાય, તું જિનાજી ભૂલે તો ? શું થાય ? આંખ મીંચી તારા અંદરનો અવાજ સાંભળ. તું ગભરાઈ ઊઠીશ. સહન નહિ કરે, તેથી જ સાધુ મનક ! તને કહું છું, “ જે ધૂવળોગી છે તે ભિસુ ”

થમ, નિયમ, પ્રાણાયામ, આસન કરી દીધાં એટલે કદાચ તને કોઈ યોગી ‘કહી દેશે, પણ તું’ એવા સસ્તા હવકા પદનો માલિક બને, એ મને ના ગમે, ધૂવયોગી બનવાનું છે.

તું કહીશ ધૂવયોગી એટલે નિશ્ચયયોગી કરીશ. ના ભાઈલા ના. ધૂવયોગીનો ‘માર્ગ’ એટલો સહેલો નથી. મહાગ્રાત તો તે ‘સ્વીકાર્પ’ છે.

સાધુ જીવનમાં તું વ્યવસ્થિત થઈ ગયો છે એટલે તું સ્વીકારની પૂર્ણ-  
હૃતિ કરીશ અમાં કોઈ મોટી વાત નથી.

ધૂવયોગી એટલે તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક પ્રવૃત્તિ તીર્થ-  
કરને સમર્પિત તીર્થંકરની આજી મુજબ જ તેનાં મન, વચન, કાયા  
પ્રવર્તે. તીર્થંકરની જ્યાં આજી ન હોય ત્યાં સાધુનું મન સંમુચ્ચિદ્ધમ.

તીર્થંકરની જ્યાં આજી ન હોય ત્યાં તેની વાણીને મૌનનું  
શરાણ. તીર્થંકરની આજી ન હોય ત્યાં શરીરને લક્ષ્ય હોય તેવી દશા.

ધૂવયોગી પરિલેખણ કરે ત્યારે કપડાં ફેરવી ન જય.

ધૂવયોગી પરિલેખણ કરે ત્યારે કપડાંના ડાઘ ન જુવે.

ધૂવયોગી પરિલેખણ મન ફ્લાવે ત્યારે ના કરે. જેમ તેમ ના કરે,  
ગામનાં ગપ્પાં મારતાં ના કરે.

ધૂવયોગી પરિલેખણ નિયમિત સમયે કરે. જીવદયાના ઉપયોગપૂર્વક  
કરે. દોષ વર્ણને કરે, સાવધાન બનીને કરે, મૌનપૂર્વક કરે. નાના મોટાના  
વિવેકપૂર્વક કરે, શાસ્ત્રના આદેશ અનુસાર પરિલેખણ કરતાં પહેલાં  
પ્રતિલેખના કરે, પછી ગ્રમાર્જના કરે. કાંજે બેતા કોમળ દશીના  
ભાગથી લે. વધુ શું કહું. ધૂવયોગી એટલે વિધિ નિર્ધારના ઉપયોગ પૂર્વક  
પ્રત્યેક વિધિ કરે.

ધૂવયોગી એટલે પોતાનું નામ ભૂલી જય, પોતાનું ગામ ભૂલી  
જય. અરે દેહને પણ ભૂલી જય. દ્વાદશાંગીમય બની જય. પાંડેલું  
ફળ જુઓ તો તેને દ્વાદશાંગીમાં પ્રક્રિપેલ પુરુગલના ધર્મ યાદ આવે.

કોઈ રૂપલાવણ્ય યુક્ત સુંદરી દેખાય, તો તેને લાગે જિતજન્મા  
લિષેકમાં ભક્તિધેલી બનેલી દિગ્નુક્કમારિકા હશે અથવા વિચાર આવે,  
કેટલો ધન્યાત્મા છે! જિતજન્મામાં સરળતા અને નિરભિમાન દશા કરી  
છે, તેનાં કેવા સુંદર ફળ લોગવે છે?

ધૂવયોગી એટલે તેના શાસોચ્છ્વાસમાં આગમ રમે. સ્વઅનમાં પણ આગમનો અભ્યાસ કરે. આક્રાવ અને 'સંવરના જ વિચારમાં' ક્યાં આગમમાં આત્માનુ' વર્ણન, ક્યાં આગમમાં તત્ત્વોનુ' વર્ણન, ક્યાં કેત્તનુ' વર્ણન, ક્યાં આગમમાં આચારનુ' વર્ણન..

ધૂવયોગી એટલે તેના આગમ પુસ્તકમાં નહિ, કબાટમાં નહિ, નોટમાં નહિ, ગુરુ જાણે તેમ પણ નહિ, આગમમય તેનાં મન, કાયા પણ આગમની અનુસાર જ પ્રવૃત્તિ કરે.

ધૂવયોગી એટલે સાધુજીવનની એક-એકે કાળનુ' મૂલ્યાંકન કરનાર. ધૂવયોગી પાસે ઢીલી દાળ જેવી વાત ન હોય. દીક્ષા લીવે તો વર્ષો થયાં, પણ શું કરું? તબીયત સારી ન હતી, ખાસ બુદ્ધિ નહિ, અનુકૂળ રાયોગ નહિ, ભણવાનુ' મન થાય ત્યારે ભણવનાર નહિ, ભણવનાર હોય ત્યારે પુસ્તક નહિ, પુસ્તક આવે ત્યારે વિહારનો સમય, અહિતનો સમય, આવી વેવલી વાત ન કરે.

ધૂવયોગી એટલે કહે : દેહ છે એટલે દેહના ધર્મો રહેવાના. પુણ્ય પ્રભલ નથી એટલે અનુકૂળ સંયોગ ન પણ મળે, પણ પ્રભુશાસન અને સંયમ મળ્યું, પછી બીજુ' શું જેઈએ? પ્રભુશાસન અને સંયમમાં તાકાત છે. દરેક પરિસ્થિતિ ઉપર વિજય મેળવી પ્રતિપળનો ઉપયોગ કરવાની.

ધૂવયોગી કહે : જિનશાસનનો દરેક યોગ એવો અનુપમ છે, જો મને સાધતાં આવડે, મેળવતાં આવડે, તો મોક્ષ મળે. મારે માટે રોગ પણ કર્મ નજ્ર રાકારક, મારે માટે પ્રતિકૂલતા, સહનશીતતાદાયક, મારે માટે પુસ્તકનો આભાવ ગુરુ સાનિધ્યનો દાયક.

બેટા મનક !

કુવો પુણ્યશાળી છે. ચોસઠ ઠંડ્રો, અસંખ્ય દેવો તારા ભાગ્યની ઈર્પા કરે છે. મારા જેવા પ્રોફ્ને પણ થાય. અમે બીજ નંબરનો એક

ધર્મો કરીને આવ્યા, દેવાળું કાઢ્યું, હવે બીજો ધર્મે લાગ્યા. તું આવી બાલ્ય ઉંમરમાં મનમાં આશાઓ ઉર્ભર્યાં જાગે તે પહેલાં સાધ્યું બન્યો. બસ. ધૂવયોગી બન, તારી પ્રત્યેક ક્ષાળને, તારી પ્રત્યેક પ્રવૃત્તિને જિનાકાથી શોભાવી હે, અમારા જેવા ખ્રોણોને પ્રેરણપાત્ર બન.

મહાત્મા મનક તો છ મહિનાના અલપસમયમાં ધૂવયોગી જની જિંદગીને જીતી ગયા. હવે આગિય અમને આપો સંયમજંગમાં શુરા બનવાના !



## ૪૧. અવિહેકયે જે સ લિકુભુ



સત્તાધીશ બલવાન સામે જૂકી જવું અને કીડી સમા નિર્બલ  
સામે કટક લાવવું એ દુનિયાદારીની શીત છે. જ્યાં જવાબ ન આપી.  
શકે, ત્યાં મૌન રહે એ સંસારી.

ભૂખ હતી નહિ એટલે ખાધું નહિ, તો ઉપવાસી કહેવાય ? શરીર  
રોગિષ હતું એટલે થી છોડી, તો ત્યાંગી કહેવાય ? પાપ કરીને  
આવ્યો છે. પેસો હાથમાં આવતો નથી તો નિષ્પરિગ્રહી કહેવાય ?

કૃધા સમયે ઊવાસનો લખાવો લુંટવામાં મજા, યૌવનમાં લેણો  
છોડવામાં શૂરવીરતા, ચારે બાજુ સમૃદ્ધિની છોળો ઉછણતી હોય ત્યારે  
સંસારને લાત મારવામાં સમર્થતા.

શૂરાના હાથમાં સમયેર શોલે, સમજુંને સાધુતા વ્રત શોલે.

મનક ! વ્રત નહિ, મહાવ્રત લીધાં છે. એક નહિ, પાંચ લીધાં  
છે, પણ એકલા ઝડથી ઉદ્ઘાન ના શોભે. ઉદ્ઘાનમાં વૃક્ષો પણ હોય,  
છોડ પણ હોય, લતા પણ હોય, ડરિયાળી ભૂમિ પણ હોય; તેમ તારા  
સાધુજીવનના ઉદ્ઘાનને શોભાવનારાં મહાવ્રતો રૂપી વૃક્ષો તો હોવાં જ  
ઓઈએ, પણ રાંત્રભોજનનો ત્યાગ, ખુલ્લા માણે અને અહવાણે પગે  
વિહાર, લોય રૂપ અનેક સુંદર છોડ અનિવાર્ય ગણાય. શાન્તિ સરળતા,  
ઉદારતા, મૌન વૃત્તિ રૂપ લતાઓ કૂલી ફાલવી ઓઈએ. લિકુભુ બનવા  
અનેક મુખ્ય નિયમો, અને પેટા નિયમોનું પાલન ખૂબ જરૂરી છે, પણ  
આ બધામાં તારે એક મુખ્ય ગુગુ પ્રામ કરવાનો છે. અવિહેક  
અનવાનું છે.

‘સાધુ થયો એટબે ત્યાગી થયો, જ્ઞાની થઈશ, વિદ્વાન ભનીશ, હજરો જિજ્ઞાસુ આવશે, કેટલાયે ગામ ગપ્પાં મારનારો આવશે, તારે સૌને સતપથપર દોરવાના છે, તારે નેતા બનવાનું છે, ઉન્માર્ગથી હૂર કરવા જેહાદ જગ્ગાવવી પડ્યે. અસત્યનો પ્રતિકાર કરવો પડ્યે, પણ કંયાંય ક્યારેય જોઈનો તિરસ્કાર કરવાનો નહિ. ભૂલતો નહિ. તું સાધક છે, તારામાં ધીર્ય જોઈએ, ગાભીર્ય જોઈએ, અજ્ઞાની સામે પણ રોપ નહિ કરવાનો, જ્ઞાનીનો પણ દોપ નહિ કાઢવાનો, પાપીનો તિરસ્કાર નહિ કરવાનો, સમયનો હુર્ચય કરનાર સામે પણ અપમાનથી નહિ વર્તવાનું. રાજક્ષા, લક્ષ્ણક્ષા, દેશક્ષા, ખીક્ષાના આસક્તને તું જવાબ આપવામાં સમર્થ હોય, બધાંનાં મુખ બંધ કરવાની તારામાં શક્તિ હોય, પણ તિરસ્કાર ના કરાય.

વીતરાગની ક્ષમા કાપડનું હથિયાર નથી. વીતરાગની ક્ષમા શૂર-વીરનું શલ્ય છે. તારું દિલ કદાચ અધીરું થઈ જાય તો વિક્ષા કરનારને જોઈને એક ખૂણામાં જઈ પ્રેમથી સમજવજે. થાસનદેવોને પ્રાર્થના કરજે, તેઓની આદત સુધરે તેવો પ્રયત્ન કરજે, પણ તિરસ્કાર કરતો નહિ.

તું સાધુ છે. ચોરાથીલાખ જીવયોનિના અનંત અનંત પ્રાણીનો, જીવગણોનો તું ગુરુ છે. ભૂલ કાઢે તે ગુરુ કે ભૂલ સુધારે તે ગુરુ? રસનામાં પથર છે એવી ભૂમ બીમાર અથક્ત મારે, સમર્થ બલવાન તો પથર ઉઠાવે, પોતે પડ્યો ન હોય તોથી બીજાને પતનમાંથી બચાવે.. તું જિનાજ્ઞાલંજકનો પણ તિરસ્કાર ના કરે. તું જ્યારે જ્યારે તિરસ્કાર કરે, ત્યારે ત્યારે કરજે તિરસ્કાર એલા અધમ અધ્યવસાયોનો, અધમ-કર્મનિ જેણો આ સિદ્ધસદૃશ આત્માઓને આજે એક રાજ્ય, એક સી અને પારકી પંચાતમાં લપેટી દીધાં છે,

અગાધ જ્ઞાનના માલિક ચૌદ પૂર્ણે એક અંતમુંહૂર્તમાં

પૂર્વાનુપૂર્વી અને પશ્ચાતનુવીંથી સ્વાધ્યાય કરી શકે તેવાં પાંચદશ સાલની નકામી હુંસાનુંસોથી મેળવેલી રાજકીય ખટપટોમાં સંભેદાય ખરા ? જિનઆગમનાં નિર્મણનીર પીવાનાં છાડી વિકથા રૂપ ગટરનાં પાણી પીવે ?

પ્રલો ! ભક્તિ આપો, સન્માર્ગ દેવવાની બુદ્ધિ આપો, બળ આપો ધર્મતીર્થ પ્રવર્તવવાનું, મારાથી આ સહન થતું નથી. તિરસ્કાર તો પોતાની આસક્તિનો બીજ કોઈનો ય નહિ.

મનક !

સિંહ ભૂષ્યો રહે, પાળ ધાસ ન ખાય; તેમ શક્તિ હોય, સામર્થ્ય હોય, જ્ઞાન હોય, જવાબ દેવાની તાકાત હોય, વાદવિવાદ કરી કોઈને પરાસ્ત કરવાની તાકાત હોય, છતાંય કોઈનોય નિરસ્કાર નહિ કરવાનો, કોઈને દુઃખ લાગે તેમ નહિ વર્તવાનું. કોઈના દિવની કૂણી લાગણી દુભાય તેમ નહિ કરવાનું.

તારા હૈયામાનું જીવમાત્ર પ્રત્યે શુભભાવ છે. જિનાજ્ઞાને તું સમર્પિત છે. તારી પાસે શબ્દોનો તોટો ના હોય, આચાર્ય ભગવંત સાથે ચર્ચા વિચારણા કરતાં બોલીશ : શું કહો છો ? કેમ કહો છો ? એ બધું ના સમજાય.....આવું બોલીશ તો યોગ્ય કહેવાશે ? તારી વાત કોઈ દાદરામાંથી સંભળે અને નિર્ણય કરી શકે ખરું કે તું વહીલ સાથે વાત કરે છે કે સમવયસ્ક સાથે વાત કરે છે. આપ ફરમાવો, મારી બુદ્ધિ અહેંએ છે, મને 'સમજતું' નથી. આપ આસન ઉપર બિરાજે, મને લાભ આપો, મને તારો, મારા ઉપર ઉપકાર કરો, આવા શબ્દો સંભળાય, અને આગંતુક કહી દે : અહીં જ્ઞાની ગુરુ છે, વિનયી ગિય છે.

યોગ્ય વ્યક્તિનો ઉચિત આદરે નહિ, તો વિનય ક્યાં ? વિનય વગર સ્વાધ્યુતા થોબે કયાંથી ?

જેમ અયોગ્યનો અનાદર નહિ કરવાનો, તેમ યોગ્યના સન્માન પણ અવશ્ય કરવાના. પૂ. હરિભટ્ટસ્કુરિ મહારાજ કહે છે : બીજા મહા-પુરુષો અવિહેડનો અર્થ કોથ નિષ્ફળ કરવો તેમ કહે છે.

મનક !

યાદ રાખી લે. સાધુનાની મજા તેના ભવ્ય પાલનમાં છે. સાધુનું મુખ સોહમાણું હેઠ છે, એટલે દુનિયા તેની પાસે નથી આવતી. દુનિયા તેની સાચી આરાધના જોઈને ચરણરજ લેવા પડાપડી કરે છે, તેથી તારે ખૂબ સાવધાનીથી જીવવાનું છે. શક્તિ છનાં અયોગ્ય વિકથા કરનારાઓના અપમાન નહિ કરવાના, શક્તિ સમજ મેળવીને યોગ્યના ઉચિત સન્માન દિલનાં અદકેરાં ભાવથી કરવાનાં.

વિપરીત—અયોગ્ય દેખતાં કોથ આવી જાય, ત્યારે પણ તેને અંદર સમાવી લેવાનો, નિષ્ફળ કરી દેવાનો તો તું અવિહેડક થઈશ. અને તે દૂરા તારી સાધુતા પૂર્ણ કલાથી શોભતા ચંદ્રની જેમ સુશોભિત લાગશે.

આઠવર્ષના બાળમુનિને તે સમયના શાસનના ગચ્છયોગી પૂ. શય્યભવસ્કુરિ મહારાજના એકના એક પનોતા પુત્રને પણ સંયમજીવનમાં આટલી સૂક્ષ્મ સાવધાની રાખવાની પિતા બાલક જાળીને માફ કરતાં નથી. આઠ વર્ષના બાળકને પણ કંડક નિયમ પાળવાના વિકચામાં, પાપમાં, ગઘ્યામાં. આસકતનો પણ તિરસ્કાર નહિ કરવાનો. આપણે શું કરવાનું ? સાધુ સાધુતાનો તિરસ્કાર કરે.....અપમાન કરે. પોતાનો સહવર્તી સાધક હીણો દેખાય, જીણો ' દેખાય, તેવું સ્વર્ણમાં પણ કરે ?

આ જિનશાસનમાં લંઘુસાધુનો પણ તિરસ્કાર વળ્યો છે, તો પડીલ સાધુની અવહેલના તો ક્યાંથી થાય ? સમુદ્ધાયની શોભાની પુઞ્ચ કરનાર શાસનની પ્રભાવના કરનાર જ્ઞાની તપસ્વીનો તિરસ્કાર

તો શું તેમને અરુચિ થાય તેલું પણ ન કરે. પ્રભુ શાસન ફરમાવે છે, સમજાવે છે કે તું નાના સાધુનું પણ અપમાન કરીશ, તિરસ્કાર કરીશ તો તેં પરમેષ્ઠ પદનું અપમાન કર્યું કહેવાશે. આચાર્ય, ઉપાધ્યાય, વ્યાખ્યાનકાર આ બધા કયાં કર્મના ઉદ્યથી થાય ? તને ખબર છે ? તીર્થંકર નામ કર્મ જેવા પુણ્ય કર્મના આણ પાતળા ઉદ્યના સહારાથી વડીજના, શાસન પ્રભાવકના અપમાન કરીશ, તો તું તીર્થંકર નામ—કર્મ સદશ જેવા પુણ્યકર્મના ધારક પુણ્યશાળી આત્માની આશાતનાનો ભાગી બનીશ.

પૂ. હરિલદ્રસૂરિ મહારાજ તો દશલૌકાલિકની ટીકામાં ફરમાવે છે : અવિહેડ એનો એક અર્થ “કોઈનો તિરસ્કાર નહિ કરવો” એ છે અને બીજો અર્થ એ છે “યોગ્ય ઉચિત આદર આપવો.” જો તું યોગ્યને ઉચિત આદર આપીશ તો તારી સાધુતા શોભશે.

જે વ્યક્તિ જે સન્માનને યોગ્ય હોય તેનું તે રીતે સન્માન કરીશ તો જ સાચો સાધુ બની શકીશ.



## ૪૨. પુઠવી સમે મુણી હવિજજા

માતાપિતા વાન્સલ્ય સાગર હોય છે, ખુદના સંતાન માટે અનેક આશા અને અરમાન હોય છે. બિચારી ‘મા’ તો ગર્ભમાંથી પુત્રના મહાન સૃષ્ટન સેવતી હોય છે અને બાલકને જન્મબાદ પારણામાં પોઢાડતાં પણ પોતાના લાલની ભાવિની યથગાથા ગાતી હોય છે.

જગતના કોઈ પણ મહાપુરુષને પૂછી આવો : તમે મહાન કેમ બની શક્યા ? જવાબ એક જ આવશે, અજાન માનસમાં માતાપિતાએ મહાનતાનાં બીજ રોખાં હતાં.

મહાત્મા પુ. શ્રદ્ધયંભવસૂરિ મહારાજ એક એવા પિતાં છે. પત્નીને ગર્ભ રહ્યો એવી સંપૂર્ણ જાણ થતાં પહેલાં પોતે સંયમના માર્ગ વિહરણ પ્રારંભી દીખેલ. બાળક મનક માતાના રાજ્યમાં જન્મ્યો, પોપળ પામ્યો, અને પિતાની જોજ માટે એકલો અટૂલો નીકળી પડ્યો. પિતા પુત્રનું મિલન થયું. પિતા જણે છે, આજ મારો લાલો છે, પણ પુત્ર હજુ જાણતો નથી. મારા પિતા કયાં છે ? કોણ છે ?

પિતા શ્રદ્ધયંભવસૂરિ મહારાજ સંયમના જદુગર છે. તેમના ઉપદેશના જદુઓ અનેકના મોહ દૂર કર્યા છે. અને પરમાત્માના તારક ચરણેમાં કંઈક લભ્યાત્માને સ્થાપ્યા છે.

પિતાપુત્રનું મિલન અને પુ. શ્રદ્ધયંભવસૂરિ મહારાજની કોસ એકગ્રામીનેશન શરૂ થઈ. ડેક્ટર વૈદ્ય બની ઘણાની વાઢકાપ કરી

દેખ, પણ પોતાની કે પોતાનાની વાત આવી, ત્યારે મહારથીઓ પણ  
કૂછ ઉદ્ઘાનાં ..ન્યાયના આસન પર બેસી મંધ્યસ્થના નિધાક્ષતા પર  
આડુક થઈ ધારુાના સાચા પોતાના ન્યાય તોળ્યા, પણ જ્યારે પોતાના  
પુત્રનો ન્યાય તોળવાનો અવસર આવ્યો, ત્યારે કંઈક સંપથથી વ્યલિત  
વઈ ગયા. કોઈ વિગ્રહ જ ન્યાયાસનને ન્યાયી રાખી શક્યા.

આને પૂ. શખાંભવસ્થુરિ મહારાજ સમજ એક વિકટ સમસ્યા  
ઓભી થઈ છે. મારો આઠ વર્ષનો માસ્કુમ બાળક 'મા' ને છોડી એકદો  
અટૂંડો પિનાજ પિતાજ કરીને ઝૂરતો મારી સમજ આવીને ઓભો છે.  
ઓક જન્મના ઓક ટેહના પિનાની દર્શન કરાવું કે અનંત — જાનના  
દાતા અનંત આત્માના જનના કરના, પરમાત્માના શાસનનાં દર્શન  
કરાવું ? પિતા તરીકે મારી ઓળખાસુમાં તેના મોહની પણ અભિવૃદ્ધિ,  
મારા મોહની પણ અભિવૃદ્ધિ..પૂર્વ કશાનું સંસ્મરણા...ના જોઈએ વીતી  
ગયેલી વાતોની ધારદ...સંગમી પિનાની શોધમાં આવેલ આ ધન્યાત્માને  
અમસ્ત સંયમીઓના પિના જિનેશ્વરનાં દર્શન કરાવું...જિનશ્વાસનનાં  
રહરય આપું. પિનાનું કર્તવ્ય બજાવું અને આપણે પિનાનો વેગાળા  
વિજયી બન્યો...આગક મનક બાલ મુનિ અન્યા ..પિતા આગમશાશ્વના  
મંથન કરી વેગાળામૃતનાં રસાયણ બાલમુનિને પાઈ રહ્યાં છે.

શાન્દુંદુંમાં જેમ રાજમાટા રાજમહારાજાઓને જોજનમાં દરરોજ  
શાડું થોડું જેર આપે છે. રોજ જેર ખાનાં જેર ગચ્છાવવાની  
શક્તિ આવે છે. તેમ પૂ. શખાંભવસ્થુરિમહારાજ પ્રતિદિન બાલમુનિને  
સહનશીરતાના પાઠ ભાલું કરે, અનાં વાત્સલ્યમૂર્તિ પિનાને લાગે છે કે  
કદાચ બાળક સંમજો નહિ, કારેક ભૂલ કરી છે, તો મારે તેને લેવો  
બનાવરો છે ને ભાવ રન્નું કરરા ટે...

બાગ્યવાન સાધક !

વન્નું શું કહું ! બસ " પુઢવો સમે મુલ્લી હવિજાળ " પુછ્યીઅમાન  
સહનશીલ બનજો.

શા માટે પૃથ્વી સમાન ? બીજા કોઈના જેવા નહિ અને પૃથ્વી જેવા...સમજાતું નથી ? એમ સમજશે નહિ...ચિંતન કરીશ તો જ સમજશે ! મનન કરીશ તો જ મારી વાતનું રહસ્ય સમજશે.

પૃથ્વી પોતાના પર જે નાખો તે સ્વીકારી બે. કોઈને હેંકી ના દે, કોઈનો પણ નિરસ્કાર નહિ, જે આવો તે મારા, જેવા હોય તેવા પણ મારા. પૃથ્વી પર વિષા નાખો તો માટી સાથે મળી ખાતર થઈ ધાન્યોત્પત્તિમાં સહાયક થાય. પૃથ્વી પર મહદું નાખો તો ખુદના ગર્ભમાં બદ્ધ તેનો બદળું ટાળી ખુદનું સ્વરૂપ આપે. પૃથ્વી પર ફૂલ નાખો તો તેનો સુવાસથી મધ્યમધી અનેક નવા છોડિને પેદા કરે. પૃથ્વી પર ગોટલો નાખો તો અંબાડુપે નવસર્જિત કરે, એકમાંથી અનેકને પેદા કરે. પૃથ્વી પર ગમે તેટલો ભાર નાખો, તો પણ મૌનપૂર્વક સહન કરી સદ્ગુરૂની ધારણ કરવામાં મસ્ત રહે.

પૃથ્વી અશુદ્ધને શુદ્ધ કરે, અશુદ્ધને ગાળી નવપલિત કરે. પૃથ્વી બીજાડુપે રહેલી શક્તિને વિકસિત કરે. પૃથ્વી ક્યારે પણ કર્ત્વ્ય ભ્રાષ્ટ થાય નહિ. પૃથ્વી ક્યારે પણ બડાબડાટ ન કરે — પૃથ્વી ક્યારે પણ બદાઈ ના કરે. પૃથ્વી ક્યારે પણ માન — અપમાનની વાત ના કરે.

મનક ! તારે પણ પૃથ્વી જેવા બનવાનું છે. સહવર્તીઓમાં કોઈ કોધી, કોઈ માની હોય તો તું તારી સહનશીલતા દ્વારા તેમના અવગુણની અશુદ્ધિ દૂર કરને. સહવર્તીઓમાં કોઈ માલી હોય તો શાશ્વતના વૈરાગ્યામૃત વહે તેમના જીવનને નવપલિત કરને. સહવર્તીઓમાં કોઈ બુદ્ધિમાન — પ્રતિભાવાન બાળ સાધુ હોય તો તેના યોગસ્થેમ કરી તેનો આધાર બનને. બાબ વૃદ્ધ જીવનની સેવા કરતાં ક્યારે પણ મિઅજ ગુમાવતો નહિ, ક્યારે પણ તેમની ઉપેક્ષા કરતો નહિ. જિનનાજીને વિચારી હાર્દિકભાવોથી તેમની સેવા દ્વારા સહાય કરે તે સાધુ હોય. કર્ત્વ્યધર્મમાં આગળ વધને.

વૈરાગી મહાત્માઓ પણ કોઈ કાર કોષ વિજયી બની જાય છે. કોઈ કાર સમુદ્દરના સાધુ ગુસ્સો કરે તારે તું મૌનની મસ્તીમાં મહાલજે. સવાલજવાબ પ્રતિકાર, તર્કવિતર્ક ના કરતો. સાંભળવાની શક્તિ મેળવજે. સમુદ્દર છે. અવશ્ય ગુણી મહાત્માઓ રહેવાના. ગુણાનુરાગીના દ્વારા તે તારા ગુણ ગાથે. તને ધન્યાત્મા...પુણ્યાત્મા. તમારા જેવા જ્ઞાની સેવાભાવી સંયમી દુર્લભ. તમારા દર્શને ધન્ય બન્યો...ત્યારે કહેજે અને માનજે પ્રભુના શાસનનું સાધુજીવન મહાન છે. સાધુપદમાં આ ગુણ હોય છે, આપના આશીર્વદ અમોદ છે. આપની કૃપા મને આ ગુણનો માલિક બનાવે, બાકી આપ જે કહો છો, તે આપના ગુણાનુરાગી સ્વભાવને કરાણે. છે. આપની દદિ ગુણ દદિ હોવાથી ગુણ દેખાય છે. બાકી મારી, વાત તો જહેરમાં કરવા જેવી નથી.

સમુદ્દરના કોઈ વાગ્યાળ સાધુ તારી મશકરી કરી દે, પણ ભૂલે ચૂકે એ વાત દિલ પર લાવતો નહિ, બોલતો નહિ, બસ બહુ થાય તો એમ વિચારજે: જગતમાં કેવી વિચિત્રતા છે! ગુલાબ સાથે કાંટા! મહાત્મા સાથે હાસ્ય કિયા..આનાથી આગળ વધારે કયારે પણ વિચારતો નહિ, નહિનર તુ કર્મશાસ્નકનો નિષ્ણાત છે તે નહિ માની શકાય...અપમાન સમયે પાપના ઉદ્યને વિચારવાનું છે — પણ માન સન્માનમાં આપણો પુરુષાર્થ બુલ્લિ પ્રતિભાને આગળ કરવાનો નથી. ત્યાં પણ રેન્ઝ વિચારવાનું...કર્મ પરમાણુ તો તેના તેજ મેં જેવા અધ્યવસાયે તે પરમાણુ ગ્રહણ કર્યાં, તે રૂપે પરિણમ્યાં. મારા શુભ અધ્યવસાય કયારે પરિણમે કર્મપરમાણુને તીર્થેંકર નામ કર્મરૂપે પરિણમાણું, મારાર્મં કયારે એવી તાકાત આવે, જર્વ સંતરભાવને સાધું.

મુનિ! તારી સહનશીલતા જ્યારે પુઠવી સેમાન થશે, ત્યારે દેવોન્દ્રો તારા ચશ્ચે આળોટના હશે. મોહનીય કર્મનો ઉપશમ નહિ, ક્ષય થઈ જશે. પુઠવીસમાન સહનશીલ બનીશ ત્યારે અહૃતીશ અઠૃતીશ

પ્રકૃતિ તને છોડી દૂર દૂર ભાગી જશે. પણી બીજાં કમેને હઠાવવા તારે  
પ્રયત્ન નહિ કરવો પડે. મોહ તેની સેનાને કહેશે...ભાગો, સહનશીલતા  
વિજયો બનો છે. મૂઢીવાળીને દોડો, કર્મ તારાથી દૂર દૂર ભાગી જશે.  
કાયિકભાવનું શુદ્ધ ચારિત્ર તારા આત્મમંદિરના દરવાણે દર્શન દેશે.

મનક ! મહાત્મા પૃથ્વી સમા સહનશીલ બન્યા પણ... અમે...  
સાધુ બન્યા છીએ. સાચા સાધુ બનવાની ભાવના છે, પણ આ  
ક્રીધનો લાવારસ એટલો ઊંકળે છે કે અમારી સહનશીલતા રૂપ  
પૃથ્વી પર હરધરીએ ધરતીકંપ ધાય છે. ગુરુદેવ ! અમને સહનશીલ  
બનાવો. અમે પણ આપના મનક, અમારું પણ કલ્યાણ કરો. એ જ  
તારક ચરણમાં વિનાનિ.



## ૪૩. અતાણું ન સમુક્કસે જે 'સ' લિકુભૂ

માનની જંખના જાગે છે, ત્યારે માનવમન સંનમ બની જય છે. માનની કીર્તિની લાવસા અજાણું બે લયંકર દોષ આપણામાં પેદા કરી દે છે.

પર નિંદા —સુધ્રા પ્રશ્નંસા

આ બે એવા લયંકર દુર્ગુણ છે, જેમાં જ્ઞાની પાણું ભૂલ ખાઈ જય છે. તપસ્વી પાણું ચક્કર ખાઈ જય છે, સાધ્યક પણ ભૂલ કરી બેસે છે, આરાધક પણ ભૂલ કરી બેસે છે.

ધારી વખત તો એવું બને છે કે માનવ સમજ પણ શકતો નથી કે હું લયંકર દુર્ગુણને આધીન બની જઈ છું.

પરનિંદા અને સ્વપ્રશ્નંસા માનવમાં એટલી સહજતાથી પ્રવેશી ગઈ છે કે કોઈ ભલો સજનન તેને જરા જાવધાન કરે ભાઈ ! શા માટે તું બીજાની પંચાત કરે છે ?

“શું હું પંચાત કરું છું ? હું કોઈ દિવસું પારકી પંચાત ના કરું, પણ મારો સ્વભાવ સ્પષ્ટ વક્તા જેવો છે. જેઉં તે સાચું કહી દેવાય...ના ભાઈ ના...હું પંચાત કરતો નથી.”

એવો સજનન વિચાર કરતાં જરા હસી પડ્યો, એવા ભાઈ કહે, “કેમ મારી વાત તમને હસવા જેવી લાગે છે? મારી બુદ્ધિ તીક્ષ્ણ છે, સમૃતિ શક્તિ તીવ્ર છે, સરસ્વતી જિહુવાગ્રો છે એટલે કોઈ પણ પ્રસંગ જોયો, તેની સ્પષ્ટ વિવેચના થઈ જય છે. ભાઈ, આ શું પંચાત કહેવાય? પંચાત તો મને જરાય ના ગમે, પણ હા મારો સ્વભાવ સ્પષ્ટ કહેવાનો એટલે કોઈવાર સામાને ના ગમે, માહું લાગી જય.

હું તો સાચું કહું છું, મને ગોળ ગોળ ના આવડે, આપણે એ શીખ્યા જ નથી.

સજજન ગંભીર બનીને કહે છે : ભાઈ ! સ્પષ્ટ બોલતાં જ શીખ્યા છો કે પછી સ્પષ્ટ સાંભળતાં પણ ? મીઠું બોલવું ગમતું નથી કે મીઠું સાંભળવું ? શાન્ત સ્વસ્થ થઈને જવાબ આપો.

આ પ્રેરણોત્તરી કદાચ કોઈ વ્યક્તિની હથે. રૂપ, રંગ, ભાપા—સ્થળ—સ્થાન્ય અલગ, હથે, પણ સમસ્ન માનવી માનવી વર્ચ્યે થતી કળિયાની હોળીની પ્રેરણોત્તરીનું મૂળ આમાં છે. તેમજ વિશ્વની સમસ્ન શાંતિનાં બીજ પણ આમાં છે. માનવીની ભાષાનો જેટલો જૂનો ઈનિહાસ છે, પરનિંદા અને સ્વપ્રશંસાનો એટલો જ જૂનો ઈનિહાસ એ પરનિંદાનું પાપ જેમ ભયંકર છે, તેમ સ્વપ્રશંસાનું પાપ તેનાથી ય અધિક ભયંકર છે.

સ્વપ્રશંસાનાં સ્વભાવમાંથી જ પરનિંદા પ્રગટ થાય છે.

જેને સ્વપ્રશંસા ના ખ્યે, તેને પરનિંદાની ખટપટમાં કયારે ય પડવું પડતું નથી. સ્વપ્રશંસાનો ભૂખ એટલી બંધી જબરી છે, કે એક ચિંતકે કહેલું કે જીબ મીઠો રસ ખાઈને થાકે છે, પછી ખાડું, ખાડું માગે છે, પણ કાન કયારે ય મીઠાશથી ધરાતા નથી, તેને કડવું સાંભળવાની ટેવ જ નથી. હજાર દિવસ મીઠાશથી કદ્દું, પણ એક દિવસ કડવું બોલાઈ ગયું. તો ખેલ ખતમ.

સ્વપ્રશંસાનો રસ લાવારસની જેમ સદૈવ સળગતો રહે છે. લાવારસમાંથી ધરતોકંપ થાય તેમ સ્વપ્રશંસામાંથી પરનિંદા પેદા થાય. દુનિયામાં કોઈ ધન્યાત્મા હથે જેણે કયારેય પરનિંદા નહિ કરો હોય, પણ કોણું મહાત્મા હથે જેણે સ્વપ્રશંસા સાંભળી પણ નહિ હોય ? કોણું સંત હથે જેને સ્વપ્રશંસાએ એકવાર હયમચાવી ના મૂક્યા હોય ? સ્વપ્રશંસાએ ઉન્નત જીવનને પતનાલિમુખ લઈ જનાર લપસણિયું પગથિયું છે.

જીવનમાર્ગના સાચા રાહબર જીવનની બધી આંટીધૂંટી સમજાવે—  
જીવનમાર્ગમાં સંક્ષળતાની કેડીઓ બતાવે. સાથે જીવનની ભૂ લભૂ લામણીના  
પાઠ. પહેલાં જ ગોખાવી હે.

પૂ. શિષ્યંભવસૂરિ મહારાજ “માનવી મન” પાસે એક સિદ્ધિની  
ગુટિકા મૂકે છે. “માન — વમન” પ્રગતિ પથનો મુશ્ખાફર થતાં પહેલાં  
આ ગુટિકા સદ્વેષ મુખમાં રાખજો. ઉન્નતિ તારા ચરણમાં આવશે.  
જેમ માતા બાળકને જેવો બનાવવો હોય તેવા રાંસકાર ગળથૂંથીમાંથી  
આપે, તેમ.

ગુરુદેવ પૂ. શિષ્યંભવસૂરિ મહારાજ સિદ્ધિસાધક છે. હજરો  
શિષ્યના પ્રગતિપથના માર્ગદર્શક, ખુદના બાલપુત્ર સાધુ મનકના સાચા  
રાહબર ના બને એ? બને.

બાલક મનકને ગુરુ કહે છે : “આત્માણં ન સમુક્કસે જે સ બિકણૂ”  
ખુદની બાધાઈ ના કરે, તે સાધુ, પણ અનાદિ કાળનો આ રોગ દૂર  
કરવા પ્રભુમાર્ગનિઃ અભ્યાસ કરવો પડશે. બધુઃ ભાગીથ, પણ કર્મનું  
તત્ત્વજ્ઞાન નહિ લે તો તારો રોગ નહીં જય. રવપ્રશસાનો રોગ હટા-  
વવા કર્મની પ્રકૃતિ કે એકલા બંધહેઠું ગાળીશ, તે નહીં ચાલે. જેમ  
પ્રત્યેક આત્મા પૃથક છે, તેમ પ્રત્યેક આત્માનાં ગાપ અને પુણ્ય જુદાં  
છે. પાપ અને પુણ્યના ઉદ્યને આધીન ચૌની પ્રવૃત્તિ છે. કર્મના ઉદ્ય  
મિથ્યા કરવાની તૃક્કાત કોની છે?

નંદિપેણ જેવા મહાત્મા દીક્ષા લે ચારિત્રમોહનીયકર્મના જ્ઞાયોપ-  
શમના કારણે. નંદિપેણ જેવા મહાત્મા દીક્ષા છાડે ચારિત્રમોહનીય  
કર્મના ઉદ્યના કારણે. નંદિપેણ જેવા મહાત્મા વેશ્યાના ઘરમાં રહ્યા,  
પ્રતિદિન દશ આત્માને તારી શકે. કચા કર્મના કારણે?

ઉપદેશલભિના પ્રતાપે. એક જ વ્યક્તિમાં એક જીવે પાપ  
પુણ્યના કેવા વિવિધ — વિચિત્ર ઉદ્ય છે?

પ્રભુશાસનના પ્રતાપે તું જ્ઞાની થઈશ, તપસ્વી થઈશ. સાધક થઈશ, પણ સાધુ તો ત્યારે જ થઈશ, જ્યારે આત્મોત્કર્પ નહિ કરે. આત્મોત્કર્પની — બડાઈની ભાવનાને અને સાધુતાને પૂર્વ—પશ્ચિમનું અંતર છે.

મનક...,

તાચી હેયાની નોધપોથીમાં નોંધી લે.

મારે સાધુના જોઈએ છીએ, માટે મારી વાહ—વાહનાં ગીતો કચારે ય નહિ ગાડિ. આ ઓક એટલી સુંદર રીત છે કે એક કાકરે બે પંખી ઉઠશે. આત્મોત્કર્પ કરવાની ટેવ જણે એટલે પરનિંદા જણે. પરનિંદા જણે એટલે તારે દુર્ગાણ અને દુર્ગાલીને સ્વર્ણમાં પણ જોવાના નહિ.

ગુણ અને ગુણીના દર્શન દ્વારા તારું સાધુજીવન પ્રશોસાથી મધ્યમધી ઉઠશે.

સાધુ બનવા માટે નેમ રજેહગણ, મુહુપત્રિ, ગુરનિશા જરૂરી, તેમ સાધુ બનવા માટે સ્વપ્રશંસાનો ત્યાગ પણ એટલો જ જરૂરી છે.

બેટા ! કોતરી નાંખ તારી દિલની દીવાલ પર, દિલની દીવાલ પર લખાયેલ લેખ કૃયારે ય ભૂસારો નહિ.

યોતાની પ્રથંચા ન કરે તે સાધુ...

મનક, બસ ઓક જ વિચાર, તું સાધુ બન. સાધુ બનવા જે છોડવું પડે તે કાચી સેંકડમાં છોડ. એ જ તારા પિનાની હિતશિક્ષા.



## ૪૪. નિરૂપકુકેસે પરિયાએ



જેની પાસે મન છે, તેવો કોઈ પણ માનવ જગડા, ટંટા, ફિસાદ, લડાઈ, વેર, ઈર્ધા, અદેખાઈ પસંદ કરે? જે માનવ થઈને પણ આવી આસુરી વૃત્તિમાં રહે છે, તે ટેહનો માનવ, પણ દિલનો અસુર છે.

અભિલાષા અને પ્રવૃત્તિ વચ્ચે ક્યારેક આકાશ અને પાતાળનું અંતર રહે છે. ત્યારે થાય શું : માનવ ! તું આટલો વામન ! અભિલાષા પ્રમાણે પ્રવૃત્તિ ના કરી શકે ? જવાબ એક જ મળશે... મજબૂર છું... સંસારના ચક્કરમાં ફસાયો છું.

મનક !

તેં સંસાર છોડયો. મુનિદ્વાત ગ્રહણ કર્યાં.

સાચે સંસાર છોડવાના બહાને તેં સમસ્ત હુંખના કારણરૂપ કલેશને છોડયો છે. ગૃહસ્થનું જીવન એટલે ત્યાં કલેશપ્રધાન બને. સાધુનું જીવન એટલે સમતાપ્રધાન બને. બિચારો ગૃહસ્થ જંબે : મારે અધડો ગુસ્સો નથી કરવો, રાગઢોપ નથી કરવા, પણ ગૃહસ્થ વૃત્તિ જ કલેશથી સભર છે.

ગૃહસ્થજીવન એટલે ચિંતિનજીવન,

મુનિજીવન એટલે નિશ્ચિંત જીવન.

ગૃહસ્થને છ શત્રુઓ તો સંસારમાં રહેવા માત્રથી વ્યાકુળ કરી દે છે. નિવાસ, વાઞ્ચ, આહાર, સંપત્તિ, સંતતિ અને સ્વજન.

સંસારમાં રહેવા પ્રથમ ધર જોઈએ. ધર પોતાનું કરવા આકાશ પાતાળ એક કર્યાં. હવે એ ધરમાં કોઈ પેસી ના જય, બગાડી ના જય, ખરાબ ન કરે, તે માટે સતત સંઘર્ષ કર્યા કરવાનો. ધરની ચિંતા કંઈક ઓછી થાય, ત્યાં સમાજમાં જીવવા મોભાદાર વલ્લો જોઈએ.. વલ્લની એક મહિનામાં એકવીશ જત બદલાય. દરરોજ નવી નવી પછતિ બહાર પડે, કદાચ મનમાન્યાં વલ્લદ્વારા વેશભૂશા કરી, પણ દેહનું જ્ઞૌંદર્ય કયારેય બદલાઈ જય? વલ્લો પાછળ સમય સંપત્તિ બગાડયાં, પણ ચિંતા તો પાછી તેની તે. કોઈ પ્રશ્ન વરસમાં એક વાર આવે. કોઈ પ્રશ્ન મહિનામાં એક વાર, કોઈ પ્રશ્ન દિવસમાં એક વાર પણ પણ આહારનો પ્રશ્ન સ્વાદ લોલુપીને ચોવીશ કલાક સતાવે. કેમે કરી બોજના પ્રાપ્તિની સમસ્યા હલ કરે, ત્યાં જીબ અને પેટ બે યુલ્લ જમાવી દે. જીબ મનપસંદ ખોરાક જાંખે. જીબને ગમતો ખોરાક લીધો એટલે પેટ બળવો પોકારે. જાડા, ઉલટી, રોગ, બિચારો મૂંજાઈ જય. શું કરણું? જીબનો સ્વાદ સચવાય, તો શરીર રોગી બને. શરીરનું ધ્યાન રાખે, તો જીબ બળવો પોકારે, મોઢામાં જ કાંઈ ના જવા દે.. આહારની ચિંતા ધણી મોટી. આહાર માટે આહારનો પ્રશ્ન હલ થાય, ત્યાં આરોગ્યનો પ્રશ્ન ઉભો થાય આરોગ્યનો પ્રશ્ન એવો ઉધમાત મચાવી દે કે ડાલ્યો પણ ગાડો બની જય અને તેમાં આજની ચિકિત્સા એટલે પૈસાનો ધુમાડો! આમ ચિંતાનું જ ચક !

કેટલું ચિંતાયુક્ત ગૃહસ્થ જીવન ! અગ્રવલ્લ અને નિવાસ જેવી પ્રાથમિક સમસ્યા જરા હલ કરી, ત્યાં તો મોટી સમસ્યાની વણાજાર આવી. સંસારમાં જીવવા તો પૈસા જોઈએ. સ્વાધીં લોકો રાંપત્તિ સિવાય કોઈને સ્થાન આપત્તા નથી. તમારા જીવનનું મૂલ્યાંકન ન કરો. નાસ્તો, દોડો, ભાગો, ચોરી કરો, જૂઠ બોલો, અન્યાય કરો, પણ સંપત્તિ મેળવો. સમાજ તમારા ગુણનો પૂજક નહિ, સંપત્તિનો પૂજક છે. સંપત્તિ

માટે આકાશ—ગાનાળ ઓક કર્યા. કેંદ્રિક મુજુંથી થાથ આપ્યો. શંપત્તિ મળી ગાય શાંતિ વગરની શંપત્તિનો હું કરવાનો? હાય! આ તો વર્દાન છે કે થાપ? શાંતિની જાગનામાં દોલો બન્યો. કેટલું ય કર્યું, શાંતિન ન મળી. હાથ દુઃખી હાથ ચિંતા, કોણ ચેવા કરશે? શાંતિ-વાળા માતાપિના રૂદ્ધન કરતા આવાં : મુખુ ! મુખુ ! અમને નિર્બંધને વર્દાન આપ્યો. અમે તો માનવનાં ગાનાપિતા છીએ કે વાનરનાં? અમઝલ્યનું નથી. શાંતિ શાંતિ નથી આપતી, આહ આપે છે. શાંતિની ચિંતા નિર્દેશિની અધીં શક્તિ બરદાદ કરે છે. ત્યાં રઘુનાના મેંડો પ્રભનાંન બોલાવીએ તો અભિમાન, બોલાવીએ તો કંચી માદાઈ દેખાડવા દેખ કરે છે. ઓક રંગથી હૃદા, ત્યાં બીજુ રંગથી નાદાન થઈ જાય.

દિવદનો ગંશદ પ્રાર્બદ મુગ્રબાતથી નહિ, છજદો ચમક્યા સાંચ. જગનાં ગાય ચિંતા, નીંદમાં પાય ચિંતા. ચિંતા ચીહ્યો, ઓકલવાયો, અનદો, ગુરુસાભાદ જનાવે, અધ્યાત્મ દત થતા નથી એટલે થાગું પના બધુંકર અધ્યાત્મામાં આવી જવાય છે. પંક્તિનાં હે પાણી ધૂલિતી, તે હેં નિશ્ચિંતન જનીને કરું છું, ગાય અંતે જ્યાંદે અસ્ત્રાય અવસ્થા આવે છે, ત્યાંદે રૂદ્ધ કરું છું, પાય કોઈ આંશુ લુણાર નથી. જાત્યા રૂદ્ધન થાયે, જીવન પાય રૂદ્ધ સાંચ અને ગુન્યુ પાય રૂદ્ધ થાયે. આનુસ્કેશમય ગૃહસ્થ જીવન છે, ત્યાં ચુંચ, શાંતિ, જોદ, ચંપ, અમતાના દર્શન કર્યાથી થાય? ચિત્તની પ્રશ્નનના કયાંથી પ્રગટે? રઘુન આત્મ-ગાવના દર્શન પાય રૂલ્યા.

મનદી ! તું કેવો ગુણ્યાન્યા ! કોઈ ચાય ચિંતા નારી શક્તિનો દ્વારા કરે? નારી મનને કલેશયુક્ત જનાવે તે પહેલાં પ્રભુમાર્ગને તું પામી શક્યો. નારી દેહ પવિત્ર, નારું વચન પવિત્ર, નારું મા પવિત્ર, નારી દિનદ્રિયો પવિત્ર અને નારી બુદ્ધ પવિત્ર. તે યમણે પવિત્રાતિપવિત્ર

પ્રભુના ચારિત્રને પામ્યો. તારા પુણ્યની શું અનુમોદના કરવી ! તારો પાવિત્ર નાદ વિશ્વમાં ગુંજીત બનશે. નિરૂપકક્ષે પરિધાયો.  
મુનિશ્વન કલેશ રહિત છે, નિશ્ચિંત છે.

મુનિ જીવનમાં ચિત્તપ્રસન્નતાઙ્ગ સમુદ્ર આનંદે હેરાય છે. તું અણગાર બન્યો એટલે ઘરની ચિંતાથી મુક્ત બન્યો. તું બ્રહ્મચારી બન્યો એટલે વખ્ની પંચાતથી બચ્યો. શાંતિપ્રેરક તારા હેયાના શુભ-ભાવ સમા શુભવલ્લ તારા પરિધાન. તું જિતેન્દ્રય અને પરિષહદયી બિક્ષુ બન્યો એટલે આહાર અને સ્વાદ બંનેની સમયા દૂર ભાગ્યો. માધુકરીવૃત્તિ, તારાં અણમોલ પ્રત જીબના 'માટે નહિ, સાયમની સાધના માટે આહાર ગ્રહણ કર્યા, રોજ અને સ્વાદ બંને દૂર ભાગ્યા. તું નિર્ણયિત્રાહી બન્યો એટલે સંપત્તિને તેં તુચ્છ ગણી પ્રભુના શાસનની સાધુતા એટલી જ ઉત્તમ કે જ્યાં ધરની કોઈ જરૂર જ ના પડે, તું નિર્મમ બન્યો એટલે દેહની મમતા છોડી. જેને દેહનાં મમત્વ નહિ. ઈદ્રિયોનાં તોક્ષાન નહિ, કોઈ ઈચ્છા નહિ. આશા નહિ તો તને સંતતિનો પ્રશ્ન જ કર્યાં ?

તું નિર્સંગ બન્યો. સમસ્ત સંસાર તને અસાર લાગ્યો. સંતતિની જેણે જંખના છોડી, તેને સ્નેહી સ્વજનનાં બંધન શાનાં લાગે. સ્નેહી, સ્વજન, ગ્રામ, નગર, દેશ, જાતિ, કુટુંબ બધાથી તું દૂર ગયો. હવે સ્નેહી સ્વજનનાં દુઃખ તને શાનાં ?

મનક !

પ્રભુની સાધુતાએ તને સંપૂર્ણ નિશ્ચિંત બનાવ્યો. ગુરુદેવ તથા સમુદ્રાયના પ્રત્યેક સાધુ જ્ઞાની અને ચારિત્રી એટલે નિર્સ્વાથી અને પરોપકારી. જ્ઞાની, નિર્સ્વાથી અને પરોપકારી સાધુકુળમાં તારા સંસ્કાર અભિવૃદ્ધિ પારયા. ગુરુદેવનાં જ્ઞાન મળ્યાં. તારા જીવનમાં સમતા, શાંતિ, પ્રસરણતા, ઉદારતા ગુણો શોભવા લાગ્યા. કૃપાય મોહનીયનો

જાય તો બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વ થાય, પણ અપ્રેમતા આરાધના દ્વારા તેં કપાયની અવસ્થામાં કપાયોને કીણ બળવાળા કરી દીધા. કધાય મોહનીયનો ઉદ્ય હોવા છત્તાં તેં શાંતિનું સામ્રાજ્ય જોમાયું. મૌન અને ભાષા સમિતિ દ્વારા કોધનું મોહું બંધ કરી દીધું. કલેશ-વૃત્તા તારાથી દૂર ભાગી ગઈ. કલેશ રહિત વૃત્તિનાં દર્શન તારા દ્વારા થાય છે.

મનક !

તારી જીવનવૃત્તા શા માટે તને સમજવું છું ખબર છે ? મન મર્કટ છે. ઘડીમાં રાજસિંહાસન પર પહોંચી જાય છે, તો ઘડીમાં નરકની ગોદમાં પહોંચી જાય છે. ચારિત્ર ગ્રહણ કર્યું, પણ અધ્યવસાયો વિચિત્ર છે, કયારેક મન સંસારની દિશા તરફ પણ જુઓ, તો તું એમને હુકમ કરને : રૂક જા...સોવકડેસો. ગિહવાસો. ગૃહવાસ ભયપ્રદ છે. નિરૂપકંકનો ગરિયાથે. સાધુજીવન અભયપ્રદ છે. તારી વિચારણા, તારું ચિંતન તારા જીવનમાં મંગળ કરશે. સંયમના અનુપમ લાભ સમજશે. સંસારની દુઃખદાયકતા સમજશે. તું શાંતિનો ચાહક ? અશાંતે સંસારના માર્ગ ગમન નહિ કરે. તું સમતાનો ઉપાસક ! મહાશાંત સંયમનો સાધક બનીશ.

જીવનમાં આરોહઅવરોહ આવવાના, પતન અને ઉત્થાનના સમયો આવવાના.

તને જ્ઞાન આપ્યું છે. પતનના નિમિત્તો આવે તેને પ્રગતિનાં નિમિત્તો બનાવ. અવનતિને ઓળંગી જા.

જા...બેટા...જા !

સિદ્ધોની સાથે નિવાસ કર ! તારું પ્રસ્થાન મંગલમય બનો. અભય બનો. અભયસ્થાન ને નિરાશ કરવા, નિરુત્સાહી કરવા નથી જતાવ્યાં, પણ સાવધ રહેવા જતાવ્યાં છે. અભયસ્થાન તને આશાવાદી બનવા દેખાડ્યાં છે.

તારો જેવા લઘુકર્માને તો કૃક્ત દિશાસૂચન કરવાનું. અનેક  
જનમોની આરાધના, સાધનાએ બાલ્ય ઉમરમાં દીક્ષા મળી. સાક્ષણ  
થાએ...તમારું પ્રસ્થાન...પ્રથાણ એજ હિતભાવના.

ગુરુહેવ !

મહાત્મા મનક તો ભાયે મહાન આત્મા છે. એમના જીવનમાં  
વિજયની વરમાળા હોય, પણ અમે ટેખના મોટા પણ સંયમભાવમાં  
આવ થયા. અમને સંયમમાં મહાન બનાવો.

એ જ હાઈક પ્રાર્થના.



## ૪૫. ચ્યામેજાજ હેડ ન હું ધૂમમસાસણું

શૂરવીરોને કોઈ મારી શકતા નથી, તેઓ મરતા નથી, પણ દેહનાં બલિદાન દ્વારા ધ્યેયની—નિષ્ઠાની જ્યોત વાણભૂજી પ્રજ્ઞવિલિત રાખે છે. જ્યારે સ્વતંત્રતાનો પવન કુંકાઈ રહ્યો હતો, ત્યારે સ્વતંત્રતાની વાત કરનાર ભારતીય રવતંત્રવીરને બ્રિટિશ સરકાર ફાંસીની સજ કરતી હતી. ફાંસીના માંચડા પર તેઓ મુક્ત હાસ્ય કરતા હતા. બ્રિટિશ અમલદાર પૂછ્યા કે તમને મરણની વેદના સત્તાવતી નથી ?

“મરણ કોનું ? દેહનું કે આત્માનું ? હું ભારતીય છું. આત્માના પુનર્જન્મમાં માનું છું. આ જન્મમાં તો સ્વતંત્રતાનો રંગ મોડો જાયો આવતા જન્મમાં માતાના ગર્ભમાંથી સ્વતંત્રતા માટે લડવાનો લેખ લઈશ. વળી જીવનો હતો, ત્યારે એક જગાએ ભાપળ કરી શકતો હતો, એક સ્થળે રહી શકતો હતો, હવે સ્વતંત્રતાની ભાવના વાળી મારા દેહની રાખ—ભર્મ સારા દેશમાં ફેલાશે અને દેશબ્યાપી સ્વતંત્રતાની જેહાદ જગાવશે. માનું બલિદાન નિષ્ઠળ નહિ જાય તમારી સત્તાને ધરાશાયી બનાવશે. ચાલો ... ચાલો, વાત ન કરો, મારે મોંટું થાય છે. શૂરવીરોનું, મૃત્યુ ન હોય, બલિદાન હોય.”

મનક !

તું પ્રતધારી નહિ, મહાવ્રત ધારી છે.

તું ઋષિ નહિ, મહર્ષિ છે.

તારી પ્રતિજ્ઞા સામાન્ય નથી, સંયમ લીધું તો હવે ઉજ્જવલ બનાવ. તારો લવકાર.....તારો પડકાર સૌધર્મેન્દ્રને પણ હયમચાવી

નાખનારો હોય. કોઈ બકાલ પૂછશે : તે દીક્ષા લીધી પણ, વિહાર નહિ થાય તો ? - 'થાય નહિ થાય તો ?' જીવનમાં મુશ્કેલી આવશે તો ?'

પ્રથમ તો જિનશાસનમાં સાધુને મુશ્કેલી આવે શાની ? મુશ્કેલી આવે પુદ્ગલ પ્રેમીને.....! સાધુએ તો પુદ્ગલ સાથે સગાઈ તોડી નાખી, સંબંધ નોડ્યા. તેની સામે શાનું જોવાનું ? સાધુ એ તો આત્મ પ્રેમી, આત્મ રમણીતા સાથે તેને ઘેલું લાગ્યું. આત્મદેવને ચિત્ત પ્રેસન્ન-તાની મર્સ્તી ચૂઢી. હવે પુદ્ગલ પ્રીતિ કર્યાંથી થાય ? જિનાજી દ્વારા આત્માની શક્તિ જાણી ને હતી. ત્યાં ચુધી દેહનાં જતન કર્યાં. દેહની પ્રીતિમાં ગ્રતને વિસાર્યાં...ગઈ કાલે પુદ્ગલના ધર્મો મને સત્તાવતા હતા, પણ આજે તો આત્મ રાજીની ચિંદાનંદની મર્સ્તી મને આકપી રહી છે. પહેલાની વાત કરું.

ગુરુ મને હિતશિક્ષા આપે તે ચોક્કસ ગમતું, પણ મારું અભિમાન મારી આગળ પાછળ આંટા મારી મને કહેતું : જો જો જતનાં અપુમાન ન થવા દેવાય, ગુરુની સેવા કરવાની, પણ તિરસ્કાર નહિ સહેવાનો.

પણ જ્યારથી મોક્ષની ઉત્કટ અભિલાષા જાગી છે, ત્યારથી મારું અભિમાન બિચારું મૂંગું થઈ ગયું છે. નમ્રતા મને કહે છે. ભૂલા ભાઈ ? સહનશીલતમાં ધર્મ છે. કેળા કેવી રીતે ખાય છે ? છાલફેંકી દઉં છું અને અંદરનો ગલ ખાઈ જઉ છું. ગલ કેવો લાગે છે ? બહુ મીઠો, આચોર્ય દાયક. બસ ગુરુનાં વચન સાંભળ, ત્યારે પણ એમ હૃદ્દાલું નથી. કરું કરીએંતા રૂપ છાલ એ તો શર્દુ જન્ય છે, તે ફેંકી દે. કર. કરવાથી કઠોરેંતા રૂપ છાલ એ તો શર્દુ જન્ય છે, તે ફેંકી દે. હ્યાની હિતભાવના સ્વીકારી હે. આત્મ સ્વાસ્થ્ય અવશ્ય પ્રાપ્ત થશે.

આજકાલ માયા તો સંતાઈ ગઈ છે. સરળતા સમગ્ર જીવનમાં છવાઈ ગઈ છે. સરળતા દ્વારા મારા જીવનમાં કર્યાંય કોઈ પ્રેરણ રહ્યો નથી. મારી વાત સરળતાથી સમજાવું છું. સરળતાથી સૌની વાત સ્વીકારું છું. હવે તક, અનુમાન, બટપેટની જરૂર પડતી નથી એવું

માયા બિચારી રિસાઈ ગઈ છે. લોભનું ગજું શું? મારા નિષ્કામ રૂપી રાજ્યમહેલમાં પ્રવેશી શકે ખરો? મેં જી—પુત્ર, ધન, ધર, કીર્તિ બધું છોડી દીધું છે. જ્યાં કોઈ છચ્છા નથી, આશા નથી, જે મળે...જેવું મળે તેને સંયમનું સાધન બનાવી લઉં છું, પછી લોભ જાહુગર કર્યાં પ્રવેશ કરે?

ગુરુકૃપાએ ધર્મશાસ્ત્રના અભ્યાસે—સધાર્મિક મુનિઓના સમાગમે હું સુખી, શાંત વિચારક બની ગયો છું. આવેશમાં આવીને દુઃખથી કંટાળીને કે સુખની દૃઢાધી નહિ, પણ આત્મસ્થ બનીને કહું છું. કદાચ કોઈક કાળ એવો આવશે...ભયંકર કર્મેનો ઉદ્ય થશે, તો કર્મની સામે જંગ જમાવીને રહીશ...કર્મની સામે વનરાજ ચાવડાના પિતા જ્યશિભરી જેવો રંગ જમાવીશ. હારીને, ધાયલ થઈને પણ પુદ્ધગલ સાથે, સંસાર સાથે લડાઈ યાલુ રાખીશ. સ્વતંત્ર વીરો સ્વતંત્રતાનો હક્ક બોલીના અકશોથી લખીને માંગો છે. હું મારા સાડા ત્રણ કરેડ રૂવાંટાંમાં આનંદની ઉર્મિથી અનંતા સિદ્ધાંતે સાક્ષી રાખી કહું છું: કદાચ પ્રસંગ ખાવશે તો ‘ચર્ચિજા દેહ’ ન હું ધર્મ સાસણું, દેહને છોડવામાં પળની ય વાર નહિ કરું, દેહના મોહમાં નહિ ફૂસાઉં, પણ ધર્મશાસન—જિનાજા તો નહિ છોડું. પહેલાં સમજ ન હતી, હવે સમજયું છે.

દેહ વિનશ્ચર છે.....ધર્મ શાશ્વત છે.

દેહની લેટ દરેક ભવમાં માંગો છે, ધર્મની કમાણી, ધર્મનું શાસન ભાગ્યશાળી માનવને જ મળો છે.

દેહ અહીં જ છૂટી જનારો માસનો વોચો છે, ધર્મનું શાસન સંસ્કાર રૂપે આત્માની સાથે વિહરે છે.

શું દેહ મૂાતર ધર્મને ગૌણ કરું? પણ પરિશોષે દેહ તો દૂંટ-વાનો. ઓ તો, પંચપચાસ વર્ષમાં પાણીનું આપી દે અને ધર્મનું સામ્રાજ્ય છોડું, પછી હું કોઈનો નહિ, તેથી સમજ વિચારી અશા-

શ્વતની પ્રીતિ વિચારી છે. શાશ્વત, તારક, ઉદ્ગારક ધર્મશાસન—જિના-  
જીનાની સત્તા સ્વીકારી છે. શૂરા સૈનિકની જેમ કહું છું કે દેહ જથે,  
તો જવા દઈશ, પણ મારા ભાવ પ્રાણો મહાવ્રતોને કયારે પણ નહીં  
છોડું. મારી આંતરિક ભાવનાનું બ્યુગલ કૂંકાયું, ત્યાં તો કાન, આંખ,  
નાક, જીબ, ચામડી કહે : અરે સાધક ! બધાને છોડ્યાં...અમને નહીં  
છોડતા...અમે જરા પણ તોફાન નહીં કરીએ, તમારી આજીવાં રહીશું,  
અમને ન છોડો. આત્માની હાલત સામે ઈદ્રિયોએ ચપળતાનાં નખરાનાં  
શથો છોડી દીધાં...હવે બિચારી ઈદ્રિયો તો વફાદાર સૈનિક જેવી  
થઈ ગઈ છે. વફાદાર સેના રાજ ખાતર શલ્યના ધા સહે, તેમ ઈદ્રિયો  
મારી આજી ખાતર સંયમનો ભાર વહે છે.

મહાત્મા મનક ! તમો ધન્ય છો ! કૃત પુણ્ય છો !

આપે તો પિતાની વાણી સ્વીકારી, રાગન્યાગના દંદ—યુદ્ધ સામે  
ઘર શાસન સ્વીકારનો શંખદાન કુંકી દીધ્યા. આપનો શંખનાદ અમને  
પણ સંભળાય અને પુરુગલ પ્રીતિ ત્યજવા અમે પણ સમર્થ  
અનીએ. આપો આશ્રિપ.



## ૪૬. પદ્ધિસોય લઘુ લક્ષ્મેણં



હિમાલયના એવરેસ્ટ શિખર પર આરોહણ કરવા તો ધરણા નીકળ્યા,  
પણ તેનસિંગ હીલરી જેવા કોઈક જ શિખર સર કરી શક્યા.

જે નિષ્ફળ ગયા તેને પૂછજો ભાઈ ! કેમ નિષ્ફળ ગયા ? અરે !  
શું કરીએ ? ભયંકર બરકુ, કઠિન ચઢાણ, પ્રકાશનો પણ અભાવ, સહાયક  
સાધનોનો અભાવ, અમારી મુશ્કેલી અમે જાણીએ.

કોઈ પણ કેતની, કોઈ પણ સહ્ય વ્યક્તિને પૂછજો : તું સહ્ય  
કેમ છે ? જવાબ એક જ આવશે. તું સહ્યનીતાનો સાચો ચાહક  
હતો.

ભાઈ ! તમને કયાએય કોઈ અગવડ, વિધન, પ્રતિકૂળતા ન  
આવી ? સહ્ય વ્યક્તિ હસ્તીને કહે છે : સહ્યનીતા ત્યારે જ મળી જયારે  
અમે પ્રતિકૂળતા સાથે લડી લીધું.

મનક !

સાધુજીવન એટલે અનુકૂળતાનો ત્યાગ.

સાધુજીવન એટલે પ્રતિકૂળતાનો સ્વીકાર.

તારું ધ્યેય કોઈ તુચ્છ ચીજ માટે હોત, તારા મનોરથ સામાન્ય  
હોત, તો તું હજુ પણ કેમ ચાહે તેમ કરી શકત ! પણ તારા મનો-  
રથો મહાન છે. દીક્ષાને દિવસે કરેબિ ભંતે ઉચ્ચારતાં તું બોલ્યો છે :  
અપ્પાણ વેસિરામિ. આજ સુધીના મારા પાપમય—આક્રાવમય આત્માને  
ત્યાગું છું. હવે મારા આત્માને સંવરમય બનાવું છું. આત્માને સંવરમાં  
સ્થાપવો એટલે શું સમજે છે ?

જમીન ઉપર રહ્યા રહ્યા ટેકરી પર રહેલ વૃક્ષનાં ફળ તોડવાં તે માટે કેટલી બુલ્દિ ? કેટલો પ્રયત્ન ? કેટલા એકાગ્ર બનવું પડે. કેટલી વાર ઊંચાનીયા થવું પડે, તેનાથી ય અધિક તારે તારા જીવનમાં સાહસ અને સતત જીવંત જગૃતિ સાથે વિચરવાનું છે, વિલરવાનું છે.

સમસ્ત દુનિયા જેમાં મહાલે છે, જેને સારું માને છે, તે નારે ક્ષણના વિચાર વગર ત્યાગવું પડશે. દુનિયા જેનાથી ભાગો છે, તેને સાહિં તારે સ્વીકારવું પડશે.

નદીના પ્રવાહની દિશામાં તો સૌ હોડી હંકારે, નદીના અનુકૂળ પ્રવાહમાં તો સૌ નદી પાર કરે, પણ સનસનાટીપૂર્વ ક વાતા પવન ચામે તો કોઈ વિરલ જ નદી પાર કરી શકે.

સાધુના શબ્દકોશમાં સુખ, સગવડ, અનુકૂળતા, મનપસંદ, ફાવે-તેવું, સહેલું પડે એવું આ બધા શબ્દો રદ થઈ જવા જોઈએ. શબ્દ રદ કરવા માત્રથી નથી ચાલવાનું. શબ્દને જમાવનારી ભાવનાઓ જ ભસ્મીભૂત કરવી પડશે.

જગત જેને દુઃખ કહે તેને સાહિં લેટવા તૈયાર થા.

જગત જેને સુખ કહે તેને ત્યાગવા હરદમ તૈયાર રહે.

જગત જેને પ્રતિકૂળ સંયોગ કહે નેમાં જ તારે સાધના કરવાની.

જગત જેને અનુકૂળ સંયોગ કહે તેનાથી દૂર ભાગીને સાધના કરવાની.

### મનક !

જલ્દી કહે, તારે મોક્ષ ગમે ત્યારે જોઈએ છે કે જેટલો જલ્દી મળે તેટલો જલ્દી જોઈએ છે ? જો જલ્દી મોક્ષ જોઈએ તો પ્રતિકૂળતાને સ્વીકાર. પ્રતિકૂળતામાં આત્મા સંજગ રહે છે અને ભયંકર દુષ્કૃત્યનો, નિકાયિત પાપોનો કષ્ય થશે. અનુકૂળતામાં શાના પેદા થશે અને તે શાના મોહના ચક્કરમાં બેંચી જશે.

સાધુ બન્યા બાદ અનુકૂળતાનો વિચાર કે સ્વીકાર કરીય, તો

તારી દશા ધોયીના બળદ જેવી. ખૂબ ચાલ્યો, પણ હતો ત્યાં ને ત્યાં  
તેમ ત્યાગ કર્યા છતાં શાતાની ચાહના એટલે સંસારી.

તું નાનો બાળક છે. પ્રાતઃકાળમાં તું વહેલા ઉઠીશ કે કોઈ  
વહેલા તને ઉઠાડ્યે, ત્યારે ઊંઘ તુરણ ફરિયાદ નોંધાવશે. મારે મહાપ્રતો  
પાળવાનાં છે, ઊંઘને કયાં છોડવાની છે. જરા સૂવા દો. જો...સુઈ  
ગયો તો...અનુકૂળતાએ તારા સ્વાધ્યાયને, તારી નભેતાને, તારા અપ્રમત્તા  
ભાવને કર્યાડી નાખ્યો. તને લાગે છે, જરા સુઈ જઉ એમાં શું? હું  
કયાં હિંસા કરું છું? જૂઠું બોલું છું તે પાપ લાગે. સૂવાની તો  
ભગવાનની પણ આજા જ છે ને?

### ભલા સાધક !

સાધુને સંથારો કરવાનેં પાણું નિયમિન રામયે અને ઉઠવાનું પણ  
નિયમિન રામયે. જિનેશ્વર પ્રભુની રંથારા માટેની આજા યાદ રહે  
છે અને રાનિના છેલ્લા પ્રહરમાં સ્વાધ્યાયની આજા છે તે કેમ ભૂલી  
જાય છે? સાચે અનુકૂળતાનો પ્રેમ તારા જ્ઞાનગુણને દૂષિત કરે છે.

નીંદ આવતી હોય, શરીર તૂટનું હોય, તો પણ ભગવાનની આજા  
યાદ કરી પગના અંગૂઠા પકડી સ્વાધ્યાયમાં લીન બન. જો કેટલી  
કર્મનિર્જરા થાય છે. તારું જ્ઞાન કેટલું મજબૂત બને છે. થોડા  
દિવસ અવિરત પુરુષાર્થ કરીશ એટલે નિંદા તારા સ્વાધ્યાયના સમયે  
ભાગી જશે.

ગોખી લે પહેલું સૂત્ર :—

નીંદ આવે ને સૂવે તે સંસારી.

નીંદ આંખમા વેરાતી હોય છતાં સ્વાધ્યાયમાં તત્પર બને તે સાધુ.

ભૂગ લાગે એટલે મનપસંદ ખાય તે સંસારી.

ભૂગ લાગે છતાં કલ્ય અને રૂક્ષવૃત્તિમાં મજા માણે તે સાધુ.

સાધુ જીબ માટે આહાર ન લે. સાધુ સાધના માટે આહાર લે,  
તેથી ઠંડું, ગરમ, સુસ્વાદ, અસ્વાદ, પૌષ્ટિક, અપૌષ્ટિક, સરસ, નીરસાના

બેટ તેને ના સતાવે. બસ. બેંતાલીશ દોપ ગૌચરી લેવામાં ન લાગવા જેઈએ, એ જેટલું જરૂરી, તેનાથી પણ અધિક જરૂરી માંડલીના પાંચ દોપના લાગવા જેઈએ. માંડલીના પાંચ દોપનું આસેવન થઈ જય, તો બેંતાલીશ દોપથી રહિત નિર્દેષ ગૌચરી પણ એક મિનિટમાં સદોપ જની જય.

લોજનની કણા તો મહાત્મા કુરગડુ જાણતા હતા. થુંક્યુક્ટ, તિરસ્કારયુક્ત આહાર ગ્રહણ કરતાં તેમને કેવળજ્ઞાન મેળવ્યું.

શીધુ કર્મક્ષયનો કીમિયો તો બંધકજી જાણતા હતા. ચામડી દેહથી અલગ થાય અને તે માને મારા કર્મક્ષય થઈ રહ્યા છે અને તેમ થતાંની સાથે કેવળજ્ઞાન.

મનક !

અનુકૂળના નારી શગૃતા કરશે. પ્રતિકૂળના મિત્રતા કરશે. દેહના જતન, મનગમતા આહાર, કોમળ શથ્યા, મૂલાયન વખ્યો, મીઠા શબ્દો કંદાચ તને આકર્પી લેશે, પણ એ તારા શગૃ છે. તેમાં રાગદૂપના મૂળ છે; અને જ્યાં રાગદૂપ છે, તે સંસાર જ છે. રાગદૂપથી અલગ કોઈ જ સંસાર નથી. વિપય સુખના સાધનમાં નથી, પણ મમત્વમા, ઈચ્છામાં, આશામાં, ચાહનામાં છે. એટલે જ ફરી ફરી તને અનુકૂળતાને ફર કરવાની સલાહ આપું છું.

પ્રતિકૂળતા એ શબ્દ સાંભળતાં પણ માણસ ડરી જય - છે. વિચાર આવતાં આંખ સામે ભયાનકના ખડી થાય છે, તો સાચે પ્રતિકૂળતા સ્વીકારતા શું થાય ?

નને ખબર નથી. જગતના એક સર્વશ્રેષ્ઠ પ્રક્રિયિ લેખકને પૂછ્યું. તમારી સદ્ગણના શાને આભાંગી ? મારી જલ તોતહાય છે, તેથી જો બોલતા આવડતું હોત, તો નાહકની પંચાત કરી મારો સમય અને શક્તિ વેદફાઈ જત. તોતડો છું એટલે બોલવાનું બંધ કરી સાહિત્ય સર્જનમાં વધ્યો.

સાધક !

તું પણ વિચાર. મનગમતાં બોજન મળ્યાં હોત, તો ઉણોદરી પ્રતનું પાલન થાત, સ્વાધ્યાય થાત...કેટલો પુણ્યશાળી ? નીરસ આહાર મળ્યો, એટલે પ્રમાણાતિરિક્તતાનો દોપ્ઠ ના લાગ્યો. પ્રમાદ ન આવ્યો. અપ્રમન્તભાવે સંયમની સાધના થઈ.

પ્રતિકૂળ આહાર જેમ સંયમની સાધનામાં સહાયક છે. તેમ પ્રતિકૂળ વાતાવરણ પણ સંયમમાં સહાયક છે.

વિનીત આજ્ઞાપાલક શિષ્ય મળે, તો કદાચ રાગ થઈ જય, મમત્વનું બંધન લાગ્યી જય.

શાંત—સુકોમળ ગુરુ મળી જાય, તો કદાચ તારી સાધના શિથિલ થઈ જય. જો ગુરુ ઉગ્રસ્વભાવી, કડક મળે, તો તારી સાધના સ્વર્ણ-શ્રોષ બનશે.

ગુરુ જેવા ઉપકારક પણ તને અનુકૂળ મળશે, તો તું તેમને સાલસતા દ્વારા હદ્યના અહોભાવે નમીશ નહીં, પણ તારા દુર્ગુણોને જ પોપીશ.

હા...પ્રતિકૂળતા એકલી જ કાર્ય સાધિકા નથી, પણ પ્રતિકૂળ વાતાવરણમાં જીવવાની કણા આવડવી જોઈએ. જો એ કળા હસ્તનગત ન થાય, તો કણે કણે કર્મબંધ. અરે ! સાધુ થયો તો આ પ્રતિકૂળતાએ ? ના...ભાઈ...ના, સાધુ થયો એટલે નહિં, કર્મનો વિચિત્ર ઉદ્ય છે, તેથી પ્રતિકૂળતા ગતજન્મમાં સુસાધનનો દુરૂપયોગ કરેલો એટલે પ્રતિકૂળતા. સાધુ થયો એટલે પ્રતિકૂળતા તને કર્મબંધનું કારણ નહિં બને. પ્રતિકૂળતા કર્મ નિર્જરામમાં સહાયક બનશે; પણ હજી એ વાત ચાદ રાખવાની છે. સ્વાર્થ માટે, સત્તા માટે, કોણ પ્રનિકૂળતા સહન નથી કરતું ?

સાધુ પ્રતિકૂળતામાં જીવવાની શક્તિ મેળવે, યાણ મોક્ષના લક્ષ્યની પ્રાપ્તિ માટે, તેથી તેને પ્રન્યેક પ્રસંગમાં એક જ દેખાય. એક જ

અનુભવ થાય અને મોક્ષમાં જે સહાયક થાય, તે જ મારાં જીવનબળો,  
પછી ભલેને એ પ્રતિકૂળ હોય. મારું ધ્યેય જાગૃત છે, તેથી પ્રતિકૂળતા  
મને કર્મનિર્રાનો હેતુ બનશે. આમ.

પ્રતિકૂળ વાતાવરણમાં લક્ષ્યની પ્રાપ્તિ કરે તે સાધુ. જે લક્ષ્યથી  
કયારે પણ ચલિત ન થાય. વાતાવરણ કેને કુદ્ધ ન કરે તે સાધુ.  
મનક !

પ્રતિકૂળતા રૂપ પ્રતિસ્થોત્રમાં, ઉલ્ટા પ્રવાહમાં મોક્ષના લભ્ય લક્ષ્ય-  
વાળો તરી જય છે, તેથી અનુકૂળતા છોડી સાધુની જીવનચર્ચા જ્ઞાન  
તેના આચાર વિહાર વગેરે સમજ અને ધન્ય બન—સાચું કહું છું.

ગુરુદેવ !

અમે તો પ્રતિકૂળતાના નામથી ડરીએ છીએ, પણ કર્મક્ષયમાં  
પ્રતિકૂળતા કેવી રીતે સહાયક બને? પ્રત્યેક સંયોગમાં અમે જે મોકનું  
લક્ષ્ય કર્યું છે, તે, લક્ષ્ય પ્રતિ સતત સાવધ રહી પ્રતિકૂળતાને પણ  
આરાધનામાં સહાયક બનાવવાની ભાવના થાય તેવા આશિષ.

આવો ભાવ કયારેક તો સહૃદ બનશે ને? હજુ તો ભાવ જ  
નથી થતા. આ છે અમારી લાચારી !...



## ૪૭. મમતાવં ન કહિંધિ કુજળ

સરોવરના કાંઠે લીલાઇમ વૃક્ષના જૂથના જૂથ હોય છે, પ્રાતઃ  
કાળનો, સોહામણો, સમય હોય છે. સૂર્યના રક્ત કિરણોથી પૃથ્વી નવ-  
પદ્ધતિવિત ના બની હોય એ પહેલાં વૃક્ષો પરથી હજરોની સંખ્યામાં  
પક્ષીગણો મુક્ત ગીત ગતાં અનંત આકાશના પ્રવાસી બની જાય છે.  
જ્યાં રાત્રિના વિશ્વામ કરેલ થાકને દુઃખ દૂર કરેલ...નવીસ્કૃતિ—નવી  
તાજગી જે વૃક્ષની શીતળ છાયામાં મેળવેલ તે વૃક્ષ સામે પુનઃ એકવાર  
દાખિન નિશ્ચેપ પણ કરતાં નથી. બસ એ પક્ષીઓનો એક જ પોકાર છે,  
વૃક્ષ બંધન છે...સીમિત છે. અમે તો અનંત આકાશના પ્રવાસી—  
આકાશનો પથ જ્યા સુધી ન મલ્યો હતો, ત્યાં સુધી માળાના—વૃક્ષના  
પાંજરામાં રહ્યા હતાં અમને અમારું મળવાથી અલૌકિક આનંદ છે.  
ભૂખનાં દુઃખ ના સત્તાવે, થાક ન લાગે, બસ ઉડ્યા જ કરીશું, ઉડ્યા  
જ કરીશું.

મનક !

તું સિદ્ધોની દુનિયાનો પ્રવાસી, તારી મસ્તી કોઈ અનોખી,  
પુફ્ફાલની માયા તને ના લાગે, રાગના રાજમહેલ સામે પણ તું એક  
ઉપેક્ષાની દાખિએ જુઓ. છ અંડનો માલિક ચક્રવર્તી તેના ૧૪ રતન,  
નવનિધિ અને બત્રીસ હજર મુક્કટબંધ રાજતું ઔશ્વર્ય, ચોસક  
હજર રમણીઓના લાલિત્યનું વર્ણિન કરતાં સાહિત્યની એક નવી દુનિયા  
સર્જ દે, પણ સાધુના મુખ ઉપરનું નિર્મણ સ્થિત જોતાં તે શરમાઈ  
જાય. તેનું મન કાબૂમાં ન રહે.

સાધુને વિનવણી કરે : મહારાજ ! આ પ્રસન્નવદ્ધનતા કયા રસા—  
યાણ દ્વારા મલે ? આ હાસ્ય કયા શીરનના વિનોદમાંથી મલે ?  
બતાવો...સમજવો. હું તો આવી પ્રસન્નતા માટે આકાશપાતાળ એક  
કરી ચૂક્યો, તમને પ્રાપ્તિ કરી રીતે ?

ચક્કવતી ! તારું ચક્કરન કે તારું સામ્રાજ્ય જેના ચરણોમાં  
આપોએ છે, એવા મારા ધર્મચક્કવતી વીતરાગના વચનમાં આ પવિત્ર  
હાસ્ય સર્જવાની તાકાત છે. એ વચન છે.

**“મમતભાવન ન કહિંપિ કુજળ”**

ચક્કવતી ! હું પણ તારા જેવો જ દુઃખી હતો. મારાં અને  
તારાં દુઃખ સમાન હતાં. સમજ લેને કે તારા નોકરનાં અને તારાં  
સુખની ઝંખના અલગ નથી...દુઃખનાં કારણો દૂર કરવાની વૃત્તિ અલગ  
નથી. માત્ર સ્થળ અને સમયનો ફેરફાર હોય છે. બાકી રાગીદ્વોપીનાં તોષાન  
ધાંખલ ઉત્પાતમાં કોઈ ફરક નથી. મારી પણ આજ હાલત. આજ  
પરિસ્થિતિ હતી. કોઈ શાંત સુભાગી પળ આવીને વીતરાગદેવની ત્યાગની  
અંસરોનાં ગીત મારા હદ્યને દ્વારે પહોંચી ગયાં. કાને શબ્દો સાંભળ્યા,  
હદ્યમાં વીતરાગ સ્થાપિત થયા. કાચા બિચારી કલ્યાણરી કામિની જેવી  
છે. એ કથારે પણ મનનો હુકમ અનુસર્યા વગર રહેતી નથી.

પ્રભુના એક વાક્યને મેં મહા—આગમ માન્યું; પુનઃ પુનઃ તેનું  
ચિંતન, મનન, નિદિધ્યાસન કર્યું. મારા દેવનું વાક્ય “મમતભાવન ન  
કહિંપિ કુજળ” એ વાક્ય મને કંઈક વિચારવાને ગોરે છે.

**પ્રભુએ પદાર્થનો ત્યાગ કેમ ના કર્યો ?**

શું દાન, માલ, મિલંકત, ઘર, મહેલ, પત્ની, પુત્ર, સર્ગાં—સેહી  
એ બધા પરિગ્રહ ? આ બધું છોડવાથી જ ત્યાગી થવાય ? જિનાગમ  
મારા મમતભાવને ઢંઢોળે છે જવાબ આપ.

અલ્યા બેવકૂફ !

રસ્તા ઉપર ફરનાં લિખારીને રાજમહેલમાં બેસાડી દો એટલે  
-રાજ થઈ જાય ? શું કાગાં બદલ્યાં, નામ બદલ્યું એટલે સાધુ થઈ  
જવાય ? ત્યાગી થઈ જવાય ?

છોડવા માત્રથી ત્યાગી કહેવાય, તો સારી દુનિયા ત્યાગી જ  
કહેવાય ને ? કારણ મરણ સમયે સહુ છોડે જ છે ને ? ત્યાગી જ છે  
ને ? ક્યાં કંઈ વસ્તુ અંગે માસું એમ બોલે છે. ક્યાં કંઈ ચસ્તુનો  
ઉપયોગ કરે છે ?

ભાઈ ! છોડવું અને ત્યાગવું ફરક છે. સાધુ તો થયો, પણ આજ  
સુધી સાધુતા સ્વીકારી મેં સાધનો અલ્ય કરેલાં. મેં મારાં પાત્ર બદલ્યાં  
પણ મારા મોહને મેં પોખેલો, તેથી સાધુતા સ્વીકાર્ય બાદ પણ કોઈ-  
વાર પરિગ્રહ મને સતાવી જતો. છેવટે કોઈવાર પરિગ્રહથી તંગ થઈ  
ઉપવાસ પર ઊતરી જતો. મને થતું હવે આહારની જંજટ તો જશે.  
ખાઉં તો પંચાતને. આ જોઈએ ને તે જોઈએ, આવું જોઈએ ને તેવું  
જોઈએ. લાઘો સમસ્યા હલ થાય, ત્યારે મનપસંદ ઓરાક મહે. તેમાં  
યે પેટમાં ભૂખ ન હોય તો જોજન એ પણ સજા. પેટમાં ભૂખ  
-અને મનગમતો ઓરાક મળ્યો. બસ, પછી તો આહાર ઉપર માર્શિલ  
લો કર્યો. હાશ.. બોલ્યું એ પહેલાં પેટે યુદ્ધની જહેરાત કરી. અન્ન  
પારકું, પણ ચેટ તારુંને ? અલ્યા મૂરખ ! જાતનાં જોખમ વહેરી આ શું  
ગાંડપણ આદર્યું ? જોજનની જથું કરતાથી કંટાળી ઉપવાસમાં જોડાયો.  
શું કંઈ પણ છોડતો પણ જથુથી કંટાળીને, કરતો. તેથી સમજીને કંઈ  
ન કરતો. ને કંઈ ના મલ્યું તે પકડયું.

ઉપવાસ તો થરુ કર્યા, પણ દેહ સુકાવા લાગ્યો. ગલરાયો. બધા  
વગર ચાલે પણ દેહ વગર ચાલે ? શાસ્કનું પણ ઓથું લીધું, દેહ  
હોય તો ધર્મ આરાધના થાય. દેહ વગર શું ? બધું મારાથી અલગ.  
એ કદાચ છોડું પણ શરીર કેવી રીતે છોડું ? પરિગ્રહના મૂળ કારણ

શરીરને પંપાળવા લાગ્યો. શરીરના કારણે પાછી એ ગમસન પરિગ્રહની-ભૂતાવળ મને દોરી વળી. ખરેખર કંટાળયો...ગાજ્યો જેમ નાનું છોકરું માર ખાઈને લડી જગડી અપ્યમાનિત થઈને 'મા'ની સોહમાં સમાવા આવે તેમ પરિગ્રહથી ત્રાહિ ત્રાહિ પોકારી હું પણ વીતરાગના શરાણમાં આવ્યો. મેં પણ ખૂબ હીબકાં લીધાં, મારો સતતમણીમાંથી માર્ગ કાઢો.

પ્રલુનો શબ્દ કાને પડ્યો : “ભવ્યાત્મા”

મારું રુદ્ધન હાસ્યમાં ફેરવાયું. દુનિયાએ મને તિરસ્કાર્યો, મારા પ્રલુબુએ ભવ્યાત્મા કહ્યો. હવે હું સ્વસ્થ બન્યો.  
ભવા ત્યાગી !

સાધના માટે અધિક સાધનનો ત્યાગ જેટબો જરૂરી છે, સાધક માટે જરૂરી સાધનનો ઉપયોગ પણ તેટબો જ જરૂરી છે. તું એક જ સમજ્યો, દાદર હતો એટલે પડ્યો, પણ ભાઈ, દાદર એ તો ચડવામાં ય મદદ કરે અને ચડતા ન આવડે તો પાડી પણ દે.

સાધક !

તું ત્યાગી છે, તને હવે સ્નેહીનાં બંધન ન ચાલે. સ્વજનનાં બંધન ના સત્તાવે. સ્વદેશ મારો, શત્રુ મારો, મિત્ર મારો આ બધું ના ચાલે. તેથી જ કષ્ટું છે, પરિગ્રહના મહાકારણ ખ્યી—સ્નેહી—ધન—સત્તા ધર તો છોડવાનું પણ સાધન—ઉપકરણમાં ય ક્યાંય મમત્વ ભાવ નહિ. કરવાનો. દેહને પણ સાધનાનું જ અંગ મારવાનું. પાત્ર તૂટે...વલ્લ ફૂટે, તેની કાળજી કરીયો, તેમ શરીરની કાળજી ખરી, પણ મમત્વ નહિ.

પેદાં ગંખીઓઓ જેમ આરામનું સ્થળ વૃક્ષને બનાયું, તેમ તું પણ મોકષનું સાધન બનાવજો. ભૂલેચૂકે ય ક્યાંય મારું છે તેથું માની. ન હેતો.

ને દિવસથી વીતરાગનો વાત હેણે વસી ગઈ છે, ત્યારથી મમત્વભાવના વિષય હટયાં છે. તે દિવસથી જગતનું, પ્રેમીઓનું સાચું સ્વરૂપ સમજી ચૂક્યો છું, તેથી “મમત્વભાવ” ન કહિંપિ કુઝજી” ના બખનર પહેરીને સંસારમાં વિહરણ કરું છું. મારા પર પરિગ્રહ સેનાપતિનાં ભયંકર શથ્યો નાકામયાબ બને છે.

ચક્કવતી !

“સાંભળીને મારા મુક્ત હાસ્યની પાશ્વભૂમિકા”. મારો દોસ્ત બન્ની જ. તને પણ મારી સંપત્તિનો માલિક બનાવી દઉં. ચાલ, મારા વીતરાગના શરણમાં. જય જય.

‘મમત્વભાવ’ ન કહિંપિ કુઝજી’ મમત્વભાવ કૃયારે પણ નહિ કરું. મમત્વભાવ કોઈ ચીજ ઉપર પણ નહિ કરું. મમત્વભાવ કોઈ વ્યક્તિ ઉપર પણ નહિ કરું.



## ૪૮. સુતસ્સ મર્ગજોણ ચરેજો લિક્ષ્ય

મૂર્ખ હંમેશાં પોતાને મન ફ્રાવે તે રહ્યે જાય. બુદ્ધિમાન બધાને પૂછે, પછી પોતાને યોગ્ય-લાગે તે રહ્યે જાય, પણ સાધુની જીવનર્થાના નિયમો જ અલગ પ્રકારના. સમજી. વિચારી શાલ્કાથી જેના ચરણમાં સિર ઝુકાવ્યું, તેમાં પુનઃ વિચાર નહિ કરવાનો.

મનક ! આજીવન ગુરુનિશ્ચામાં રહેવાનું...પ્રાણાન્ત કષે આવે, તો પણ ગુર્વજ્ઞાનાં પાલન કરવાનાં...ગુર્વજ્ઞાનાં પાલનમાં કયારે પણ પોછે એ નહિ કરવાની. ગુરુએ યોગ્યતા વિચારી, શાસનનો લાભ જોઈ તને દૂર મોકલ્યો. ક્ષેત્ર બદલાતાં..સંધ બદલાશે. ત્યાંનાં દ્રવ્ય—ક્ષેત્ર—કાળ ભાવને આશાયીને અનેક પ્રેરણો અને અનેક સમયા તારી સામે ખડી થશે...ગુરુથી શીળી છાપા યાદ આવતાં નયનો નીરથી ભરાઈ જશે—મનોમન પ્રાર્થના થઈ જશે : પ્રભો ! રક્ષા કરો આપના શિષ્યની. આવા સમયે તુ કેવી રીતે નિર્ણય કરીશ.

ભાઈ ! આ તો સર્વજ્ઞાનું શાસન ..અહીં તો તીર્થ કર બનવા માટે પણ કોઈની મોનોપોલી ચાલે નહિ. તીર્થાં કર પરમાત્મા પણ એમ જ કહે, અનંતા તીર્થાં કરોએ કલ્યું, તે હું કહું છું.

સર્વજ્ઞ શાસનના ગુરુ ભગવંતો કયારે પણ પોતાની ભાવના—ઈચ્છા—સમજ વિચાર મુજબ બોલે નહિ—તત્ત્વ—પ્રકૃતે નહિ. વિવાદાત્મક પ્રેરણમાં પોતાની બુદ્ધિથી નિર્ણય ના લે. ગુરુભગવંતો પણ કોઈ આચરણ સામાચારી કોઈ વિધિ કહે, તે શાશ્યના આપારે એટલા વિનમ્રભાવે કહે : મારી અલ્પબુદ્ધિમાં જાની લગ્નં તનો અભિપ્રાય આ પ્રમાણે લાગે છે, તત્ત્વ તો કેવીગમ્ય.

શાસનની શ્રદ્ધા, શુષ્ણ ચારિત્રનું પાવન, સતત શાખાભ્યાસ, શાખવાચનથી જેઓની બુદ્ધિ—મતિ—શાખ—પરિકર્મિત થઈ ગઈ છે, દૃઢભાયોગ—વચ્ચનયોગની સીમા વટાવી સામર્થ્યયોગી સમા મહાપુરૂપ પણ શાખ પ્રમાણપૂર્વક વાત કરે. આજનો દીક્ષિત પણ શાખનો કોઈ પાઠ આપે, તો વિચાર કરવા થોબે...તેઓ પણ કહે : ભાઈ, “મુનયઃ શાખ ચક્ષુપાઃ, મારા વાંચનમાં આમ આવ્યું છે. ક્ષ્યોપશમની વિચિત્રતા છે. પુનઃ પુનઃ શાખપાઠના સમરણ કરું. આવી છે સર્વજ્ઞના શાસનનાં ગુરુદેવોની શાખાધીનતા. તેઓ કહે, જે અમે અમારી બુદ્ધિ—મતિ, કલ્પનાને સ્થાન આપો તે મુજબ અર્થ વિચારણ અને પ્રરૂપણ કરીશું, તો આ સર્વજ્ઞનું શાસન નહિ રહે, છઘસ્થનું શાસન બની જશે. આ શાસનમાં બુદ્ધિ—તર્ક—પ્રતિભાનો ઉપયોગ આજાને સમજવા કરવાનો.—ખુદના નિર્ણયિને—વિકલ્પોને સિદ્ધ—કરવાના નહિ. જેના શાસ ઉચ્છ્વાસ પણ શાખવચનથી સિદ્ધ થયા છે તે પણ સૂત્રને પ્રમાણ કરે.

આગમવ્યવહારીને આત્માગમ પ્રમાણ પણ સૂત્રવ્યવહારીને સૂત્રગમ પ્રમાણ—સૂત્ર સિદ્ધાંતના એકએક અર્થને સ્વીકારે અને એક પણ અર્થને ના વોપે, સિદ્ધાંતની સત્યવાત તે જ કરી શકે—જેનામાં નિભી—કતા હોય. ખુદની આસક્તિ ને અશક્તિને છુપાવવા શાખની એથ ના બે. શાખદ્વારા તો ખુદના દુર્ગુંણો દૂર કરવાના. પોતે સન્માર્ગમાં સ્થિર બનવાનું. બીજાને સન્માર્ગમાં સ્થિર કરવાના! શાખાધ્યયન કરી કોઈને શિથિલ ઉન્માર્ગો નહિ કહેવાના, પણ શાખાધ્યયન દ્વારા કરુણા પેદા કરી સૌને પ્રભુમાર્ગો સન્મુખ કરવાના. અંધના હાથમાં અરીસો આપે, તો તે બીજાને કહેશે : જુવો, તમારું મોહું કેવું લાગે છે ? શાખાધ્યયન કર્યા બાદ આપણું આત્મનિરીક્ષણ ન થાયે, તો આપણું પણ અંધદંશા.

કર્મનો ઉદ્ય વિચિત્ર છે. દીક્ષા લીધા બાદ ચર્મચક્ષુ કદાચ નષ્ટ થાય, પણ સાંધુના શાખચક્ષુ દિવંસ 'જતાચારિત્ર' પર્યાય વધતાં વધુ તેજસ્વી બને, તેથી અલપક્ષાનમાં કોઈ સંગતિ દોષના કરુણે પણ વિર્પરીતં

પ્રકૃપણા થઈ ગઈ હોય તો તેને માટે બાળક જેવા સરળ હડયથી મિચ્છામિ દુકૂડ આપે. ગુરુદેવો વિદ્વાન હોય, અનેક ગ્રન્થોનાં સર્જન કર્યાં હોય, કયાંક રમૃતિ વિપર્યાસ થયો હોય એટાણે શિષ્યોને અંતિમ સમગે સાહ શખ્દોમાં કહે : “ હું તમારો ગુરુ, તાર્સક, પણ પ્રભુશાસનના સહારે મેં અનેક ગ્રન્થોનાં ગુરુકૃપાએ સર્જન કર્યાં છે. તેમાં જે વાત સર્વજ્ઞ શાસનને અનુરૂપ છે, તે ગુરુકૃપાને આધીન છે. કંઈ પણ સૂત્ર વિરુદ્ધ પ્રકૃપણા થઈ હોય, તે મારી બુદ્ધિનો દોષ છે. પ્રભુ શાસનને પામી અદ્વિતીય શ્રદ્ધાના બલથી કહું છું, મારી પણ ભૂલ હોય તો સુધારજો અને શાખમાર્ગને અનુસરજો. આ પ્રમાણે વચન-માન્ય કરશો, તો તમે ગુરુના આત્માને પ્રસન્ન કર્યો કહેવાશે. અન્યથાં વાહ વાહ અને છેલ્દે હવા હવા થનારી નાશવંત કીર્તિને અનુસર્યા કહેવાશે. ગુરુનો દ્રોહ, જિનેશ્વરનો દ્રોહ અને તમારા આત્માનોય દ્રોહ થાય, તેથી કહું છું : મારું તમારું નામ ભૂલજો, પણ શાખવચનને, શાખમાર્ગને કર્યારે પણ છોડશો નહિ.

શાખમૂર્તિ સમા ગુરુદેવો શાખને પ્રમાણ કરે, તો ભલા ! તારે કયા માર્ગ ચાલવાનું ? સાથે બીજું એક સત્ય પણ કહી દઉં ?

શાસન સ્થાપક તીર્થંકર પરમાત્માના દેહના આયુધની પણ મર્યાદા છે અને ગુરુના દેહને પણ આયુધની મર્યાદા છે. તું કયારે કેવી રીતે જીવીશ ? કેવી રીતે નિરૂપ્ય લઈશ ? પ્રત અને પરચકખાણ, આરાધના અને વિરાધનાના નિરૂપ્ય કેવી રીતે કરીશ ? તેથી જ કહું છું : “ સૂત્રસ્સ ભગોળ ચરેજાજ મિખ્ખુ ” સાધુ સૂત્રમાર્ગ ચાલે. સૂત્રનો અર્થ જે રીતે આજા કરે, તે શિરસાવંધ કરે. સૂત્રના અર્થને જે થિરસાવંધ કરે છે, તેને સાદેવ ગુરુ સાંનિધ્ય છે. જ સૂત્રના અર્થને જે બહુમાન્ય ગાયે છે, તેની ઉપર અનંત અનંત ગુરુઓની હૃપાલૃષી થાય છે. સૂત્રનો અર્થ જે સાદેહ છે, પ્રકૃપે છે, તે એક તીર્થંકર પરમાત્માના

એક ગણધરની દ્વારથાંગીને સાન્માનિક અનંતા તીર્થંકર પરમાત્માના અનંતા ગણધરોની અનંતા દ્વારથાંગીનો પૂજાક બને છે. શાસ્ત્રપૂજા એટલે શું ? પુસ્તકને સાપડા ઉપર જિરાજમાન જ કરવું ? વાસકોપ દ્વારા પૂજાન જ કરવું ? ના. નિર્મણ હેઠામાં નિર્મણભાવે શાસ્ત્રાશાને સ્થાપવી. પાલનમાં સદ્ગુરુશક્ય તત્પર રહેવું, જે પાલન ન થાય, તેના માટે હાઈક ભાવથી પક્ષાત્તાપ કરવો. . . . .

મનક ! ઉપવાસ, આયંભિલ, આતાપના, આ બધું સહેલું છે, શક્ય છે, કારણ તેમાં દેહના ઉમન છે; જ્યારે શાસ્ત્રજ્ઞ મુજબ ચાલવું દુષ્કર છે. દર્શન અને ચારિત્ર મોહનીય કર્મ સામે, બળવો જારી રાખી શકે, કોઈ પણ સંયોગોમાં મિથ્યાત્વ, ઝાવવા જ ન દે, તો જ શાસ્ત્રજ્ઞ મુજબ પાલન, કરી શકાય. શાસ્ત્રાશામુજબ જીવવા, માનકીર્તિસાથે પણ લડવું પડશે; અન્યથા મહાપ્રતિ સ્વીકારતી વખતે સ્વીકારેલ શરણાગતિના થપથ : નિષ્ફળ થશો. . . . .

શાસ્ત્રાશા શિરસાવંદ્ય કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર નિર્મણ થાય છે. નિર્મણ રન્નત્રથી જ મોક્ષે લઈ જાય છે.

મનક ! શાસ્ત્રમાર્ગ ચાલવું પ્રતિસ્થોત્ર પ્રવાહેનદી તરવા જેવું દુષ્કર છે. જગત તારું નહિં બને. અક્તોના ટોળાં નહિં. જમે. કોઈક તને એમ પણ કહેશે : આ, કાળમાં આ બધું, ના ચાલે. એ બધાની ઉપેક્ષા કરતા. શીખીશ, તો, શાસ્ત્રની અપેક્ષા, કરી શકીશ. મને વિશ્વાસ છે, મારો મનક, અશાશ્વતતના, કારણે, શાશ્વત ના, છોડે. જે જિનાશાને આધીન બની સમસ્ત સંસાર ત્યાગવાની શક્તિ, મળી, તો તે જિનાશાની શરણાગતિ દ્વારા સમસ્ત મોહનીય કર્મને ઉત્તસ્ત્વ મુન્તસ્ત્વ ભને. બસ, શાસ્ત્રમય, બની, જી, એ જ ધૂતભૂતવના. . . . .

.. ગુરુદેવ !, શાસ્ત્ર સમજવાની શક્તિ, આપો, ગુરુહૃદયને, અનુકૂળ બનવાની, શક્તિ, આપો, અંતે, ગુરુકૃપા, અમુને, પણ, શાસ્ત્રમાર્ગ, અનુ, સારણા, કરવાની, શક્તિ, આપો. . . . .



## ૪૮. તત્થેવ ધીરો પદિસાહરેજળ.

સંપૂર્ણ ગુણી તે પરમાત્મા

ભૂલ થઈ ગયા બાદ સુધારે તે મહાત્મા

અને ભૂલ થઈ ગયા બાદ ભૂલને વધારે તે દુરાત્મા

કર્મ છે ત્યાં સુધી કપાયો છે અને કપાયો છે, ત્યાં સુધી વિપયો છે, અને જ્યાં સુધી વિપયો છે, ત્યાં સુધી તેની જંખના—ચાહના થાય ત્યાં પથભ્રાણતા છે.

ચાલે તે પછિડાય ચડે તેથણે, પણ પછિડાયા પેઢી, પહ્યા પછી સ્થિર બની જવું, તેમાં જ માનવીની મહત્ત્વા છે.

કાન, આંખ, નાકે, જલ, સ્પેર્શ 'ભૂલ' ના કરાવે તે કયારેથ બને જુદું? 'ભૂલ' થાય, પણ 'ભૂલને' સુધારવી 'તે' જ ધીર આત્માની વિશિષ્ટતા છે.

ખાવામાં, આહારને આગેગવામાં જે ભૂલ કરે તે જોને હુક્કી થાય, પણ ઉલ્ટી થાય એટલે તુરતું એવીપણ લઈ વેવાનું. બીજું ચોર ઉલ્ટી ન થાય તેની પ્રત્યેક એંચ્યેર્જાથી જીંચાં રાખે છે. જાડી છે, તો કયારેક બગડવાની, પણ તેને 'સુધારવી' કર્વી શેતે તેની કળા દરેક ગોડીવાળા રાખે જ. બાંણક છે તો કયારેક તોહાનાં અરવાનો, પણ તેને કાર્યરતું કર્મ બનાવવો તેનું શિક્ષણ, માતાપિતા, પાસે હાવું જ જોઈએ.

અનુક ।

તને વધુંભરમાં દીક્ષા આપ્યો છે. હજુ તારો ઈંદ્રિયો, કર્મનિદ્રિયો, નથી, લોગેન્ટ્રિય નથી, શાન્દનિન્દ્રિયો છે. તારું થરોર વાસનાની કાળજી કોટ્ઠો, સંભુ, નથી, તારું શરીર પર્માદય છે.

તારું વચન તને રાગટ્રોપ તરફ આકર્પણું નથી. તારા વચનથી તું કોઈને રાગટ્રોપ તરફ આકર્પણો નથી. તારી વાસ્ત્વી જિનાજ્ઞાથી પવિત્ર બની ગઈ છે. તારું મન મંહાત્માનું છે. જીવાર્ય વડે તારું મન અભિજાણું નથી. તારા વિચારમાં પદોપકારની મુરબ્લિ પ્રસરો રહી છે. ખરેખર, તું ધન્યાત્મા છે. સાચે તું વિશ્વનો પવિત્ર પુરુપ છે. હજુ તને મન, વચન, કાયાએ હાર નથી અવરાવી, પણ હું તારા ધર્મદિલ્હનો પાલક છું. મારે તો તારા ધર્મમાર્ગમાં યોગક્ષેમ કરવાના છે, તેથી મારે સત્ય સમજાવણું જ રહ્યું. મન—વચન—કાયાના નિલેટે તું અથરાઈ જાય તો? તારે આ રખડપાટમાંથી કેવી રીતે રરતો કાટવાનો? તેનો નેતા કેવી રીતે બનવાનો? તું શૂર બનવાને રાંજિયેલો છે. બકાલ બનવા તારે જન્મ નથી. તારે વીર બનવાનું છે, પણ વીર બનવા પ્રથમ તારે ધીર અવશ્ય બનવું જ જોશે. જે ધીર નહિ તે કયારે પણ વીર ના જ બની શકે.

### પૂજય!

હું તો આપનો ચરણોપાસક છું. મને વિશ્વાસ છે આપની શરૂઆતિમાં! જેમ સાંચું બનાયો, તેમ ધીર અને વીર બનાવો. હું શું કહું? બસ, હું તો આપના ચરણમાં અર્જ કરું.

### ભલા!

વારસ્યામાં સંપત્તિ અપાય, રથાન અપાય, સત્તા અપાય, પણ સદ્ગુરુ અપાતા નથી. સદ્ગુરુ પ્રત્યેક વ્યક્તિએ ખુદના પ્રયત્ન દ્વારા પ્રાપ્ત કરવાના છે. હું તને ધીર બનવાનું ચિકાણું આપી શકું, ધીર બનવાની તાલીમ આપી શકું, પણ ધીર તો તારે જ બનવું રહ્યું રહ્યાબળ જેટા..

સીધા સાદા લાગતા મન—વચન અને કાયા કયારેક ઓવી ગુંડા-ગીરી કરે છે. આપણું સંયમધન આપણા પોતાના થઈને ચોરી જાય છે. મહારથી અને માંધાતાઓ આપણી હુનિયાની સાચે અનેણે વીર હોય છે, પણ જ્યારે ગૃહયુદ્ધ ઉત્પન્ન થાય છે, ત્યારે “ભીંગરું પરાનેણું પ્રાપ્ત કરે છે, તેમ સાધક આગળ પણ આવી જ પ્રેરનોની સુમસ્યાં થિયાની..”

બૌમાર મારી કાયા થાકી જશે, તો જરા સાચવી લઉં. શરીર સાલું હશે, નો ધર્મ આરાધના થશે ને. રોગ છે. રોગ નિવારણ માટે ટ્રા લઉં તો...દવા માટે પથ્ય લઉં તો, શુષ્ઠ પથ્ય ના મળે તો કરવાનું શું? એમાં શું? જરા અગુહ વઈ લેવાનું, તેમ મન ટાપશી પૂરશે અને વચન કહેશે: કાયા અને મનનો હું તો મહત્વનો વકીલ તૈયાર જ છું. તમારા બંનેની ફરિયાદ એવી સુંદર રીતે રજૂ કરીશ કે સાચે આ મહાત્મા છે. તે શરીર માટે કશું કરતા નથી. ફક્ત શરીરને ધર્મકાય અનાવવા સંભાળી રહ્યા છે. પછી ગ્રણની ટોળકી જમી જશે અને તારું આત્મધન, તારી સહૃદગતિ, તારી સાધના જોતજોતામાં નાસ થઈ જશે એટલે તને કહું છું: ધીર બનીશ, સ્વસ્થ બનીશ, તો સાચો નેતા બનીશ. સાચો નેતા જ્યાં ભૂલ થઈ, ત્યાંથી પાછો ફરે. સૌન્ય હાયું. નથી ને જરા હુકમ ન માન્યો, તેમાં શું થયું? પણ હુકમની અવગારુના કરનાર, અનાદર કરનાર સૌન્ય એક દિવસ સેનાપતિના પૂરાજ્યને નોતરે છે. તેમ મહાત્મા! તારાં મન—વચન—કાયા બગડે નહિ, જરા પણ સાધનામાર્ગમાં આનાકાની કરે, ત્યારથીજ સાવધ બનજે. જેમ પ્રતિકમણ કરવું છે, પણ હમણાં તો શરીર દુઃખે છે, પછી ગમે ત્યારે કરી લઈશ. આ ગળીયા બળદની વૃત્તિ છે. આજ દુઃપ્રયુક્ત છે. બસ, ત્યાં જ જગૃત બની જા. મનને કહક ઓર્ડર કરી દેજે. નહિ ચાલે, આરામ પછી—આરોગ્ય પછી—આચાર પ્રથમ. જેમ આચાર ન બદલાય, તેમ આચારનો સમય પણ ન બદલાય.

એક વાર પણ મન—વચન—કાયાને વશ થયો, તો તારી સાધુનાના પતનની ઘડીઓ ગળાવા લાગશે. એકવાર છે ને! થઈ ગવું, શું થાગ! ચા બધી વાત જ તારા સર્વનાશને નોંંતરશે. નું ધીર બનીશ, તો તને સમજશે કે કયારેય પણ મન—વચન—કાયા કયાંય એકલાં કશું કરી શકતા નથી. બહારથી અલગ દેખાય, તો પણ આ આંદરથી એક જ છે, એટલે એકની સખવના, અપરાધમાં કંઈક અંશે ગ્રણે દૂધિત છે, જુન્દે-ગાર છે. જ્યારે નણે પ્રગટ બળવો કરશે, ત્યારે તારા હાથમાંથી બાછ

ચાલી ગણેલી હશે. એટલે 'તને કહું છું : ક્યાંય પણ સાધુ આચારથો વિરુદ્ધ વ્રતના મન—વચન—કાયાને જુઓ, ત્યાં જ તે જ ઘડીએ સાવધ બની જાઓ. તેઓની" અવળી ચાલને સમજવામાં ધીર્ય રાખજો. કાયા આરામ જ એ તો કહેજો : તારા સદૈવના આરામ માટે હવે આગુસણ જ જરૂરી છે. જુબ બોલવા માટે તલપાપડ થાય, 'તો કહી દેવાનું : મારે તારી પાસે બોલાવવું જ છે, સમવસરણમા ધર્મદિશના અપાવવી છે. જ્યાં સુધી સમવસરણમા બેસી ધર્મદિશના ન આપી શકે, 'ત્યાં સુધી વચનનો દુરૂપયોગ નહિ કરાય. સુયોગ્ય વચનનાં તાલીમ બેવી જ રહી. હવે ગુરૂજીએ વગર કશું નહિ બોલવાનું, વ્યાખ્યાન પણ નહિ, અને ધર્મો-પદેશ પણ નહિ.

મન શું કરે છે તે સમજવાનું છે. જે મનમાં શુક્લધ્યાન પ્રાપ્ત કરવાની શક્તિ છે. તે તને આર્તરોદ્ધ્યાનવડે નરકાભિમુખ બનાવે છે. તું તે નહિ ચલાવી લઈશ. તેની શક્તિ—અશક્તિ તેં જાણી છે. જ્યાં સુધી આત્મસાયમ નહોતો આવ્યો, ત્યાં સુધી તમે ફાલ્યા, પણ હવે ગુરુ-કૃપાએ તું ધીર બન્યો છે. આત્મસંયમી બન્યો છે. તારી દુનિયા બદલી નાંખ. સર્વત્ર જિન જિન જોતો રહે. પછી મનને કહી દે. આંખમા સમાયેલ અરિહં તને મનમાંદિરમાં બિચારિત કરવા છે. મારા હદ્યસિંહા-સનને જિનના ધ્યાનવડે પવિત્ર કર.

જે પદાર્થ—જે પરિસ્થિતિ અને જે વ્યક્તિ દ્વારા મન—વચન—કાયા ભૂલ કરે, ત્યાં જ તે પદાર્થને, તે પરિસ્થિતિને, તે વ્યક્તિને તારી સાધનાનાં અંગ બનાવી દે. મન—વચન—કાયાને સન્માર્ગ લાવ. ઉત્તમા દથી પાછા વાળ.

ગમે તેમ તોય સાધકનાં મન—વચન—કાયા છે. શિક્ષિત અશે જેવા છે. લગામ જેંચીશ એટલે જ તે સીધા થઈને દોડવા માંડશે. ગુરનું સાંનિધ્ય સ્વીકારી ભૂલ થાય તો તુરત પ્રાપ્તશીરા લઈ લે જે. એટલે મન—વચન—કાયા લગામ જેંચાતા જ બહુજ અનુકૂળ બની જશે.

મનક ! મારા મનક !

સિદ્ધિની સાધના માટે સંપૂર્ણ સદાચારી મન—વચન—કાયા જોઈએ.  
જેમ પછ્ચાદાર સૌન્ય, ન હાય, તો સેનોપતિને 'વિનંય' ન થાય, જેમ  
સાધનાની સિદ્ધિ માટે સંપૂર્ણ શુદ્ધ પર્વિત્ર મન—વચન—કાયા જોઈએ.  
ખસ, અંતરના આશિષ આપું. તું સ્બલના ન પામ અને કદાચ સ્બ-  
લના પામે, તો પણ તુરંત સાવધ બની પગાજ્યને 'વિલ્યમાં પલટાવી  
દે એ જ ચાહના છે.

ઓ ગુરુદેવ !

મહાત્મા મનક સ્બલના ન પામ્યા, કારણ આપે તેઓના સંયમ-  
રથનું સારથીપણું કર્યું. શું અમારા સારથી ના બનો. અમારી સ્બલના  
ના નિવારો ?

પ્રભો !

અવક્ષા, આશાતના, અનાચારથી અવશ્ય બચાવજો. અમારા પણ  
મન—વચન—કાયાને પરિત્ર બનાવો.

એ જ તારક ચરણોમાં નમ્ર વિનંતિ.



## ૫૦. અધ્યાત્મિક ખલું સુયુદ્ધ રહી ખુલ્યો

એક યુવાનને દૂર—સુદૂર અનેક મનોહર રમણીય દેશ જેવાની અભિલાષા જાગી. એ તો એક પછી એક અનેક વ્યક્તિને મળી પ્રવાસની માહિતી એકત્રિત કરવા લાગ્યો. ભૂલી ન જવાય એટલે તેને લાંબી નોંધ કરી. તેમાં પણ વિલાગ કર્યા. કઈ સાધન સામગ્રીની જરૂરિયાત? કંઈ ચીજથી સાવધ રહેવાનું? કયા સ્થળે શું જેવાનું? કયાંથી શું વેવાનું? કયાં કોને મળવાનું? એ તૈયારી પૂર્ણ થઈ અને પ્રયાણનો દિવસ આવી પહેંચ્યો. નોંધ મુજબ બધું જ સંભાળી લીધું. એક બે અને ત્રણ વાર ગણની કરી ચૂક્યો. પ્રવાસી મનમાં જ મલકાવા લાગ્યો. મારા જેવું કોઈ ચોક્કસ નહિ હોય, ચાલો! આપણે તો સફળ મુસા-ફર બનીશું. આમ વિચારમાં ગાડી ચાલવા લાગી, ત્યાં તો ગાડ્ય આવ્યો : ટિકિટ બતાવો ટિકિટ...અરે! મારી નોંધ કયાં ગઈ? પોતાની પૂરી નોંધ જેઈ ગયો.. ભાઈ! ટિકિટ વેવાનું મારી નોંધમાં નથી, નોંધ મુજબ બધી તૈયારી કરી છે. શું ટિકિટ વગર મુસાફરી થાય? ઊતરી જા, ગાડીના બધા પ્રવાસી હસતા રહ્યા અને ભાઈસાહેબને રહ્યે મોંઢે નીચે ઊતરી જવું પડ્યું.

યિંતક!

આ વાત સાંભળીને તું પણ હસીશ, પણ હસવાનું નથી, ગંભીર બની તારે તારો અને મારે મારો વિચાર કરવાનો છે. જેમ પેલા મુસા-ફરની અભિલાષા મહાન હતી, તૈયારી પણ અપૂર્વ હતી, પણ ટિકિટ વગર તેની મુસાફરી રોકાઈ ગઈ. આપણી ભૂલો તો તેના જેવી નથી ને?

મોક્ષની જેવના છે. શુદ્ધ શાશ્વત અને સમ્યગુજ્ઞાન મેળવ્યાં છે. ચારિત્રના કપરા માર્ગ પર ચઢાણ પ્રારંભ્યું છે. મુનિ યોગ્ય ગુણોની

વિચારણા કરવા લાગ્યો, કેટલુંક મને યાદ આવ્યું. કેટલુંક જીજાએ યાદ કરાવ્યું. “મા” એ કહ્યું બેટા ! ઓધા અને સુહપત્તિનું ધ્યાન રાખજે. કોઈએ કહ્યું ભલા ! પાત્રા અને સંથારાનું ધ્યાન રાખજે. ગુરુએ કહ્યું પ્રતિકમણ. પહિલેહણ અને સ્વાધ્યાયનું ધ્યાન રાખજે.

પણ આ તૈયારી અને સાધનામાં મુખ્ય વાત ના વિસરી જતો. મારું કામ તો મુખ્ય વાતની સમૃતિ કરાવવાનું. યાદ દેવરાવીશ, પણ રક્ષણ તો તારે કરવું પડ્યે. બધી તૈયારી કોઈ કરી આપશે અથવા કરાવવામાં મદદ કરશે. રક્ષણ તો તારે કરવું પડ્યે. શાનું જાણવું છે ? ધ્યાનપૂર્વક સાંભળ, આપણા ખલુ સાયયં રક્ષિયાય્યો. આ બધામાં સતત આત્માનું રક્ષણ કરવું જોઈએ.

મારી વાત સાંભળી તું હસવાનો અનેક અટપટા પ્રશ્ન પૂછવાનો. તું કહીશ, શું આત્મા પડી જવાનો છે ? તેને વાગવાનું છે ? તેને લાગવાનું છે ? તે માંદો પડવાનો છે ? તેના વળી રક્ષણ શાના ? બસ, એ તો અજરાયમર છે. એના રક્ષણની સાવધાની શાની ? મને આ બધી તારી પ્રશ્ન પરંપરા અને મનની ગૂંચ ખબર છે,

જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, કિયા અનુધીન બધુ કરે છે, પણ જેના માટે કરવાનું છે, જેની શુદ્ધિ માટે કરવાનું છે, તે તું જાણતો નથી એટબે ધાર્યોવાર ધાર્યું કર્યો પછી પણ અતે તું હનાશ અનુભવે છે. ધાર્યોવાર ધર્મ જેવા અમૂર્ખ તત્ત્વને કીર્તિ કાચના ટુકડા લેગા કરવાનું સાધન બનાવે છે, તેથી જ કહું છું : આપણી સમસ્ત આરાધના તપ, ત્યાગ, જપ, ધ્યાન આત્માના રક્ષણ માટે છે. આત્મા શાશ્વત છે, તેથી જ તેનું રક્ષણ કરવાનું.

પ્રસ્તુત પ્રકરણમાં તને ભૂતનું રક્ષણ કરવાનું ના કહ્યું. પ્રાણનું રક્ષણ કરવાનું ના કહ્યું, જીવનનું રક્ષણ કરવાનું ના કહ્યું, પણ આત્માનું રક્ષણ કરવાનું કેમ કહ્યું તે અણે કોઈ દિવસ કંઈ વિચાર્યું ?

જ્યાં ચૌતન્ય દશા અતિ ભલિન છે તે ભૂત.

( પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જળ ) જ્યાં ચૌતન્ય દશા એટલી બાપડી છે કે શ્વાસોચ્છ્વાસ અને ભાષામાં જ તે સીમિત થઈ જાય છે તે પ્રાણ.

આવા ( પ્રાણધારી બેઈન્ડ્રિય વગેરે ) જ્યાં ચૌતન્ય દશા એટલી તિરેભૂત થઈ ગઈ છે કે દેહમાં જ દેહિના દર્શન થાય છે તે જીવ.

જ્યાં ચૌતન્ય દશા સંપૂર્ણ વિકસિત છે. જ્ઞાન—દર્શન—ચારિત્ર નિજ સ્વરૂપે પ્રકાશયા તે આત્મા.

મનક !

સાધુપણું સ્વીકાર્ય બાદ આવી શુદ્ધ આત્મદશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો છે.

ધૂળધીયો ધૂળમાંથી સોનું હેવી શીતે શોધી કાઢે. દુનિયાને ધૂળ ટેખાય. પણ ધૂળધીયો કહે આમાં સોનું છે. મારા અને તમારા જેવા કહે ભાઈ ! અમને તો ધૂળ લાગે તે ફેંકી દે. તે કહે તમારી પાસે યોગ્ય પ્રયત્ન નથી. તમને ગમ નથી પણ મને ગમ છે. આમાંથી જ ચાળી ચાળીને સોનું કાઢીશ.

કહેવાય છે મુંબઈ શહેરની સમસ્ત ગટરો જ્યાં એકઠી થાય છે, ગંદકી, દુર્ગંધ માથું ફાટી જાય તેવી છે, ત્યાં કેટલાક જવેરાતના દલાદો અનુભૂતિ નમાવીને બેઠા છે. કચરામાંથી મહા મૂલ્યવાન હીશને શોધે છે અને પેલા ધૂળધીયા અધુદ્ધા ઓક નંગને પાંચ હજાર, ચાત હજારમાં કેચે છે. અદ્યો માલ તો પેલા જવેરી મેળવે છે, ઓક જવેરી કહે ગટરમાંથી દલાદે સામટા નંગ પાંચહજારમાં આપ્યાં. ચાંજ મેં ઓક જ નંગના ઓકવીશ હજાર મેળવ્યા, કોઈએ ગટરમાંથી શોધ્યો અને કોઈએ ઓપોળખીને વેર્યો બોઝને !

ગટરના કચરામાંથી હીરો શોધ્યો કોઈએ ! મૂલ્ય સમજે કોઈ અને વેર્યે કોઈ !

સાધક !

સંસારની વિષમ અવસ્થામાં રાગ અને દોપનાંતોફાન વચ્ચે કર્માં અને અધ્યવસાયના સંઘર્ષ વચ્ચે વિજયી બનવાનું છે. પ્રમત્તા અવસ્થામાંથી જ અપ્રમત્તા અવસ્થાની સાધના આગળ વધારવાની છે. ઓદયિકભાવના, કષોપશમલભાવના સંગ્રામમાં પહેલાં ઉત્તરવાનું છે. તે પછી બનને સાધન બનાવી કાયિકભાવના, શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર-મેળવવાનાં છે.

સરાંગ સંયમથી વીતરાગ સંયમની પ્રાપ્તિ અંગે જગૂમવાનું છે. આર્તગૈદ ધ્યાનના સંયોગોમાંથી સતત ધર્મધ્યાનમા રત રહી શુક્લધ્યાનના સોપાન સર કરવાના છે. આત્માનું રક્ષણ ઓટલે તેના શુદ્ધ સ્વરૂપનું રક્ષણ. શુદ્ધસ્વરૂપના પ્રગટીકરણનો પુરુષાર્થ પ્રતિક્રમણ જેવી તારી દિનની નાની ડિયામાં પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય રાખવું પડશે.

પહેલાં યોગ્ય સમયે પ્રતિક્રમણ કરવું, યોગ્ય સ્થળે કરવું, યોગ્ય વિધિથી કરવું, સૂત્રના યોગ્ય ઉચ્ચારણ ફૂરા કરવું. યોગ્ય ઝરવ-દીધિનો જ્યાલ રાખવો, અથનો જ્યાલ રાખવો, યોગ્ય મુદ્રાનો જ્યાલ રાખવો, યોગ્ય તત્ત્વયતા પેદા કરવી, તે માટે તમમણે તલ્વેસ્સે તલ્વભાવેની સાધના કરવી જરૂરી રહેશે. એ બાદ વિચારણ રહેશે. મારી શું શુદ્ધ થઈ ? મારા જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણ કેટલા વિકસ્યા ?

સમસ્ત દુનિયાની સમસ્ત દુન્યાની ચીજેને વિસારી, આત્મગુણોની પ્રાપ્તિ અથે સતત પ્રયત્નશીલ રહેણું તે આત્મરક્ષણ. આમાં કોઈના પ્રમાણપત્ર નહિ ચાલે. કોઈની લાગવગ નહિ ચાલે. સંપૂર્ણ શુદ્ધગુણની. પ્રાપ્તિ અને તેનું જતન તે આત્મરક્ષણ.

કેવળજ્ઞાન આપણાં અતિમ ધ્યેય બિંદુ. કેવળજ્ઞાન નહિ મળો ત્યાં. સુધી જ પીને નહિ બેસવાનું.

જિનેશ્વર ભગવાંતે અન્તયોગ કર્યા છે.

કોઈને કોઈ યોગ દ્વારા શુદ્ધાત્મ દશા પ્રામ કરવાની મુખ્ય ચાર રહ્સ્યાનુયોગ તારે ઘણાને, પણ ધીમે ધીમે ગણિતાનું યોગ ચરણ કરણાનુયોગ. મધ્યમ ઝડપે દ્રવ્યાનુયોગ દ્વારા તરે, થોડા પણ તરે, જલદીથી શાશ્વતના ચિંતન મનતથી દ્રવ્યાનુયોગનો આરાધક બન અને આત્માનું રક્ષણ કર. બસ, એ જ હિતભાવના.

મનક !

રક્ષણ શાશ્વત પદાર્થનું, હિતકારક પદાર્થનું અને સ્વભાવભૂત પદાર્થનું કરવાનું હોય. આણું રક્ષણ કરી વિકરણ મોહનું રક્ષણ કર. વિશ્વનાં તમામ ભૂતો અને પ્રાણીનું રક્ષણ પછી સ્વાભાવિક બની જશે અને તે દ્વારા આત્માનું સનત રક્ષણ થઈ જ જવાનું. ઓ શ્રદ્ધાંમભવસૂરિ મ. !

આપણા સાંનિધ્યમાં મહાત્મા મનકના આત્માનું રક્ષણ થયું, નેથી તો બાળક પણ બહિરાત્મદશામાંથી મહાત્મદશાને વર્યા. કૃપા કરો અમ સમા પામર પર, અને કરો સદૈવ જાંજેરાં અમ આત્માનાં જતન !



